

# પરબ

સ્થાપના વર્ષ : ૧૯૬૦

વર્ષ : ૫

જુલાઈ : ૨૦૧૦

અંક : ૧

ભગવતીકુમાર શર્મા  
પ્રમુખ

: પચામર્શનસમિતિ :  
રાત્રિલાલ બોરીસાગર  
વરિષ્ઠ લેખક

પ્રકૃત્લલ રાવલ  
પ્રકાશન મંત્રી

: તંત્રી :  
યોગેશ જોધી  
: સહતંત્રી :  
મોહન પરમાર



## ગુજરાતી સાહિત્ય પરિષદ

મેધાણી શાનપીઠ મ. ક. લા. સ્વાધ્યાયમંડિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ,

'થાઇસ' પાછળ, નાદીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૯

ફોન : ૨૬૪૮૭૮૪૭

## પરબ

ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

- v 'પરબ' દર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.
- v 'પરબ'ના ગ્રાહક તથા પરિષદના સભ્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.
- v 'પરબ'નું વાર્ષિક લવાજમ રૂ. ૧૫૦ છે.
- v વિદ્યાર્થીઓ માટે 'પરબ'નું વાર્ષિક લવાજમ રૂ. ૭૫ છે, પ્રમાણપત્ર સાથે બીડવું.
- v ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિક તેમજ આજીવન સભ્યપદના શુલ્કમાં 'પરબ'ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.
- v પરિષદના વાર્ષિક બ્યક્ઝિંગત સભ્યપદનું શુલ્ક રૂ. ૨૦૦ તથા સંસ્થાગત સભ્યપદનું શુલ્ક રૂ. ૩૦૦ છે.
- v પરિષદના આજીવન સભ્યપદનું શુલ્ક રૂ. ૨,૦૦૦ છે તથા સંસ્થા આજીવન સભ્ય રૂ. ૩,૦૦૦ છે. (વિદેશવાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)
- v 'પરબ' લવાજમ તથા પરિષદ સભ્યપદ શુલ્કની રકમ મનીઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના નામે જ મોકલવી.

## લેખકોને :

- v 'પરબ'માં પ્રગટ થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.
- v લેખકોએ પોતાનું લખાણ ફૂલ્સકેપ અથવા A4 સાઈઝના કાગળની એક બાજુએ, સુવાચ્ય અક્ષરે લખી મોકલવું. પોસ્ટકાર્ડ, ઠિન્લોન્ડ કે ચબરખીઓમાં કૃતિ મોકલવી નહીં. પ્રત્યેક કૃતિ નીચે પૂરું સરનામું લખવા તથા એક નકલ પોતાની પાસે રાખીને જ કૃતિઓ મોકલવા વિનંતી.
- v સ્વીકૃત કૃતિની જાણ કરાશે. ટ્યાલન્ટિકો ચૌંટેલું કવર મોકલ્યું હશે તો અસ્વીકૃત કૃતિ પરત કરવામાં આવશે, અન્યથા કૃતિ રદ ગણાવી. પોસ્ટકાર્ડ મોકલ્યું હશે તો અસ્વીકૃતિની જાણ કરાશે.
- v પત્રવ્યવહારનું સરનામું : તંત્રી, 'પરબ' ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'થાઇસ' પાછળ, નાદીકિનારે, પો.બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

E-mail : gspadmin@vsnl.net

Web-site : [www.gujaratishahityaparishad.org](http://www.gujaratishahityaparishad.org)  
[www.gujaratishahityaparishad.com](http://www.gujaratishahityaparishad.com)

ફોન અને ફેક્સ : ૨૬૪૮૭૮૪૭

ISSN0250-9747 પરબ

છૂટ ક્રિ. રૂ. ૨૦/-

માલિક : ગુજરાતી સાહિત્ય પરિષદ વતી મુદ્રક અને પ્રકાશક : પ્રકૃત્લલ રાવલ (પ્રકાશનમંત્રી), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'થાઇસ' પાછળ, નાદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૮ S તંત્રી : યોગેશ જોધી S મુદ્રણસ્થાન : શારદા મુદ્રણસ્થાય, ૨૦૧, તિલકરાજ, પંચવતી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૬ & ૨૬૪૬૪૨૭૮

અનુકૂળ

પરિષદ્-પ્રમુખનો પત્ર

કવિતા

લેખિકાસત્ર : વધુ સાર્થક આયોજનોની દિશા બેધડી • ભગવતીકુમાર શર્મા ૪  
સુગત સર્વોક્તિ • હરિકૃષ્ણ પાઠક ૭, નિયતિ • પ્રા. મુકુંદ દે. ભંડ ૭, મરીઝ • હરીશ મીનાશુ ૮, તાર જોડાઈ ગયો છે • નિતિન વડગામા ૯, નીકળું છું... • હર્ષ બ્રહ્મભં ૧૦, રંબું છે • હર્ષ બ્રહ્મભં ૧૦, સતત આ જીવાનું • હર્ષ બ્રહ્મભં ૧૦, દીવો પેટાવ મા • ભરત જોશી પાર્થ મહાબાદુ ૧૧, નામ અનું... • હનીફ સાહિલ ૧૧, ગજલ • તૃપ્તિ પારેખ ૧૧, અમે - તમે • મનોહર નિરેદી ૧૨, છોકરાવે કંઠે જઈ પૂછ્યું • મનોહર નિરેદી ૧૨, જિયો જિયો તિ જિયો • મનોહર નિરેદી ૧૩, મિલનસેહિતા • જગાદીપ ઉપાધ્યાય ૧૩

વાર્તા

દર્શાન-બિભાગ • મધુસૂદન ઢાંકી ૧૪, કદરદાન • ડેઝમશી પરમાર ૧૭  
“કોશ કૂવો ને કોશિયો” • અરવિંદ ટાંક ૨૨

વિનોદ

બાપુ ધ ‘શેકન્ડ’ • નિરંજન નિરેદી ૨૯

શતાબ્દીવંદના

કવિવર ઉ.શે.નું પ્રભાવક ગીત : લૂ, જરી તું - • લાભશંકર ઠાકર ૩૨, ‘છિન્નાભિન્ન છું’ - ઉમાશંકરની કવિતાના નવા પ્રસ્થાનનું પહેલું પદ • ચંદ્રકન્ત શેઠ ૩૫, કવિશ્રી ઉમાશંકર જોશી : થોડીક અંતરંગ વાતો... • મણિલાલ ડ. પટેલ ૪૦

વિદેશી સાહિત્ય

અભ્યાસ

નવલક્ષ્મા - રોમાંચક ઈતિહાસના ધોઘ નીચે • રમણ સોની ૪૭

સુરક્ષા

સરદાર જયંતી : એક સુરક્ષા • રાજેશ મેકવાન ૬૧

શ્રદ્ધાંજલિ

પ્રયોગાત્મક ટૂંકિવાર્તાના સર્જક ઘનશ્યામ દેસાઈની ચિરવિદ્યા • પ્રફુલ્લ રાવલ ૬૫, સમર્થ સમકાળીન કવિ-વિવેચક : નિતિન મહેતા • મણિલાલ ડ. પટેલ ૬૮

અહેવાલ

સામાજિક સંદ્રભાવના આપણી સહિયારી જવાબદારી છે - સંદ્રભાવના પર્વ-૨ ઉજવાયું • ડિકેશ ઓઝ ૭૨

સમીક્ષા/ગ્રંથાવલોકન

પત્રસેતુ

ચૂચિ

રાખ્રભાવનાનું ઘડતર અને રચનાત્મક કાર્ય • ડૉ. અરુણ કક્કડ ૬૫

હરેશ ધોળકિયા ૭૭

સાહિત્યિક પત્રકારત્વ વિષયના ગુજરાતી ભાષામાં પ્રાચ્ય સંદર્ભ ગ્રંથો-લેખો • ડૉ. ડિશોર વ્યાસ ૭૮

સંકલન : રાજેન્દ્ર પટેલ ૮૫

સંકલન : ઈતુભાઈ કુરુકુટ્યા ૮૭

89

શિવાની પટેલ

પરિષદ્-પ્રમુખનો પત્ર

લેખિકાસત્ર : વધુ સાર્થક આયોજનોની દિશા બેધડી

‘લેખિકાસત્ર ?’! ‘લેખિકાસત્ર’ આગવું અને વિશિષ્ટ સુરતમાં તે યોજાયું, ગયા મે મહિનાની તા. સોળમી અને સતતરમી. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ્’ તેનું આયોજન કર્યું અને ‘અભિલ હિન્દ મહિલા પરિષદ્’ની બૃહદ્ શાખા તથા તેના નેજા હેઠળ ચાલતા ‘વાચકમંચ’નો તેને પૂર્ણ, સક્રિય સહકાર પ્રાપ્ત થયો. છેલ્લા ન્રોક મહિનામાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ્’ દ્વારા સુરતમાં યોજાયેલો આ બીજો સાહિત્યિક કાર્યક્રમ હતો. આ અગાઉ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના સહકારથી સુરતમાં ‘નવલકથાસત્ર’ યોજાયું હતું. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ‘સાહિત્ય પરિષદ્’ના ઉપકમે વધુ ન્રોક સાહિત્યવિષયક કાર્યક્રમો યોજવાની અમારી ભાવના છે. એ દ્વારા સાહિત્યની આબોહવાનો પ્રસાર એ જ આશય હોય.

પરિષદના ઉપકમે ‘લેખિકાસત્ર’ જેવાં જાંન આયોજનો આ પહેલાં કદાચ નહિ થયાં હોય. સુરતમાં તો તે પહેલું જ હતું. છૂટાંછવાયાં લેખિકા-સંમેલનો થતાં રહે છે. થોડાંક વર્ષ પહેલાં વલસાડમાં એક એવું સંમેલન યોજાયું હતું પણ જેમાં કચ્છથી મુખ્ય સુધીનાં પચાસેક જેટલાં લેખિકાઓ-કવિવિત્રીઓ હાજર રહ્યા હોય તેવું સંભવત: આ પહેલું સત્ર હતું. વસ્તુત: આ ‘લેખિકાસત્ર’ યોજાયું અને સાકાર થયું ત્યારે જ તેના ખરા મહિમાનો ઘણાંને ખ્યાલ આવ્યો હોય. હું તો મૂલત: ઉમળકાનો માણસ. ઔપચારિકતાઓ, વિધિવિધાન કે યમનિયમોની મને જાંન ગતાગમ નથી, તે હું કબૂલું છું, પણ મારો ઉમળકો સાહિત્યપદ્ધાર્થકન્દ્રી જ છે, તે મારે સ્પષ્ટ કરવું જોઈએ. મેં તો ‘લેખિકાસત્ર’ની ઉદ્ઘાટનબેઠકમાં જ મારા વક્તવ્ય દરમિયાન કઢી દીધું કે ભવિષ્યમાં ક્યારેક ‘ગુજરાતી સાહિત્ય પરિષદ્’નું એક આખું અધિવેશન લેખિકાઓને જ સમર્પિત કેમ ન કરી શકાય? એમાં ‘પરિષદ્-પ્રમુખ, વિભાગીય અધ્યક્ષાઓ, વક્તાઓ – સર્વત્ર લેખિકાઓ’ જ બિરાજમાન હીય. મારા આ સૂચનને સત્રમાં ઉપસ્થિત લેખિકાઓએ ઉમળકાને વધાવી લીધું, તે બતાવે છે કે આવા ઉપકમે પરતે તેઓનો ઉત્સાહ અને ઉત્સુકતા કેવાં પ્રબળ છે. તહુપરાંત પરિષદના મહામંત્રી રાજેન્દ્ર પટેલે એવો પણ વિચાર વ્યક્ત કર્યો કે પરિષદના ઉપકમે લેખિકાસત્ર જેવું આયોજન વર્ષમાં એક વાર તો થવું જ જોઈએ. આ બધું સૂચવે છે કે એક કરવા જેવા કામનો પ્રારંભ તો થયો છે અને તે સુરતમાં.

એકદરે ઘણાં સાહિત્યધર્માંઓની એવી માન્યતા અને લાગણી છે કે ગુજરાતમાં લેખકોના અનુપાતમાં લેખિકાઓની સંખ્યા હજુ ઘડી ઓછી છે. લેખિકાસત્રનાં અધ્યક્ષા અને સુવિષ્યાત વાર્તાલેખિકા ડૉ. હિમાંશી શેલતે તેમના અધ્યક્ષીય પ્રવચનમાં આ હકીકતનો પડદ્યો પાડ્યો. આમેય ‘લેખિકાસત્ર’માં હિમાંશીબહેનનાં બધાં વક્તવ્યો સમુચ્ચિત રીતે ધારદાર અને મુદ્દાસરનાં હતાં. તેમનો એક વેદ્ધક દાખાંત આપતાં કહું કે મહેન્દ્ર મેધાણી જેવા ઉત્તમ અને સમર્થ વાચક-ભાવક-સંપાદક દ્વારા સંપાદિત અને પ્રકાશિત થયેલા ‘મારી વાચનયાત્રા’ના દણદાર ગ્રંથોમાં લેખકોના લેખોની સંખ્યા ત્રણસોથી વધુ છે, જ્યારે લેખિકાઓના લેખોની સંખ્યા માત્ર નવેક જેટલી જ છે. જો મહેન્દ્રભાઈના સંપાદનમાં પણ

આ સ્થિતિ હોય તો લેખિકાઓને સંદર્ભે અન્યત્ર શી દશા હશે એ કલ્પી શકાય. સ્ત્રીઓ લેખન પ્રતિ કેમ ઓછી વળે છે અને જેઓ લખે છે તેઓમાં પણ લેખન-સાતત્ય કેમ જગ્યાવાતું નથી, તેની મીમાંસા કરવાની સાથે તેમણે સ્ત્રીઓની બીજી સર્જનાત્મક ક્ષમતાઓનો પણ સરસ ઉલ્લેખ કર્યો.

આ લેખિકાસત્રમાં પુરુષલેખકો દ્વારા તેઓની કૃતિઓમાં થતું નારી-નિરૂપણ, લેખિકાઓની રચનામાં સ્ત્રીજીવનનું આલેખન; નવલકથા, ટૂંકી વાર્તા, નિંબંધ અને કવિતાક્ષેત્રે ગુજરાતી લેખિકાઓના યોગદાન વિશે બિન્ન બિન્ન બેઠકો યોજાઈ. રાત્રે કવિયત્રીસંમેલન પણ યોજાયું. બધીયે બેઠકોમાં પુરુષ વક્તાઓ તો બે-ત્રણ જ હતા. બાકીનો સમગ્ર દોર બહેનોએ સંભાળ્યો. આ એક મોટી લાક્ષણિકતા હતી. ‘અભિલ હિન્દ મહિલા પરિષદ’ બુહુદ્દ શાખાનાં અધિકારી અને સુરતનાં માતૃમૂર્તિ સમાન નેવુંવર્ષિયા ધ્રુવતાબહેન પારેખ સત્રમાં અથેતિ હાજર રહ્યાં તે પણ વિશેષ ઉલ્લેખનીય ઘટના હતી.

‘લેખિકાસત્ર’ની બધી જ બેઠકો સાંગ્ખોપાંગ સફણ અને સાર્થક રહી એમ કહેવું યોગ્ય નહીં લેખાય. મંચ પરની બેઠકોમાં થોડીક અધ્યરૂપો અને કચાશ વર્તાઈ. કેટલીક અપેક્ષાપૂર્તિ પણ ન થઈ. પરંતુ તે સ્વાભાવિક લેખાવું જોઈએ. કારણ કે આ પ્રકારનો આ પ્રાય: પ્રથમ પ્રયોગ અને તજજન્ય અનુભવ હતા. આ સત્રને સ્થિંગબોર્ડ સમાન લેખવામાં ઘણું ઔચિત્ય છે. આ સત્રમાંથી મળેલા અનુભવોને આધારે બીજું વધારે સાર્થક અને સુસ્થિષ્ટ આયોજન થઈ શકે અને અહી જે ઉત્સાહ પ્રગટ્યો, દિશા મળી તેને આધારે કહી શકાય કે તેવું આયોજન થશે પણ ખરું. આમ છીતાં આ સત્રમાં કેટલાંક વક્તવ્યો અત્યંત નોંધપાત્ર રહ્યાં. તેમાં કવિતાની બેઠકનાં અધ્યક્ષા ઉષા ઉપાધ્યાય અને નવલકથાની બેઠકનાં અધ્યક્ષા બિંદુબહેન બહેનો સવિશેષ ઉલ્લેખ કરવો જોઈએ.

લેખિકાઓ-કવિયત્રીઓની કેફિયતોનો કંઈક અતિરેક અને પ્રસ્તાર પણ થયો. પરંતુ નવલકથાની બેઠકમાં લોકપ્રિય નવલકથા-લેખિકા કાજલ ઓઝા-વૈદ્યની કેફિયત ખાસ નોંધ માળી લે છે. કાજલબહેન આજનાં ઘણાં લોકપ્રિય નવલકથા-લેખિકા છે. તેમણે જ કહું તે પ્રમાણે તેમની નવલકથાઓ બહોળા વાચકસમુદ્દાય સુધી પહોંચી છે અને તેની ઘણી પ્રતો વેચાતી રહે છે. તેમણે આ પુસ્તક-પ્રસારમાં માર્કટિંગનો પણ મહિમા કર્યો. એક વાત નિઃસંદેહ છે કે કાજલ ઓઝા-વૈદ્ય ગુજરાતી ભાષાનાં કદાચ પહેલાં ‘લોકપ્રિય’ નવલકથા-લેખિકા છે. લોકપ્રિય નવલકથાકારોની આપણે ત્યાં કશી નવાઈ નથી. વિહલ પંડ્યા, સારંગ બારોટ, હરકિશન મહેતા, અધિની ભડ્ઢ, પ્રિયકંત પરીખ, રજનીકુમાર પંડ્યા વગેરે કેટલાંક નામો આ સંદર્ભે ગજાવી શકાય. પરંતુ ‘લોકપ્રિય’ નવલકથા-લેખિકાની પ્રથમ મુદ્રા સંભવત: કાજલબહેનને પ્રાપ્ત થઈ છે. આ એક નવીન નોંધનીય ગતિવિધિ છે. જોકે નવલકથાની લોકપ્રિયતા અને તેના માર્કટિંગનો કાજલબહેન જ મહિમા કર્યો તેનો પ્રતિભાવ હિમાંશીબહેન શેલત તેમના સમાપન-વક્તવ્યમાં આપણે જ એવી અપેક્ષા હતી. અને તે ફળી પણ ખરી. હિમાંશીબહેન કહું કે લોકપ્રિયતા, માર્કટિંગ એ બધું બરાબર છે, પણ સાચા સર્જકની અપેક્ષા અને સાધના તો સર્જનમાં ઉત્કૃષ્ટતાની જ હોય. એમના આ મંતવ્ય સાથે કયો સારો સાહિત્યસર્જક અસંમત થશે? હિમાંશીબહેને હવે આવાં સત્રોમાં કેફિયતોમાંથી બહાર નીકળી જવાની અને આગળ વધવાની આવશ્યકતા પર યોગ્ય રીતે જ ભાર મૂક્યો. મારું

સૂચન એવું રહ્યું છે કે ભવિષ્યે કવિતાઓની જેમ થોડીક ગદ્યફક્તિઓનું પણ પઠન આવાં સત્રોમાં થાય તે ઈચ્છનીય છે, કારણ કે છેવટે તો ભાવકને લેખક કે લેખિકાની કેફિયત કે મથામણ કરતાં તેની ફુતિઓના આસ્વાધની જ વિશેષ અપેક્ષા રહે.

આ ‘લેખિકાસત્ર’ ગુજરાતી લેખિકાઓ, કવિયત્રીઓમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કર્યો છે, તેવી મારી પ્રતીતિ છે. ‘સાહિત્યક્ષેત્રે’ અમે સાવ ઉપેક્ષિત કે સેકન્ડ કલાસ સિટિઝન જેવાં નથી’ એવો આત્મવિશ્વાસ બહેનોમાં પ્રગટ થયો હોય તો તે પર્યાપ્ત લેખાવું જોઈએ. એ તો સ્પષ્ટ છે કે લેખિકાઓ લેખકો અને ભાવકો પાસે કૃપાદિષ્ટ માગતી નથી. તેઓને ‘કૃપાગુણથી ઉતીર્ણાં’ના પ્રમાણપત્રની આવશ્યકતા પણ નથી. નારીમુક્તિવાદ આ સત્રમાં પ્રારંભે સહેજ ડોકાયો અને સત્રઅધ્યક્ષાની ટકોર પછી તે લુપ્ત થયો જે ઈષ્ટ હતું. છતાં નારીવાદના દસ્તિબિંદુથી લખતી લેખિકાઓ અને કવિયત્રીઓની નોંધ સત્રમાં લેવાઈ જ. થોડીક તેવી કાવ્યરચનાઓ પણ રજૂ થઈ. જેમ આજની સ્ત્રી માનવવ્યક્તિ તરીકેનો પોતાનો સ્વીકાર વાંછે છે તેમ લેખિકાઓ અને કવિયત્રીઓ પણ જાતિનિરપેક્ષભાવે એક સાહિત્યસર્જક તરીકેનો પોતાનો સ્વીકાર ઈચ્છતી હોય તો તે યોગ્ય જ છે.

તા. ૧૨-૬-૨૦૧૦

**ભગવતીકુમાર શર્મા**

## આશા

પ્રભાતે મંદ પ્રસ્યંકે પૃથ્વીનું પોપચું ખૂલે,  
નવેલાં તેજાનાં દર્શો ઘડી આનંદમાં જૂલે.

વિભાવરી નીંદરમાં વિતાવી

પ્રભાતનાં મંગલ સ્વખ સેવતાં;

કોલાહલે, કિંતુ, દિને નિહાળી

મીઠાં બધાં એ ઉરસ્વભની રિતા !

સન્ધ્યાનાં શાન્ત અંધારે પૃથ્વીનું પોપચું ઢેણે,  
ભાવિનાં નવલાં સ્વને ફરી એકાન્તમાં સરે.

[‘સત્રમાર કવિતા’]

**- ઉમાશાકર જોશી**



## સ્વગત સર્વોક્રિતિ | હરિદ્રષા પાઠક

(મંદિકાન્તા સોનેર)

માન્યો સૌઅ ગહન-ગલીરો, છીછરો કાં વહું છું ?  
શ્રદ્ધા - જેની મુજપર - પડી સાવ ભોઈ લહું છું.  
વાતે વાતે વળ બદલતો, છેતંદું જાત પહેલાં -  
જેથી હૈયું લવ ન થડકે અન્યને છેહ દેતાં.

દૂંકા સ્વાર્થે નિજ, અવરની હાણ છાની કરું છું,  
દાવા પાછો પ્રબળ કરતો : શ્રેય સૌનું ચહું છું.  
પામ્યો ઉંચાં પદ અવનવાં ને રણ્યો કઈ પ્રતિષ્ઠા  
ખેલ્યું બેદી છળ, ધરી દીધી હોડમાં સર્વ નિષા.

ભોગો-જોગો પણ પનારું પડજું જેમને તે  
વાળી લેતાં મન : વરદ કેવો ફળ્યો વક રીતે !  
સાચી-ખોટી સમજણ ધરીને કશો બાખડાંચો છું;  
આજે પાછો અચરજ કરું - શો મને સાંપડવો છું !  
માહું લાગ્યું કદીક પણ ? - તો ચીતવો સ્વસ્થ વિશે,  
નિઝાતિનું સુખ રળવિયું લો, નજીવા નિમિત્તે....

## નિયતિ | પ્રા. મુર્કુંદ દ. ભટ્ટ

નીકળવું હતું આમ અને તેમ નીકળ્યા !  
ધાર્યાંતા જે આધાર નિરાધાર નીકળ્યા.  
મળવાનાં હતાં રાજ ને મળવાના હતા પાટ,  
ત્યાં મળ્યાં વલ્કલ ને વનવાસ નીકળ્યા.  
સંધાય માંડ સાત ત્યાં તૂટી જાય તેર,  
માન્યાંતા જે હમદમ તે જલ્લાદ નીકળ્યા.  
ધરે છે કારવાં બસ ખાનાબદોશની જેમ,  
થાક્યા ચરણની શોધમાં વિસામા ન નીકળ્યા.  
વિશ્વાસે દૂલ્યાં હાણની વ્યથા લંડારવી રહી,  
માલમ પર માંડાતી આશ તે છળનાર નીકળ્યા.

## મરીજ | હરીશ મીનાશુ

આ સતત અવગણના એની મહેરબાની છે, મરીજ  
સાવ ભીની આંખ ને ભીતર વિરાની છે, મરીજ  
ખુદ ખુદાની આપણા જેવી કહાની છે, મરીજ  
મુખવટો છે ને ઉપરથી આ બુકાની છે, મરીજ.  
દર્દની બાબત બહુ મિથ્યાલિમાની છે, મરીજ  
ઔષધિ યે કરગારે, કારણ ? - સ્વમાની છે મરીજ.  
આપણી યે પંખી જેવી ખાનદાની છે, મરીજ  
મારીનો મનખો ને મન તો આસમાની છે, મરીજ.  
ઓ ને કાયમ કાફ્ફિયે રમજાટ રવાની છે, મરીજ  
સ્થિરતા સાથે રદીકે તે જ શાની છે, મરીજ.  
એક કષણની માનતા તો મેંય માની છે, મરીજ  
જ્યાં મરણની ટોચ ઉપર જિન્દગાની છે, મરીજ.  
આપણો કરતા રહ્યા તૌબા ને એ ભરતો રહ્યો  
તે જ છે રહેમત વળી અનહંદ તુકાની છે. મરીજ.  
મેં તને જોઈને લડખડવાનો લય શીખી લીધો  
બાકી આ બંદાને ક્યાં આદત નશાની છે, મરીજ.  
ના, નથી ઓછી મદિરા કે ન ગળતું જામ છે  
પણ હકીકતમાં તરસની બેઈમાની છે, મરીજ.  
જામમાં છે બે'ક પરપોટા વળી ગીણી તરફ  
કે હવે તો માન, દુનિયા સાવ જાની છે, મરીજ.  
સાવ ખાલી ગલાસમાંથી ચુસ્કીઓ ભરતો રહે  
રિન્દની આ રિક્તતા કેવી રૂહાની છે, મરીજ.  
અન્યની મોજૂદગી તો છે જ ક્યાં નવખંડમાં  
તે છતાં ખંડિત અરીસે ભીડ શાની છે, મરીજ.  
આપણો જાયક ને એની બાંધી મૂઢી લાખની  
રાખ ધરપત : એ સખી દાતાર દાની છે, મરીજ.  
જો, હદ્ય ઊછળે કે આ તો એની અંધાણી જ છે  
પાંખડી પર કોકના નખની નિશાની છે, મરીજ.

તુંજ તો અલ્લાહના નામે ઉલા મિસરો અને  
શબ્દના સોગંદ, મારું નામ સાચી છે, મરીજ.  
તાળીઓના ગડગડાટે ભરસલામાં તું સંદ  
જે કથા કહેતો રહ્યો તે સાવ છાની છે, મરીજ.  
રાખજો ગીણો ભરોસો આ ગઠલની વાત પર  
સાવ મૂંગી એક કન્યાની જુબાની છે, મરીજ.  
આ ગઠલ મારી અને મકતામાં તું, કથા બાત હૈ  
સૌ કહે છે આ તો તારી માનહાનિ છે, મરીજ.

પુષ્યસ્મરણ : મરીજ

### નીકળું છું... | હર્ષ બ્રહ્મભક્ત

શોધવા જયારે તને હું નીકળું છું,  
ક્યાંક તારામાં જ જિલેલો માનું છું.  
હોય છે કયા કોઈ પોતાનું છતાં પણ,  
બાચકા ભરવા હવામાં નીકળું છું.  
માનવાથી તો મટી જાશો નહીં કે,  
હું પણ કયા માનતો કે ફળફળું છું.  
કાંકરા ખખડી રહ્યા છે હંડલીમાં,  
મન ખલીઝનું મળ્યું છે સાંભળું છું.  
હોઉં છું સિદ્ધાર્થ હું વેલી સવારે,  
હર્ષ થૈને સાંજના પાછો વળું છું.

### રહ્યું છે | હર્ષ બ્રહ્મભક્ત

બધી અજવાણું ફેલાઈ રહ્યું છે,  
કે અંધારું જ અમળાઈ રહ્યું છે ?  
હતું આકાશના જેવું ઉઘાડું,  
હવે ભળતું જ ચર્ચાઈ રહ્યું છે.  
અજબની સ્વસ્થતા આવી રહી છે,  
કશું ઊરે ધકેલાઈ રહ્યું છે.  
મળ્યું ખાલીપણું પણ પૂર જેવું,  
બધી ધસમસતું વિટળાઈ રહ્યું છે.  
બધું જડમૂળથી છૂટી ગયું તો,  
હશે એ શું ? જે જોંચાઈ રહ્યું છે.  
પવનની જેમ નીકળતું સરળ કયાં ?  
શરીર આપ્યું ઉગરાઈ રહ્યું છે.

### તાર જોડાઈ ગયો છે | નીતિન વડગામા

જૂજવા આકાર સાથે તાર જોડાઈ ગયો છે.  
સાવ નિરાકાર સાથે તાર જોડાઈ ગયો છે.  
બંધ આંખે પણ જગત આખુંય કેવું જળહળે છે !  
જાગતા અંધાર સાથે તાર જોડાઈ ગયો છે.  
દોડતી આવી રહી છે મહેકતી ભીનાશ સામે,  
ગુંજતા મહાર સાથે તાર જોડાઈ ગયો છે.  
ભૂસવા ચાહે અહીં એ ખુદ બધાં ભૂસાઈ જાશે,  
જવતા આધાર સાથે તાર જોડાઈ ગયો છે.  
રોમરોમે સામટી ઊરો સભરતા આપમેળે,  
સ્કેજ અપરંપાર સાથે તાર જોડાઈ ગયો છે.  
સાંપડયું છે આજ ભગવા રંગનું સાચ્યું પગેરું,  
તત્ત્વના આ તાર સાથે તાર જોડાઈ ગયો છે.  
આથ્યા સંઘળા ઉધામા, ઓસરી અંતે ઉપાધિ,  
સાબદી સરકાર સાથે તાર જોડાઈ ગયો છે.

### સતત આ જીવવાનું | હર્ષ બ્રહ્મભક્ત

એકલા ચૂપચાપ ધૂંટાઈ સતત આ જીવવાનું,  
ને બધા જોયા કરે જાશે રમત આ જીવવાનું.  
રીત કઈ ખોટી અને સાચી કઈ, ના થાય નક્કી,  
રોજ શિખવાડે નવેસરથી જગત આ જીવવાનું.  
શોખચલ્યી એક બીતર ખૂબ રંજાડ્યા કરે છે,  
મન સતત તોડી રહ્યું છે મનઘડત આ જીવવાનું.  
બેઉ ઘોડા પર સવારી એકસાથે થાય ક્યાંથી ?  
થઈ ગયું છે બાર-ભીતરની લડત આ જીવવાનું.  
રોજ દઈ પહેલો પરીક્ષા ને પછીથી પાઠ શીખ્યું,  
સ્કૂલથી અવળું મળ્યું છે હરવખત આ જીવવાનું.  
લઈ જશે કાયમ ગુલામીની હંદે આ સંઘળા સંબંધો,  
કોઈ જે ઈચ્છા કરે એવું તરત આ જીવવાનું.

## દીવો પેટાવ મા | ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

ગોખલામાં દીવો પેટાવ મા...  
 પાતાળે ધરબેલી તરસ્યુને વીરડામાં પાછી બોલાવ મા...  
 ખાલીખમ્ય છાતીમાં શાસોની આભારી ભરતી  
 લોહીમાં પાવળુક ઉમરીઓ ચડતી-ઓસરતી.  
 ફૂલફૂલ શાશગારી હિંડોળા બાવળની ડાળે બંધાવ મા...  
 ગોખલામાં દીવો પેટાવ મા...  
 કદરુપા અંધારાં કીઝીની વચ્ચોવચ ઊજે  
 પોપચાંની માલીપા કાળમીઠ પડછાયા પૂગે.  
 સમશાંનું કિરિયારું પૂરવા તું એકલ ઉજાગરા કરાવ મા...  
 ગોખલામાં દીવો પેટાવ મા...

## નામ એનું... | હનીફ સાહિલ

નામ એનું ઘડીકબર લીધું  
 જામ જાણો કે તરબતર લીધું.  
 શોધ એની નગર નગર કીધી  
 નામ એનું ડગર ડગર લીધું.  
 એ સલ્લામાંથી ઉકી ચાલ્યા ને  
 આ રાજાવાનું દરબદ્ધ લીધું.  
 હું અનિમેષ તાકતો જ રહ્યો  
 ધ્યાન એણો ઠધરઉંધર લીધું.  
 આવવા માટે થઈ જ્ઞો મજબૂર  
 મેં વચન પણ અટલ અફર લીધું.  
 અન્ય કોઈ મને જગા ન મળી  
 સજાઓ કરવા મેં એનું દર લીધું.  
 કોણ રહે છે હનીફ તારું અહીં  
 આ નગરમાં તેં કેમ ઘર લીધું.

## ગગલ | તૃપ્તિત પારેખ

વાયુ યે છવઈ ગયો,  
 હુંય થડ થઈ ગયો.  
 શાસ રંગમાં ઢળ્યા,  
 લીલોછમ થઈ ગયો.  
 ડાળ પર ટહુકો મૃદુ,  
 આજ કુપળ થઈ ગયો.  
 મૂઢ ઉપદેશક થયો,  
 પ્રશ્ન કરી પૂછી ગયો.  
 મૂળમાં ગયા પછી  
 મૂળમાં સમર્દ ગયો.  
 ને પછી જૂની તીઠચો,  
 એ ખુદીને પી ગયો.  
 એ જપવન, એ જ જળ,  
 એ જ વૃક્ષ થઈ ગયો.  
 પ્રીત લઈને પોતાની  
 એ જ પાતો થઈ ગયો.  
 મેઘ શો ઝણુંબી એ  
 ‘તૃપ્તિ’ લ્લિજવી ગયો.

## અમે – તમે | મનોહર ત્રિવેદી

જનમજૂઠડા અમે, સાધુડા, તમે જ મોતી સાચાં રે  
 સૂરજનાં અજવાળાંઓ પણ પડે તમસને ટાંચાં રે.

પડછાયામાં અમે રથ્યા

ને થયા તેજથી આધા

ઉતાર્યા ફેંક્યા ને બદલ્યા

નવા નવા કેં વાધા

તમે ગેરુઓ રંગ ચૂન્યો જ્યાં બીજા સરવે કાચા રે.

પાય તમારા અટકે ત્યાં-ત્યાં

કેંક ઉઘદે દ્વાર

હાથ અડે તો થાય ધૂળમાં

કૂપળનો સંચાર

ગળતી ચાતે તંબુરને અમથી ના ફૂટે વાચા રે.

હળ્યામળ્યા ને હેત વર્ણચત્તા,

મળે કોઈ જો સામું

વગર નાંતરે ગયા વ્યથાનું

પૂછીને સરનામું

તમે ઘરેઘર હતા ને અમને રોકે ખૂષાખાંચા રે

જનમજૂઠડા અમે, સાધુડા, તમે જ મોતી સાચા રે

## છોકરાવે કાંઠે જઈ પૂછયું | મનોહર ત્રિવેદી

છોકરાવે કાંઠે જઈ પૂછયું કે નદીબાઈ, આમ તમે કેશીપા હાલ્યાં ?

કુંગરેથી કોતરેથી દોટ એવી મેલી કે કોઈથી જલાવ નહીં આલ્યાં.

શેડે જુઓને, એકબીજાને ખેતર સૌ

પૂછે છે પામી નવાઈ :

એવો તે કેવો આ નેડો લાગ્યો કે

એણો તો રતથોરી લીલી વનરાઈ ?

અકર્તાં થયાં છો તમે પાણીને જોઈ, અરે, આટલાં શું ફૂલ્યાં ને ફાલ્યાં ?

કો'કે તો એમ કંબું : આદૈના દરિયાની

પાણાં છો ગળાડૂબ પ્રેમમાં

એણો તો નદીબાઈ, કેંકને ફસાવ્યા છે

રહેજો ના નાહકના વહેમમાં

નદીએ કીધું કે, અદ્યા, મૂલ જરી ફૂટવા થો, કોઈથી વળશો ના વાળ્યા

છોકરાવે કાંઠે જઈ પૂછયું કે નદીબાઈ, આમ તમે કેશીપા હાલ્યાં ?

## ગિયો ગિયો તિ ગિયો | મનોહર ત્રિવેદી

ગિયો ગિયો તિ ગિયો હાથથી એક છોકરો ગિયો  
જિયો જિયો મેં કશું હાલથી : માટી થઈને જિયો.

ફાટવાતુટવા સગપણમાં ઘર નિત્ય થીંગડા મૂકે  
ઓરંગી ચાલ્યા ઉભર તો કશું ન રૂધેવું ચૂકે :  
નાનકડું ટીપું આ કયાંથી દરિયો આવો થિયો ?

ઘરની નરી, આખા પંથકની ટૂકી પડતી હદ  
હવે મૂળને દોરે માપે હુનિયાભરનું કદ  
રિયો રિયો ના આજ હવે તિ પોતામાં ના રિયો.

કિયા શુકનમાં અડી જે હશે પતંગિયાની પાંખ  
કિની છોળમાં જબકોળાઈ હશે બે કોરી આંખ  
સુજાણ હો તો કહો કે ઈશે રસ ચાખ્યો તિ કિયો ?  
ગિયો ગિયો તિ ગિયો હાથથી એક છોકરો ગિયો

## મિલનસંહિતા | જગદીપ ઉપાધ્યાય

ઘાસ જાગતી ઘાસ, લોહીમાં પ્રજળે લીની આગ, ટેરવાં ચીરી લીજે  
ઘાસ, ઘાસને પવન અડે ને ઉઠતા લીલા સનકારે બે જીવ મળ્યા,  
બાગ વચાળે છોડ છોડવે કૂદતાં ઉઠતાં પતંગિયાની પાંખ શૂળમાં જોઈ  
તા'કડતી ડાળ ડાળીએ મૂક જનમતા ચિત્કારે બે જીવ મળ્યા.

ચૂર વાયરા વાય, ઉઠતાં વાસંતી તોકણ ઉરમાં; ખીલી છે વનરાઈ  
પ્રીતની કેસૂડે ચિક્કાર નીખર્યા રંગ કસુંબલ કેસરિયાળા,  
ક્યાંક રહુકા છલકે, છલકે ક્યાંક વ્યથાઓ, પીંખે વિફળતાઓ; છાતી  
લીસાતી કૂલોથી, આરે અમથાં અમથાં અંગુઢાં, અંગુઢાં કેવાં ? કાગણિયાળાં !  
દેંદું, પૂજા, દેવ બધુંયે પ્રેમ; કપૂરી ઉડે ચાસમાં ચાસ, આલરી વાગે  
રોમે રણજાણ... રણજાણ... મનમંહિરના પગથારે બે જીવ મળ્યા.

આગળ જીવ ઘડીભર, આંખો થાય ઘડીભર આગળ; હાંહે અદ્ધર થાસે  
કડો; એવો કાયામાં તલસાટ મિલનનો ઉછળે કે ના પાટ વોંકળા નડતા,  
વાગે પગમાં શૂળ, ગોખરું, છાલ, સાંચીકાં; ખૂંચે કાંકરા; ઠેલે ચાડતા પથરા  
કરી અણિયાળાં ને ચરણોમાં પડતાં છાલાં; સૂકા હોઠ છતાંયે હસતા,  
રણજ્યા વગડે ભૂષ્યા તરસ્યા; માઘા પગલે સીમ ઝુગરા; સળગ્યા  
ઉલે ચાસ, છતાંયે મન મુકીને માટી કણના સથવારે બે જીવ મળ્યા.

## વાર્તા

### દર્પણ-બિભબ (મનોવૈજ્ઞાનિક કાલ્પનિક) | મધુસૂદન ઢાકી

મને યાદ છે ત્યાં સુધી મને ૧૪મું પૂરું થઈ ૧૫મું વરસ બેઠું હતું. હાઈસ્કુલમાં  
એ સમયની ગજના મુજબ હું પાંચમા ધોરણમાં દાખલ થઈ ગયેલો, ૧૯૪૧ની સાલ. એ  
કાળે આકર્ષક સામાજિક પ્રવૃત્તિઓમાં તો શાંતિમાં સગાંવહાલાં તેમજ કવચિત્ મિત્રોનાં લંજન  
માણસાં એ મોટી અને ખાસ પ્રવૃત્તિ હતી. એવા એક પ્રસંગે હું બનીઠનીને વરઘોડામાં ગયેલો.  
વરઘોડો ન્યાતની વંડીએ ઉત્તરેલો, જ્યાં લગનવિધિ થનાર હતી. રાખેતા મુજબ ત્યાં  
કમાનયુક્ત મુખ્ય ખંડ અને સાથે જોડેલ વિશિકા તે વખતની પ્રથા મુજબ અંદરથી શાશ્વતારેલાં  
હતાં. સંજીવટમાં વિજાળીનાં હાંડી જુમ્મરો ઉપરાંત દીવાલો પર મોટી આરસીઓ લગાવેલ.  
અનેતેના પર શિલ્ડ અને કોસ કરેલ વાવયાઓ ગોડેલ હતાં. કન્યાપક્ષ તરફથી જાનેયા  
તેમજ સ્વપક્ષને અપાતી માયરાની સુવિષ્યાત મસાલેદાર ચાના બે-ત્રણ કપ પી, વરપક્ષ  
તરફથી વહેંચાતા પાનનાં, ડાંસીઠાંસીને મસાલો ભરેલ. પિચામિડ ઘાટનાં, લવિંગ પરશેવેલ.  
પાનનાં સોનેરી બીડાં ચંગરી, કન્યાદાન દેવાઈ ગયા પદીના ગાળામાં, મુખ્ય ખંડ છોડીને  
હું બીજા ભાગોમાં લટાર મારતો હતો. પસાર થતાં અચાનક જ મારું ધ્યાન ભીંત પર લગાવેલ  
એક મોટી આરસી તરફ ગયું. તેમાં સહસ્ર મારું પ્રતિબિભબ જોયું. સરસ ડગલો, બહુ ગોરો  
નહીં પણ વાઉચર્સ કરતાં ઊજળો છેલ્લો, લાંબી રોક્ક નાસેડાં, પાંચાં કાંચાથી થયેલા  
આશા રતુંબડા હોઈ, મોહક આંખો અને આકર્ષક જુલ્દાં સમેતના વંકડિયા વાળ. મને અત્યાર  
સુધી અપરિચિત, અથવા ધ્યાનથી કોઈ વખત ન નીરખેલ એવા મારા સ્વરૂપને હું જોઈ  
રહ્યો. મને એ ક્ષણો, અને પહેલી વાર, લાગ્યું કે હું સોહામણો છું. ભલા આજ દિવસ સુધી  
મને ખબર કેમ ન પડી અને કોઈએ મને ક્રિદું પણ કેમ નહોતું ?

બીજે દિવસે સ્કુલમાં, હેમશાં ગીણાવટબર્ઝૂ અવલોકન કરનાર પણ વિચિત્ર સ્વભાવના,  
નાતીલા પણ ટીકાખોર સહાય્યાયીએ મને ટોક્યો : “ગઈ કાલે વંડીમાં તમે વારંવાર અરીસા  
સામે ઊભા રહી નીરખતા હતા. જાણે તમે તમારા રૂપ પર મોટી પડ્યા કેમ ન હોય !”  
હું બોંદી પડી ગયો. થોડો ગુરુસો પણ આબ્યો. પણ અને દબાવી કંઈ પણ બોલ્યા સિવાય  
આંદું જોઈ ગયો. પછીથી મને લાગેલું કે એની વાત અમુકાંશે સાચી તો હતી; પણ પકડાઈ  
ગયાની લાગજી હઠતી નહોતી.

પદીના મેટ્રિક સુધીના અને કોલેજનાં વર્ષોમાં મેં મારા દેખાવ પર ખાસ ધ્યાન આપેલું  
નહીં. હા ! એક વખત આચાર્ય અનેના ‘લગ્નની બેડી’ નાટકના એક મહત્વના પાત્ર –  
પણગ – તરીકે ભાગ ભજવવાનું કોલેજના મહોત્સવ-મંત્રીએ ભાવપૂર્વક (અને ભારપૂર્વક)  
કહેલું, જે વાત મેં હસી કહેલી.

ગ્રેજ્યુઅશેન પણી ઘેર આવ્યા બાદ વિશેષ અભ્યાસાર્થે વિદેશ જવાના બે વર્ષ સુધી  
લાગલગાટ કરેલા પ્રયત્નો નિષ્ણળ જતાં નિરાશ થઈ ગયેલો. મને લાગ્યું કે લોકો હવે મારી  
વાતો કરતા થયા છે કે ભાજી ગજીને આવેલ આ છોકરો કંઈ જ કમાતો નથી અને

બાપદાદાના પેસે મોજ કરી ફર્યા કરે છે ! એ કપરા કાળ દરમિયાન એક તરફથી મેં દેવસ્થાનોમાં અને ધર્મગુરુઓને મળવા જવાનું શરૂ કર્યું અને બીજી તરફ સાંજે નવા મિત્રો સાથે ફરવા જવાનો કમ રાખેલો. એક સાંજે એવા એક મિત્ર મને મળવા ઘેર આવેલા. હું દસ્કિશની બારી પાસે ખુરશી પર બેઠેલો અને એ મારી સામે બેઠેલા. એકાએક ‘ઓ હો હો, બારીમાંથી આવતા તેજમાં તમારો જમણો પ્રોફ્શાહીલ ખૂબ જ સુનદર લાગે છે !’ હું ચ્યામક્યો, એમના ગયા પછી સામેના કબાટમાં જરેલા લંબા અર્ધ આયનામાં મેં મારું મોઢું જોયું. કંડારેલ પોર્ટ્રેટ શિલ્પ સમાન એ ભાસી રહ્યું હતું !

એ દિવસોમાં શહેરની એક વિષ્યાત બેન્ક તરફથી જાહેરખબર પ્રસિદ્ધ થયેલી કે અંગેજુ પર પ્રભુત્વ ધરાવતા ને વ્યક્તિત્વશાળી ગ્રેજ્યુએટની એમને જરૂર છે. આવી વ્યક્તિઓએ અરજી કરવી. અમારા ગામમાં એ કાળે તો ગણ્યાંગાંકા જ ગ્રેજ્યુએટ હતા, અને એ બધા પોતાપોતાના ધ્યે લાગી ગયેલા. મને થયું લાવ તોશિશ કરી જોઉં. નોકરી મળવાની શક્યતા સારા પ્રમાણમાં છે. ઘેર પૂછી જોયું. ગુરુજીનોની પણ સલાહ લાંધી. સૌઅં હા પાડી.

અને ઈન્ટરવ્યૂનો કાગળ પણ આવ્યો ખરો. મારે બીજે જ દિવસે સવારે ૧૧.૩૦ના સમયે બેન્કમાં પહોંચવાનું હતું. જવા માટે તૈયાર થઈ હું અમારા મકાનના સૌથી ઉપવા મજબુતે બાપુજીના કબાટના મોટા આયનામાં મારો પોશાક. ટાપ્ટીપ, ને વાળ કેવા ઓળાયેલા છે તે જોવા ગયો. મને લાગ્યું કે હું ખરેખર સરસ લાગ્યું છું. મારું પ્રતિબિંબ ધ્યાન દઈ વિગતવાર જોઈ રહ્યો હતો. પણ આજે મને એમાં કર્દી જુદ્ધાપણાનો આહેરો ભાસ થયો. મારી ચેષ્ટાઓ, ચહેરાનાં હલનચલન આહિ તો બરોબર બિભિત્ત થઈ રહ્યાં હતાં; પણ મુખભાવ ? મને લાગ્યું કે એની આંખોમાં આછો શો વંગ, કર્દી નિશ્ચય જણકતો હોવાનું કેમ લાગી રહ્યું હતું ? મને થયું કે ભ્રમ થઈ રહ્યો છે. હું સહેજ ગમ્ભરાયો. પણ બિભભાં ચેહેરા પર એ ભાવ ઊઠ્યો નહીં. ભાવસૃષ્ટિમાં બિભા મારાથી સૂક્ષ્મ રીતે જુદી જ રીતે વરતી રહ્યું હોય તેવો ભાસ થઈ રહ્યો હતો. Am I suffering from illusion ? Split personality ? Schizophrenia ? અને હવે જે બન્યું તે કલ્યાણાત્તિત હતું, હું ડર ખાયેલ હાલતમાં પણ પૂતળાંસરાની સ્થિર મુદ્રામાં ઊભો હતો. પણ બિભા એકાએક active બન્યું. આયનામાંથી કુદી બહાર આવ્યું. અવાક્ બની, જમણી બાજુ વળીને મેં એની સામે જોયું. હવે એની બધી જ ચેષ્ટાઓ આમ તો મારા જેવી જ હતી. પણ ધ્યાન ભેંચે તેવી વાત એ હતી કે એનો સેંથો દર્શણમાં દેખાય છે તે પ્રમાણે ઊભાં હતો. હું બીકનો માર્યો જરૂપથી દાદરા તરફ વળ્યો એ પણ મારી જોડાજોડ, કદમ મિલાવી સમાંતર દાદરા પરથી ઊતરવા લાગ્યું. મને થયું કે એ ઊતરે છે તે ભામક સીડી પર જો હું ભૂલથીયે પગ માંડી દઈશ તો ધંનોરો ગબડતો ગબડતો નીચે જઈશ ! આશર્વની વાત એ હતી કે ઘરમાં મારા સિવાય કોઈ જ એને દેખતું નહોતું. રસ્તા પર પણ નહીં. (ક્યાંથી જોઈ શકે ? એ આયનાના આધાર વગરનું બહાર નીકળી આવેલું બિભા હતું !) અમે ચાવતા હતા ત્યારે સામેથી આવનારાઓમાં કપડાનાં પોટલાં લાદેલ ગણેડા પર બેઠેલ ધોળના છીકરામાંથી બિભા સાંગ્યોપાંગ પસાર થઈ ગયું.

બેન્કનું મકાન મારા ઘરથી દોડેક ફલાંગ જેટલું જ દૂર હતું. દરેક મિનિટમાં મેનેજરે

મને બોલાવ્યો. એમના ટેબલની સામેની ખુરશી પર હું બેઠો ને બિભા બાજુની ખુરશી પર. મેં એ તરફ જોવાનું બંધ કર્યું. વીસેક મિનિટના ઈન્ટરવ્યૂ બાદ મેનેજરે કહ્યું ‘સારું,’ તો પહેલી તારીખથી જોડાઈ જાઓ. તમને એપોઇન્ટમેન્ટ લેટર મળી જશે.

વળતાં મારી જોડે ચાલતા બિભાની સામે મેં નજર પણ નાખી નહીં, મને એના પર નહરત આવી ગઈ. ઘેર આવી સડસડાટ સીડીઓ ચઢી ચોંચે મારે પહોંચે ગયો. બિભાં પણ મારી જોડે જ ! અરીસા સામે અમે બને ઊભા હતા. મેં એને નિશાની કરી કે પાછું અરીસામાં ઘૂસ્લી જા ! જ્યાંથી આવ્યું છે ત્યાં : પણ એના ચહેરા પર ખંધું સ્થિત ઊપસી આવ્યું. એણે મારા તરફ હાથ લંબાવી મારો સ્પર્શ કરવાની ચેષ્ટા કરી, અને કોણ જાણે શું થયું, મને આંખે અંધારાં આવવા લાગ્યાં. મારી ચેતના હરાઈને બિભામાં પ્રવેશતી હોય તેટલું હું એ ક્ષણોમાં કળી શક્યો. હું હવાથી પણ પાતળો, શક્તિવિહીન બની ગયો. વાસ્તવમાં હું બિભા બની રહ્યો હતો. અને બિભાનું ‘હું’માં પરિવર્તન થઈ રહ્યુંહતું. બધું નિમિષ માત્રમાં બની ગયું. બીજી જ ક્ષણો બિભા મારી આયનામાં હડસેલી દીધો અને ત્વરાથી સીડી ઊતરી નીચે ચાલ્યું ગયું. આ ક્ષણથી મારું અસ્તિત્વ કેવળ ભાવથી જ રહ્યું. એ પછીની પળથી બિભાની તમામ કિયાઓ, જે અન્યથાં હું જ કરવાનો હોઈશ, તે અનુભવી રહ્યો હતો. મારામાં તો હવે મારી મૂળ ચેતનાનો અંશ માત્ર રહેલો. હું હવે બે સ્વરૂપે જીવતો હતો. એક તો એનાં તમામ સંવેદનો, કાર્યોના સાક્ષી રૂપે, પ્રત્યક્ષ દ્રષ્ટા રૂપે : બીજું મારી સ્વતંત્ર રીતે પણ વિચારી શકતો હતો. આ બધું યુગપત્ર થયા કરતું હતું. હું આમ તે પળથી દેંત સ્વરૂપે જીવી રહ્યો.

મેં આયનામાંથી બહાર નીકળવા પ્રયત્ન કર્યા. પણ અસંભવિત ! હું દ્રવ્ય રૂપે હવે રહ્યો નહોતો, આફૂતિ રૂપે પણ નહીં. મારામાં કોઈ પ્રકારની Substantiality હતી જ નહીં. હું પૂર્ણત્વાં અમૂર્ત, નિરાકાર બની ગયો હતો. પ્રેતાત્મા તો હરીફરી શકે : કવચિત્ વાદળના ટુકડામાંથી સર્જન થયું હોય તેમ દેખાડો પણ દેય, તો અનુકૂળ વાતાવરણમાં પૂર્ણાકારે, મૂળ પૌર્ણગલિક આભાસ સાથે પણ પ્રગત થઈ શકે. પણ મારું તો માત્ર જ્ઞાનથી જ અસિત્તવ હતું. હું પૂર્ણત્વાં અકર્તા બની ગયો હતો. દુઃખી થઈ ગયો. મેં વિચાર કર્યો કે ‘એ’ જો આયના સામે આવે તો હું કૂદકો મારી બહાર નીકળી એને આયનાની અંદર ધકેલી દઉં અને પછી તરત જ આયનાને પથર મારી તોડી નાખું પણ એ ઘણો જ લુચ્યો નીકળ્યો. ક્યારેય એ આયના સામે આવ્યો જ નહીં. કબાટની બાજુના બારણામાંથી એને અગારીમાં જવું હોય તો પણ તે આયનામાં દસ્તિ નાખ્યા સિવાય જરૂપથી બાજુમાં થઈ ચાલ્યો જતો.

આમ દિવસો, મહિનાઓ, વર્ષો વીતી ગયાં. એ ક્યારેક સારાં કામો કરતો. એનું શોધકાર્ય પણ વખણાયું; પણ ક્યારેક એ મૂર્જ, નિર્બંધ અને બીરું રૂપે વર્તતો. આમ તો પ્રામાણિક હતો. નીતિમાર્ગ પર ચાલનાર હતો, સત્યવક્તા હતો. પણ ક્યારેક કોઈક દબાણને કરારો યા failure to rise to the occasion સરખી ક્ષણોમાં ન કરવાનું કરતો કે મૂઢ અને મૂક બની જતો. ત્યારે મને એના પર દ્રાઘ આવતી તો કેટલીક વાર ગુસ્સો આવતો. એનાં સુખદુઃખો, દર્દો-બીમારીઓ, મારે અનુભવવાનાં, બોગવવાનાં રહેતાં. એ હવે વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂક્યો હતો. મારાથી જુદા પડ્યાને હવે તો સાઠેક વર્ષ વીતી ગયાં હશે. દરમિયાન ઘરમાં આ આયનાવાળો કબાટ વેચાઈ ગયો. એક સુખડીયા પરિવારે તે

ખરીદેલો. બીજું બધું, રાચરચીંબું પણ વેચાઈ ગયું. છેવટે ઘર પણ. સ્થળાંતરોમાં કબાટના આયનામાં મારી કેદીની અવસ્થા તો ચાલુ જ રહેવાની હતી. એ પરિસ્થિતિમાંથી ક્યારે છૂટીશ તે વિશે વિચારતાં મને લાગ્યું કે એ ‘હું’ રૂપે રહેલ બિભાગના મૃત્યુ સાથે, એની ચેતના છૂટી પડતાં જ આ આયનામાં એનો ‘મારા રૂપે’ જે અંશ બંધનાવસ્થામાં નિષ્ઠિ રૂપે પડેલો છે તે પણ છૂટીને તેમાં બળી જશે અને પૂર્ણ બનેલી ચેતના અણાત અલોકમાં જશે. હે ઈશ્વર ! યા અલ્વાહ ! મારા પર દયા કરો ! રહેમ કરો ! મારી અંશ માત્ર રહેલી આયનાસ્થ ચેતના વચ્ચે વચ્ચે રડી રહેતી, પણ આંસુ વહી શકે તેમ નહોતાં.

મને એક પ્રશ્ન ઘણી વાર ઉઠ્યો રહેતો. હું શા માટે આ અવદશાને ભેટ્યો ? હાઈસ્કૂલના દિવસોમાં મારા રૂપથી સંપ્રણાત બન્યો તે ક્ષણમાં એનું બીજ હશે ? શું હું મારા પોતાના ઘ્યારમાં પડી ગયો હોઈશ ? ના, ના, ના. હું narcissismમાં ફસાયો નહોતો. મારી તો કેવળ aesthetic દસ્તિ જ રહી હતી. તો પછી મને એનો ગર્વ થશે હશે ? આગમોમાં ‘મદના પ્રકારોમાં ‘જાતિમદ’, ‘કુલમદ’, ‘ઔચ્ચર્યમદ’, ‘વિદ્યામદ’ અને અન્ય મદ્દો સાથે ‘રૂપમદ’નો પણ ઉલ્લેખ થયેલો છે. કદાચ એ કારણો મારે આ શિક્ષા સહન કરવી પડી હશે ? સંભવ છે રૂપનો ગર્વ – Vanity – આ ઘોર સંજ્ઞા પાછળ નિમિત બન્યો હોય. પ્રકૃતિના કોઈ અકળ લક્ષણને કારણે, કન્યૂનને પ્રભાવે પ્રગટ થતી વિરલ પ્રક્રિયાને કારણે હોય. જે હોય તે. છુટકારાનો દીન હવે બહુ દૂર નહોતો. હું હવે બિભાગમાં રહેલ ‘હું’ ના અંતઃકાળની પ્રતીક્ષા કરી રહ્યો છું !

## કદરદાન | ઉજમશી પરમાર

હીરાભાઈ શેઠને અશાંકની સાથે પ્રથમ મુલાકાત થઈ હતી તે દિવસ આજે પણ બારાબર યાદ છે. અશાંક રહેતો હતો તે વિસ્તાર તો નામ માત્રની સોસાયટી. નાની નાની જોલીઓ જેવાં સર્ઝંગ ગાળાનાં ઘર. રસ્તા જાણે ઓછા સાંકડા હોય તેમ ઘર બાહાર બકરીઓ બાંધી હોય. મરદાં ચિચિવારીઓ મચાવતાં હોય ને બાંદી બચેલી જીવ્યામાં પાંગના દોરાને કાચ પવાતો હોય ને કાં તો સૂતરમાંથી દોરડાં વણતાં હોય. કોઈં અને સૂકી આમલી – તાડકણીની સાથે ઈંડાનાં સ્ટેન્ડની લારીઓ અને આ બધાંમાં પાછી મગજ ધમધમાવી ઢે એવી આમલેટ તળાવાની ગંધ... એટે આવી સાંકડી ગલીઓમાં તેમની ગાડી કેવી રીતે અંદર આવી શકે ? તેથી ગાડીને સોસાયટીની બખાર જ પાર્ક કરીને તે પરે ચાલતા અંદર આવ્યા હતા.

વાત એમ હતી કે બે જ દિવસની કમળાની બીમારીમાં તેમનો ડ્રાઇવર દિલશાદ ભરયુવાનીમાં ગુજરી ગયો હતો. તેમને ખબર હતી કે તેનું કુંબ બહુ મુશ્કેલીમાં દિવસો કારી રહ્યું હતું, કેમકે પરિવારમાં તે જ એક માત્ર કમાનાર હતો. તેમના ગુમાસ્તા મણિકાકાએ તો કંધું,

“અરે સાહેબ, આવી રીતે તમે કેટલાને મદદ કરશો ? કબૂલ કે એ તમારો ડ્રાઇવર હતો, પણ એ તો બીમારીમાં મૃત્યુ પામ્યો છે, એમાં કોઈ શું કરે ?”

પણ હીરાભાઈ જેમનું નામ, દિલશાદની માને પેસા દેવા રૂબરૂ આવ્યા અને હાથોહાથ બે હજારનો ચેક આપીને ત્યાંથી વળી નીકળ્યા. પાછા વળતી વખતે થોડી નિરાંત હતી, એટે આસપાસ બધું જોતાં જોતાં આવતા હતા, એમાં એક નાનકડી ઓરડીમાં તેમજે જે જોયું તેનાથી તેમના પગ રોકાયા વગર ન રહી શક્યા. વીસ-બાવીસનો એક યુવાન કેનવાસ પર પીંઠીથી ટચિંગ કરી રહ્યો હતો. પેઇન્ટિંગ પર ઝૂકેલા તેના ધ્યાનમળન ચહેરાનો પોણો ભાગ તો જાલરની જેમ લટકતાં તેના ઝુલ્ફાંથી ઢંગઈ જતો હતો. કેટલીય વાર સુધી તેનું ધ્યાન જ ના ગયું કે છેક તેની નજીક આવીને કોઈ તેની કામગીરી નિહાળી રહ્યું છે. કોઈએ તેનું ધ્યાન આગંતુક પ્રત્યે દોર્યું, ત્યારે તેણે પીંઠીને પેલેટની સાથે બાજુ પર મૂકી કર્યું, “વાહ ! પેઇન્ટિંગ તો સરસ બનાવો છો !”

તેણે તેમને બેસાડા માટે આજુબાજુ કંઈક શોધી જોયું.

“નહીં, બેસનું નથી, આ તો અહીંથી પસાર થતો હતો ને તમારા પેઇન્ટિંગ પર નજર પડી ગઈ. આ પેઇન્ટિંગ ક્યારે પૂરું થશે ?”

“એ તો કેવી રીતે કહી શકું ? ક્યારેની વાત ક્યાં કરું, પૂરું થશે કે કેમ એય મોટો પ્રશ્ન છે.”

“કેમ ? એટલો આત્મવિશ્વાસ તો કળાકારમાં હોવો જોઈએ.”

“આત્મવિશ્વાસની વાત નથી ચાચા, પેઇનટિંગને કદી પણ પૂરું થયું એમ કહી શકાય નહીં.”

હીરાભાઈને લિયોનાર્દ્દ-વિન્ચીનું એક વિષ્યાત વાક્ય યાદ આવી ગયું, જે અદલ આને મળાંતું આવતું હતું.

“વાહ !” હીરાભાઈ કળા વિશેની તેની સમજ પર વારી ગયા. તેનો સમગ્ર દેખાવ અને તેના વિચારો એક ધૂની કળાકારની છાપ ઊભી કરતા હતા.

“તમારું નામ ?”

“જી, અશાંક.”

“આ સિવાય બીજું કઈ કામ ?”

“અરે જનાબ, આનાથી મોટું બીજું કંધું કામ હોઈ શકે ?”

હીરાભાઈ પાસે તેના સવાલનો કોઈ જવાબ નહોતો.

“ભાઈ અશાંક, આ પેઇન્ટિંગ પૂરું થાય પછી મને ઝોન કરીને જણાવી શકશો ? આ મારું કાર્ડ છે.”

“શાના માટે ? હું સમજ્યો નહીં.”

“આ પેઇન્ટિંગ માટે મારી ચેમબરમાં મૂકવા માટે જોઈએ. પેઇન્ટિંગની કિંમત પણ જણાવશો, જેથી મારો માણસ આવીને તે આપી જશે અને પેઇન્ટિંગ લઈ જશે.”

“શુક્કિયા, આપના જેવા કદરદાન બહુ ઓછા મળે છે. માણસ મોકલવાની જરૂર નથી. હું જાતે પેઇન્ટિંગ પૂરું થયેથી લઈને આવીશ.”

હીરાભાઈએ તે પેઇન્ટિંગ ખરીદું અને તેની ઓંકવામાં આવેલી કિંમત કરતાં એક હજાર રૂપિયા વધારાએ ચૂકવ્યા અને અશાંકની મહિનાઓ સુધીની રોજગારી પૂરી પાડી દીધી.

પણ અશક્ષાકને ખબર હતી કે આ તો એક સુખદ યોગ હતો અને આવા યોગ રોજ રોજ નથી રહ્યાતા, અને રોજગારી તો રોજની રોજ જોઈતી હોય છે. પછી મહિનાઓ સુધી તે ડોકાયો નહોતો અને હીરાભાઈ તો એટલા બધા વ્યસ્ત રહેતા કે તેના ઘર સુધી જઈ શકતા નહીં. પછી તો તેમનાથી તેને યાદ કરવાનું વીસરાઈ ગયું.

વચ્ચે એકાદ વાર તે ડોકાયો હતો, પણ ત્યારે હીરાભાઈની ચેમ્બરમાં પિટિંગ ચાવી રહી હતી. તેણે ચિહ્ની મોકલવાની. અને તેને બેસવાનું કહેવામાં આવ્યું, પણ પછી કલાકેક વિતી ગયો, છેવટ કંયાળીને તે જતો રહ્યો.

પછી તો વરસેક નીકળી ગયું. વળી પાછી ફુરસદની ક્ષણે સામેની ભીતે લટકતાં પેઇન્ટિંગ ઉપર તેમની નજર પડી ને તેમને અશક્ષા યાદ આવી ગયો. કેવો સરસ કળાકાર ! તેની એક જ મહેશ્યા હતી કે તેના પેઇન્ટિંગનો વન મેન શો આર્ટગેલેરીમાં યોજાય. તેના માટે તેણે તેમને ઝોન દ્વારા વિનંતી પણ કરી હતી કે તેમણે ખરીદેલું પેઇન્ટિંગ ફક્ત પ્રદર્શન માટે એક અઠવાહિયા પૂરું જો તેઓ આપી શકે તો મોટી મહેરબાની. તેમણે તે માટે ચાંઝુશીથી સંમતિ પણ આપી હતી, પણ તે સમય વીતી જવા છતાંય આવ્યો જ નહોતો.

“શું કરતો હશે ? તેની પાસે ઝોન તો હતો નહીં. હવે તો મણિકાકાને પૃથ્યા કરવા મોકલવા પડશો.” હજુ તે વિચાર જ કરતા હતા ત્યાં જ અશક્ષાકની ચિહ્ની અંદર આવી. તેમણે તરત કહ્યું, “અંદર મોકલો..”

તે અંદર આવ્યો ત્યારે હીરાભાઈ ઝોન પર વાત કરી રહ્યા હતા. તેમણે તેને બેસવાનો સંકેત કરીને વાત ચાલુ રાખી. હવે પાછાય કેવી રીતે જતા રહેવાય, નાશ્ટટકે આવીને તેમને ખવેલ ન પડે તેવી રીતે સાચવાને એક ખુરશીમાં બેઠો.

વાત કરતાં કરતાંય હીરાભાઈ તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા, જોઈને તેમનો જીવ બળી ગયો, તેના હવામાં ફગફગતા કોરાં જુલ્ફાંમાં કેટલાય સફેદ વાળ દેખાઈ રહ્યા હતા. પોતે ઊભા થઈને તેના માથામાંથી એટલા સફેદ વાળ ચૂંટી લે તો ? અરે નહીં નહીં, અશક્ષાકને કેવું લાગશે ? તેની આંખોમાં પણ રંગબરી અંય હતી. તેના ચહેરાની સમગ્ર મુદ્રા એક ઉદાસીભરી કવિતા જેવી લાગતી હતી. હવે તેમની ઝોન પરની વાત ગૌણ અને પ્રત્યક્ષ નિરીક્ષણના કારણે મનમાં ચાલવા લાગેલો સંવાદ મુખ્ય બની ગયો. આ સંવાદમાં ઝોનની વાત અંતરાય જીવી લાગતાં તેમણે તે જલ્દી જલ્દી ઢૂકવી દીધી. તેના કારણે વાતમાં થોડી રૂક્ષતા પણ આવી ગઈ, જે તેમના સ્વભાવમાં નહોતી, “જુઓને જવરાજભાઈ, હમણા એક તો મંદીનો સમય છે, વળી હાથ પણ થોડો ભીડમાં આવી ગયો છે. હા હા બદ્ધ, તમને તો મજાક જ લાગે ને, પણ ખોડું શું કામ બોલું ? કેટલાય સમયથી કાર બદલવાનો મારો વિચાર ખોરંબે પડ્યો છે. ઝીજ પણ બદલવાનું છે ને તે માટે ઘરવાળાં તકાજો કરી રહ્યાં છે. નાના બદ્ધ, હમણાં તો તમે બીજી કાંઈક વ્યવસ્થા કરો, ખોડું ન લગાડતા, ચાલો ત્યારે, મળીએ..”

તેમણે રિસીવર ઉપર ઝોન એવી રીતે મૂકી દીધો કે જાણે છાતી ઉપરથી પહાડ ઉત્તાર્યો હોય. આટલી ઉદાસીમાંય અશક્ષાકના મોં ઉપર જરાક મલકાટ આવી જ ગયો. બસ, એ મલકાટ જોઈને હીરાભાઈને એટલી બધી રાહત વળી ગઈ કે પેલા થોડાક સફેદ વાળ જોવા પડ્યાનું દુઃખ વિસારે પડ્યું.

“શું ખબર છે અશક્ષાક ?” તેમની આંખોમાં હરખનો ચમકારો વરતાયો, “આજ તો હું ખરેખર બહુ કંયાળી ગયો, પણ તું આવ્યો એટલે હળવો થઈ ગયો. બોલ, શું લઈશ, ચા પીએ ??”

અશક્ષાક કંઈ બોલ્યો નહીં, પણ એવી રીતે ડોક હલાની કે તેમને લાગ્યું કે તે ચા પીશે. તેમણે કેશુને બોલાવીને ચાનું કહ્યું, “હવે બોલ, તારું પેઇન્ટિંગ કેમ ચાલે છે ? તેને બહુ દિવસો પછી જોયો, એટલે લાગે છે કે વન મેન શો યોજાઈ જાય એટલાં પેઇન્ટિંગ તો થઈ જ ગયાં હોવાં જોઈએ.”

અશક્ષાકનો ચહેરો રૂ જેવો સફેદ થઈ ગયો. તેણે એવી રીતે આંખોમાં ને આંખોમાં જ નકાર ભજ્યો કે હીરાભાઈનું કાળજું બળી ગયું.

એમાં મણિકાકા અંદર આવ્યા.

“અરે મણિકાકા, આ છીકરાને થયું છે શું ? તે આવ્યો ત્યારે ઘરીક તો લાગ્યું કે હવે બધો કંયાળો ગાયબ. હા, કંયાળો તો ગાયબ થયો પણ સવાલો કેટલા બધા ઊભા થઈ ગયા !”

“કેમ ભઈલા,” મણિકાકાએ અશક્ષાકના ખબે પ્રેમથી હાથ મૂક્યો, “ક્યાં હતો આટલા દિવસ ??”

“મણિકાકા, તમે અને હીરાભાઈ સાહેબ મારા પર કેટલો બધો પ્રેમ દર્શાવો છો ! બસ, તેનાથી જ મારું પેટ ભરાઈ જાય છે. શું પેઇન્ટિંગમાં આપ લોકોનો મારા પ્રત્યેનો ઘાર હું ચીતરી શકું ? વાલિદ તો જન્તનશીન થઈ ગયા, પણ આપ લોકોએ તે ખોટ ભરપાઈ કરી દીધી છે. રહી વાત પેઇન્ટિંગની, તો જે દસ-બાર થઈ ગયાં તે બહુ થઈ ગયાં, હવે એ બધાંથી હું ધારી ગયો છું.”

“અચ્છા, તો હવે પેઇન્ટિંગ નથી કરતો, તો પછી કરે છે શું ?” હીરાભાઈ અકળાયા.

અશક્ષાકના મોઢે જાણો તાર્યું લાગી ગયું. નીચે ઢળી પડેલી નજર જાણે ઉપારી ઊપરથી નહોતી. પછી હળવેક રહીને બોલ્યો, “થોડાક સમય પહેલાં સાઈનબોર્ડનું થોડું કામ મળ્યું હતું.”

“એમ કહેને ત્યારે, આ સાઈનબોર્ડનું કામ કરવામાં જ હવે પેઇન્ટિંગને તિલાંજલી આવી દીધી લાગે છે !”

“ખરું તો એ છે કે પેઇન્ટિંગે હવે મને છોડી દીધો છે, તેનાથી એક ખોટો માણસ પસેંદ થઈ ગયો હતો.”

“અરે બદ્ધ, તું મને નાહકનો ગુર્સસો ના અપાવ.” હીરાભાઈ ચિડાઈને બરાડી ઊકચા, તેમના અવાજની ઊંચી યાત્રાએ ચેમ્બરના કાચની આરપાર દેખાતા બહાર કામ કરતા લોકોના મોં ઊંચાં કરાવી દીધાં. “મને શું પેઇન્ટિંગમાં ખબર નથી પડતી એમ તું માને છે ? મણિકાકા, સમજાવો આને, પણ રહેવા દો, કોઈના સમજાવ્યો એ થોડો સમજવાનો છે ??”

મણિકાકાએ એક વાર ફાઈલમાંથી ઊંચું જોઈને બન્નેની તરફ જોયું અને ફરી પાછા કેલક્યુલેટરમાં ધ્યાન પરોયું.

હીરાભાઈએ હવે અશક્ષાક જાણે હાજર જ ન હોય તેવી રીતે પોતાની ફાઈલ જોવા

માંડી, જાણે ઘણું અગત્યનું કોઈ કામ તપ્તકાવિક આવી પડ્યું હોય જોકે ઘણા અગત્યનાં કહી શકાય તેવાં કેટલાંય કામકાજ સતત તેમના માથે ગાજતાં જ રહેતાં, પણ અત્યારે તેમાંનું એક પણ તેઓ નહોતા કરતા ! થોડીક વાર તો જાણે ચેમ્બરમાં સોપો પડી ગયો.

“તમે સમજો સાહેબ”, અશફકે ધીમે ધીમે વાત શરૂ કરી, ‘‘પેઠન્ટિંગ બહુ ખર્ચણ થઈ ગયું છે, વળી તેના ખરીદનારા હજારે એકાઉ માંડ હોય, અને રોજ કમાઈને રોજ ખાવાનું હોય ત્યારે વન-મેન શોના ધનારા કેવી રીતે પોસાય. ક્યારેક મને એમ લાગે છે કે થાળીમાંની લૂભીસૂકી ભાખરી અને થોડુક શાક ચીતરવાનું વધારે અધરું છે...!”

હીરાભાઈએ ડ્રોઅરમાં હાથ નાખીને ચેકબુક લીધી અને લખવા માટે પેન ઉંઠાવી, પણ અશફકની મક્કમ આંખો અને લીડાતાં જતાં જડબાં જોઈને તેમણે હતાશામાં ચેકબુક પાછી ડ્રોઅરમાં મૂકી દીધી.

હવે જરાક હસીને અશફકે આગળ ચલાવ્યું,

“એક સાઈનબોર્ડનું મોટું કામ મળી ગયું છે. રંગ લાવવાના પૈસા ખૂટી પડ્યા. એડવાન્સ માટે કચ્ચું છે. કદાચ મળશે તો કામ શરૂ થઈ શકશે. બીજા પેઠન્ટોને પણ કામે લગાડવા પડશે. અહીંથી જતો હતો તે થયું કે આપ લોકોને મળતો જાઉં...”

ચા પીને તે ઉઠાયો. તેના ગયા પણી હીરાભાઈએ પાંચ હજારનું બંડલ કાઢીને મણિકાકાને આપ્યું.

“ખરી વાત એ છે કે મારી જીવરાજભાઈ સાથેની વાતચીત ફીન પર સાંભળીને તે પૈસા નથી માગતો. પણ તમે આ લઈ જાવ; એને કહેજો કે આ પૈસા તમે તેને આપી રહ્યા છો ને ઉછીના છે એટલે પાછા લેવાના છો. શું સમજ્યા ? હું પિક્ચરમાં ના આવવો જોઈએ. છેવટ ના જ માને તો નહીં જેવું વ્યાજ નક્કી કરી દેજો, બરાબર ? મણિકાકા તેમની સામે એકીટસે જોઈ જ રહ્યા.

૧

## ભાવના

એ જ એકાકી મુજ ઉરનો સૂર હો,  
એ જ ગુંજો ધ્વનિ ચિત્તતંત્રી;  
પતિતનાં પાપને, દલિતનાં દુઃખને  
હદ્ય મારું સદા રૂહો નિમન્ત્રી.  
પતિતતમ સાથમાં પતિત સમ થઈ રહું  
કચાંક એકાન્ત ખૂણે અદીકે.  
દેઠ તળીયે પડેલાં તણા પગ ઠરે  
પ્રશ્નત મુજ પ્રાણની પાદપીઠે.

[‘સમગ્ર કવિતા’]

- ઉમાશાંકર જોશી

## નિબંધ

“કોશ કૂવો ને કોશિયો”

અરવિંદ ટાંક

વરસની ત્રણ ઝતુ. પણ ખેડૂતનો ખટકો એટલે હરિયાળું ખેતર ઠંડા મીઠા પવનની લેઝેરમાં હેરાય. શેઢે શેઢે ફરીને... હથમાં લાકડી તો હોય જ, આંટોફેરો લગાવે. આણાં-આંખરાં, ઊંચી વાડો, વાડોલીયાં, કુંચી-કટલું તો ક્યારેક નેળિયામાં માટી પગલાંના ભૂદળ લિસોટા. ક્યારેક નજર આગળ સાપ ધામણ કે અંધળી ચાકરણ દેખા દે જ. ‘મારગ છે તે જાય... હરેકેરે’ બીક શાની ! પણ હથમાં હાથ પૂરું આ હથિયાર છેવટે સોટી કે સેટલી હોય જ. નેળિયામાં તેતરની હાર જોવી ગમે. માથોં દુંદૂઢમાથોડું કંઠણા થુલેરમાં કરોળિયાના ઝાંણા, ને ચોમાસામાં ફૂટી નીકળે... ન જોયું, જાણું ન કલયું ન વાવેલું, અનુભવેલુંય નહીં. એવું અગણિત થઈ ઊગી નીકળું ધાસ. શેઢે હંગારી, પડતરમાં, ખેડેલામાં, ખળમાં, ઉકડામાં... જમીન દેખાય તાં જે આકડો, કૌચા, ઈંક્ય, બાવચી, ગળો, ગોખરું, ચણોઠી, તમરો, ડોડી, ખીરોડો, દમવેલ, ધંતૂરો, બોરડી, સાટોડી, દુધેલી, પોપટી, આવળ-બાવળ, ચીપો, ધરો, કુકરપાડો, વાડોલીયું, ખરહંડી, ડેમરો, અરે ! કેટકેટલું ઊગી નીકળું. જાણેલું, ન જોયેલું. વરસાઈ વાતો કરવા.

શાલે-ફૂલે ને ફટકે એ જ સત્ય. વંશીય. તે શિયાળે પરિપક્વ થાય. હેરમાં આવે ને ચેતનપદ ગાંધું ગેરે લારે... વાસ્તુ ચિરૂ રેલા ગુંથાસ ને... થાય તેવાભૂત. રેલો તો વાડનો વાસંતી શાશગાર. ઉકરડોય સંજેધજે. ટાકમાં જાકળ રમે બુંદ બુંદ, હવાસંગ, તો ક્યારેક જાકળજણ બની ટ્ય ટ્ય પડે જાડ ઉપરથી.... ને જાકળજણ જીલતાં સાખી સાથે અથડાઈ જતા... કલમી બોરના રસ્તિયા ખરાને ! આ ઉત્સવ ઉનાળો આવતાં ડચકાં ખાવા લાગે. શીંગો સ્વરૂપ થઈ ફટકિયાં થઈ છૂટે. બી વેરાય, પશુપંખીના ચારાનો ખોરાક બનતાં છાણ સુકાતાં ફરુંટું, ઊડતું ચોમાસાની વાટ જોતું શેકાતું પડી રહે. નદીય ખેંચી જાય. ગાઉ ગાઉ છેટ ને ફરી ચોમાસું આવતાં ઊગી નીકળું દોષરહિત થઈને. ને ક્યારેક ખેતરમાં બિયારણ સાથે ઊગી નીકળું. જે નિંદામણ સ્વરૂપે લેખાતું. ઉપાડવામાં આવતું લીલું લીલું ધાસ પશુધન ચરે. શેઢો ખીલે, પગવાટ ઊઘડે. ખબે પાવડો ને ઢીચણ સુધીના મારીપગમાં ધોરીયો આકાશલીટો તાણતો જાય... ને ધફ, કરતાં જ પાવડો પાળ તોડે. ને દાંબુ બધ થાય. ખૂલે ને ખેતરમાં કીટકોનાં ગોળાં જાય તણાઈ. પાળીયું રસાંબસાં થાય. પાળો ભીજાય એટલે તેથી લીલોછમ ચીલ લીટીમાં ઊભરાય. સુકકા લીલા ખેતરમાં પથરાતું પાણી ક્યારેક ઉંદરદરમાં પુરાય ને નીકળી આવે ફૂંકાડો. ઉંદરના ઘરમાં પાણીની-પાણીની ટોળી જીવત વીણતી ટી...ટી...ટી...ટી... કરતી બગાલા સાથે ઊડાઉિડ કરતાં નર્તન કરે. ફરી ખબે પાવડો લઈને ખેડૂત કે મશારી ટાંક કે તડકો, ન જોવે રાત કે દિવસ. હા, ઢોળાવમાં પાણી ઠળે, રમરમાટ પાણી વહું જાય. ધોરીયામાં આડપાન તરે ને કીડીય સફર કરે. ઝરણું ગાતું એમ ગીતી ગાય ખળજળ. વહી આવે ‘ક્યાંથી આવતું હશે ?’ ધોરીયો તો સીધો ને પાણી કૂરીમાં પડે. પણ એ પહેલાં થાળામાં આવે. ‘ક્યાંથી આવ્યું આ પાણી ?’ પ્રશ્ન થાય. ને આંખ ઠરે. નજરમાં

કુવો... બંધ બાંધિલો, માંચડો ને કિચ્ચુડ-કિચ્ચુડ ગરગડીનો કશર્વશ પ્રિય લાગતો અવાજ ને એ અવાજમાં થતો બીજો અવાજ.. પડે કુવામાં... ધારા રૂપે... પાણી પડવાનો અવાજ. એ સાથે જ કંઈક ધોધમાર કાળી ગાંસડી ભર ઉભરાતું પાણી થાળામાં દડતું. મીઠુંમહ ટોપરા જેવું, વૈશાખી બોલ જેવું, કોઠો યાઢક કરતું, ખોબલે-ખોબલે, ચોગળે-ચોગળે પિવાતું ભૂજળ, ને નજર આમ ફરે, નજર તેમ ફરે ને વાયરો વાત લાણે, ‘એ રંમ આયા, એ રંમ આયા’ કોઈ બોલતું જાય ને વિજયવેવું થઈ આનંદિત બની જરીક આમ નજર કરું તો કોશ બોલે છે કોશ ગીત ગાય છે. અરે આ તો કોશિયો... ને ગાંસડી તો કોશ.

નવી પેઢીમાં ગીણું જોવા-વાંચવાની ટેવ-ઉત્સુકતા ક્યાંથી હોય, ખેતરની ઘેલશા કે ખેતર શું છે ? શા માટે છે ? ક્યાંથી આવ્યું ? પ્રશ્નો થાય. જવાબ પણ મળે. દાદા-પરદાદા આ જ ખેતરમાંથી મબલક પાક મેળવતા. તેમની કામ કરવાની ધગશ. એમાં જરાય કૃતિમતા નહીં. શરીર લોહબળીયું. ચેતનવંતું. દરિયા જેવં વિશાળ મન. રાગ-દ્રેષ. અરે ! આંખમાં તો છલકે અમીરસ ને જરે. હદ્યના શાસ સાંધતું મન તો પ્રફુલ્લિત જીવનરાગ.

માનવીનું મન તો ગોકુળ. મેળો મહાબે. ઉત્સવોમાં થાક ઊતરે. ઘર ઓસરીઓ રંગ ભરતો ઢોલી શેરી જગતીને ચાલે. સાથે ઘર-પાશેશી, સગાં, ગીતરાગમાં સાથે ચાલે, જાંઝર જંઝવતાં. સોને મધીને. ઢોલની દાંડી પિતાય તાલબદ્ધ. અવાજ બને પ્રશ્ન. ગામમાં ઊડતો પ્રશ્ન માનવમનમાં ઊજે. ને વાત કૂટે બંધાયેલી. સાગાઈ, સામૈયું, લંન-ઉત્સવ, વાસ્તુ કે હં... કં તો નવો કુવો. મૂહત ને ગોળ-ધાણા... ગોળના રવા સાત... વીસ ડિલોવાળા. ગામખૂણોય ગળપણમાં કુવાની વાતોમાં ગુંથાય. ઢોલી માઢજોડીનો બાળ ઊતરતો થેપાડે ગોળ બાંધીને મલકાતો જાય. અમે હળવે હાથે વગાડી લઈએ. સ્પર્શ ખીલતો રહે. અવાજ ઘૂમરાતો રહે. ગામલોકનો લેટો, શુંનો પ્રશ્ન ને જવાબ. ઢોલદાડી.

ગામલોક ખેતરમાં ઊભરાય. ને અમે ઘૂમીએ વાડે. ડોડીની કુણી કુંઝો ખાવા. ને ડોડી ખાવા... જાળવીને વાડે વાડે ફરીએ. કેમ આવ્યા ? રાખીયાળું ગાતા ઢોલ સાથે. શું મળશે ? ગોળધાણા. ને ગામગોર ફંદવાળા. નાડાછડી બાંધી કંકુ છાટે. વિધિ કરે. કંકુચોખા, શ્રીફળ ને પછી પાણીની દિશામાં કોદાળીના પાંચ ટસુકા પાંચ વાર જમીનમાં મારે. ‘જે’ બોલાય. હર્ષાલ્લાસથી ખોજે ને ખોજે ગોળધાણા ખાતા ઘર તરફ વળીએ. હા, ગામ તો છેટું ને છેટું પણ આવે નજીક.

અમારી નાની નાની પગલીઓ, ખુલ્લા પગ નેળિયાની રેતમાં ઊતરી જાય. ને રહી જાય પાછળ ખાડા. હું ને લેટું પણ અમારી સાથે સુરબિ તો હોય જ. ડેવી નિર્દ્દિષ્ટા હતી ! નિરાળો સમય. મન-અંતર તો ભેગાં... ને ભેગાં જ. વિકસિત મનહદ્ય તો નાદ કરે.

બાળસાખી સાથે ગાડામાં ખેતરે જઈએ. પેલો કોશ ને વરસાદ જેવું જ ભરેલો કોશ ને કોશિયો બોલે. ‘રંમ જીવાજો ભરી.. રંમ આવાજો’ ને કોશ ખેંચાય. જાંઝ વરત કુવામાં કોશ સાથે બંધાય. ને અંદરથી ચામડાનો કોશ પાણીમાં ને પાછાં ફરતાં બળદ ને કોશિયાનો ડચકારો. ફરી બળદ ધોકમાં ચાલે ને ખેંચાય કુવામાંથી તારેલો કોશ. અમે કુવાના કંઈથી પેલો વરસાદી અવાજ સાંભળીએ કુવામાં પડતો અવાજ ઉપર આવતાં વધે. પછી આ કાળોમેંશ કોશ ઢોળાય થાળામાં ને દણદળતું પાણી જાય થાળામાં. એમાંથી કૂંઝીમાં – કૂંઝી ઊભરાતાં વાર લાગે. એક કોશમાં દસથી બાર મજા પાણી સમાય. આ કોશનું વરત જાંઝું

ને રસ્સી (રાસ) પાતળી, એટલે રાત પડે ને વરત ગોળ વાળીને ગાડામાં નાખીને ઘેર. ભીતિ રહે બિરાતના ભીલ લઈ જાય. ચોરી થાય. ને કોશ પણ ઘરભેગો. મૌંધી વસ્તુ, કોશ તો બેંશનું પાકટ ચામડું સીરેલું. કોશની કિમત દોઢરોથી બસો શુપિયા થતી.

સવારે ચાર વાગે – પરોડિયે કોશ ચાલુ થાય. કુવો-પાણી-કોશ-થાળો-કૂંઝી-ધોરીયો, નીક ને પાળિયું. રસાંબસાં થાય. સાંજ સુધીમાં વીધો, દોઢ વીધો રૂ જેવું પોચું ખેતર ધરાઈને પાણી પીએ.

પાણીનાં તળ ઊંચાં, નીચાં કે ઢોળાવ પ્રદેશ સમ તો કહેવાય છે ને જોયેલું કે કુવાના કંઈથી લોટો ભરાય. એ તો સાચું પણ બાવાજ્ય દોરીલોટો રાખે. કુરે પાણી પીતા જાય ને આશીર્વાદ આપતા જાય. આ હતું આસ્થા ધર્મનું પરિણામ. નવા કુવાનો ગોળ જાય ને પીએ પાણી. બોલો વાળી ‘બમ્બુ બમ્બુ ભોવે.’

કુવો ખોદાય, નવા કુરે કંટરાટી ફરમાવાળો એ ગોળ ગોળ ફરમા ભરે. જ્યાં કંકુચોઝા ને થયું હોય મુદ્દૂર્ત ત્યાં જાડો ખોદાય. શકનમાં ગોળ-ધાણા. ભયો ભયો.

કુવો ખોદાય, કુવો બાંધવો, કુવો ખાળવો.

સિમેન્ટ, જિલાસળી, ગોળ ચેવલ, નદીની દાણાદાર શુદ્ધ રેતી. નાળિયેર ગોળધાણા જાય ને માંડે વાત ફરમા બાંધવાની, ને ભરાય એક ગોળ ફરમો. આમ જમીનમાં દસ કૂટના ખાડામાં ને જમીન બહાર ચાર ફરમા ભરાય. પોણા બે હાથનો ઊંચો ફરમો. લોખંડના સણિયા ઉપર આવે. ગોળ ગોળ ફરે. બંધ બંધતું લોંગડ ફરમા સાથે થાય. મજબૂત ગાડું એક કુવા માટે રાખવું જ પડે. તંબાની મોરી ગોરીઓ ભરી લાવી નાના હોજમાં ઠલવાય. પાણી ને કંટરાટી તો બેઠો હોય તંબૂ તાણીને. આગમ કરે. આવે-જાય. પણ ધ્યાન વધુ રાખે. આ રીત હતી કુવો ગાળવાની, બાંધવાની, ખોદવાની. વાતો તો છે મજાની. બુદ્ધિ માળી લે તેવી. તપમાં રેતાળ હોય ત્યાં સાદી રીત. અને જ્યાં મુરમ, પીળી, કાળી મજબૂત પથરિયાળ જમીનમાં રીત અલગ ખર્ચાળી.

રેતાળમાં જમીનથી ઉપર ચાર ફરમા ભરાય ને પછી પાકટ થતાં બંધાય ઉપર માંચડો. મજબૂત જાડા મોખ. કંઠા ઉપર ને વચ્ચે જગ્યા. પછી શંકુ આકારનો મોખ માંચડો. ઉપર ગરગડીમાં થઈને એક છેડો કુવામાં ને એક છેડો બહાર દૂર વરતનો. કોશ જેવું જ પણ કુવાની અંદરના છેડે મજબૂત ટોપલો. ટોપલામાં ભરાય માટી. કુવાના ફરમા વચ્ચેના કેન્દ્રબિંદુમાંથી જ માટી લેવાની એ જ નિયમ. નિયમ એટલે નિયમ. કુવામાં બપોરે સૂરજ માથાનું અજવાણું ઊતરે. હા, બીજે છેડે બળથી વરત બેંચાય. માટીનો ટોપલો ઉપર આવે. પાણીથી નિયોવાતો, ને બાજુમાં થાય રેતંગર, માટીનો હુંગર. આ મખમલી માટી સુરબિને ગમે. સુક્કી માટીમાં રમીએ. ઘેર પણ લાવતા. હા, વચ્ચેથી લેવાતી માટી. ખાડો કરતી જાય ને ફરમા ફરતાની અંદરની માટી દબાણથી બસતી જાય ખાડા તરફ ને ખાડો ઊંડો ઊંડો ઊતરતો જાય. ને ધીરે ધીરે માંચડો ય કુવામાં ઊતરતો જાય, એ ગામખૂણોય જાડો ઓંપણે પાછું લેવલ જોવાતું જાય. એ લેવલને દુંડી કહેવાતી. જે બાજુ માંચડો નમે એની વિરુદ્ધ દિશામાં માટી લેવાતી. દુંરી જોવાતી જાય ને આમ મજાની વાત થતી. લગભગ એવું ન બને પણ લેવલ જોવાતું જાય ને વજનથી ફરમાવાળો કુવો જમીનમાં ઊતરતો જાય ને ફરતાં બહારથી દબાણમાં રહેતો જાય. હા, કુવાનો કોન્ટ્રાક્ટ અપાતો છતાંય ઘરનો રોટલો –

મજૂરવર્ગને આનંદ આપતો. દૂધ-છાશની રેલમહેલ. ફરમા સાથે તેનો માંચડો અંદર ઉત્તરે પછી માંચડો છૂટે. ફરી ફરમા ભરાય. ફરી માંચડો બંધાય. ને મારીનો દુંગર મોટો થાય. આમ કુવો ઊરો થતો જાય. ફરમા ઉત્તરતા જાય. બાર-પેંડર ફૂટના ઘેરવાવણા. હા, મૂરમકાયા પથરનો કુવો ખુલ્લો રખાતો પણ બાંધવો તો પડતો જ. ઈંટચણતરથી. આ બધું સમય માગી વેતું. હા ફૂવાકંઠો ચાર ફૂટનો રખાતો. કુવો તેથાર થતાં ખાટલામાં મજબૂત ચાર વરત બાંધી દાઢાને કૂવામાં પ્રત્યક્ષ દર્શન કરવા ઉત્તરેલા. પાણી તો ચારે બાજુથી ફૂટે. અંદર પાટડા રાખવામાં આવે. ગામલોક ઢોલની દંડીએ પાછું ગોળ ખાવા ને પાણી પીવા આવે. પણ હું તો સુરભિ સાથે સખામંડળ લઈ શેડે ચણીઓર ને ઝેંગીનાં ઝેંગીનાં ખાવામાં મશગૂલ. બૂમ પડતી. ખટીકા થતા દોડીએ. ને ફરી કોશ ખેંચાતો. જેતર તરબતર થતું. આનંદની હેલી વરસી પડતી. ને મન મોર બની નાચી ઉદ્ધતું. પહેલાં કૂવામાં રેંટ ચલાવવામાં આવતો – ગોળ ગોળ બળદ ફરે. મશીન સાંદું રેંટને ફેરવે. પાણી બહાર થાળામાં ને કુંડીમાંથી જેતરમાં જાય.

તળ ઊરો જતાં કોશ સારું કામ કરે. મહેનતનું કામ હતું.

હા, નદીકિનારે આજ પણ ઢેકું (ઢેકલી) જોવા મળે છે. તેનાથી પણ જેતી થાય છે. સાદી ને સરળ રીત છે.

હા ! પરોઢિયે અંધકાર ઓઢીને ફરતું, લોક-માણસ જેતર પહોંચવાની ઉત્તરાણમાં. ને સ્ત્રીઓ પશુધન સાચવે. બધું કામ દીવા જેવી તેજ આંખો કરે. ને બીજું કરે હાથ-પગ ને હૈયું. જેડૂતને જેતર પહોંચવું, બળદ જોડવા, કોશ ચલાવવો, જેતરને ભીજવવું. જેતરમાં ઓરેલા બિયારણને મારીના કણ-કણ વિટળાઈ વળે ને ચાર-પાંચ દિવસ પછી ફૂટે ફણગા. નવા કોટા ફૂટે. વેત ઊંચું વધી, ને સાથે નિંદામણ પણ બેદરકારીનું પરિણામ. કણનું મજા નિંદામણ થયું ને જેડૂત ત્રાસી ગયો. ઉકરડામાંથી છાણિયું ખાતર ગાડામાં ભરીને જેતરમાં પૂંજી પાડવામાં આવે. પૂંજાને પાવડાથી પાથરી દેવામાં આવે. જેતર સવારે વહેલા જેડાનું બપોરે હળ ફૂટે. પછી સાંજના બળદને આરામ આપતો. બળદ તો હાથીબળવાણા. સાંજે ખાશ કપાસનું. ભૂસરીયું. શિયાળામાં કચરીયું. બાહેલો ગવાર, લીલું-સુકું ઘાસ. જાર-બાજીના મલાઈભરેલી પાંઠના પૂળા. ગાય, લેંશ, બળદ તો ઘરના સભ્ય ગણાતા. માણસનાં મન મોટાં હતાં ને આવાં હતાં સાંદાં યંત્રો માનવસૂલુવાળાં યંત્રો હતાં પણ દરિયાપાર હતાં. મોંઘાં પણ આવી રહ્યાં હતાં. માનવીના વિચારો ખડતલ હતા. એક મહામંત્ર હતો : ‘ાતમહેનત લિંદાબાદ.’

એકબીજાને મદદરૂપ થતાં અધ્યરું કામ સરળતાથી અરે ! ચપટી વાગતાં થતું. જેતર જેડવા હુંઢેલ થતી. જેડેલા જેતરમાં બિયારણ પેરાનું. પાણી આપાતું. નિંદામણ થતું. રોગ તો નામશેષ હતો. પછી હવા શું ? તેથાર થતાં પાકની લણણી થતી. વઢાયેલો પાક ખળામાં સુકાતો આંખ નજર સામે. ગાડા ઠલવાતાં ખળામાં. ને હાલરું-ફરતું બળદની હુંઢેલથી. કામ સરળ થતું. હાલરું ચાલતું ત્યારે બળદના મોઢે હુંદું-સોચીયું બાંધવામાં આવતું. જેથી બળદ ગોળ ફરતાં ખાઈ શકે નહીં. ધાનને ઘાસ છૂટું પડતાં જ પંછાવ નાખવામાં આવતો. ત્રણ પાંખિવાવાળી ઘોડીથી ઘાન ઊપણાનું ને ઘરકોઈમાં જતું. ત્યાં જઈને સૂપડે ઝાર્ટકીને ઘંટ્લાવામાં દળાનું. ‘ઘરરર... ઘરરર’ બા દળતાં. ખાંયણામાં સાંબેલું લઈ ખાંડતાં. ડાંગર જવ, જાર,

બાજરી, ઘઉં, હા ચૂલે કલાડામાં બાજરીના રોટલા થતા. બા લૂંઓ લઈ હાથમાં થેપી ટપાકા મારતા જાય ને રોટલો ચંદરમાનો ચોથીયો ચૂલે ચડતો જાય. કપાસ, એરંડા, તુવેરની સાંઠીઓથી ચૂલો ચેતનવંતો રહેતો હતો. છાણનાં છાણનાં થેપીને બા છાણાંય સળગાવતાં. રાખ થતી તે જેતરમાં ઉડાડવામાં આવતી. હંગારીના સાવરણા બંધાતા ખળામાં કામ આવતા.

ઘાસ-પૂળાની આંઘલીનું મંડાણ થતું. પશુઓને પૌસ્ટિક આહાર મળતો. દૂધનું દહીને વલોણું પરોઢિયે જગે. એ અવાજ ગમતો.

સવારે જેતરમાં નાળી થતી. બપોરે ધી-ગોળ, કઢી-રોટલા, છાશ. સાંજે ખીચડી, દૂધ, રોટલા. આ હતું આપણી સંસ્કૃતિનું ખાણું. સાન્ચિક ખાણું. દૂધ-છાશ, ધી-દહી, માખણાની રેલમહેલ હતી. ગામહકેવત હતી ‘શાશમાં હંડો ઠરે.’ દહીં ભાગેલી છાશ. પણ પેંબું છાણમૂતરનું વાસીદું વાગતાં ગમાણમાંથી ઝર્તી ઝીણી ગંધ ઝમતી. એ ગમે.

દૂધાં પશુને રાત્રે ખાણમાં કપાસ બાજીને આપતો. હું ગમાણ પાસે બેસું. ભૂરી ભેંશ મને બહુ ગમે. બે ખોબા વધારે નાખું. વધારે દૂધ આપે એટલે ને થોડુંક વધારે હક્કથી માગતા ‘બા... બા...! મેં એક ખોબો વધારે ખાણ નાખ્યુંતું.’ હા સુરભિ આવે એટલે બા દૂધ આપે, એને પાય. મને પાય. જ્વાસ ખાલી થવો ન જોઈએ. તોય મારા જ્વાસમાં નાખતા કહેતી, ‘મારા ઘેર કાલે તું દૂધ પીવા આવજે !’ આ હતી અમારી બાળરમત. ચૂલા ઉપર ચડતું કપાસનું ખાણ એમાંથી બાહેલા દાણા દબાવીને અંદરનો ગર્ભ ખાતા. મજા આવતી. વાત મનમાં વર્સી જાય. ને પેલી ગમાણની સુગંધ અમને આનંદ આપતી. હા, નવી વિવાયેલી ભેંસનું કરાંદું હા ! બા એ દૂધની બરી બનાવતાં. અમે ગોળ સાથે ખાતા એ આનંદ તો અમારો વિશેષ હતો.

દાદા સાથે જેતરશેડે ટહુકે કોયલ, એટલે ટહુકા શોધીએ. શાખાઓની વચ્ચમાં, ઘટાદાર કુજગલીમાં પણ કોયલ ન કળાય. સુરભિ શેડા પાડોશી, ઘર પાડોશી, ને શાળામાં સહાધ્યાઓ, જેતરમાં આંબા, મહુડા, લીમડા. શેડો તો ભરચક નજર બંધવાડની ઓથ. વાડમાં ચણોઠી આંખ મીચકારે, ચણીઓર ચમકે. હવામાં હેરાય પાંદ. પંખીઓ વનફણ ખાય. એ જોવાનું ગમે. પછી ખાય માનવી. એટલે પહેલો હક્ક મુંગા પશુ-પંખીઓનો.

હાથી જેવા બળદ જેતર બેડે. કોશ બેંચે, બોર બરેલું ગાડું ખેંચે. ગમે તેવો ઊંચો ઢાળ પણ ચરી જાય. જેતર શેડે કે પાણીયે સાહટો નેઘલ્યો હોય ને બળદ તો ભરઉનાણે બરક-બરક ખાય. ને વાગોળે. બળદને પાકું ખાણું મળતું. માણસ અને પશુ વચ્ચેનું અંતર વળી શું સમજજું ! અરે ! એની પાસેથી આપણે જે કામ લઈએ છીએ એ કામ માણસથી નથી થવાનું જ. બળદમાં તાકાત જબરી, મચક ન આપે. ‘હાં’ કહેતાં હેંડે ને ઝીજવીએ તો શીંગદું મારે. દાદાને ન મારે... પછી ધીરે ધીરે બધાનો માનીતો થઈ જાય. બળદ અને ગાયનો વંશરેલો ચારપાંચ પેઢીથી ચાલ્યો આવે. બળદની જોડી તો દૂધ જેવી. તળાબે કે હવાડે દાદા નવડાવે. બાપા જેતરે જતાં કે આવતાં હવાડે પાણી પાવાનું ન ભૂલે. સાંજે ગવાર બાજીને આપાતો. મજાથી બેય ખાતા હોય. સુકો ગવાર ન આપાય. ડબામાં બાજીએ એટલે બસેરનો સાતસેર થાય. કાચોય ન આપાય. ગવાર બાજીએ એટલે ફિંગાય, બફાય, એટલે ફૂલે. કાચો ગવાર આફરો કરે. કાચારેક દુઃખી થવાય. બળદ જેતી કામ કરતો ઘરડો થાય એટલે એને જીવે ત્યાં સુધી ખવડાવવાનું. સાચવાવાનો નહીં. દાદા કહેતો

આખી જિંદગી આપજા ઘરનો મોબલ બનીને રહ્યો હોય. એને વેચાય ખરો ! એનાથી જ આપણી લીલાવહેર છે.’

હા, નવા વાઇરડા (રેલ્વે)ને પાકટ થયે યુવાન રેલ્વાને બળદ બનાવવામાં આવતો. રેનવા લોક આ કામ કરતા. રેડલો યુવાન થાય. નાકમાં નાથ પરોવાય. પછી પરોટાય. પછી આખી જિંદગી ખેતર ને ઘર-ઘરના મોભી જેવો. સ્વજન જેવો. માણસ થાકે એમ એય થાકે. આપ્તજન સમો બળદ ગમાણે બંધાય.

કોશનું પાણી ખેંચોને બળદ થાકે. સમય સમયની વાત. પાણીતળ ઉડા જતાં ગામમાં સુરભિના ખેતરમાં વાગી સીટીઓને ગામલોક થયું જેણું. ધૂમાડા કાઢતું હુક...હુક...હુક...હુક... અવાજ ને ગોટાય કાળાં વાફાં. ઉડ ને ધૂમાડો ગોટાય. ચાર ચાર ગાઉ સુધી અવાજ સંભળાય. ગળતી ચતના. મોટા પૈડાવાણું મશીન ચાવે ત્યારે ખબર પડી કે આ તો કૂવામાંથી પાણી કાઢવાનું મશીન છે. ગામને ગમ્યું. ને કોશ થયા ઢીલા. કોશ ગયા ને મશીન બેઠા ધૂમાડો કાઢતાં. કૂડ પીતા.

કૂવામાં લાકડાના જાડા પાટડા મૂકી થાપો બનાવીને મુકાયા પંપ. લાંબા પણ્ણાથી ઉપરનીચે, નીચે-ઉપર પણો ફરવા લાગ્યો. નાની ઓર્રીમાં ભોયરું. કબૂતરનું ધૂ ધૂ ધૂ ને હવામાં જોબા ખાતા સુગરીના માળાઓ. ત્યાં ફરતી મોટરને અંદર ફરતો પંપ. કૂવામાં મુકાઈ લોખંડની સીટી. રસ્સી ગઈ ખીટીએ. ટીંગાઈ. હા...! કૂવામાં કંઈ પડી જતું તો બિલાડી રસ્સીની મદદથી નાખવામાં આવતી. અંદર પડેલી વસ્તુ ફસાય એટલે રસ્સી સાથે બિલાડીને વસ્તુ ખેંચાઈ આવતું. આ ઘરડાંની સૂજબૂજ હતી.

કૂવાની ઓર્રી નાણિયાંવાળી. એમાં કેટકેલું મુકાતું. જેવું કે લાકડી પરોણી, આડાં, કુહાડી, સેટલી, દંતાળી, કોશીયું, ખંપારી, દાતરડાં, કોશ, રાસ ખીલા-ખીલી, હથોડો, ઝાચર, ખપડું, હમાલ (એ બહાર રહેતો), પાવડો, કોદાળી ત્રીકમ, હળ, રાંપ, ઝાંસલો, વેધણું, હા પંપ મોટર આવ્યા પછી પાનાં બોલ્ટ, ટોપી બોલ્ટ, ગ્રીસ કૂડ કેટકેલુંથી પડજું હોય. ખૂબો સાચવતો ન હોય તો પાડોશી યા શેઢાપાડોશીને ત્યાંથી લવાતું. કામ પૂરું થયે પરત આપતું પડતું.

હા, ગામમાં અઢીયાં, દોડીયાં, હવાયાં ને એક હાથિયાંના માટીઘર તો ક્યાંક દેશી-વિલાયતી મેંગલોરી નાણિયાંની છતથી ઢંકાયેલા રહેતાં. પતરંય હતાં. મોબલ, જાડા બીજા લાકડામાં વાંસની પણીઓ, પાથરીને છત ઉપર દેશી નાણિયાંય અવળાં-સવળાં મુકાતાં ને દર ઉનાણે સંચયાં પણ પડતાં. નહીં તો ચોમાસામાં ચૂવો થાતો. રાત જાગવું પડે. ઉજાગરે ખેતીમાં નડતરરૂપ થતો.

સુરભિના પિતાજી મુંબઈ-અમદાવાદની ખેપ સારી કરે. એટલે ગામમાં પહેલાં-વહેલાં ઘરને પાકું સિમેન્ટ-ટીટ, ચૂના-પથર રેતીથી બાંધ્યું. લોખંડાના પતરાથી ધાણું ભર્યું. ને ખોલ્યું તો પતરાની ગેડ, ગીસીઓની ડિઝાઇન ઊપરસી આવેલી.

ગામમાં લાઈટ આવી. ઘેરઘેર બલબ સળજ્યો ને ઊઘડયું તેજ. પછી ઊગ્યા થાંબલા, એ તો જગહળી ઉઠચા. ફણિયું, શેરી, પરસાળ, પાડોશ ને માણ-મેડીનો ઢાળ. ને ગામ ઝગમગી ઉઠયું. પણ બાપા કહેતા, ‘આ નવી નવી વસ્તુ આવી પણ પગમાં કુહાડો ને ઘરમાં લાવી (શરીરમાં) રોગ, હાથના કર્યા હૈયે વાગરો’ ને ગાજવા લાગ્યો. નિર્જવ કોશ-

રેડિયો ગામમાં ભવાઈ, નાટકો થતાં. મનોરંજન થતું. તૂરી, તરગાળા બહુરૂપી આવતા. આનંદ થતો. મન નાચી ઉઠતું. મનભાવન થતું.

ગામમાં કંઈક નવું તો સુરભિ, ને પેલા મશીન ગામકૂવે જઈને બેઠા. દાદા કહેતા કે ‘અંગરેજો નવું નવું લાવ્યા, નફો જલદી મળો. કામ સરળ, માનવશક્તિ ઓછી. મશીન ફરે. કૂડ બળે ને પાણી નીકળે. ‘પાણી જીકો મારે’ ને સમયાન્તરે લાઈટ ધૂમાડો શોખી લીધો. પાતાળમાંથી પાણી કાઢવા લાગ્યા બોરકૂવા. ને પુરાવા લાગ્યા પેલા કોશકૂવા. બળદની ખેતરચાલમાં ટ્રોક્ટર આવ્યું. પેલું છ કોશનું પાણી મશીન એકસાથે કાઢતું હતું તેની જગ્યાએ લાઈટ વિસ ગણું પાણી કાઢવા લાગી. ને શોખાવા લાગ્યું પાતાળ.

માણસે ફેલાવી પાંખો. ફાલી ગયું ઉડતાં. કોશ રીંગાયો ખીટીએ આંસુ સારતો. ને બળદ બેઠા ગમાડો ભૂખ્યા. સમયની થાપ પરિવર્તનનો પવન લાવે છે. એમાં વિંઝાઈએ છીએ આપણે. ઘર-ખેતર-કામ છીનવી લીધાં મશીને. માનવ મેદસ્વી થઈ ગયો. આજે કંઈકે કે કોશ કૂવો ને કોશીયો તો બાળકો કહેશે “શું એ વારતા છે ?” આ છે આપણો ઉત્તરાર્થ.

### શાખાર્થ - તળ પ્રદેશના

સેટલી - ખેતઓઝાર, નિંદામણ - નકામું ઘાસ, દાંમડું - પાળ તોડી પાળવું, ટસુકા - માટીમાં કોદાળીથી ખોડવું, ચીલ - ઘાસ, ભાજી, વનસ્પતિ, ગાંસડી - જાડા કાપડનું - ઘાસનું પોટલું, થેપાડું - ધોતી, ટુરી - લેવલ જોતું - ઔખલો, કોટા - બીજ અંકુર, પુંજો - ખેતરમાં સુકકો ધાણના ઢગલા, રમરમાટ - અડચણ વગર, પાંનાઈ - જાર-બાજરીની ગાંઠ ફૂટનું લાંબુંકૂણું પાનઘાસ, હૂંઢેલ - હળ-બળ લઈ ખોડૂત એકબીજાને મદદ કરે તે, પેરવું - વાવવું, ખટકો - ઉત્તરાળ, લાણણી - પાકટ ઘાન કાપવું તે, આફરો - પશુઓમાં થતો પેટનો વાયુરોગ, સૂરજમાથ્યું - બધોર, રસાંબસાં - ખેતર ધરાઈને પાણી પીએવે તે, પંછાવા - પંચાવા પણ બોલાય, પછીયીથી નંજાતો પવન, પાંચ જાળની મદદથી નંખાતો પવન, ઉપણવું - ઘાન + ઘાસ અલગ કરવું, લૂસો - પાણી નાખી બાંધીલો લાટ, નાળી - સવારનો નાસ્તો જે ખેતરમાં થતો, હાંઠો - પાકટ ઘાસનો દંડ (સુકું ઘાસ), ભોર - ગાડામાં ગોઈબાયેલ ઘાસપૂળાનું મંડાણ, સાંભળો - એક ઘાસ, નેઘલવું - ઊગવું, રેલ્વો - યુવાન બળદ, ખળું - ગામનજરની જગ્યા, ઘાસનઘાસ અલગ કરવાની જગ્યા, હાલવું - ખાળમાં બળદની મદદથી અનાજ અને ઘાસ અલગ કરવું. હુંકું-રોચી - હાલરું, ઘાસ કે પાકમાં બળદ ફરે ત્યારે મોંઝે બંધાયું. કરાંટું - વિયાયેલી ભેંસનું પ્રથમ કાઢેલું દૂધ. બરી - કરાંટું - દૂધમાંથી બનતી વસ્તુ, જે ખવાય. ઝોગવું - પલગવું, આંઘલી - સુકકા પૂળાનું - મંડાણ કરવું. બીલાડી - કૂવામાં પડી ગયેલ વસ્તુ કાઢવા માટે વપરાનું સાધન જે દીરઢાની મદદથી કૂવામાં નંખાનું લોખંડની અણીયા અંગ્રોળ સણિયાનો સમૂહ. ચાળો - બેઠક / બુલ્લી બેઠક / કૂવામાંથી પાણી નીકળતું થાળામાં પડે ઢોળાવવાળો, પાટડો - લાકડાનો જાડો બીમ, શેનવા - એક જાતિ, ચૂવો - કાચી છતમાંથી પાણી ટપકવું, ‘પાણી જીકો મારે’ - પાણીધાર લાંબી પડે, ઝેંગી - વૃક્ષનું નામ - બીજી વાળવા પાનનો ઉપયોગ થાય. તેની શીંગો (ફળ) મીઠી લાગે, સંચવું - સાફ કરી કાઢવો (જે નણિયાં સાફ કરવાં તે)

૧

યાદ આવે છે પોરબંદર ખાતેનું પરિષદનું અધિવેશન. પ્રો. રામપ્રસાદ બક્ષી (ઉમર ૮૪ વર્ષ) પ્રમુખ હતા. ત્યારબાદ તો ભારતના વડપ્રધાન પણ લગભગ એ જ ઉમરના બન્યા હતા.

એ અધિવેશનમાં બક્ષુલ ત્રિપાઠીનો એક મોજ-મજાનો કાર્યક્રમ ચાન્તિ બેઠકમાં રાખ્યો હતો. બક્ષુલબાઈ ખૂબ ખીલ્યા હતા. સહેવાગ શૈલીમાં બાંટિંગ કરી હતી. અમે પણ ગંભીરની જેમ પણ અંધ્રાપણે તેમને સાથ આપેલો.

જુદા જુદા સાહિત્યકારોને તે સ્ટેજ ઉપર બોલાવતા, કંઈક સવાલો પૂછીતા અને રમૂજ પેઢા થતી. મને યાદ છે સ્ટેજ ઉપર મને બોલાવી પૂછ્યું, 'નિરંજન ત્રિવેદી, ચાલીસથી નાની ઉમરના કોઈ સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે નિમચાના હોય તો તમે કોણું નામ સૂચ્યવો ?' આ પ્રશ્ન પુછાયો ત્યારે સ્ટેજ ઉપર ચોર્યાસી વર્ષના પ્રમુખ બક્ષીસાહેબ બેઠા હતા.

અમે પ્રશ્ન સાંભળ્યો. થોડાક ગુંચવાયા પણ ખરા. પ્રશ્નોથી ગુંચવાઈ જવાની અમારી આદત છેક વિદ્યાર્થીકાળથી. પણ પછી સ્વસ્થ થઈ કર્યું, 'જો ચાલીસ વર્ષથી નીચેના પ્રમુખ સાહિત્ય પરિષદને જોઈતા હોય તો, નિરંજન ત્રિવેદી ઉપલબ્ધ છે.'

'કેમ તમારું પોતાનું નામ સૂચ્યવો છો ?' બક્ષુલબાઈએ તોઝાની સિમતથી પૂછેલું.

'કારણ કે ચોર્યાસી વર્ષ સુધી હું ધીરજ ધરી શકું તેમ નથી. બક્ષીસાહેબ તરફ નજર કરી મેં કર્યું, વળી કોઈ સુંદર કન્યા માટે મુરતિયો ગોતવાનું કોઈ કુંવારાને કહો તો તે શા માટે એ પોતાનું નામ ન આપે ?'

એ વાત તો ત્યાં પૂરી થઈ. કહેવાનું એટલું કે પરિષદના પ્રમુખપદ માટે નામ સૂચવવાનો મારો અનુભવ કાફી પુરાણો છે એટલે 'વોહી કહાની હોલે સે દૂબારા છેદું છું' આજે પરિષદપ્રમુખ માટે નામ સૂચવવાની વાત કરું.

ગુજરાતી સાહિત્ય પરિષદના એ સદ્ધનસીબ હતા કે, પૂં બાપુ મહાત્મા ગાંધી, ચાન્દ્રપિતા થયા ન હતા તે પહેલાં પરિષદના પ્રમુખ થયા હતા.

હવે મને વિચાર આવે છે કે પરિષદના પ્રમુખ તરીકે એક વધુ 'બાપુ' આવે. એ વાત ખરી કે ગુજરાતમાં 'બાપુ'ઓની ખોટ નથી. શંકરસિંહ (વાઘેલા) બાપુ, કે શક્તિસિંહ બાપુ, આ બાપુ કે તે બાપુ જહાં જુવો ત્યાં બાપુ - બાપુ છે. (શું કહો છો બાપુ ?) વળી શંકરસિંહ બાપુએ તો પરિષદને એકાવન લાખની સખાવત કરેલી એ પૈસા લાવી આપનાર લેખક તો પરિષદપ્રમુખ થઈ ચૂક્યા છે. એટલે રમેશ પારેખની ભાષામાં કહું તો માગતલ તો પ્રમુખ થઈ ચૂક્યા છે. આપતલ બાકી છે. આપતલ માટે કોઈ કહે તો કહે. એર અત્યારે મારા મનમાં શંકરસિંહ બાપુ નથી. શંકરસિંહ બાપુના મનમાં પણ પરિષદનું પ્રમુખપદ ન જ હોય. એમના મનમાં અત્યારે ઘણુંબધું હશે. (કોઈકને લાગે પણ ખરું કે કાપડખાતાના પ્રધાનનું વસ્ત્રાહરણ થઈ ગયું છે.) શંકરસિંહબાપુ સારા વહીવટકર્તા છે, પણ એમની વહીવટી

શક્તિનો લાભ અત્યારે પરિષદને ન મળે. એ સંજોગોમાં એ પ્રમુખ ન બને. પરિષદના મતદારો પણ કદાચ સંમત ન થાય. અને પ્રમુખપદ માટે 'ડોનરસીટ'ની વ્યવસ્થા નથી.

મને વિચાર આવે છે કે મહાત્મા ગાંધી - પૂં બાપુ પછી એક વધુ બાપુ પરિષદને પ્રમુખ તરીકે મળે. ઈતિહાસની ભાષામાં 'બાપુ ધ સેકન્ડ' કહી શકે.

એ છે વન ઓન્ડ ઓન્લી વન મુરારીબાપુ. મોહનલાલ પછી મુરારીબાપુ પરિષદને મળે તે યોગ્ય જ છે. કોઈક પૂછ્યું 'મુરારીબાપુ તો સતત પ્રવાસ કરતા હોય છે એમને પરિષદ માટે સમય મળે ?' મિત્રો, ગાંધીજી જ્યારે પરિષદપ્રમુખ થયા ત્યારે તો તેઓ સ્વાતંત્ર્ય સંગ્રહ લડી રહ્યા હતા. ગુજરાતમાં જૂઝ રહેતા છતાં ગુજરાતી ભાષાની સાહિત્ય પરિષદના પ્રમુખ થયા હતા. એમની સરખામણીમાં મુરારીબાપુ ઓછા વ્યસ્ત કહેવાય. અને ગુજરાત બહારનો પ્રવાસ તો ઘણો ઓછો હોય. એટલે ગાંધીબાપુની સરખામણીમાં વ્યસ્તતા મુરારીબાપુને જરા પણ અવરોધક નથી.

એક જાહેરાતમાં કહેવાયું છે કે 'આઈ ઇટ કિકેટ, આઈ ડ્રિન્ક કિકેટ, આઈ લીવ કિકેટ.' મુરારીબાપુ માટે પણ એ જ રીતે કહી શકાય કે તેઓ સાહિત્ય ખાય છે, સાહિત્ય પીએ છે, અને સાહિત્ય જીવે છે, સાહિત્યને જીવાડે પણ છે. દર વર્ષ મહુવા-તલગાજરડામાં બાપુ સાહિત્યકારોને આમંત્રે છે. પ્રેમથી ત્રણ-ચાર દિવસ રાખે છે. એ દિવસોમાં 'સાહિત્ય-ધૂન' ત્યાં સંભળાય છે. સાહિત્યકારો ઉપરાંત કલાકારો પણ બાપુના સાહિત્યપર્વ એવા અસ્મિતાપર્વમાં આવે છે. એટલે ઘણાબધા ધૂરંધર સાહિત્યકારો કરતાં પણ બાપુની સાહિત્યસેવા વધુ ગણાય.

ગાંધીબાપુ સાહિત્ય પરિષદના પ્રમુખ થયા તે પહેલાં કે તે સમયમાં તેમના હાથે સાહિત્યના પુસ્તકોનાં લોકાર્પણ થયાનું પણમાં નથી. પણ મુરારીબાપુએ અનેક પુસ્તકોનાં લોકાર્પણ કર્યા છે. હમણાં જ કવિ હર્ષ બ્રહ્મભણાં પુસ્તકોના લોકાર્પણનું કાર્ય એમના વરદ્ધકસ્તે, નવભારતે ઘોઝેલું, અગાઉ પણ અને હવે પછી પછી પણ આ સિલસિલો તો રહેવાનો જ. કદાચ તેમણે કરેલી રામકથા કરતાં પુસ્તકના લોકાર્પણનો આંક વધી જશે એમ લાગે છે.

સૌથી મોટી વાત ઘણી વાર જેમના વરદ્ધકસ્તે પુસ્તકનું લોકાર્પણ થાય છે તે વિભાતના નયનકાળે ભાગ્યે જ એ પુસ્તક વાંચ્યું હોય છે. ઘણી વાર લોકાર્પણ કાર્યક્રમમાં એ વિદ્વાન પુસ્તક વિષે ભાગ્યે જ બોલે, બોલે તો પોતાના વિષે જ કંઈક બોલે. આપણને લાગે કે આપણે લેખકના પુસ્તકપ્રાગટ્યના કાર્યક્રમમાં આવ્યા છીએ કે લોકાર્પણ કરનાર મહેમાન વિદ્વાનોની જન્મજયંતિની ઉજવણીમાં ? વિદ્વાન પોતાનું જ ભરડે રાખે. લેખક કે તેના પુસ્તક વિષે કાંઈ ન બોલે. એ એવી રામકથા કરે તેમાં રામ કે સીતા હોય જ નહિ.

જ્યારે બાપુની વાતમાં અવળગણ દેખાય. પુસ્તક વિષે પૂરી જાણકારી તેમના પ્રવચનમાં આવે. લેખકે રજૂ કરેલી ફૂતિ પાછળનું તત્ત્વજ્ઞાન પણ બાપુ રજૂ કરે. (આ ગેરલાયકાત તો નહિ ગણાય ને ?)

અને બાપુ સદ્ગ પઠન કરે છે તે ગોસ્વામી તુલસીદાસજીનો ગ્રંથ એ એક અદ્ભુત સાહિત્યગ્રંથ છે. કેવળ ધર્મગ્રંથ નથી. એ વખતે 'નોબેલ પ્રાઇઝ' હોતું તો તુલસીદાસજીને જરૂર મળત તેટલી સમૃદ્ધિ તેમાં છે. એક સેમ્પલ સીતાહરણ કરી જતા રાવણ સાથે જયયું

યુદ્ધ કર્યું. ગંભીર રીતે ઘાયલ થઈને પડ્યો છે. ભગવાન રામ એને ઉદાહરણ તેના ઘાલૂછવા માટે કોઈ કપડાની તપાસ કરે છે, કંઈ દેખાનું નથી એટલે ભગવાન પોતાની વાંબી જટા છોડી એ વાળથી જટાયુના ઘા સાફ કરવા વાળ પકડી નીચે નમે છે. ત્યારે તુલસીદાસજી વર્ઝન કરે છે કે સામાન્યતઃ ભગવાનના ચરણમાં ભક્તનું માથું હોય પણ આજે ભગવાનનું માથું ભક્તના ચરણમાં છે. (શું ઈન્ટરપ્રોટેશન છે ?) આ વાત ઉપર જ તુલસીદાસજીના ચરણમાં માથું નમાવવું પડે. આ મહાન ગ્રથના અભ્યાસી સાહિત્ય પરિષદના પ્રમુખ થાય તો એથી આધિક સુંદર શું ?!

૧

## ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા 'તા કુંગરા,  
જંગલની કુજ કુજ જોવી હતી;  
જોવી 'તી કોતરો ને જોવી 'તી કંદરા,  
રોતાં ઝરણાંની આંખ લહોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાણે  
હંસોની હાર મારે ગણવી હતી;  
ડાળે જૂલંત કોક કોકિલાને માળે  
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભિને એકલો  
પડ્યા ઉરબોલના ઝીલવા ગયો;  
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,  
એકલો અદૂલો આંખો પડ્યો.

આંખો અવતાર મારે ભમવા કુંગરિયા,  
જંગલની કુજ કુજ જોવી ફરી;  
ભોમિયા ભૂતે એવી ભમવી રે કંદરા,  
અંતરની આંખડી લહોવી જરી.

[‘સમગ્ર કવિતા’]

- ઉમાશંકર જોશી

## શતાબ્દીવંદના

### કવિવર ઉ.જો.નું પ્રભાવક ગીત : લૂં જરી તું - | લાભશંકર ઠાકર

બે-એક વર્ષ પહેલાંની સ્મૃતિ છે. કવિવર ઉ.જો.ની સ્મૃતિસંધ્યામાં એક વક્તાએ મંચ પરથી, ઉ.જો.ના ગીતો વિશે આ ભાવકને ન ગમે તેવું વિધાન કર્યું હું ક્ષુદ્ર થયો. મારી ચેતનામાં ઉ. જો. એક અનન્ય ગીતસર્જક તરીકે નિત્ય સ્મરણીય અને શ્રવણીય ભાવસત્ય છે. ખેર. ભારતભરમાં ગુજરાતી સાહિત્યના વિદ્ધાન અભ્યાસી તરફે પ્રતિનિધિત્વ કરનાર (હાસ્તો, ભારતભૂષણ) અને વળી કવિ ઉ.જો.ના ચાહકનું ભાવતંત્ર ઠપ થઈ ગયું હશે ? મારી કિશોર - કુમાર વયથી આજ સુધી મારા પ્રિય ગીતસર્જક રહેલા કવિ ઉ. જો.ના ગીતસર્જન વિશે આવો અભિપ્રાય ? એ ક્ષણોમાં હું સાંસ્કૃતિક રહ્યો. આ ક્ષણોમાં થાય છે, મારા પ્રિય ગીતસર્જક ઉ.જો.ની કોઈ એક ગીતરચના વિશે મારા ભાવનને કંઈક વિગતે આમ લખતા સાંભળ્યું, પામું.

કવિ શ્રી નિરંજન ભગત સાથે, આપણી ભાષાના દલપત્રામથી રાવજી પટેલ સુધીના કવિઓને અમે પ્રતિમાસ સ્મરવાનો ઉપકમ રાજેલો. ભગત સાહેબ મને ગાવા પણ દે. હા, યાદ આવે છે, ઉ. જો.ને સ્મરવાના ઉપકમમાં મેં એક ગીત ગાયેલું.' એ ગીત વિશે મારા ભાવનને સાંભળવા આ ક્ષણોમાં ઉત્સુક છું.

લૂં જરી તું દીરે દીરે વા,  
કે મારો મોગરો વિલાય !  
કોકિલા, તું ધીમે ધીમે ગા,  
કે મારો જ્યારો હુભાય !

‘લૂ’ પછી ગીતસર્જકે અલ્યવિરામ લીધો છે. હાસ્તો ભાવકે (કહો કે ગાયકે) અલ્યવિરામ લેવો અનિવાર્ય. લૂનો દીર્ઘાંચ્યાર (હાસ્તો ગાતા ગાતા) પછી અલ્યવિરામ. આ અલ્યવિરામ નાટ્યાત્મક ક્ષણનો અનુભવ કરાવે. ગીતમાં નાયિકાની પ્રથમ વ્યક્તિ એકવચનમાં અભિવ્યક્તિ છે. નાયિકા અટકે અને એક વિરામ, કહો કે સાયલન્સ સર્જય. તે ભાવપૂર્ણતાનો નાટ્યાત્મક અનુભવ કરાવે. ગીતનો આ વિરામ અને પછીના ભાવકથન સાચ્યતની સંરચના પ્રેક્ષણીય પરિમાણ સર્જે છે. હા, ભાવકની ચેતનાના ઈનર રંગમંચ પર એક નાયિકા પ્રત્યક્ષ થાય છે. તે લૂને સંબોધન કરે છે. લૂનો ઊ-કાર અને પછી આવતા તુંનો ઊ-કાર ભાવકની ચેતનાને શ્રવણીય પકડમાં પકડે-જકડે (હા, અનયાસ) અને એક ભાવલોકમાં તલ્લીન કરે.

નાયિકા લૂને ‘તું જરી ધીરે ધીરે વા’ એમ કહે છે; કેમ જે તે લૂથી ‘મારો મોગરો વિલાય !’ મોગરો તે પ્રસ્તિક્ષ પુષ્ય છે. તે લૂથી વિલાય. નાયિકાના અંતઃકરણમાં મોગરો કર્યો ભાવસકેત વ્યક્તિ કરે છે ? આ ક્ષણો એક ભાવક એમ કહે; પ્રેમભાવ. કોઈ ભાવક કહે : પ્રેમમિલન ભાવ.

પછીની પંક્તિઓમાં કોકિલાને સંબોધન છે. તે ગાઈ રહી છે. તેને નાયિકા ‘ધીમે

ધીમે ગા' એમ કહે છે. કેમ ? 'કે મારો જીયરો દુભાય !' મોગરો વિલાય છે અને જીયરો દુભાય છે. જીયરો એટલે જીવ, નાયિકાનું ધબકતું હદ્ય.

આ ગીતરચના તરત જ રંગમંચને પ્રત્યક્ષ કરે છે. ગીતના આરંભ સાથે જ નાયિકાના આંગિકમૂ - વાચિકમૂ પ્રત્યક્ષ થાય છે. કોઈએ આ વિશ્વને રંગમંચની ઉપમા આપી છે. આ ગીતમાં જે વિશ્વ સર્જાય છે તેના ઘટકીમાં સૃષ્ટિ સમસ્ત છે અને કાલ (ધ વાઈમ) છે. આ ગીતની સહજ એવી રંગમંચક્ષમતા પરમ પ્રકર્ષક અને પ્રભાવક બની રહે છે. નાયિકા ગીતની સંરચનાના કેન્દ્રમાં છે. અને નાયિકાની ઐતસિક ઘટનાના કેન્દ્રમાં નાયક, નાયકની પ્રતીક્ષા છે. ભાવકની આંતરચેતનામાં સ્થળવાલસાપેક્ષ રંગમંચ સર્જાય, એક ગીતમાં, તે ગીતસર્જકની અપૂર્વ વસ્તુનિર્માણક્ષમા પ્રજ્ઞાનો પ્રભાવ છે.

આ ફ્રામેટિક રૂપ સાથે પ્રત્યક્ષ થતા ગીતના આરંભ પછી, ગીતની લયાત્મક સ્ટ્રક્ચરલ બ્યુટિમાં કેવું રૂપાંતર આવે છે, તે સાંભળો.

**પાંખો થંભાવી ઊભું સ્થિર આભાંખી**

**સૃષ્ટિ મધ્યાહ્ન કરી ઘેનમાં છે જંપી.**

**એકલી અર્ડી હું રહી પ્રિયતમને ઝંખી..**

**લૂ, જરી તું....**

કળાના ભાવસત્યને પામવામાં એક સમજ તો ભાવકમાં અપેક્ષિત છે. કળા માત્ર, તેના formal રૂપમાં, રૂપના કથનમાં અને આ કે ચરિત્રના તથ્યમાં કેવલ, શુદ્ધ કથના હોય છે. કથના તે રચનાનો પર્યાય છે. ના રિયાલિટી (વાસ્તવ)ની કોઈ મેયપણી, માપપણી આ સંદર્ભમાં પ્રયોજવી થથાર્થ નથી. જેમકે આ નાયિકા, તેના પ્રથમ વ્યક્તિ એક વચનમાં પ્રકટ, પ્રત્યક્ષ થતો ભાવપૂર્ણ અવાજ તે કેવળ કથના (રચના) છે. હા, એક વિરહિણી પ્રત્યક્ષ થઈ છે. તે શું વિરહાજિની આગ-જાળમાં ગાય, નર્તન કરે ? ના, કળા એવા વાસ્તવની મેયપણીની સાપેક્ષતાથી બિન્ન, અલગ એવા નિજ પરિમાણ સત્યમાં રાચે. આ નાયિકા 'આભાંખી'ને અનુભવે છે. પાંખો છે. પણ તેણે પાંખો થંભાવી દીધી છે. આ કથન વિરહિણી નાયિકાના ગાનલયમાં પ્રત્યક્ષ થયું છે. 'સૃષ્ટિ મધ્યાહ્ન કરા ઘેનમાં છે જંપી.' આવી આભ-સૃષ્ટિની સંચાર-રહિત ક્ષણોમાં નાયિકાનું નિજ ભાવકથન છે :

**એકલી અર્ડી હું રહી પ્રિયતમને ઝંખી.**

હા, આ વિરહિણીની એકલતાની અને ઉત્કટ એવી પ્રિયતમની ઝંખનાની ક્ષણો વિશ્વમંચ પર પ્રત્યક્ષ થઈ રહી છે. વિરહિણી વિરહથી વિરઘ છે, અને ઋતુકણથી ય વિરઘ છે.

મનોદેહિક સત્ય છે તો મારા પ્રતિભાવનના અવાજને સાંભળ્યું. પ્રાણૈષણ્ય (સજીવ ધબકતા રહેવાની ઈચ્છા) તે સર્વ પ્રથમ ઉત્કટ, સહજ એષણા છે. કહો કે પ્રાજાને ટકાવવા ધનની, સાધનની અનિવાર્યતા. તેથી ધનૈષણ્ય ય પ્રાણૈષણ્યનું સહજ પરિણામપ્રવર્તન. પછીય એક દુર્નિવાર એષણા સહજ, ઈનેટ છે. હા, ડિઝાયર ઓફ સેક્સ. તે ઉત્કટ મનોદેહિક સુખનો, આનંદનો અનુભવ છે. કોઈ વેદકથન છે કે ઉપરથ-યોનિનો આનંદ તે સર્વોચ્ચ આનંદ છે.

વિરહિણીનાં વ્યથા-પીડા-અગન-દાહ-એકલતા આ ગીતમાં, કહું કે વિશ્વરંગમંચ પર, પ્રત્યક્ષ થયાં છે. હાસ્તો એમાં યોગ-સંયોગની, એક અને અનન્ય થવાની ઝંખના છે. પણ (સાંસ્કૃતિક સત્યને કારણે) પ્રિયતમ તો દૂર-સુદૂર હોય, હશે. 'એક' મટીને અન્યતાથી મુક્ત

થવાની, અનન્ય, અદ્વૈત થવાની ઝંખના તે પ્રાફુતિક સત્ય છે. હા. ભાવકની ચેતનામાં મંચ અનાયાસ રચાઈ જાય છે. મારા પ્રતિભાવનની આ ક્ષણોના યથાર્થને વ્યક્ત કરું તો આ ગીતરચના પ્રકૃતિની ઉત્કટ ઝંખનાને જગત મંચ પર પ્રગટ, પ્રત્યક્ષ કરે છે, જેને પુરુષ સાથે એક થવું છે.

કવિ ઉ.જો.એ એક સર્વસામાન્ય એવી વયસ્ક નારીને, નાયિકાને એવા સંરચના-સત્યમાં ચાક્ષુષ, શુતિગોચર કરી છે કે ભાવયિત્રી પ્રતિભાવે નિજ સર્જનપ્રક્રિયામાં સ્વયં પ્રકૃતિનો સાક્ષાત્કાર થાય.

કવિ ઉ.જો. આ પૃથ્વી પર મનુષ્ય હોવાના પાયાના, સહજ એવા 'માનવીય' સત્યને પ્રગટ, પ્રત્યક્ષ કરે છે. ના, તે લેશ માત્ર 'શીછ'ના કવિ નથી. હા, 'વિશ્વશાંતિ'ના કવિ છે. વિશેતિ સર્વમૂ. તે અભિલ-નિખિલના સમગ્ર સંદર્ભની સાપેક્ષતામાં મનુષ્યને, એક વયસ્ક નારીને, એક આવતી કાલની જનનીને, એના ઈનેટ સત્યથી પ્રેરાયેલાં આંગિકમૂ - વાચિકમૂને તદ્વાપ થઈને જોઈ-સાંભળી રહ્યા છે. હા, તે ઓડિયો-વિડિયો કેમેરા સાથે, એક વ્યક્તિચેતનાને, footage આપીને તેના આંગિકમૂ-વાચિકમૂને નેત્રપટ પર અને અંતઃશુતિપટ જાલવામાં તદ્વાપ છે. સાંભળો બીજો અંતરો -

**ધખતો શો ધોમ ધીકે ધરશીની કાયા :**

**ઉલ્લિ છું ઓઢીને પ્રિયતમની છાયા,**

**પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયા.**

**લૂ, જરી તું....**

ધખતા ધોમમાં ધરશી ધીકે છે. નાયિકા આ ધોમ ધખતા તાપથી સંતપ્ત છે, તેથી અધિક વિરહાનિથી સંતપ્ત છે. હા, ઈન અને આઉટ ધોમ ધખે છે. એ આઉટ કેમ છે ? પ્રતીક્ષામાં છે, પ્રિયતમની. ના, તે બંધ બારણે તાપથી બચવા પુરાઈ રહે તેવું તેવું ઈનર સત્ય નથી. દૂરથીયે એ દેખાય તો એને શાતાનો, સુખનો અનુભવ થાય. એ ધોમ ધખતા તાપમાં ઊભી છે. પ્રથમ વ્યક્તિ એકવચનમાં એ કહે છે. (કૌસમાં કોઈ પૂછે એમ કલ્પિએ. કોણ પૂછે ? પ્રેક્ષક, શ્રોતા. એ પૂછે તે પહેલાં નાયિકાનું ઈનર એવું આચાસન સત્ય પ્રકટ થાય છે. સાંભળો, ફરી.)

**ઉલ્લિ છું ઓઢીને પ્રિયતમની છાયા;**

હા, એ પ્રિયતમની છાયાને ઓઢીને ઉલ્લિ છે. છાયા છે ? છે. ક્યાં ? નાયિકાના મનમાં અને ઉત્કટ પ્રતીક્ષામાં. આ એનું મનોમય સત્ય છે. હા, છે અને ઉત્કટ એવું પ્રભાવક સત્ય છે. સ્નેહમિલન પુષ્પ છે. છે જ. એનો પરિમલ ઊડે છે જે નાયિકા feel કરે છે. એનું ઈનર સત્ય તો એવું છે કે 'ન ફૂલ હૈયે સમાયા.' તેવું સત્ય સ્નેહાધીન છે.

હા, કહું કે આ પુષ્પિતા નારીનું અંતર કથન છે. વેલ પુષ્પિત થાય પછી ફિલિત થાય. આ વયસ્ક નારી પુષ્પિતા છે. હા, ઉત્કટ આશા અને અભિવાસ સાથે She is waiting. આ દુર્નિવાર એવી મનોદેહિક ઝંખના છે.

ગીતના અંતે, આરંભ, પુનરુક્ત થાય છે.

**કોકિલા, તું ધીમે ધીમે ગા,**

**કે મારો જીયરો દુભાય,**

લૂ જરી તું ધીરે ધીરે વા,  
કે મારો મોગરો વિલાય.

[અમદાવાદમાં, ગીત રચાયું ૨૫-૧૧-૧૯૫૦ના હિવસે. આ ગીત ‘વસંતવર્ષ’માં છે.]

કવિ ઉ.જો.નાં બીજાં એકાધિક ગીતો વિશેના મારા પ્રતિભાવને આમ લખીને સાંભળવાની સહજ અભિલાષા છે.

[૩૧-૫-૨૦૧૦]

## ‘છિન્નભિન્ન છું’ – ઉમાશંકરની કવિતાના નવા પ્રસ્થાનનું પહેલું પદ | ચંદ્રકાન્ત શેડ

ઉમાશંકર જોશીના કાવ્યપ્રાસાદનો પાણો ‘વિશ્વાંતિ’, તેનું શિખર રે ‘સપ્તપદી’ અને શિખર પરનો સુવર્ણકણથ રે ‘પંખીલોક’. કવિ ઉમાશંકરના દસ કાવ્યશ્રોમાંથી ત્રણમાં છે સાત સાત કાવ્યો. ‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’ સાત સાત નાટ્યાત્મક દીર્ઘ કાવ્યોના સંગ્રહો તો ‘સપ્તપદી’, તેનું નામ સૂચે છે તેમ, સાત પદોનો – સાત ઉર્મિકાવ્યોનો સંગ્રહ. જેમ લગ્નજીવનમાં સપ્તપદીનો તેમ ઉમાશંકરના કવિજીવનમાં એમની ‘સપ્તપદી’નો વિશેષભાવે મહિમા છે. સત્તાં હિ સખ્યમું સાપ્તપદીનમું આહુઃ । – સત્તિયાં જનો (સંતો)નું સખ્ય સાત ડગનું કહેવાય છે. સત્તક્વિ ઉમાશંકરનાં ‘સપ્તપદી’માંનાં સાત કાવ્યો એના અંતરંગે ને બહિરંગો કવિ શ્રી ઉમાશંકર જોશીની વિકાસલક્ષી કાવ્યયાત્રાની ખૂબી તથા ખાસિયતનાં ધોતક છે. જેમ ‘વિશ્વાંતિ’થી ‘અર્વાચીન કવિતા’ના લેખક – કવિ-વિરેચક શ્રી સુન્દરમે ગુજરાતી કવિતાનો એક નૂતન તબક્કો શરૂ થયાનું જગ્ઘાવેલું તેમ ૧૯૫૬માં રચાયેલા ‘છિન્નભિન્ન છું’ કાવ્યથી પણ સ્વાતંશ્ચોત્તર કવિતાનો વિષયવસ્તુ તેમ જ અભિવ્યક્તિના સંદર્ભમાં એક નૂતન તબક્કો શરૂ થયાનું આપણે કહી શકીએ એમ છીએ.

‘છિન્નભિન્ન છું’ ‘સપ્તપદી’ના કાવ્યસપ્તકમાંનું પહેલું કાવ્ય છે. શરદપૂનમની રાત્રે નખી સરોવર પાસેથી – પ્રકૃતિ પાસેથી કાવ્યસૌદર્યની દીક્ષા પામનાર તથા કારણગૃહના બંધન વચ્ચે અહંમુક્તિની – ચેતોવિસ્તારની આધ્યાત્મિક ભૂમિકાની જીવનદીક્ષા પામનાર ઉમાશંકરે ૧૯૫૮માં કહેલું : ‘અમે સારસ્વતો, સંવાદિતાના સાધકો.’ અને એ જ કવિ ૧૯૫૮માં કહે છે :

“છિન્નભિન્ન છું,  
નિશ્ચિંદ કવિતામાં ધબકવા કરતા લય સમો,  
માનવજીતિના જીવનપટ પર ઉપસવા મથતી કોઈ ભાત જેવો,  
ઘેર ઘેર પડેલ હજુ નવ-હાથ-લાગ્યા લિક્ષુકના ટુક જેમ,  
વિશ્ચિન છું.”

એવું તે પોતાની અંદર-બહાર શું ગુજરી રહ્યું હતું કે આ સંવાદિતાના સાધક કવિને વિસંવાદિતાના વિષમ અનુભવો વેઠાના આવ્યા ?!

આ કવિએ ૧૯૭૧માં વિશ્વાંતિની અને એ નિમિત્ત વિશ્વપ્રેમની વાત માંડી, પણ

૧૯૭૮માં તો એમની કવિદસ્થિઓ આપણી સમક્ષ ‘આત્માનાં ખંડેર’ ૨જુ કર્યું. ૧૯૭૮થી ૧૯૮૬ વચ્ચેના ગણ્યમાં જગતિક ભૂમિકાએ એવું એવું જેવા મળ્યું કે વ્યક્તિએ અને સમાજિએ મૂળભૂત રીતે પોતાના વિશે, પોતાની આસપાસના સંદર્ભો અને સંબંધો વિશે વિચારવાનું – રિબાઈનેય સમજવાનું અનિવાર્ય થઈ પડ્યું. સ્વતંત્રતા, બંધુતા અને સમાનતા માટેના સંઘર્ષોએ ને યુદ્ધોએ માનવજીતિના ધર્મપ્રેમ ને પ્રેમધર્મના, અર્થનીતિ ને રાજનીતિના, શિક્ષણનીતિ ને સમાજનીતિના પરંપરાગત જ્યાલો સામે અનેક યક્ષપશ્મો ઊભા. કર્યા. યંત્ર-તંત્રની જાણજીજાળને કારણે સુન્દરમ્ય જેવા કવિને ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ એમ કહેવાનું તો આપણા આ કવિને પણ ‘સ્વનોને સળગવું હોય તો —’ એ કાવ્યમાં ‘મંત્ર તો ‘મનુષ્ય’ – માનવનું હોવું, માનવનું જીવવું’ – એમ કહેવાનું પ્રાપ્ત થયું. માનવ થવું એટલે માનવતાવાળા થવું; પ્રેમ અને કરુણાવાળા થવું, અને એવા થવાનું – એવા થઈને રહેવાનું વસમું બની જાય એવો જો જીવન અને જગતનો માહોલ બની જાય તો તે કેમ ચાલે ? મનુષ્યને વિંધીપીંડી નાખનારાં તત્ત્વો પોતાની અંદર કંઈ ઓછાં નથી અને તેથી જ પોતાની છિન્નભિન્નતા જોનાર કવિની અંતર્યાત્રા અનિવાર્યપણે અહીં ઉઝેણાઈને રહે છે.

કવિ કાવ્યનો આરંભ કરે છે પોતાની છિન્નભિન્નતાની હાલત પોતાની આગવી શૈલીથી બતાવીને. કવિનું હોતું ‘હું’ પદથી સૂચવાય છે. આ ‘હું’માં ‘હું’ અંતહીંત છે જ. છિન્નભિન્નતાનો અનુભવ વેદનાકર છે, પરંતુ એ અનુભવને અભિવ્યક્ત કરવા જેટલી કવિની અડીયમતા હજુ બચી છે. છિંદનો સાંગીતિક સંવાદ બલે વિક્ષિપણ કે ખંડિત થયો પણ હજ્યે નિશ્ચંદતામાં ધબકી શકે એવું લયતત્ત્વ – કવિની સર્જકતાનું સંપદનતત્ત્વ ઊર્ઝ ઊર્ઝ સાબૂત છે જ અને તેથી છિન્નભિન્નતાની અનુભૂતિની આવી કવિતાનું રચનાવિધાન શક્ય બન્યું છે. જેમ અંધકારમાંથી પ્રકાશમાં તેમ વિશ્ચિન્નતામાંથી – વિસંવાદિતામાંથી અવિશ્ચિન્નતામાં – સંવાદિતામાં પહોંચવાની વૃત્તિ ને ક્ષમતા નિઃશોષ થઈ નથી જ.

કવિની આસપાસનો માહોલ – કહો કે, પરિવેશ – એવો છે કે કોયલનો ટહુકો પણ કવિ સહી શકતા નથી. યંત્રતંત્રની જાળ એવી વકરી છે કે હવે પ્રકૃતિનો સ્વાદ – સંવાદ પણ કવિચિત્ર સહજતાયા અનુભવી શકે એવી ભાવસ્થિતિ બચી નથી. વસંતપંચમી કેમ આવી ને કેમ ગઈ એની આ કવિને (કોકિલ, પંચમબોલ બોલો / કે પંચમી આવી વસંતની.) – એવું ગાન કરનારા ‘વસંતવર્ષ’ના આ કવિને) ખબર સરળી રહેતી નથી. પ્રકૃતિ તો જેવી છે તેવી છે, રામાયણ ખરી તો મનુષ્યપક્ષે છે. મનુષ્યનાં એવાં કરનામાં કે કરતૂતો છે કે એથી પ્રકૃતિનો ચહેરો મ્લાન થયો હોય એવું હવે લાગવા માંડ્યું છે. મનુષ્યની ઊખાગીરીથી પ્રકૃતિની સંવાદ-સુખમાં વિક્ષિપણ કે વિશ્બુદ્ધ થઈ હોય એવું લાગે છે અને એથી કવિનો પોતે વિશ્ચિન્ન હોવાનો ભાવ વધુ ધેરો બને છે. એ રીતે કવિ પોતાની આસપાસના પ્રકૃતિક સંદર્ભથી. અને તેના પરિણામે માનવીય સંબંધોથી પણ વિશ્ચેદ પામ્યાનો વેદનાકર અનુભવ કરે છે. આવો અનુભવ એક પ્રકારની ઉંમૂલનતા કે નિરધારીનો ભાવ પણ સંકોરી શકે, જોકે કવિ એવા સંપ્રેષણ કે સભાના છે, એવી સુંદર સહનશરીરિવાળા છે કે વેદનાનો ભરપૂર અનુભવ કરવા છતાં વેદનામાં પોતાને તશ્વાવા દેતા નથી. વેદનાથી તરડાય છે ખરા, પણ તૂટા નથી. તેઓ આત્મદાયાની રીતે કહે છે :

**“માની લીધીલી એકત્તા વ્યક્તિત્વી**

**શતબંડ નુટિટ મેં નજરોનજર દેખી લીધી છે.”**

કવિ પોતાના વ્યક્તિત્વમાં પડતી તિરાઝો આવા જેટલી બબરદારી પણ દાખલે છે. તેઓ વિચિન્નતાનો અનુભવ કરનારા છે તો પોતાનામાં વિચિન્નતાના કારણે કેવી સ્થિતિ સર્જય છે તેનું સાક્ષીભાવે દર્શન કરનારા પણ છે.

ઉમાશંકર જે ભાવત્મક પરિબળોના દ્બાવ હેઠળ પોતાનું સંવિતરંત્ર કામ કરે છે તેની વાત માંડે છે. એમ કરતાં પોતાની અંદરની પ્રકૃતિમાં વિકાર-વિવર્તનો પેદા કરનારાં રાગ, દ્વેષ અને ભયનાં તત્ત્વોનો નિર્દેશ કરે છે. તેઓ એ ગ્રણેય તત્ત્વોને મૂર્ત (મૂર્તિ) – સ્વરૂપે અહીં રજૂ કરે છે.

રાગમૂર્તિનું અને તેના પ્રભાવનું નિરૂપણ કરતાં કહે છે :

“તમારે સ્મરણો રુધિર નાચી ઊદ્ઘંનું,  
તમારે દર્શન હૃદય રાચી ઊદ્ઘંનું,  
ન વિરહમાં બસ મરણ યાચી ઊદ્ઘંનું,  
તમે મારી ઊભનાનું મધુર પ્રેયોરૂપ —  
રાગમૂર્તિ, નમોનમો !

તે પછી દ્વેષમૂર્તિનું અને તેના પ્રભાવનું નિરૂપણ કરતાં કહે છે :

તમે મારી વાસનાનું કાલફૂટ વિરૂપ,  
અંખની પ્યાલી મહી ઊદ્ઘણેલ અર્જિન્કૂપ,  
ઊદેલ ચાસોચ્છ્વાસ સાથે દગ્ધ હૈયાધૂપ,  
તમારા સ્પર્શો નયન-પક્ષમો વિખૂટાં —  
દ્વેષમૂર્તિ, નમોનમો !

અને છેલ્યે ભયમૂર્તિનું અને તેના પ્રભાવનું નિરૂપણ કરતાં કહે છે :

તમારા શવ-આશ્વેષથી શીત છૂટવાં,  
હીર હૈયા તણાં છેક સુકાઈ ખૂટવાં,  
ચેતનાસ્પદનો મંદ આકંદ-દૂલ્ઘાં,  
તમે મારી કામનાનો નગન નિશ્છલ છંદ —  
ભયમૂર્તિ, નમોનમો !

— આ ત્રિમૂર્તિએ કોઈક રીતે ઉમાશંકરને પ્રેમધર્મની દિશામાં – વિચિન્નતાની વિરુદ્ધની સંવાહિતાની દિશામાં પ્રેર્યા છે, ધકેલ્યા છે અને તેથી જ ઉમાશંકર કૃતજ્ઞતા અને નિખાલસતાથી કહે છે :

“એક-કેન્દ્ર વ્યક્તિત્વ કરવા મથ્યાં તમે મારે માટે  
અને દીક્ષા આપી પ્રેમધર્મની  
જેના કખગધનેયે પામવાનું કેમે કરી  
શવનું નથી હજ્યા.”

ઉમાશંકરે જીવનમાં જેમ દુરિતના તત્ત્વનો વિવેયાત્મક અભિગમથી તેમ રાગ, દ્વેષ અને ભયનો પણ નમસ્કારપૂર્વક સત્કાર કર્યો જણાય છે. વિષમતાના અનુભવો જીવનમાં તૌડવાનું કામ કરતા જણાય તે તો એક ભૂમિકાએથી, બીજી વધુ ઉન્ત ભૂમિકાએથી જોતાં એ અનિષ્ટ તત્ત્વો પણ પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે ઈષ્ટ તત્ત્વોના સમર્થન, સંવર્ધન અને વિકાસમાં કોઈક રીતે ઉપકારક પણ થતાં વરતાય. ઉમાશંકર વિચિન્નતાના તળીયે એક-કેન્દ્ર વ્યક્તિત્વ કરવા માટેની જે ક્ષમતા રહેલી છે તેથી અભિજ્ઞ જણાય છે અને તેથી જ રાગશિયા ગાડાની જેમ કિચૂડ-કટ-ચૂં કિચૂડ-ખટ-ચૂં એમ અવાજ કરતાં કરતાં પોતાનું જીવન જે રીતે પસાર થાય છે તેમાં કોઈ રીતે સૌની શરતે ચાહતાં રહેવું એ જ એક મહત્વનો આચાસક આધાર અને અગત્યનું સંધારક ભાવબળ હોવાનું કવિને પ્રતીત થયું છે. કવિએ રાગ, દ્વેષ અને ભયની ત્રિમૂર્તિ પાસેથી પ્રેમધર્મની દીક્ષા જરૂર ગ્રહણ કરી છે પરંતુ તેઓ તો એ પ્રેમધર્મના પોતાને પ્રાથમિક નિશાળિયા માત્ર માને છે ! પ્રેમધર્મ એવો વ્યાપક, ગહન અને સંકુલ છે કે એનો પૂરો તાગ પામવાનું એક વ્યક્તિ તરીકે, એક મનુષ્ય તરીકે પોતાના માટે, ખાસ તો વિચિન્નતાનો અનુભવ કરનાર કવિ માટે આસાન નથી.

કવિને બબર છે જીવનમાં જાતભાતના સંબંધોની કેવી જટિલ જાળ હોય છે તેની. કવિએ એવા સંબંધોનો મર્મસંકેત પણ અહીં કર્યો છે. કોઈને ચાહતાં ન આવડતું હોય, કોઈ વિકારતા હોય, કોઈ પોતાની વંકાઈથી તાવતા હોય – એ રીતે પારસ્પરિક સંબંધોમાં ભીસાવાનું, પિસાવાનું, ખંડિત થવાનું બને; પણ તેથી જેમ જીવનને ન છોડાય એમ ચાહવાનું પણ ન જ છોડાય એ આ કાલ્યમાં કવિનું અંતનિહિત ધ્વનપદ હોવાનું લાગે છે. કવિ વિવિધ સંબંધોની વાસ્તવિક ભૂમિકાનો અનુભવ કરતાં માર્મિક રીતે કહે છે :

“ભલે એમ તો એમ, જઘડવાનો સમય ક્યાં છે ?  
તમારી શરતે ચાહીશ તમને.”

પછી કહે છે :

“તમને વિકારવાની મને ફરજ નહિ પાડી શકે,  
કદીય વિકારી શકાય, એક વાર ચાહું જેન ?”

કવિ મૂળભૂત રીતે જ આદમી છે ચાહતના. જેમને પ્રેમ દ્વારા નહીં પણ વિકાર દ્વારા જ ચાહતાં શરૂ છે તેમનેય તેઓ તો ‘ભલા જવ’ કહે છે. પામરતાથી કે વંકાઈથી વર્તનારાઓ પ્રત્યે પણ તેમની ઉદારતા બરકશાર રહે છે. ઉમાશંકર પોતાને દુનિયાના શિષ્ય તરીકે ઓળખાવે છે; પરંતુ દુનિયાદારી કેવી છે તેનો તેમને અંદાજ છે. દુનિયા તો બે મોઢેય બોકે. એ દુનિયા કવિને ‘તું દુનિયાને જમજતો નથી’ એમ પણ કહે અને ‘તું દુનિયાનો જ જવ છે’ એમ પણ કહે ! દુનિયામાં એ રીતે બેય પ્રકારે બોલનારા જરૂર. વળી એ દુનિયા જ્યારે કરોડોપતિઓને, સર્વાત્માના શહીદોને, માનમોટાઈમાં મહાલનારાઓને ભૂલીને પાગલ પ્રેમીઓ અને કવિએને સંભારતી રહી છે ત્યારે એ દુનિયા ખરેખર દુનિયાદારીમાં માને છે એવું કહી શકાય બનું ? કવિનો આ મર્માણો પ્રશ્ન છે.

કવિ ‘સ્મૃતિ એ જ તો જીવન છે’ એમ સ્વીકારે છે અને તે સાથે કોઈ સંભારે ન સંભારે એની તથા શા માટે કરવી એવો પ્રશ્ન પણ ઉઠાવે છે. પોતાની ભીતર છિન્નભિન્નતાની

અંખી કરનારા આ કવિનો વધુમાં વધુ મદાર છે હદ્યની ઉખાશક્તિ ઉપર. હદ્યની ઉખા હશે – મનુષ્યનો પ્રેમ હશે તો વિચિન્નતાના તબક્કામાંથી પસાર થઈ શકશે અને સાબરની શીળી સરવાળી જેવી સેહની સરવાળીથી જીવનના મુભૂમિ ('વેસ્ટલેન્ડ') જેવા યંત્રત્વગ્રસ્ત વિસ્તારોમાંથી ડેમખેમ પાર પણ નીકળી શકશે.

કવિનું હદ્ય – મનુષ્યનું હદ્ય ક્રીએક રીતે પોતાને સ્પર્શો ને ઢારે એવી અમૃત-સરવાળી આજની વિષમ આબોહવામાં શું નહીં પામી શકે ? અંજો છે, પિન્નતા છે, એક-કેન્દ્ર થવા મથી રહેલા કવિજીવની છિલન્નતા પણ છે – એ રીતે છિન્નભિન્નતા પણ છે; પરંતુ એ છિન્નભિન્નતાને અભિવ્યક્ત કરવા પૂરતી કવિસંવિતની કેન્દ્રસ્થતા છેક જ ભષ્ટ કે વિલુપ્ત થઈ નથી એ મોંટું આચાસન છે અને જીવનની કવિતાના જીવનની હજુયે અખંડિત એવી અને ટકી રહેલી ઊજળી આશા પણ છે.

આ કાવ્યમાં કવિએ વર્તમાન જ્ઞાતિક પરિસ્થિતિની જે વિભાગિકા છે તેમાં માનવમનની – માનવજીવનની જે ભીસ છે, વેદના છે તેને અભિવ્યક્ત આપતાં કાવ્યનાં છંદોલય, બાની વગેરેમાં ટીક ટીક અદૃઢ તત્ત્વોનો વિનિયોગ કરી વિષયવસ્તુ અને રજૂઆતની દાસ્તિએ અનન્ય કહેવાય એવો કાવ્યપ્રયોગ સિદ્ધ કરી બતાવ્યો છે. ઉમાશંકરે 'છિન્નભિન્ન છું' અને 'શોધ' – એ ને કાવ્યોથી એમના લયઠિબારત અંગેના પ્રયોગો – પ્રયત્નો શરૂ કર્યા. તેઓ જ્ઞાવે છે તેમ, આ કૃતિએ ગુજરાતી ભાષામાં છંદોમુક્તિના પ્રયોગોને મદદ કરી છે. ગુજરાતી પદ્યરચનાના ચારેય પ્રકાર – અક્ષરમેળ, માત્રામેળ, સંઘામેળ, લયમેળ ઉપરાંત ગદ્યના ટુકડાનો પણ એમાં ઉપયોગ થયો છે. મુક્તપદ્યને ઝેડવું અને છંદોમુક્તિ સુધી પણ પહોંચી જતું – એવા ખ્યાલ સાથે ઉમાશંકરે 'છિન્નભિન્ન છું' અને 'શોધ' કાવ્યો અવાજ દ્વારા પહેલવહેલાં આકાશવાળી પરનાં કાવ્યસંમેલનોમાં પ્રસ્તુત કર્યા હતાં. આ બંને કાવ્યોમાં અરાંભના લયની ઈબારત એવી છે કે વાચનથી પણ વિલક્ષણ ભાવક તેમાંનો લય પક્કી શકે; પદીથી ભલે, વિચાર કરવા બેસે કે લયનો આધાર શો છે.

પ્રસ્તુત કાવ્યમાં કવિએ અદૃઢ કલ્યાનો, યંત્રત્રનગત વિલક્ષણ ઉક્તિસંદર્ભો દ્વારા પોતાની છિન્નભિન્નતાની ભૂમિકાને લય, પ્રાસ, બાની આદિથી ઉઠાવ આપવાનો સભાન પ્રયત્ન કર્યો છે. આ કાવ્ય ઉમાશંકરની કવિ તરીકેની પ્રતિભા કેવી ઉત્કૃષ્ટ છે અને એમનો કાવ્યકસબ પણ કેટલો ઉદાચર છે તેનું સભળ ઉદાહરણ પૂરું પાડે છે. ગાંધીયુગના આ પ્રતિનિધિ-કવિ સ્વાતંત્ર્યોત્તર આધુનિક યુગના પણ નવપ્રસ્થાનકાર ને પ્રભાવક કવિ બની રહે છે તે ખાસ તો આ 'સત્પદી'ની કાવ્યસંપત્તિના આધારે, એમ આપણે કહી શકીએ. આધુનિક યુગ-સંવેદનાને અનુરૂપ એવી વિલક્ષણ વાર્ષિક્ય-આકૃતિમાં રજૂ થતી આ કૃતિ ઉમાશંકરની કવિતામાં પણ 'અભિજ્ઞા'થી જે વળાંક આવે છે તેનાથે એક સાહસપૂર્ણ કવિકર્મની ધોતક છે. 'ભિન્નભિન્ન છું'નો ભાવાનુભવ સંવાદિતાના સાધક ઉમાશંકરની અહુમની અકળામજૂર પણ દાખલે છે એમ કહી શકાય. છેવટે 'ંધીલોક'માં અહુમના વિગલન ('નામ મારું ભાષામાં ઓગળી ગયું છે.') સુધી પહોંચતી ઉમાશંકરની કવિતાના નવા પ્રેસ્થાનના પહેલા પદ તરીકેય આ કૃતિનું મૂલ્ય અને મહત્વ છે તેથી સુશ્રેષ્ઠ યથાર્થતયા પ્રીછશે એવી શ્રદ્ધા વ્યક્ત કરીને અહીં વિરમીએ.

૨૩-૬-૨૦૧૦

પરબ્ર. v જુલાઈ, 2010

## કવિશ્રી ઉમાશંકર જોશી : થોડીક અંતરંગ વાતો.... | મણિલાલ હ. પટેલ

ગુજરાતી ભાષામાં લખનારા ભારતીય સર્જક ઉમાશંકર જોશી, વિચના વીસમી સદ્ગીના મોટા લેખકો-સર્જકોમાં, મહત્વના અને સશક્ત સાહિત્યકાર તરીકે પણ ગણના પામેલા છે. આપણી ભાષાના આ મૂર્ખન્ય સર્જકનું સર્જક વ્યક્તિત્વ તો ખરું જ પણ 'માણસ' તરીકેની વ્યક્તિમત્તા પણ સમૃદ્ધ અને દાયાત્રૂપ રહ્યા છે. ઈ.સ. ૧૯૧૧ના જુલાઈની ૨૧મી તારીખે ભીલોડા તાલુકાના બામજા ગામે પિતા જેઠાલાલ જોશીને ત્યાં માતા નવલબાની કૂરે તેમનો જન્મ થયેલો. આમ, ઈ.સ. ૨૦૧૦ જુલાઈથી ૨૦૧૧નું વર્ષ એમની જન્મશતાબ્દીનું વર્ષ છે. ૧૯૮૮ના ડિસેમ્બરમાં કવિશ્રી સ્વર્ગવાસી થયા હતા.

કહેવું હોય તો કહી શકાય કે ઉમાશંકર પણ નોખા અર્થમાં પહાડોનું સંતાન હતા. એમનું બામજાનું ઘર બંનેરિયા દુંગરાની કૂખમાં ઊભનું છે. આ આખો મલક અરવલ્લીની ગિરિમાળાનો દક્ષિણ પૂર્વનો છેલ્લો હિસ્સો છે. ઈડર-શામળાજીના આ દુંગરો લાખો વર્ષ જૂના છે. ઈડરના પથરિયા પહાડોનું સૌંદર્ય કેમેરાના કલાકારને લોભારે તો શામળાજીલોડાના દુંગરોની વનશી કવિજીવને સંમોહિત કરે જ કરે ! ખેતી-પશુપાલન કરનારી અહીની પંચંગી પ્રજા પણ ભલી, માણસુડી અને અભાવો વચ્ચે પ્રકૃતિની ગોદમાં મોજ કરનારી, મેળા મહાલાનારી તથા પ્રેમ-વિરહનાં ગીતો ગાનારી ખમીર-ખુમારીવાળી પ્રજા. એને ખુવાર થતાં અને જરવતાં પણ આવડે. ઉમાશંકર જોશીના સમગ્ર સર્જનમાં આ આખો ઈશાનિયો (પૂર્વિતર સાબરકંઠા) પ્રદેશ પ્રતિબિંબિત થતો રહ્યો છે. કવિનો શબ્દ પહાડોની ગોદમાં રમતા જરણાની કલકલ વાળીમાંથી પ્રગટ્યો અને વેદઉપનિષદ્ધીની અધ્યાત્મવાણીમાં જઈને વિરયો. વચ્ચે એમાં ગાંધીવિચારે પ્રાણ પૂર્યા તો શાંતિનિકેતન અને યાગોરની સૌંદર્યધારાએ માધુર્ય છલકાત્યાં છે.

ઊજળી, ગોરવર્ણી કાયા; હસું હસું થતો ભાવથી છલકાતો એ ચહેરો, મોંટ તેજસ્વી કપાળ; આંખો સેન્ડાર્ડ; બોલે ત્યારે આખું વ્યક્તિત્વ બોલતું પમાય. ચહેરો રત્યા પકડે... એમની સાથેના સંવાદની ક્ષણો પણ સુંબદી બની રહ્યાનું યાદ છે. ધોતી-જબ્બો સહેદ ખાડીનાં, ઉપર બદામી જાયની બંડી, શિયાળે ટોપી પણ મૂકતા ને મુસાફરીમાં ગળે મહીલર કે ખબે સરસ શાલ હોય જ ! જીજી આંખો કરીને વાતમાં ઊંડા ઊતરે ને માર્મિક હાસ્ય સાથે વાત પૂરી કરે... કયારેક વાણી ઉગ્રતાને વિકલ્પે ઊંચી થાય, નક્કર પ્રતીતિ કરાવે ને પાછા હળવા હાસ્ય સાથે દોરને ઢીલ આપે. ઉમાશંકર જોશીને સાંભળવા એ લ્હાવો હતો લ્હાવો !!

જોનારેને તરત લાગે કે આ વ્યક્તિ કવિ જ છે; પ્રતિભાશાળી છે. દેખાવે ય નાજુક ને વાણીવર્તનેય બહુધા નર્યા પ્રેમાળ. મારી પાસે તો 'માઈલોના માઈલો' એમની સાથે મુસાફરી કર્યાના અને નિરાંતે એમને બોલતાં સાંભળવા – માણલાના અમૂલ્ય અવસરોની યાદો છે. ધીમે મંદ સ્વરે દ્વારાં જેમ એ કેંક કહેતા હોય, કયારેક ભર્યાભાવથી શબ્દો વહી આવતા હોય... જરમર ઝુહારમાં અને એકધારા વરસાદમાં પલળવાનો મારો અનુભવ ઉમાશંકર સાથેના સંવાદોમાંય રહ્યો છે. એમનો શબ્દ અને સ્વભાવ : બંનેની જાહુગરી મેં જાણી-માણી છે. સહજતા, અર્થપૂર્ણતા અને નિસબત એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં મહેસૂસ થતાં રહ્યા છે.

નદીનાં ‘બળતાં પાડી’ જેમ કહે છે : ‘અરે ! જે ખાડોએ નિજ સરુ નિચોવી અરપિયું...’ એ વાત કવિને પોતાનેય એટલી જ વાગુ પડતી હતી... એ મલકે આપેલું દી ખૂટલ નથી નીવડ્યું. કવિ પોતે એના ઓશિંગણ રહ્યાનું કબૂલતા રહેતા, પણ જ્યારે મોડાસા જતા (ડૉ. ધીરુભાઈ ઠાકરના તેક્ચા) કે અમારી ઈડર કોલેજમાં અમે પરિસંવાદોમાં એમને લઈ આવતા ત્યારે અફસોસને દબાવ્યા વિના – ખાડોમાં ફરતાં મને, અમને કહેતા કે ‘મારા મલકમાં મારે કરવું જોઈએ તે હું તો નથી જ કરી શક્યો...’ તમે સૌ એ કરી રહ્યા છો – મારા વતી જાણે; એમ લાગે છે. માટે આભારી છું !’ સરચાઈ અને આર્ડ્રતા બંને મને ભીજવતાં બલકે ધન્ય કરતાં ! “નદીએ પાસેનાં સણગી મરતાંને અવગણી / જવું સિન્ધુ કરા અદીઠ વડવાનિ બૂજવવા...” હા, નદીનાં કાર્યો જ એ છે. માટે તો એ લોકમાતા છે – સૌની છે. ઈડરમાં અને સમીપવર્તી ખાડોમાં ફરતાં ફરતાં એ પોતાના (તથા પન્નાવાલ સાથેના) શાળાજીવનના અનુભવો, એટલા ભર્યાભાવથી અને ઓતપ્રોત થઈને કહેતા તે જાણે પાણ કિશોરવયમાં ચાલ્યા જતા. કવિ બાળક બની જતા.

ઈડરની સર પ્રતાપ હાઈસ્ક્યુલ (એ પછીનું નામ) પાસેની કેસરીસિંહ બોર્ડિંગનો, એમનો ત્યારનો ઓરડરો (૧૯૮૦ સુધી તો બોર્ડિંગ હતી) અને ઓરડામાંનો ગોખલો મને બતાવીને કહેતા : ‘આ મારી લાઈબ્રરી હતો. એમાં જ રાક્ષસો ને રાજકુવરીઓ સંતારી રહેતાં – ‘સરસ્વતીચન્દ્ર’ની પાણની સ્તો !’ મદાલસા ડુંગર, એનાં ઝરણાં ને ત્યાં જોયેલાં ઝરણનું વર્ણન કરતા. ઓમ કારેશ્વર પાસેની તળાવરીમાં પોતે દૂબતા હતા ત્યારે માથાની ચોટવી પકડીને મિત્રે બચાવેલા તે વાત કહીને ઘીરીક ત્યાં સૂનમૂન થઈ ગયેલા !

ઔંશી (૧૯૮૦ તથા પછીનાં) વર્ષોમાં ઈડર કોલેજમાં અમે એમને ચારેક વખત મેળવી શકેલા. ખૂબ ઉમળકથી પોતાના મલકમાં આવતા ને જૂની વાતોની સ્મરણ મંજૂલાઓ ખોલતા... પ્રસન્નતા હેઠેતા હતા જાણે ! અલબત્ત, સાંપ્રતનાં વિપથગામી વલણોથી એ ચિંતિત પણ રહેતા હતા. પણ માનવમાં શ્રદ્ધા ને સમાજલોક માટે ખૂબ પ્રેમાદર. ખાસ્સા આશાવાદી થઈને વાતો માંડતા. ઉત્તમનો આસ્વાદ કરાવતા અને મૂલ્યાંકન કરી આપતા ઉમાશંકરને અમે ઈડર કોલેજમાં નિરાંતે સાંભળ્યા હતા. એમની હાજરીમાં કવિસંમેલન યોજિલું. માનું સંચાલન હતું. ચિનુ મોટી, રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, રામદરશ મિશ્ર, રઘુવીર ચૌધરી વગેરેના કાવ્યપાઠ વચ્ચે મેં થોડાક નવોદિતોને રજૂ કરેલા. સમાપનમાં બોલેલા : ‘નવી પેઢીને આવવા દો.... એમને વધુ સમય ફાળવો.... આજે એમને સાંભળીને પ્રસન્ન છું...’ પોતાના પછીની સર્જક પેઢીનું જતન કરવું ને પ્રોત્સાહન આપવું એ એમણે કર્યું ‘એટલું પછી પણ કોઈએ નથી કર્યું... આધુનિકોએ તો જરા પણ નહિ ! અફસોસ !! સ્વાતંશ્ચોત્તર હિન્દી-ગુજરાતી કવિતા / કથાસાહિત્યના એ રાષ્ટ્રીય પરિસંવાદોએ ખાસ્સી કૃતિ મેળવેલી. મારા જીવાઓ એમાંથી ઘડતર પાખ્યા... વિનોદ જોશી, જ્યાદેવ શુક્લ, પુરુણ જોશી, નીતિન મહેતા જેવા અનેક નવા અભ્યાસીઓ એ પરિસંવાદોમાં વક્તા તરીકે પ્રથમ વાર આવેલા અને ધ્યાનપાત્ર વક્તવ્યો આપેલાં.

એક વાર, વાયા બામણા-ભિલોડા માર્ગ હું ઉમાશંકર જોશીને ઈડર કોલેજના પરિસંવાદ માટે, ટેક્સી દ્વારા લઈ આવેલો. ત્યારના ચારેક પ્રસંગો યાદગાર બની ગયા છે. આજે પણ એ યાદ કરતાં રોમાંચિત થઈ જવાય છે. બામણાના એમના ઘરમાં – પડસાળમાં

બઢેલા અને જૂની યાદો તાજી કરતાં કરતાં ભાવવિભોર થઈ રહેલા ઉમાશંકર હજ્ય આંખો સામે તરવરે છે. કેટલાં બધાં વર્ષો પછી એ વતનગામ આવ્યા હતા... ખૂલેશરભાઈ સાથે, ટેક્રીઓના ઊંચા-પથરિયા આસન બેસીને એમજો ‘સાપના ભારા’નાં એકાંકીઓ વાંચેલાં, તે બતાવીને કહેતા હતા કે તળબોલીના શબ્દો બીજે દિવસે ખૂલેશર લોકોમાં સાંભળેલા ને રાજ્યથી વ્યક્ત કરેલો. બામણા ગામ પુનાસાં ગામની પાસે હાથમતી – ઈન્દ્રાસણીના મેથી બનેલા સરોવરને દક્ષિણ-પૂર્વ છેડે વસેલું છે. તેમનાં પાણી ચળકતાં હતાં ને કાંઠે ઘઉં-ચણા-મકાની શિયાળુ ખેતી લહેચાતી હતી. સામે ક્ષિતિજમાં ત્રાંબક્ષિયા ખાડોની હારમણા ને એની પાર શામળાજીના હુંગરો ! આવા રમણીય પરિસરમાં ઉમાશંકર ખૂબ પ્રસન્ન ટેખાતા હતા.

બામણાના ઘરેથી નીકળતાં ગાળ પછીની જમણી શેરીને નાકે, એમનાં બહેન જશોદાબહેન (કદાચ આ જ નામ ?) મળવા ઊભાં હતાં. ઘણે વર્ષે થતું ભાઈબહેનનું એ મિલન આંખથી ઓઝલ થતું નથી, બલકે આર્ડ કરી મૂકે છે. ‘હાજાનરવા તો ખરા ક નીં ?’ પૂછતી બહેનનો ગળગળો અવાજ અને પાંપણેથી તૂટ્ટો મોતનમાણ ! પરિસર ભીજાઈ ગયો હતો. હું કવિશ્રીના ચહેરાને – એની વધતી રતાશને અને ધૂજતા-કંપતા હોઠ તથા ભાવને મારામાં અનુભવતો હતો ! બાણાંઓનાં લગ્નમાંય નહિ પહોંચી શકેલા ઉમાશંકર અફસોસ દબાવીને બધાંની ખબર પૂછીતા હતા... ‘બધાં કુશલક્ષેમ તો ખરાંને !...’ હાથમતી-ઇન્દ્રાસણીનાં પાણી છેક એમની પાંપણોમાં તગતગી રહેલાં તે હું આર્ડ થૈને જોતો હતો. બહેને ભાઈનો હાથ પકડ્યો ને કાંડા ઉપર હોઠ અડાડી હેતીની બચી કરી; પછી આશિષ માગતાં બહેન નમ્યાં ને હાથ જોડીને બોલ્યા : ‘તમે તો ઘણા મોટા માણસ થૈ જ્યા, લૈ ! ભગવાન તમને સો વરસના કરે... કુંદુંબની ખતખબર્ય લેતા રહેજો... જૈ !’ લાગણીનાં પૂરને ખાળતા અને નહિ વહી શકતાં પાણીના ધમપણાને રોકતા કવિશ્રીને હું મોટર સુધી દોરી ગયો હતો. નાંદોજ અને વાંકનેર ગામ આવતાં એમની વાણી પુનઃ વહેવા લાગી હતી... ફીર્દુનું ઘર યાદ કર્યું ને એમને ઘરે અમે ગયા. ફીર્દી સરચંચ બનેલાં, કાંતશ કરતાં ને ગામસુધારણા હાથ ધરેલી. ફીર્દી સાથે એ જૂની વાતોમાં પછી ખોવાઈ ગયા તે પણ હું માણસો જ રહેલો... એમના મલકમાં એમને લાવ્યાનો આ અવસર મને પણ ધન્ય કરતો હતો... હે ઉમાશંકરજી ઈડર ન આવે ને અહીંથી જ ‘સેતુ’ પર પરત જાય તોય મને પરમ સંતોષ હતો... હા, આ ઘટના એમના ગામ-સમાજના સંદર્ભો જાણનારને સમજાશે કે વિરલ જ હતી !

બધોર પહેલાં અમે લિલોડા પહોંચ્યા. એન. આર. એ. વિદ્યાલયના આચાર્યશ્રી લાભુભાઈ પંચચાએ બધું ગોડલેલું. વિદ્યાર્થીઓ જ નહિ, આખ્યાં ગામ ઊમેલેલું, લોકવાદો વાગતાં હતાં ને કન્યાઓ કળશ-ગગરી-કુમકુમ અક્ષત - ફૂલો લૈને સ્વાગત માટે ઊભી હતી... જાણ કોઈ શુભ પર્વ ને મેગલ મહોત્સવ ન હોય !! ‘આ બધું શુ છે ?’ એવી સવાલી નજરે એ મને જોઈ રહેલા; મેં ક્ષમાયાચના કરતાં કહેલું કે : ‘આની તો મનેય જાણ નથી; લાભુભાઈનો પ્રેમ છે આ...’ મને જરા ડર હતો – એમની નારાજગીનો ! પણ ના ! આજનો દિવસ એમને માટેય જાણો નોખો હતો ! શિક્ષકો-યુવાનો-ગ્રામજનો એમનું અભિવાદન કરતાં ધરતાં નહોતાં !

મારી કસોટીની કાશો – ત્યાં જ – આવી ઊભેલી. ઉમાશંકરની હાજરીમાં, પહેલી

જ વાર મારે જાહેરમાં અને એમને વિશે બોલવાનું હતું ! ‘ગાણું અધૂરું મેલ્ય મા ’લ્યા વાલમા...’ ‘ભોમિયા વિના’ તથા ‘રહ્યાં વર્ષો’ અને ‘ઘરે આવું છું છું –’ આટલી એમની કાબ્યરચનાઓને કેન્દ્રમાં રાખી મેં વાતો કરી. પન્નાલાલની બેત્રણ વાર્તાઓ વિશે ચર્ચા કરી વાત પૂરી કરેલી. ઉમાશંકરે ભર્યા ભાવે સૌને સ્વજનો ગણીને સમાજ-શિક્ષણ-સાહિત્ય-સંસ્કારની વાતો કરેલી... પછી ભોજન. આચામ... ને નીકળ્યા ઈડર ભણી !

રસ્તામાં જુમસર તથા મુઢેઝી ગામે જવાના રોડ મળતા હતા. ત્યાં એક લીલીછિમ ને ખાસ્સી ઊંચી ટેકરી ઊભી છે. એમણે ગાડી રોકવા કચું. અમે ઊતર્યા ને ટેકરી સામે ઊભા રહ્યા. ટેકરીને માથે એક માત્ર જાડ - લીલુંછિમ. એની નીચે દેરી - નાનકરી. સુંદર દશ્ય હતું... ધીમેથી મર્મણું હસતાં બોલ્યા : “આ ટેકરી તે જાડો કવિતા; સાંનેટ. ને માથે જાડ તે એનું શીર્ષક... દેરી એ છંદ સૂચવે છે.” પછી મેં ઉમેર્યું : “ને તળોટીમાં નામને બદલે કવિ સાક્ષાત્ ઊભા છે...” તો વળી બોલેલા : “એનો કર્તા તો કિરતાર - અલખ ને અગોચર. એનું પ્રાગટ્ય આટલું સુંદર ન હોય તો જ નવાઈ !” એ ધન્ય ક્ષણોમાં હું સર્જકમય હતો - બંને અર્થમાં !! ઓહ ! વિરલ સુયોગ !!

ઈડર કોલેજના અતિથિનિવાસમાં થોડી વાર બેઠા. ચાપાણી કર્યા. પંદરેક મિનિટ આંખો મીંચી સૂતા રહ્યા હશે.... પછી કહે, હવે ચાલો નીકળીએ - રાજ્યન્દ્રવિહાર જઈ આવીએ. ઈડરની પચ્છિમે પહાડીની ટુંક પર વિશાળકાય પથ્થર : ધંટિયો પહાડ કહે છે એને. એની ઉપર શ્રીમદ્ રાજ્યન્દ્ર સાધના કરેલી. ત્યાં સાધનાખંડ છે ને બીજી વ્યવસ્થાઓ છે. એ આશ્રમ. ત્યારે પગથિયાં નહોતાં. સીધું ચઢાણ... પન્નાલાલ સાથેના પ્રસંગો યાદ કરતાં કરતાં અમે ચઢતા હતા. સાથે મારા મિત્ર અરવિંદ ગજજરને લીધેલા. દર્શન કરી આશ્રમની ધારેથી નીચેનો પ્રદેશ જોતા ઊભા હતા. ત્યાં નીચે રીક્ષા આવી ઊભી. બંને હાથમાં સામાન સાથે; આશ્રમના જ વડીલ હશે - તેમણે બૂમ પાડી : ‘ઈશ્વર, ઓ ઈશ્વર...’ અવાજના પડધા પડયા... ઈશ્વર... ને આશ્રમમાંથી બીજા વરીલે દોડતાં આવીને કચું... ‘એ તો નથી... નથી...’ પડધા પડતા હતા... ‘ઓ ઈશ્વર ! એ તો નથી... નથી...’ જરાક વાર સન્નાટો છવાઈ ગયો. પ્રકૃતિ પણ ઘડીક અસમંજસમાં પડી ગઈ જાણો ! અરવિંદભાઈ કહે : “હું જાઉં છું... સામાન લેવા મદદ માટે જ બોલવે છે.” ઉમાશંકર ધીમેથી જાણે જાતને કહેતા હોય એમ સ્તો બોલ્યા... “મણિભાઈ, ઈશ્વર છે, નહિ તો અરવિંદભાઈ કેમ જાય ? એણે જ એમને મોકલ્યા...” અવાઇ કરી દેનારી એ ક્ષણો ભુલાતી નથી ! પવને પથ્થરોમાં કોરેલા આકારો, પચ્છિમાકશમાં આથમતો કીરમજ સૂર્ય... દૂરનાં ગામો-ખેતરો... જોતાં અમે અંધારું ઊતર્યું ત્યાં લગ્ની બેસી રહેલા...

## વિદેશી સાહિત્ય

## પાક-શાયરોનું પાક કવિ-કર્મ

મીરાં ભટ

પૂર્બ કે આકાશ મેં જબ ભી

કોઈ પરિન્દા આતા હૈ,

સંદેશા એક પરોં પર લિખા મેરે વાસ્તે લાતા હૈ ।

વહું કે ખેત ઔર દરિયા,

ઝરને, ઝીલ ઔર પહાડ,

યાદ તુહું કરતે હૈને કહકર,

યે મુજ્જે કો રૂલવાતા હૈ ।

ભારતનાં નદી-પહાડ-દરિયા કોઈને રડાવી રહ્યા છે એ વાત સાંભળીએ તો તરત આપણને થાય કે કોઈ દૂર-સુદૂર સાત સાગરને પેલે પાર પહોંચી ગયેલા ભારતીય અમેરિકાવાસીનું હદ્ય જ આમ ભારત માટે જૂરનું હોય ! પરંતુ વાત સાવ જુદી જ છે ! આ જૂરાં હદ્ય તો સાવ અડોશપડોશની પાક-ભૂમિ પર જ વરો છે. વર્ષો વીતી ગયાં, પરંતુ અંતરનાં આ જૂરણાં શાયરી બનીને ઝરણાંની જેમ વહેતાં રહે છે.

ઉપરોક્ત શેર લખનાર છે મેજર ઈનાયત શેર. નિવૃત્ત થઈને હાલ કરાંચીમાં રહે છે. પણ આ નેરુ સ્ટેટ સ્ટેટ, પાકિસ્તાનાં ડેટલાક સાધસેની જાદ-શાયરીમાં એમના ઘારા છિન્દ દેશની ચાહત ટપક્યા કરે છે. કરાંચીમાંથી પ્રગટ થતા હમવાર નામના માસિકના સંપાદક મહોદય સૈયદ કાવિશ રિજીવી તો આજે પણ હેંડુસ્તાનને પોતાનું ‘કાબા’ માને છે અને ‘પાક-હિન્દ પ્રેમ સમા’ નામની સંસ્થા પણ સ્થાપી છે. પાકિસ્તાનની ઉદ્ઘ્રાણી જનતાએ તો આ અભિક્રમને પ્રેમપૂર્વક આવકારી લીધેલો, પણ ડેટલાક ધર્માધ મુલ્યા તથા કેટલાક ઝોશ સરદારોએ આ આખી વાત પર શંકાનાં વાદળાં ઉતારી લીધેલાં.

આ સૈયદ કાવિશ રિજીવી પોતાની ભરજુવાનીમાં ભારતના અમરોહા અને દિલ્હીની સડકો પર મહેમદ અલી જીણાસાહેબની કોમી રીતરસમ સામે બંડ પોકારી સૂત્રો પોકારતા કરતા હતા -

જિનકા કાબા ઇંગલિસ્તાન,

વહ કયા લેંગે પાકિસ્તાન;

બાંટ નહીં સકતા હિન્દુસ્તાન,

લે નહીં સકતે પાકિસ્તાન ।

એક જ રાજ્યના હિમાયતી મૌલાના આગાદ એમના પ્રેરણામૂર્તિ હતા. પરંતુ ગંદી શાજનીતિના ચક્રવે પાકિસ્તાન તો બન્યું જ બન્યું ત્યારે પણ ઈન્કિલાબ જગવવા પાકિસ્તાન પહોંચ્યા એ વખતે પણ મૌલાનાસાહેબે ચેતવેલા કે ભતરનાક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અને ભાવિ દ્રષ્ટાની આ આગાહી સાચી પણ પડી. પાકિસ્તાન હકૂમતે એમને જેલના સણિયા પાછણ ધકેલી મૂક્યા. સાત સાત વર્ષ જેલવાસમાં બારકોમાં ગોધાઈ આજાઈનાં

गान गातां रथा -

मंजूर हो तो रक्षे करो वार की तरह

ये क्या खड़े हो, साये दिवारों की तरह ।

जेलमां ज पोताना साथी हसम नाशिरनी कुर कतल वेठवी परी, त्यारना लशकरी तानाशाह लियाना अमल दरभियान ऐमनो एक पग कापी नांभवामां आव्हो त्यारे पशु ऐमणे तो हिन्द-पाक-दीस्टीनां गाझां ज गाये राख्यां। भारतना शायर केशी आजमी ऐमना 'मेरा हमदम - मेरा दोस्त' हता अने शबाना आजमी तो ऐमनी दीकरी ज छे ! जारेद अभ्जरनो आ शेर तो ए निरंतर गाया करे छे के -

ऊँची इमारतों से मकान मेरा घिर गया

कुछ लोग मेरे हिस्से का सूरज भी खा गये ।

पाकभूमि पर सैयदछु जेवां बीजां अनेक दिल धडके छे, जेमनी धडकनमांथी पाक-भारत-संबंधने विष्मुक्त बनावी महोब्जतना कांठे पहोचाडवा भाजे छे. रहिस अमरोहवीओ एक भारतीय बिरादरना विदाय समारोहमां भारतीय दूतावासमां आ नज़म वांची संभगावी त्यारे अनेकोनी आंजोमां जगजियां उभराई आव्हां हतां. रहिस साहेब कहे छे -

ओ हिन्द जानेवाले ! मेरा सलाम ले जा

ये हिन्दियों से कहना, ओ ! हिन्द जानेवालो ।

भूल से भी नहीं हम, तुम को भुलानेवाले

मुनकिर ने हो सकेंगे हरगिज जमानेवाले ।

हैं हिन्द-पाकवाले सब इक घरानेवाले

रहते खबास ले जा, शौके अवास ले जा ।

आगणनी कीओमां सवाल पुछाय छे के शुं अभारी गंगा-जमना, हिन्दी शीदा-बागबजीचाने कटी भूली शकवाना छीओ ? अझ्सोसनी वात छे के आवा दरियावदिल आदभीनुं करांचीमां झून थयुं.

आवो ज एक शायर नजर छेद्राबादी कहे छे -

एक गुलेताजा की खातिर

हम से गुलशन छूट गया ।

आते कभी न अपने गुलिस्तां को छोड़कर

हम एक हसीं बहार के धोखे में आ गये ।

पार वगरना शेरोमां मादरे वतन छोडवानी वथा आंसुमां बोलाई बोलाई धूंटाई छे. करामत शेरभान लाखे छे,

वो जंगल याद आते हैं, भरे थे जो परिन्दों से

वह दरिया, वो हिमाला, वो तराई याद आती है ।

भारतमां वसेला विविध धर्मोना लोकोनी तासीर ज साव जुदा प्रकारनी छे. भारतीय मनुष्यमां वैश्विकता भरी परी छे, ए वजतोवजत प्रगट थती ज रहे छे, पछी ए

पाकिस्तानमां वसतो होय के यूरोप-अमेरिकामां. भारतीयतानुं धावजा ज विश्वमाताना पयोधरोमांथी उभराय छे, ए दूधथी उछरेवां संतान पोतानी व्यापक बिरादरी वीसरी ज केम शके ? भारतनां संतानेने आत्म वैश्विक चेतना पेढा करतुं धावजा पिवाववामां आपशा पूर्वजोओ पोतानुं सर्वोत्तम भरची जाण्यु छे. अनेक प्रकारे विविधताओनो पुज्यसंगम थतो रहे ते माटेनां विचारपूर्वकनां आयोजने थयां छे. महाराष्ट्रना सतारा जिल्लाना वार्ड मुकामे विनोबाजाना दाढाए एक शिवमंदिर बनावडायुं अने आजमी सो वर्ष पहेलां एतुं आयोजन कर्यु के दर वर्षे आ शिवमंदिरमां कोई मुस्लिम गायकनो संगीत-कार्यक्रम थाय. १८२८मां आ मंदिर विनोबाना पिताश्रीओ हरिजनो माटे खोली दीधुं. १८१६मां विनोबा आ मंदिरमां एक वर्ष माटे स्वाध्यायार्थे रथा हता. हवे आ मंदिर जार्झ थयुं छे तो सेवकोनी ईरक्षा छे के अर्णोद्वारना ट्रस्टमां एक ट्रस्टी तो मुस्लिम जमातनो होय ज होय. काण भवे भूतमां प्रवेशी चूक्हो होय तो पश ऐनी खुशबू ए झेलाव्या वगर रहेतो ज नथी. भारत देशना काणजायी पुज्यपुरुषों 'मानव मात्र एक'नुं धावजा पायुं छे त्यारे तो पाकिस्तानना शायरो आजे पश ए ज खुशबूने रेलावता पोतानुं कविकर्म उजणुं करी प्रगट करे छे.

r

## विश्वमानवी

क्रीकी करुं बे नभतारलीनी  
ने भीटमां भापुं दिगंतरालने,  
माया वींधीने जगवादणीनी  
अंड देखुं पणमां त्रिकालने.

सन्ध्या-उषानी सज्ज पांभज्जेडली  
यात्री बनुं उर्ध्वमुखी अनंतनो;  
स्वर्गिमां झूकतुं चंद्रहेडली,  
संगी बनुं वा धूमकेतु-पंथनो.

व्यक्तित्वनां बंधन तोड़ीजोड़ी  
विश्वान्तरे ग्राषपराग पाथरुं;  
पांझो प्रकाशे-तिभिरे जबोली  
स्थणे स्थणे अंतरेप्रेम छावरुं.

व्यक्ति भटीने बनुं विश्वमानवी;  
माथे धरुं धूण वसुन्धरानी.

[‘भमत्र कविता’]

- उभारांकर जेशी

આત્મકથા સત્યના પ્રયોગોના પૂર્ણાંહિતી પ્રકરણમાં, ૧૮૨૬ માં, ગાંધીજીએ લખેલું કે, ‘હેવનું મારું જીવન એટલું બધું જાહેર છે કે કશું પ્રજા નથી જાણતી એવું ભાગ્યે જ હોય’ (પૃ. ૪૫૮, ૨૦૦૦ની આવૃત્તિ). અને એ પછી, વર્ષો સુધી ગાંધીજી વિશે (અને સ્વાતંત્ર્ય ઓંદોલનના સમયપણે વિશે) એટલું બધું લખાતું ગયું છે – ગાંધીજીની દિનવારી (સંદ્રલાલ દલાલ, ૧૯૭૦) સુધ્યાં – કે ઈતિહાસની કોઈ ધૂધળી રહેલી રેખામાં કે કોઈ ખૂટતી કરીમાં કોઈ લેખક પોતાની કલ્યાનાનો અનુપ્રવેશ કરાવીને એને અંદર વિશિષ્ટ રૂપ આપી શકે એવો અવકાશ રહેતો નથી.

આવા સંજોગોમાં, આપણા એક પ્રશસ્ત નવલકથાકાર જ્યંત ગાડીટે ભારતના સ્વતંત્ર્ય અંદોલનના, એમાં ગાંધીજીની કિયાશીલતાને કેન્દ્રમાં રાખતી ૧૧૦૦ પાનાંની બૃહત્ત નવલકથા લખીને ‘ગાંધી વિશે’ લખવાનું ને ગાંધી વિશે ‘નવલકથા’ લખવાનું એક પડકારતુપ સાહસ કર્યું છે એ મોટી જિશાસા જગાડનાર ઘટના છે.

દેખકે કરેલા ભૂમિકારૂપ ઉદ્ગારોમાં આ નવલકથાનાં કેટલાંક સ્તર જગ્યાઈ આવે છે.

જીયંત ગાડીને એક પરિચય-આવેખ કર્યો હતો પોતાની આ નવલકથા વિશે<sup>9</sup>, એમાંથી બેત્રાણ બાબતો ઊપર્સી રહે છે. એમજે લખેલું કે, ‘સત્ય’ એ ચાર ભાગમાં લખાયેલી સ્વાતંત્ર્ય અંદોલનની કથા છે. એમાં ગાંધીજી કન્દ્રમાં છે [...] સત્ય શું એ આ નવલકથાનો મુખ્ય વિષય (theme) છે. એટલે ગાંધીજીનું સત્ય એ એક જ સત્ય ન હતું પરંતુ બીજાં સત્યો પણ તે સમયે પ્રવર્તમાન હતાં.’ આમ, સત્ય અહીં કોઈ એક કે અંતિમ/પરમ સત્ય નહીં પણ વિચારસરળીઓ, દાખિકોણો, પ્રતીતિઓ, આદિરૂપે રચાયેલા વિવિધ (વર્ગીના, વ્યક્તિઓના) સત્યો છે ને એ સત્યોના, અંદોલનના સમયમાં ઊપરોલા સંદર્ભ તરીકે લેખકે આ નવલકથા આવેખી છે. આ પહેલું, ઊપર્વં સ્તર.

નવલકથાનું શીર્ષક 'સત્ય' છે ને કથાના પ્રત્યેક ખંડનાં પેટાશીર્ષકો પાવક અજિન', 'જ્વાળા', 'ધૂંધવાતો અજિન' અને 'દાવાનળ' છે. અજિનનાં આ વિવિધ રૂપો-સંકેતો ગાંધીજીના વિરલ સત્યરથર્થનાને સૂચયે છે કે આંદોલન-અજિનનાં વિવિધ સોપાનોને જ સૂચયે છે? 'આંદોલન' અને 'ગાંધી'ની વચ્ચે પ્રસરતં આ વચ્ચાં સ્તર છે.

ત્રીજું સ્તર, જ્યાંત ગાડીટે નવલકથના પહેલા બંડમાં લખેલી કેફ્લિયતમાં પડેલું છે. જીવનના ઉત્તર તબક્કે ('આજે જીવનને આરે આવી પહોંચ્યો ત્યારે') ગાંધીજી એમના ચિત્તનો કબજો લે છે. આ ગાંધીમયતા કંઈક તીવ્યતાપૂર્વક વ્યક્ત થઈ છે : 'મને કેમ ફરીકરીને એ ગાંધીજી પોતાની તરફ ભેદે છે ? ક્યાંક શું પડજું છે મારામાં જે મને સતત ગાંધી તરફ ભેદે છે ? અને, કોઈ અન્ય વ્યક્તિઓ કે સંસ્થાઓ નહીં, 'ગાંધીસંસ્થાઓ' [પણ] નહીં,

સત્ય : જ્યંત ગાડીત, અમદાવાદ, ૨૦૦૬

માત્ર ગાંધી, ગાંધી ને ગાંધી. [...] અને મેં ગાંધીની શોધ આપદી [...] મેં મારું શબ્દોથી ઉભો કરવા માંડ્યો ગાંધી. માત્ર ગાંધી નહીં, મેં ઉભું કરવા માંડ્યું છે સત્ય. શું છે સત્ય ? કોણ છે ગાંધી ? ચાલો હવે મારી સાથે.<sup>2</sup> આ અંદરનું સ્તર. આ જોતાં તો ગાંધીજી જ કેન્દ્રમાં હોય. અલબત્ત, નવલકિથાનું ધરાતલ છે સ્વાતંત્ર્ય ઔદ્યોગનાનો સમયખંડ.

S

એક વાત તો બહુ સ્પષ્ટ છે કે લેખકે આ નવલકથા લખવાના સંકલ્પ સાથે જ એક મહાપ્રયત્ન આદરેલો. આશારે ૧૨ વર્ષ સુધી એ, બીજાં બધાં જ સાહિત્યકાર્યો લગભગ<sup>૩</sup> બાજુએ મૂડી દઈને આ નવલકથા લખવામાં એકાગ્ર થયેલા ને જીવનના અંત સુધી અમણે એમાં મન પરોવેલું રાખ્યું. ગાંધીજીનાં અને ગાંધીવિષયક અનેક પુસ્તકોમાંથી એ પસાર થયેલાં, એટલું જ નહીં, દાંડી આદિ ઘણાં સ્થળોની તેમજ ગાંધીસંલંઘ ઘડી વ્યક્તિઓની મુલાકાતો લિધીલી. આવા સ્વાધ્યાયપૂર્વકના એક મોટા પ્રકલ્પ તરીકે હાથ ધરેલા નવલકથા-પ્રયાસ તરીકે એ બહુ નોંધપાત્ર છે.

૧૯૭૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડીને ભારતમાં પવેશે છે ત્યાંથી માંગીને ૧૯૪૬ના નોઆખલી હત્યાકંડમાં ગાંધીજી આહેસાની કપરી કસોટીનો અત્યંત વ્યથાભર્યો અનુભવ કરે છે ને ૧૯૪૭માં ભારતના ભાગવાથી લગભગ ભાંગી પડે છે ત્યાં સુધીનો સિલસિલાબંધ ઘટનાપટ આ કથમાં આવેખાયો છે. ગાંધીજીની હત્યાના આવેખન સુધી લેખક પહોંચાવ્યા માગતા હતા પણ કેન્સરની બીમારીને કારણે એ આગળ લખી ન શક્યા. છેલ્લાં બેત્રાણ પાનાં લેખકે બોલીને લખાવ્યાં હતાં (જુઓ : ખંડ-૧, નિવેદન : મંજુલા ગાડીત) એપ્પા વાક્યો આંદર છે પણ તિરતોના કંઈક ત્રણાણક નિર્ણયો છે. ને એમાં ગાંધીજીના વિલયનો એક દરવર્તી સંકેત પડેલો છે.<sup>૫</sup>

નવલકથા ઉઘડે છે એક લાક્ષણિક દર્શયથી : ‘અંધકાર ભેટાને સૂર્યને પૃથ્વી પર આવવાને હજુ થોડી વાર હતી ત્યારે હુંગવેન્દથી નિકળેલી એસ. અરબિયા સ્ટીમર ૧૯૭૫ પની હ્રમી જાન્યુઆરીએ અરબી સમુદ્રનાં સ્થિર જળને ધકેલતી મુંબઈના એપોલો બંદરની નજીક સરકી રહી છે. એમાં પોતાની પત્ની કસ્તૂરબાઈ સાથે મુસાફરી કરી રહેલા મોહનદાસ કરમચંદ ગંધી...’

આમ તો આ વર્ણન વિગતોની ચોકસાઈખરેલું એક દશ્ય રેચે છે. પણ બીજી નજેરે એમાં, કથાનાયકના પ્રવેશની, રૂપકાત્મકતાને અવકાશ આપે એવી શાબ્દસંયોજના જોઈ શકાશે. કોઈ વાચક એમાં સંકેત વાંચી શકે : આ સૂર્ય તે મહાત્મા ગાંધી !

પણ બસ. પછી આજીય નવલકર્યામાં આવી, બીજા અર્થને અવકાશ આપે એવી કે વાર્જિમતાવળી કોઈ અભિવ્યક્તિ ભાગ્યે જ દેખાય છે. સીધી, વિગતવક્ષી; પ્રસંગોમાં, પરિસ્થિતિઓમાં, વ્યક્તિવલણોમાં, ચર્ચાઓમાં, અંદોલનના આઘાત-પ્રતાઘાતોમાં વિટાઈને પ્રસરતી, મહિંશો વણનાત્મક પદ્ધતિએ નવલકર્યા ચાલે છે. ત્રણ દાયકાનો ભારતનો એ વિશિષ્ટ સમયખંડ નિઃશેષ રીતે આવેજન પામ્યો છે એમાં સ્વાતંત્ર્ય અંદોલનનાં લગભગ તમામ પરિમાણો ખૂલેલાં છે. અને, આ પ્રજાકીય અને રાજકીય અંદોલન સહિત સત્ય અને અહિંસા સંદર્ભ ગાંધીચરિત્રનાં પણ ઘણાં પરિમાણો ખૂલેલાં છે. અલબન્ટ, એ સિવાયનાં ગાંધીચરિત્રનાં કેટલાંક પરિમાણો વણપૂર્ણાં પણ રહ્યાં છે. નવલકર્યાનું છેલ્દું વાક્ય,

આરંભની લગોલગ આવી જઈને, વલયની ઉપલી રેખાએ અંતર્ધારન પામે છે : ‘હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ. મને કોઈ પરાજિત નહીં કરી શકે.’ કોઈ વિભૂતિમત્ત તત્ત્વના આરોપણ વગર અહીં ગાંધીજી કથાનાયક રૂપે રચાતા રહે છે – ‘મોહનદાસ’ રૂપે.

સ્વાતંત્ર્ય આંદોલનના ધરાતલ પર ગાંધીચિત્રના ઉઘાડનાં જે મહત્ત્વનાં બિંદુઓ ઉપસતાં રહે છે તે નવલકથાની સંકલ્યના રેચે છે : કોચરબનો સત્યાગ્રહ આશ્રમ અને એમાં હરિજન પરિવારને પ્રવેશ આપતા ગાંધી : ચંપારણનો એમનો પહેલો અહિંસક સત્યાગ્રહ; પછી રાષ્ટ્રીય સ્તરે ઉપાડેલો રોલેટ સત્યાગ્રહ અને હિંસા થતાં એની મોક્ષફી; ૧૯૨૧નું ખ્યાત અસહકાર આંદોલન અને એમાં એમની પ્રભાવક ભૂમિકા; એમનો વ્યાપક સચિન્ય કાનૂનભંગ (સરકારી શાળા-કોલેજ, નોકરી, પરદશી કાપડ વગેરેનો બહિજ્ઞા) ને ખાઈનું સ્થાપન; આ સત્યાગ્રહ બ્રિટિશ સરકારને પૂરી પકડમાં લઈ શક્યો હતો તે તબક્કે પણ, ચૌરાચોરીની હિંસાને કારણે ગાંધીજીએ કરેલી એની મોક્ષફી ને એમાં ઉઘઢેલું એમનું ‘વિશ્વવંદ્ય’ વ્યક્તિત્વ; સમગ્ર પ્રજાની જાગૃત્તિના અસરકારક ઉપાય તરીકે એમજો આદરેલી દાંડીકૂચ અને મીઠાનો સત્યાગ્રહ (‘મોહનદાસે જંગી મેદની સામે મીઠાની મુહીં ભરેલો હથ ઊંચો કર્યો : બ્રિટિશ સામાજયના પાચામાં હું લૂણો લગાડું છું’ – ખંડ : ૩, પૃ. ૪૧૬); ગાંધી-ઇંવિન મંત્રશા અને એ સમજૂતી કચરમાં ઉપસતા પ્રખર પણ ઊજણા મુસ્ક્રી ગાંધી; અહિસાના સંકલ્ય ને પ્રસાર છતાં વારેવારે ભડકી ઊઠતી હિંસા સામે યરવડામાં આમરણાત્ત ઉપવાસથી પશ્ચાત્તાપ કરતા ગાંધી; હિંસા ખાળવા તેમજ આત્મપ્રતીતિ પર જ સ્થિર રહેવા એમજો આરંભેલો વૈયક્તિક સત્યાગ્રહ અને ૧૯૪૨નું હિંદુ છોડો આંદોલન; કોંગ્રેસની વચ્ચાળાની સરકારમાં દૂરંદેશી વ્યવહારદક્ષતાથી નહેરુને વડપ્રધાન બનાવી શકતા ને એ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રભાવક ઠરતા ગાંધીજી (‘મોહનદાસ સત્તામાં ક્યાંય ન હતા ને છતાં એમની સત્તા સર્વત્ર હતી’) અને છેવેટે, નોઓખલી આદિમાના હિંદુ-મુસ્લિમ હત્યા-દાવાનને ઠરવા અર્થે આ રાજકારણ ને રાષ્ટ્રકારણથી દૂર ને દૂર સરતા જતા, માનવીય કરુણામાં દ્વાતા, અહિસામય મહત્ત્મા ગાંધી (ભાગલા અટકવવા દંડસંકલ્ય મોહનદાસને જોઈ ‘વાઈસરોય વિચારમાં પડી ગયા. સામે બેઠેલો વૃદ્ધ અહિસાની સાક્ષાત્ત મૂર્તિ છે’ – ૪ : ૨૫૮).

સમયક્રમની સીધી, ચુસ્ત, વિગત-ચોકસાઈન્-ખચિત રેખાઓ પર લેખકે ગાંધી-ચિત્રણ કર્યું છે. એમાં નવલકથાકારનો સ્પર્શ પામેલું ચિત્રણ ક્યાંક ક્યાંક નીખરી આવે છે. એવા ઉપસી આવેલા અંશોમાંના કેટલાક જોઈએ :

- એમજો રજૂ કરેલો અસહકારનો કાર્યક્રમ (૧૯૨૦) કોંગ્રેસ સ્વીકારશે કે કેમ તે પ્રશ્ન હતો. મહાંત્વબાર્થી કહે છે કે, જીણા, માલવિયા, મોતીલાલ, એની બેસંટ બધાં વિરોધમાં છે. ગાંધીજી કહે છે : ‘મને લાગે છે કે ખડકોને હડસેલીને પાણી આગળ ધરી જવાનું.’ (૨ : ૧૨૩)
- યુક્તપ્રાંત (ઉત્તર પ્રદેશ)નાં ગામડાનો પ્રજાસમુદ્દાય ગાંધીજીને જોવા ઊમટે છે એના નિરૂપણમાં લોકનાયકની ચાહનાનું ગતિશીલ ચિત્ર છે : ‘ઘણ કોઈ દૂસરે લીડર જૈસા નહીં. બકરીકા દૂધ પીતા હૈ. દૂસરા કુછ નહીં. તું દેખના. કોઈ રૂઆબ નહીં. અપને જૈસા

કપડા પહનતા હૈ. દૂસરે લીડર જૈસા નહીં. [...] ‘કહાં જત હો ?’ ‘ગાંધી બબુઆ.’ ‘કહાં જત હો ?’ ‘ગાંધી બબુઆ.’ ‘કહાં જત હો ?’ ‘ગાંધી બબુઆ.’ (૩ : ૧૪૦-૧૪૧)

- ગાંધીજી આંબેડકરને મુળભૂત વાત સમજાવે છે – રાજસ્તાન તરફ જતા ૧૦૦%ના પ્રતિનિધિ નહીં, ‘છેક નીચવા થરના અસ્પૃશ્યોનો પ્રતિનિધિ થવા માગું છું’ ને પછી એમનો લાક્ષણીક પુષ્યપ્રકોપ : ‘અસ્પૃશ્યો બધા એક અને આંડ હશે તો સનાતનીઓના ડિલ્વાને સુરૂંગ ચાંપી હું ઉડાવી દર્દીશ.’ (૩:૬૦)
- નોઆખલીનાં તોફાનોમાં મુસ્લિમોને છૂટો દોર આપનાર બંગાળના મુખ્ય પ્રધાન શહીદ સુહરાવદ્દિને સ્પષ્ટ સંભળાવતા ખરા ગાંધી ઉપસી રહે છે : ‘શહીદસાહેબ, સૌ તમને ગુંડાઓના સરદાર શાથી કહે છે ? તમારે માટે એક સારો શાબ્દ કહેનાર કોઈ મખ્યં નથી’ (૪ : ૨૨૬)
- ગાંધી-રોમાં રોલાંના મિલનનું દશ્ય સર્જનાત્મકતા પ્રગટાવે છે : ‘બહાર સર્વત્ર અંધકાર અને ધીમો વરસાદ હતો. એમના ઘરના વીજળીના દીવાનો જાંખો પ્રકાશ અંધકારમાં થોડો આગળ વધીને અટકી ગયેલો. ત્યાં એક જાંખો આકાર અંધકારમાંથી એમની આંખ સામે ઉપસી આવ્યો. સરેફ ગરમ શાલમાં વીટાયેલા મોહનદાસ જપ્તાપ ચાલતા રોમાં રોલાંના સામે ઊભા રવ્યા. રોલાં જોતા હતા એક હસતું બોધું મોં, સુકાયેલો ચહેરો, આંખો પર ખોખા જેવાં લાગતાં ચશ્માં અને નીચે સળી જેવા ખુલ્લા પગ. તરત એ સુકલકરી માણસ જરાય સંકોચ વગર પોતાને ગળે એક હાથ મૂકે છે. એનું આછા વાળવાનું બોડું માથું પોતાની છાતી પર મૂકે છે. રોમાં રોલાં પોતાના આજા શરીરમાં હૂંફ પ્રસરતી અનુભવે છે. ‘હું તમને મળવા કેટલો બેતાબ હતો !’ એ ધીમા વક્યના સૂર રોલાંના કાનમાં સિઝ સિમ્ફનીની જેમ ઉત્તરે છે.’ (૩ : ૫૩)

મૂળ સોતોનો આધાર હશે (ક્યા સોતમાંથી, કેટલો, કેવા શાબ્દકેરે, તે તો ચકાસી શકાયું નથી) છતાં અહીં આગળી રીતે કથાનાયક કીરાઈ આવે છે. આવાં બીજાં કેટલાંક દશ્યો / નિરૂપણો પણ નોંધી શકાય.

- ગાંધીજીનું અંતરંગ, જે આ નવલકથાની પરમ આવશ્યકતા હતી એ, ક્યાંક ક્યાંક જ પણ સ્પર્શ એ રીતે આલેખાયું છે. રોલેટ બિલ સામે સત્યાગ્રહ ઉપાડવા પૂર્વનું એક દશ્ય ગાંધીજીના મનોગતને ઉઘાડે છે :

‘મોહનદાસ પોતાની કુટિરની બહાર ખાટલા પર સૂતા હતા. સામે સાબરમતીનો પ્રવાહ કોઈ અવાજ વગર ધીમે ધીમે વહી રવ્યી હતો. ઉપર આકાશ અસંખ્ય તારાઓથી જગમગી ઊઠેલું. ક્યાંય સુધી આકાશના પથરાટને અનુભવતા મોહનદાસની આંખો મીચાઈ ત્યારે તેમજો પોતાની સામે ધુમાડો પ્રસરતો જોયો. ધુમાડો આગળ હતો, ધુમાડો બાજુમાં હતો, ધુમાડો પાછળ હતો, ધુમાડો ઉપર હતો. ધુમાડો, ધુમાડો, ધુમાડો’ (૨ : ૧૪)

- ગાંધીજીના બધા સાથીઓને લાગું હતું કે બ્રિટિશ શાસનને હયમચાવી નાખવાની એક તક સમાન સત્યાગ્રહ આંદોલન ગાંધીજીએ ખોટું પાછ્યું જેંચ્યું. એક અમૂલ્ય તક વેડહી. ગાંધીજી આત્મમંથન કરતાં કરતાં નિર્ણય પર આવે છે :

‘એ અમૂલ્ય નથી. ફેંકી દે, ફેંકી દે, મોહનદાસ, ફેંકી દે. એના મોહમાં ન ખેંચાઈશ. એમાં

- સત્તવ નથી. એ જળ નથી. એ અમૃતમય જળ નથી. નર્ધા પરપોટા ને ફીજુ છે. ક્યાંથી આવેલો અવાજ ? કોને સમજાવું એ અવાજનો બુલંદ રણકો ? [...] મને ક્ષમા કરો મિત્રો, કાર્યકરો. ક્ષમા કરો, ભારતના પ્રજાજનો. [...] હું ઉલ્લંઘી નથી શકતો એ અવાજને. એ અવાજને અનુસરવું બારું જીવિત છે? (૨ : ૨૨૮-૨૮)
- r અહિંસાની પોતાની પ્રતીતિને એ બીજાઓને પ્રતીત કરવી શકતા નથી ત્યાં આત્મદર્શનન કરતા ગાંધીજી આત્મનિંદા ને પચાતાપ કરે છે. એમાં જે વલોવાટ ને આર્ડ્ઝતા ઊપર્સી છે એ સર્જનાત્મક નિરૂપણ પામી છે. આખી નવલકથામાં આવી થોડીક ક્ષણો વેરચેલી છે :
    - ‘મારી અહિંસાની સાધના ખોટી છે ? મારો કોઈ પ્રભાવ નથી ? [...] ધૂળ પડી મારા મહાત્મા હોવામાં ! મુંબદી. અમદાવાદ પછીનું મારું બીજું ઘર. [પણ] મુંબઈના લોકોના મનમાં હું કેટલું વસ્યો ? મારું કાર્ય કેટલું વસ્યું ? (૨ : ૧૮૩)
    - મેં અસહકારની હિલચાલ ઉત્પન્ન કરી. આજે જોઉં હું કે અહિંસાની ગંધ પણ જાજ્યા વગર લોકો એકબીજા સાથે અસહકાર કરવા લાગ્યા છે. એનું કારણ શું ? એનું કારણ એ જ કે હું પોતે અહિંસક નથી. મારી તે શી અહિંસા ? જો તે પરાકાણાએ પહોંચેલી હોય તો જે હિસા હું આજે જોઈ રહ્યો હું તે ન જોઉં. એટલે મારા ઉપવાસ એ પ્રાયશ્ચિત્ત છે, તપશ્ચર્યા છે? (૨ : ૩૦૮)
    - (નોઅખલીમાં) ‘પણ મોહનદાસનું મન, પાસે પહોંચ્યતાં કારણોને ઓળંગીનેય વધુ ઊંડાં કારણોની શોધમાં આથડનું. હું અપૂર્ણ હું. હું અપૂર્ણ હું. બધા અવરોધો ભેટને મારે એમના હૃદય સુધી પહોંચવું છે. હું શું કરું ? અનિષ્ટની સામે લડી ન શકે એ અહિંસા શું કામની ?’ (૪ : ૨૪૬)

- ગાંધીચિરિત્રની સાથે બીજાં ચરિત્રો પણ ક્યાંક, ઝીણા લસરકાઓથી ઊપરસ્તાં રહ્યાં છે : કદચ સૌથી સ્પર્શક્ષમ ચરિત્રો કસ્તૂરબાઈ, મહાદેવબાઈ અને સુભાષનાં છે.
- કસ્તૂરબાઈ ગાંધીજીને ક્યાંક ભાવનાથી ને ક્યાંક કર્તવ્યધર્મથી અનુસરે તો છે પણ એનું સ્વી-પત્ની-માતા તરીકેનું વ્યક્તિત્વ, ગાંધીપ્રભાવથી બહાર રહીને ઘણી વાર ઉપર તરી આવે છે એ, (જાહીનું છતાં) આગવી છાપ ધરાવે છે. ગાંધીજી આશ્રમમાં અંત્યજ પરિવારને લાભા ને કસ્તૂરબાઈ, અનિષ્ટાએ, રાજકોટ જવા તૈયાર થાય છે ત્યારે એમનો વેદનાભર્યો વિરોધ જુઓ : ‘દીકરો [હરિલાલા] ખોયો, હવે બેરી ખુઅો.’ ને કસ્તૂરબાઈ ધૂસકેધુસકે રડી પડી. [...] ‘જેલમાં મોકલી, બંગલામાંથી ઝૂંપડામાં લાભા, ધરેણાં કાઢી બાબી બનાવી ન હવે હરિજનની જોડે રાખો...’ [૧ : ૬૧]
  - ગાંધીજી, ઓછો સાબુ વાપરી વધારે કપડાં ઊજાણાં કરવા બાબતે કસ્તૂરબાઈને યશ આપતાં કહે છે : ‘તું અનેક બાબતોમાં મારી ગુરુ છો.’ ત્યારે એ કહે છે : ‘વખાણ કરીને બીજાને ભોળવી લેવાની તમારી કળામાં હું સપડાવાની નથી એ નક્કી માનજો. ભલે તમને અનેક શિષ્યો મળે, પણ મારી આશા ન રાખતા.’ ‘તું મારી શિષ્યાથી અનેકગણી વધારે છો.’ ‘હમણાં તો કંધું, તમારી આ યુક્તિનાં હું નથી ફસાવાની.’ [૧ : ૧૪૮]
  - વાઈસરોયેને મળવા ગાંધીજી મુંબઈ જવા નીકો છે ત્યારે ‘કસ્તૂરબાઈનું મન ભારે હતું. હરિલાલાનાં ચાર બાળકોની સંભાળ માથે ન હોત તો પોતે પતિની સાથે જઈ શકત [...]’

પણ કસ્તૂરબાઈએ મોહનદાસ પાસેથી એક વચન લઈ લીધેલું, ‘આ તબિયતે હવે થર્ડ ક્લાસમાં મુસાફરી નહીં કરવા દઈ.’ મોહનદાસે હસતાં હસતાં એ આગાહ સ્વીકાર્યો, ‘જેટલું શરીરને પંપાળવાનું કહીશ એટલું એ મને વધુ મોહમાં નાખશે. મારું પતન થશે એનું પાપ હવે તને લાગશે.’ કસ્તૂરબાઈ કહે છે, ‘ધણાં પાપ તમે કરાવ્યાં છે. એટલે મને હક્ક છે તમને પાપ કરાવવાનો.’ [૨ : ૩૦]

- મહાદેવ દેસાઈ ગાંધીજીના ભક્ત ને શિષ્ય જેવા પણ ક્યારેક એ ગાંધીજી સામે સ્પષ્ટતાથી વિરોધ વ્યક્ત કરે છે એ ટૂંકાં અસરકારક વાક્યોમાં બતાવ્યું છે. મહાદેવ – દુર્ગા વચ્ચેની ક્યાંક સૂરતી લઢણાની વાતચીતમાં જીવંતતા છે. પણ સૌથી વધારે સ્પર્શક્ષમતો, આરંભે, મહાદેવબાઈના મૂળભૂત સૌદર્યરાગી કવિહંદ્યની એક સરસ રેખા અહીં આવેખાઈ છે એ છે. મુંબઈ હોડી એ અમદાવાદમાં વકીલત કરવા આવે છે ત્યારે : ‘મુંબઈનો સમુદ્ર યાદ આવતો. [...] ક્યાંય દૂર સુધી લંબાયેલા સમુદ્રનાં ઘૂઘવતાં મોઝાં કિનારે ફીજાઝીઝા થઈ વેરાઈ જતાં એ જોઈ રહેતા. સાંજનો સ્વીકારકશ, ધીર્મદીમે ક્ષિતિજ પર ઇબતો સ્વર્ય, સમુદ્રનું કમશા : શયામ બનતું જળ, એ બધાં પલતાતાં દશ્યો એમના મનની ઉદાસીને ઉલેચી નાખતાં. પણ અમદાવાદમાં દરિયો ક્યાંથી ? આચાસનરૂપ સાબરમતીનો કિનારો હતો. ચોમાસે લીલી ને ઉનાને સૂકી સાબરમતીનો, [...] ભલે પાણી વગરનો પટ મહાદેવના ચિત્તને ન સમજાય એવા સૂનકારથી ભરી દેતો. રોમાન્ટિક કવિ ક્રીટસની એમને પ્રિય પંક્તિઓ હોઈ પર આવી જતી ! [૧ : ૧૧૧]
- સુભાષ ઘોષ ભારત હોડી, બહાર જઈ, જાપાન / જર્મનીની મદદથી યુદ્ધ દ્વારા સ્વતંત્રતા લાવવાનો મહાજોખમી સંકલ્પ કરે છે, ત્યારે, જતાં પહેલાં, એ અનિશ્ચિત ભાવિમાં ધસતાં તેઓ ‘દેશની મારી’ હોડવાની જે વેદના અનુભવે છે તે વેદના રવીન્ડ્રકવિતાની સ્મૃતિની ધારેધારે વ્યક્ત થઈ છે એમાં સુભાષના ચરિત્રનું એક વિશેષ પરિમાશ ખૂલે છે : ‘હે મારી સોનાની બંગમાતા, તને હું ચાહું છું. તારું આ આકાશ, તારો વાયુ હુંમેશાં મારા પ્રાણની વાંસળી વગાડે છે’ [૪ : ૭૨]. ચુસ્ત ઈતિહાસ-સંદર્ભ ધરાવતી નવલકથામાં સર્જક જે અવકાશ રચી શકે એનું આ નાનકું પણ મહાત્વનું દસ્યાંત છે.

- વિગતવર્ણના પહેલાં સતરે રહેતી આ નવલકથા ક્યારેક ક્યારેક, સ્મરણીય બનતા પ્રસંગ-આદેખનમાં, જીવંત રસપ્રદ સંવાદોમાં ઉતરે છે ત્યારે સાહિત્યકૃતિ વાંચ્યાનો તોષ પણ વાચકને આપી શકે એવી બને છે :
- શાંતિનિકેતનની મુલાકાત (૧૯૧૫) વખતે, એક વાર ગાંધીજી સવારે રવીન્દ્રનાથ સાથે નાસ્તો કરવા બેઠા છે. મોહનદાસની સામે મગજણી, કેળાં ને લીંબુ છે, કવિની રકાબીમાં મેંદાની પૂરી અને રસગુલાં છે : ‘મોહનદાસ મેંદાની પૂરી જોઈ તરત બોલી પડ્યા, ‘આ તો ઐર છે.’ કવિની આંખો એમની એમ સ્થિર રહી. કોઈએ એમની જીભમાંથી છૂટતા મિષ્ટ સ્વાદને પડકાર્યા હતો. શું એ સ્વાદ નકામો છે ? એ સ્વાદમાંથી ઇન્દ્રિયોને મળતો આનંદ અનુચ્છિત છે ? કવિનું હૃદય ‘ના, ના’, પોકારી ઊકચું. આ ચોપાસ પથરાયેલો મારી ઇન્દ્રિયોને પુલકિત કરતો આનંદ શું ઐર છે ? [...] કવિના મોઢા પર હળવું સ્થિત આવ્યું, ‘ભલે ઐર હોય, એનો પણ આનંદ છે.’ અને મેંદાની પૂરી [એમણે] રસથી મોઢમાં મૂકી.’ [૧ : ૪૩]

- પાત્રો (વ્યક્તિઓ) વચ્ચેના સંવાદો, બહુ ઓછી જગ્યાએ, રસપ્રદ ને જીવંત છે એવા એકલે જોઈએ :  
ગાંધી-ઠર્વિન મંત્રશા ચાલતી હતી (૧૯૩૧) એ દરમ્યાન એક વાર વલ્લભભાઈ સાથે થયેલી વાતચીત :  
'મેં તો વાઈસરોયને કહ્યું છે, જમીનના મુદ્દામાં હું વલ્લભભાઈ કહેશે એમ ચાલીશ.' મોહનદાસ  
'એટલે શ્રૂણે મને જ ચડાવવાનો' – વલ્લભભાઈ  
'અંધેરી નગરીની વાર્તામાં નથી ? આજરે જાડા નરે જ. મારું તો શું ગજું ?'  
'કરો તમારે કરવું હોય તે. એક વાત કહી રહ્યું : સમજૂતી સધાઈ જાય તો પથર ખાવા જોડા જિલ્લામાં મારી સાથે આવવું પડશે'  
'ગુજરાતમાં તમારા થકી તો હું ઊજળો છું.'  
'તમારી આવી ચતુરાઈમાં જ મારા જેવો પાટીશર ભોળવાઈ જાય છે.' [૩ : ૧૮-૧૯]
- મંત્રશા પૂરી થયા પછી 'લૉડ ઠર્વિને છૂટા પડતાં પહેલાં ચા મંગાવી. મોહનદાસ માટે લીંબુપાડી અને મીઠું આવ્યાં. વાઈસરોયે મીઠા તરફ અંગળી ચીધી, 'મિ. ગાંધી, અહીં તમને બિનજકાતી મીઠું નહીં મળે.' મોહનદાસે ધીમે રહીને થેલીમાંથી મીઠાની પડીકી બહાર કાઢી. 'આ બિનજકાતી છે. તમારે મને એક ગરીબ માણસને નાતે વાપરવાની ધૂટ આપવી પડશે.' લૉડ ઠર્વિને સિમત કરતાં દાઢી પર હાથ પસવાર્યો. 'મિ. ગાંધી, તમે આટલા ચતુર હશો એ નહોતો જાણતો?' [૩ : ૨૩]

ઠર્વિનસમાં પથરાતી આ કથા ક્યાંક નવલકથાની અસરકારકતાનો અનુભવ પણ આપે છે. દાંડી અને ધારાસણાના સત્યાગ્રહનું આવેખન વધુ કથાત્મક, એથી વધુ અસર કરનારું બન્યું છે (જ્યો : ૨ : ૪૦૬-૪૪૫) નોઓખલી હત્યાકાંડનું ધ્યાજી દેનારું વર્ણન અને ગાંધીજીના કરુણા દ્રવતા ઉપયારો પણ નવલકથાનો અનુભવ આપનારા બન્યા છે (૪ : ૨૨૪-૨૫૦). વળી, ભગતસિંહનાં કાર્યશીલતા અને સમર્પણ આવેખતું પ્રકરણ (૨ : ૨૪૨-૨૮૧) તેમજ સુભાષના રોમાંચક મહાપ્રયાણને આવેખતું પ્રકરણ (૪ : ૬૮-૧૧૦) ઘણાં પ્રભાવક બન્યાં છે. અલબત્ત, સમયરેખાની સંકલનને તોડીને એ પ્રકરણો વચ્ચે પ્રેરણાં છે, ને સમગ્ર કથાની દસ્તિએ જોતાં એ પ્રકરણો પ્રસ્તારી બનીને અસંતુલન ઊભું કરે છે.

### S

૧૧૦ પાનાંમાંથી પસાર થનાર, 'નવલકથા'ના વાચક માટે આવા કેટલાક રણદીપો છે. જીવંત ગાડીત જેવા સર્જક આવાં રસપ્રદ પરિમાણોવાળી નવલકથા સાચ્ચેત આવેખી શક્યા હોત. પરંતુ, બાર વર્ષોના સતત સ્વાધ્યાયે, તથા એ બહાળા ગાંધી-સંદર્ભોમાંથી જે અનેક નોંધો એમણે કદાચ કરી હશે એણે, એમના મનને સ્વાતંત્ર્ય આંદોલનના પ્રસંગબહુલ ઠર્વિનસથી ખચી દીધું જણાય છે. એ કારણે, સર્જકના પસંદગીઝીશલને તેમજ કથાવેખકના સંકલનકોશલને માટે ઓછા અવકાશો બચ્યા છે. એની અસર, વ્યાપકપણે તો, નવલકથાની ભાષા (language of fiction) ઉપર પડતી રહી છે. કેટલુંક, આસ્વાદ આયા વિનાનું પ્રસ્તારી થઈ ગયું છે તો કેટલુંક, આવેખન-શક્યતાઓનો તાગ મેળવ્યા વિનાનું અપર્યાપ્ત

રહી ગયું છે.

શાંતિનિકેતનમાં ગાંધીજી શિક્ષકો-વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન પ્રેરે છે. [૧ : ૪૨-૪૫] : રસોઈ જાતે કરવી, વાસણ માંજવાં, સાફ્સ્યૂફી કરવી વગેરે. મોહનદાસ તથા કસ્તુરભાઈ પણ આમાં જોડાયેલાં રહે છે – એ બધાનું વર્ણન છે પણ એનો જીવંત સંચાર આપતું આવેખન નથી. તરત બીજો સંદર્ભ વાદ આવે, કે, સત્યના પ્રયોગોમાં શાંતિનિકેતન-મિવાસનું નિરૂપણ છે, એમાં એક વાક્ય છે : 'વાસણ માંજનાર દુકીનો થાક ઉતારવા કેટલાક વિદ્યાર્થીઓ સત્તાર વગાડતા' (૫૪, ૩૫૨) આ ખરું શાંતિનિકેતન – ગાંધીરવીન્ડ્રસંયોગ ! નવલકથા તો આથી વિશેષ પરિમાણ ઉપસાવી શકે. બેર.

વ્યક્તિઓ વચ્ચેની વાતો-વાતચીતો (પાત્ર-સંવાદો) પણ મોટેભાગે વિગત-લક્ષી રહે છે, પરિસ્થિતિનો કે વ્યક્તિત્વનો સંસ્પર્ચ એમાં ભાગ્યે, ક્યાંક જ અનુભવાય છે. ગાંધીજી-જીશા વચ્ચેની પ્રવંબ (૧૮ દિવસ ચાલેલી) મુલાકાત [ભાગ : ૪] સંવાદરીતિએ ચાવે છે પણ એ મુદ્દાઓ ભરેલો અહેવાલ બની રહે છે, એનું કોઈ પ્રવાહી કથારૂપ ઊપસંતું નથી. જાણો કે ચર્ચાના એકધારા રણમાં આપણાં આંખ-મન થાકતાં રણતાં રહે છે, વ્યક્તિ/પ્રસંગનો ઈતિહાસ આવેખાય છે, વ્યક્તિત્વનો (નવલ)વિશેષ પમાતો નથી. એના કરતાં તો, આ જ નવલકથામાં, નહેરુની જીશા વિશેની પ્રતિક્રિયાના માત્ર એક ઉદ્ગારમાં જ જીશાનું (ને નહેરુનું પણ) વ્યક્તિત્વપોત ઊપસી રહે છે : 'જે માણસે કાયદાનાં પુસ્તકો સ્થિવાય બીજું એકે વાંચવા જેવું પુસ્તક વાંચ્યું નથી, એને મળવાને શો અર્થ ?' [૪ : ૨૧૪] સંવાદોમાં ક્યાંક એમણે, ચરિત્રાદિ સોતોમાંથી લેવાને બદલે, આગવી સંવાદ-રચના કરી હોય એવી છાપ પડે છે ખરી (એનું આગવાપણું ચકાસવાનું થઈ શક્યું નથી), પરંતુ એમાં ક્યાંક ક્યાંક જ નર્મવૃત્તિ, માર્મિકતા, પ્રભાવકતાના તણખા જોવા મળે છે – મોટાભાગના સંવાદો તથરચનામાં અટવાયા છે.

સ્વાતંત્ર્યઅંદોલન દરમ્યાના ગાંધીજીના ઘણા રચનાત્મક કાર્યક્રમો – આશ્રમજીવન, સ્વાવલંબન, ખાદી, અસ્યુચ્યતાનિવારણ, આદિની જીશા જીશા વિગતો, જાણો કશું જ ચૂક્યા વિના, નવલકથામાં સમાવેશ પામતી, ઠલવાતી રહી છે, ને વર્ણનમાં ગોઠવાતી રહી છે. જેમકે –

'મોહનદાસ જ્યાં જ્યાં ગયા ત્યાં [.] અસ્યુચ્યતા વિશે જુદી જુદી વાતો એમનાં પ્રવચનોમાંથી નીકળતી' [૨ : ૩૩૩] પણ પછી આ વાતો ૧, ૨, ૩, એમ ૧૧ લગ્ની, કમસર, મુદ્દાસર મુકાઈ ગઈ છે ! ગાંધીજીનું કોઈ ખરેખરું પ્રવચન કે પ્રવચનાંશો – આ વાતોને (ભલેને બધી જ વાતો ન આવરી લેવાય, પણ) વધુ જીવંતપણે વ્યક્ત કરી શક્યાં હોત. કેવળ મુદ્દાઓ તો નવલકથાની પ્રવાહિતાની, ભાષાની, સામે ઊભા રહી જાય છે. આવું જ, ગાંધીજી જ્યારે રોમાં રોલાંને મળવા જાય છે ને ત્યાં પાંચેક દિવસ રોકાઈ જાય છે એ દરમ્યાન આસપાસનાં ગામોમાં જે વાતો કરે છે એ પણ સંણગ મુદ્દાઓ વિકસાવતી પ્રશ્નતરી રૂપે વ્યક્ત થયું છે [૩ : ૫૪-૫૮] અને એ પણ પ્રશ્ન-ઉત્તર-સ્વાદ આપવાને બદલે વિગત-વિચારના વિસ્તારનો અનુભવ કરાવે છે. ત્યાં પણ ગાંધીજીનું કોઈ ખરેખરું કે આધારો પરથી કલેલું) વક્તવ્ય મૂકીને કથાને પ્રવાહિત રાખી શકાઈ હોત તો વ્યક્તિત્વની ઉભાનો અનુભવ મળ્યો હોત, એમ થાય.

ગાંધીજીનાં (અનેક હતાં એમાંથી કેટલાંક) પ્રવચનોનો, પત્રકારી લખાડોનો, એમના અને અન્યોના પત્રોનો ઉચિત સ્થાનોએ, થોડોઘણો પણ, વિનિયોગ કેટલો રસપ્રદ ને વાતાવરણ-સર્જક બની રહ્યો હોત ! (એવાં ઘણાં પત્ર-સંકલનોમાંથી લેખક પસાર થયેલા છે જ, એ એમની સંદર્ભસૂચિ બતાવે છે)

‘નવજીવન’ સાપ્તાહિક ગાંધીજીના તંત્રીપદે સાટેમ્બર ૧૯૧૮થી અમદાવાદમાંથી પ્રગટ થવા લાગ્યું, કેમકે ગાંધીજી ‘અંગેજ ન વાંચી શકતા સામાન્ય લોકો સુધી પહોંચવા’ માગતા હતા અને ‘જોતઝોતામાં તો ‘નવજીવન’ ગુજરાતને ગામડેગામડે પહોંચ્યું’ [જુઓ ૨ : ૭૪]. આવા કેવળ નિર્દેશો છે પણ એના આવા વ્યાપક ને વેગીલા પ્રસારને ‘નવજીવન’માંના કોઈ પ્રેરક સરળ ગાંધી-લખાડના પ્રત્યક્ષીકરણ દ્વારા મૂર્ત થતો બતાવ્યો નથી.

નવલકથામાં પત્રોનો સૌથી વધારે ગતિસંચારક (dynamic) ઉપયોગ થઈ શકે. ગાંધીજીએ અનેકોને લખેલા (ને મેળવેલા) પત્રો, વલભભાઈ પટેલના અને અન્યોના પત્રોમાંથી કેટલાકનો વિનિયોગ પણ કેટકેટલી વૈધક્ષિક વિશેપત્તાઓ અને એમ વ્યક્તિ-પરિમાણો ખોલી શકે. આ નવલકથામાં થોડાક પત્રો/પત્રાંશો છે એ ઘણુંખરું તો ગાંધીજીએ વાઈસરોયો વગેરેને લખેલા, વિચારો-દલીલોને, કાંગ્રેસની ને પ્રજાની માગડીઓને રજૂ કરતા પત્રો છે. એમના સરલાદેવીને લખેલા પત્રોમાંથી કેટલુંક (સ્થોત-આધારિત કે પ્રતીતિકર સર્જક-કલ્પના-આધારિત) આ નવલકથામાં ઊતરી શક્યું હોત, તો કેવો રોમાંચક સંવેદના-આદેખ સાંપડ્યો હોત ! કેમકે, અહીં એવા નિર્દેશો તો છે જ. જુઓ : મોહનદાસ અને સરલાદેવી ‘પત્રોથી સતત પરસ્પરના સહવાસમાં રહ્યાં, પરસ્પરના હફયને ખોલતાં રહ્યાં, ક્યારેક સામેથી પત્રોનો ધોધ વરસતો. મોહનદાસ પણ બેચેનીપૂર્વક પત્રની રાહ જોતા. તરત સામે પ્રત્યુત્તર વાળતા. ‘મારી પ્રિય સરલાદેવી’ એવું સંબોધન કરતા અને પત્રને અંતે ‘તમારો સ્મૃતિકાર’ એવું લિખિતંગ કરતા.’ [૨ : ૮૮]

પ્રસંગો-પરિસ્થિતિઓના ઊંડાણમાં જવાની, કથાભાષા દ્વારા એનો સાક્ષાત્કાર કરાવવાની ને અને અસરકારક કરવાની તકો ઈતિહાસરેખાઓ નીચે દૂબતી રહી છે. જીવિયાંવાલા બાગના હત્યાકંડનું, વાચકની સંવેદનાને હલાવી દેનાંનું આવેખન અહીં મળું નથી. ગાંધીજીનાં પ્રતિભાવો – પ્રતિક્રિયાઓ જેવાં ચૌરાચૌરી હત્યાકંડ વિશે રજૂ થયેલાં છે એવાં જીવિયાંવાલા અંગે નથી એનું આશર્ય થાય છે.

એક પ્રશ્ન એ પણ થાય છે આ નવલકથા વિશે કે, આ મહાઘટનાની (સ્વાતંત્ર્ય અંદોલનની) નવલકથા છે કે મહાનાયકની (‘મારે ઊભો કરવો છે ગાંધી’) ? નવલકથામાંથી પસાર થતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે આ કથા સમગ્ર – ગાંધીચરિત્ર પર નહીં પણ સ્વાતંત્ર્ય-અંદોલનની ફેમમાં આવ્યા એટલા જ ગાંધી પર કેન્દ્રિત (focused) થઈ છે. આ કારણે, કેફિયતમાં વ્યક્ત થયેલી લેખકની તીવ્રતમ ગાંધીમયતા થતાં ગાંધીજીનાં કેટલાંક મહત્વનાં પાસાં અહીં આવેખાયા વિના રહી ગયાં છે : ગાંધીજીનું લેખકરૂપ – પત્રકાર, વિચારક, આત્મકથાકાર, પત્રલેખક ગાંધી – અહીં, એ સમયસંદર્ભોમાં પણ, ઊપસવા પામ્યું નથી. ‘સર્વોદય’ના – ‘unto this last’ના ગાંધી અહીં નથી ને એટલે જ, ૧૯૩૬માં પરિષદ્મમુખ તરીકે, એમણે સાહિત્યકારોને જનતા માટે સાહિત્યસર્જન કરવા

અપીલ કરેલી એ ખંડ પણ નથી. સ્વાતંત્ર્ય અંદોલનમાં પણ સંક્રિય એવા કળાકારો, સાહિત્યકારો, ચિંતકો, વિચારકો સાથેના ગાંધીજીના જીવંત સંપર્ક-સંવાદની કોઈ વાત અહીં નથી. એ તો ઢીક, પણ ૧૯૭૦માં, યરવડા જેલમાંથી, આશ્રમનાં વ્રતોનું રહસ્ય સમજાવતા પત્રો એમણે દર મંગળવારે લખેલા ને પછી એ ‘મંગળ પ્રભાત’ નામે પ્રગટ થયા એની કોઈ વાત અહીં નથી. આવું તો ઘણું યાદ આવવાનું, ચારે તરફ પથરાયેલી રાજકીય-રાષ્ટ્રીય ઘટનાઓમાં, એ કિયાશીલતામાં ગાંધીજી જેટલા કડારાયા તેટલું જ. પરિણામે, ગાંધીજીના બહુપરિમાણી વ્યક્તિ-ચરિત્રનો અહીં પૂરો સાક્ષાત્કાર મળતો નથી. મહાઘટના-લક્ષ્મિતા જ સર્વોપરિ રહી ગઈ છે.

S

શરૂઆતમાં મેં નિર્દેશ કર્યો છે એમ, ખૂબ જ જાણીતા ને નિકટના ભૂતકાળનું નવલકથા-આલોખન (પુનઃકથન નહીં) સર્જક સામે એક પડકાર હોય છે. નવલકથાના પહેલા ખંડના આરંભે, જાગૃત ગાડીઠે કરેલો ઈતિહાસ સાહિત્ય ‘ભત્ય’ નામનો લેખ, આ સંદર્ભે, બેન્ટ્રા મહત્વના જિબ્રાસાપ્રશો મૂકી આપે છે : એમણે લખ્યું છે કે જ્યારે લેખકે (જ્યાંત ગાડીઠે) ગાંધી વિશે નવલકથા લખવાનો વિચાર રજૂ કર્યો ત્યારે ‘તે સામે મારા બે પ્રશ્નો રહેતા. એક તો એ કે જેમના વિશે જીશવટભર્યું લખાણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય તેવા વ્યક્તિ અને સમયગણા વિશે ‘નવલકથા’ [fiction] કઈ રીતે શક્ય બને ?’ અને ‘આ પ્રકારના નિરૂપણમાં, ચોક્કસપણે બની ગેયેલી ઘટનાઓને અલગઅલગ સ્થોતોના જીશવટભર્યા અભ્યાસ પછી રજૂ કરવાની હોય તો તેમાં ‘સર્જનાત્મકતા’નો પ્રવેશ કેટલો શક્ય બને ?’ આગળ જતાં તે લાગે છે કે, ‘એક વાચકે આ કૃતિ પાસે કેવી રીતે આવવું ? આ કૃતિ એક નવલકથા છે, કે બને છે ? કે એક ખાસ પ્રકારનું ‘સર્જનાત્મક ઈતિહાસલેખન’ છે ?’

અનેક સ્થોતોમાં ઘૂંઘાઈને નિઃરંધ્ર બનેલો ઈતિહાસ જ્યારે નવલકથાવિષય હોય ત્યારે આવા પ્રશ્નો સામે આવવાના. ને તે વખતે સાહિત્યના વાચકનું વિસ્મય એ હોય કે એક સાહિત્યસર્જક (‘સર્જનાત્મક ઈતિહાસ’-કાર નહીં) એ પડકારને કઈ રીતે જીલે છે ? એટલે મારી દસ્તીએ તો, ‘નવલકથા કઈ રીતે શક્ય બને ?’ તથા ‘સર્જનાત્મકતાનો પ્રવેશ કેટલો શક્ય ?’ એનો એક સ્પષ્ટ જવાબ એ હોય કે, જો સર્જક કથાનાયકના અંતરંગમાં ઊતરી શકે તો ‘નવલકથા’ અને ‘સર્જનાત્મકતા’ શક્ય બની જ શકે. પ્રતીતિકરતા સાચવી હોય (એ પણ સર્જકનું જ લક્ષણ) તો પાત્રના અંતરંગમાં ઊતરવામાં ઈતિહાસ વ્યવધાનરૂપ બનતો નથી. આ નવલકથામાં એ શક્યતા તાગવાની દિશામાં લેખક કેટલે સુધી જઈ શક્યા છે ? ઐતિહાસિક વિગતોનો અને બાધ્ય સમયસંચલનોનો ભાર લેખકે એટલો બધો અનુભવ્યો છે કે એ ભાર છેવટે વાચકનેય ઉપાડવાનો આવ્યો છે – વાચક એ ખ્યાત ઈતિહાસના પ્રલંબ પથ પર મુકાઈ ગયો છે. વાચકેવાચકે આ ઈતિહાસની પૂર્વજીવકારી ઓછીવતી હીવાની, એથી ઈતિહાસ-રસની માત્રા ઓછીવતી થવાની. પરંતુ સર્જનાત્મક કૃતિનો રસ તો અંડાપણે એક વિશેષ અ-પરિચિતમાં, વિસ્મયમાં, વિસ્તરવામાંથી જ પ્રાપ્ત થવાનો. એટલે અંતરંગનો એમાં મહિમા હોય જ.

હા, ગાંધીનું અંતરંગ. આ નવલકથાને જે એક અત્યંત મહત્વાનું સર્જનાત્મક પરિમાણ

આપી શકે એમ હતું તે અંતરંગ અગાઉ ઉલ્લોખેલાં કેટલાંક મંથનો, પશ્ચાત્તાપો, આંતરવેદનાઓમાં ઊઘડું છે તે જ. (અલબત્ત, એ કેટલાંક બતાવે છે કે લેખક એ હિશા વધુ ઉઘારી શક્યા, explore કરી શક્યા હોત.) ગાંધીજીએ અંગત પરિવાર-જીવનની, સત્યો-અસત્યોની, હિંસા-અહિંસાની, વ્યક્તિસંબંધોની અનેકનેક બાધ્ય સંઘર્ષ-પળોએ જે અનુભવ્યું હશે એ મનના ઊંડાણમાં મનો-ગતમાં, બાધ્ય ઘટનાઓના એમણે આપેલા ચિત્તારની સમાન્તરે પણ લેખક જઈ શક્યા હોત, ને એ કલ્યાણપ્રવાજ અભિવ્યક્તિને રસ્તે વાચકો પણ એમાં પ્રવેશી શક્યા હોત. જાત સાથેના – બે સેલ્ફ વચ્ચેના – આંતરસંવાદોની, અન્યો સાથેના કાલ્પનિક (પણ આધારકેન્દ્રી ને પ્રતીતિકર) સંવાદોની, ક્યારેક સ્વખંડશ્યોની – એમ કેટકેટલી કથાપ્રયુક્તિઓનો વિનિયોગ થઈ શક્યો હોત ને એનાથી ઈતિહાસના જડકઠણ ખડકોની વચ્ચેથી પણ આંતરરાશને કથા-પ્રવાહિત કરી શકાયું હોત. ઈતિહાસ સ્વયં ગમે તેટલો રોમાંચક હોય, ને ગાંધીજીનો (તેમ સ્વાતંત્ર્ય અંદોલન સમયનો) ઈતિહાસ તો ઘણો રોમાંચક હતો જ, તેમ છતાં એનું સર્જનાત્મક પરિમાણ ખોલતો નવલકૃતિનો આનંદ તો એથી પણ ચાઢ્યાતી રોમાંચકતાવાળો બન્યો હોત એમાં શંકા નથી.

ગાંધીજીનો અહિસા-વિચાર ઘણો ઊરો ને સંકુલ હતો અને એને એમણે બ્રહ્મચર્ય સાથે જોડેલો એ પણ એક વિલક્ષણ પણ માર્મિક બાબત હતી – એનાં મર્માનો તાગ કાઢવાની, explore કરવાની પણ લેખકને ઉત્તમ તક સાંપ્રદેલી હતી. પિતાના મૃત્યુ સમયનો, કામસુખ સાથે જોડાયેલો ગાંધીજીનો અપરાધભાવ; અને એ પછી એમની દઢ થતી, અહિસા-બ્રહ્મચર્ય અંગેની, પ્રતીતિઓ – છેક સુધી એમના મનમાં આંદોલિત થતાં રદ્ધાં હશે. એને તાગતા જઈને, ગાંધીજીના સ્ત્રી-સંબંધો – બ્રહ્મચર્ય અંગેના એમના પ્રયોગો – લેખકની સર્જનાત્મકતાને અવકાશ આપી શકનાર એક બહુ મહત્વની બાબત હતી. આ નવલક્ષણમાં લેખક, એ હિલાકામાં થોડુંક પ્રવેશી પ્રવેશીને જાણો અટકી ગયા છે. જુઓ :

‘હહેલી સવારે સરલાદેવીના ખંડમાંથી નીકળતા બંગાળી ભજનના સૂરો મોહનદાસને બીજવતા. ચિત્તને ભેટી ઊરું સુધી ક્યાંક પ્રવેશી જતા.’ [૨ : ૮૭]

‘ભજન’ના આ ‘સૂર’ ‘ચિત્તને ભેટીને... પ્રવેશી જતા’ એ ભક્તિસંગીતના અનુભવ તરીકે નહીં, ગાંધીજીનો અનુભવ એ સૂરથી થતા સ્ત્રીભેચાણનો હતો. નવલક્ષણનો સંદર્ભ પણ એ જ બતાવે છે. ગાંધીજી તરત પેલી એમની જાળીતી નિલટ અનુભવે છે : ‘સમદાસ્તિ ને તૃષ્ણા ત્યાગી પરસ્તી જેને માત રે...’ [...] મોહનદાસ આંખો મીંચીને નરસિંહના પદનું વારેવારે રટણ કરતા... મોહનદાસ જોયું કે સરલાદેવી સાથેનો સહવાસ પોતાને ઉન્નત બનાવે છે’ [૨ : ૮૭] પછી પેલો પત્રોનો સંહર્બ. બધું વાર્ષિકાતું રહે છે મોહનદાસ પણ જીવનના પચાસ વર્ષ થયેલા જાતીય આકર્ષણના પ્રચંડ જંજાવતમાંથી પસાર થયા. પોતાની બધી શક્તિથી બહાર આવ્યા. ‘હે ઈશ્વર, એ સ્ત્રીના રૂપમાં તેં મને ઠીક તાબ્યો.’ [૨ : ૮૮]

પરંતુ એ તાવણીને – એ મંથન અને આત્મસંઘર્ષને – લેખકે વાચ્ય આપી નથી. એ ‘પ્રચંડ જંજાવત’ એમના મનમાં કેવો જાગ્યો હશે એનું આલેખન કર્યું નથી. આ આખીય માર્મિક ઊંડાણવાળી ઘટના કેટલા નિર્દેશોમાં સમેટાઈ રહી છે – ગાંધીજીનું અંતરંગ આલેખવા માટે થોભવાને બદલે એક પછી એક બનતા પ્રસંગો – બાધ્ય ઘટનાઓ – તરફ લેખક વળી જાય છે. ગાંધીજીનું એક વ્યક્તિ તરીકેનું આંતરસંવેદન ને એક વિચારક તરીકેનું દર્શાન

– એમાંથી કશું મૂર્ત્તા કે સ્વર્ણક્ષમતા ઉપસાવતું નથી.

ચોવીસ વર્ષનાં યુવાન ડોક્ટર સુશીલા નાયર સાથેનો પ્રસંગ બહુ લાક્ષણિક છે : ‘મોહનદાસ નિર્વિસ્ત્ર ન્હાવા બેસતા ત્યારે સુશીલા એમના આખા શરીરને પથરો ઘસતી, ભીના રૂમાલથી રગડીરગડીને શરીર લૂછીયી. મોહનદાસ આ આગ સાથે ખેલવાનું પસંદ કરતા. પોતાના મનને ક્યાં સુધી વિકારમુક્ત રાખી શકાય છે એની કરોટી કરતા.’ [૩ : ૨૧૨]

પરંતુ, આ પછી, એમના મન પર છિલાતી એની અસરો અકથ – વણાદ્વારાયેલી – રહી છે. વિકારમુક્ત રહેવાનો આંતરિક સંઘર્ષ ને એની સાથે જોડાયેલાં અહિસાનાં વિચાર-સંવેદન ગાંધીજીના આ પ્રયોગનો સાક્ષાત્કાર આપી શક્યો હોત. પણ તરત જ કેવળ વિગત આવે છે : ‘એક દિવસ રાત્રે એમને વીર્યસ્ખલન થઈ ગયું [...] મોહનદાસ ચોકી ગયા. મારું મન નિર્વિકાર નથી.’ [એ જ, ૨૧૨] એમણે અખતરો બંધ કર્યો. એની સામે સુશીલા નાયરનો જવાબ એક મહત્વનો દિલ્લીકોણ રજૂ કરે છે : ‘બાપુ, એક ડોક્ટર માટે સ્ત્રી કે પુરુષ બંને સરબાં જ છે. અમારા વિજ્ઞાનનું એ જીવિત છે. સ્ત્રી કે પુરુષના શરીરભાવ વગર માત્ર રોગને સ્વર્ણ કરે તે સાચો ડોક્ટર.’ [એ જ, ૨૧૨] તો, આની સામે ગાંધીજીનું કોઈ આંતરિક દર્શન કે દિલ્લીકોણ શક્ય નહોતાં ? ‘મોહનદાસ મૌન થઈ ગયા.’ [એ જ, ૨૧૨] એટલો જ પ્રતિભાવ અહીં મુકાયો છે ને એ મૌન થઈ ગયા પછી કેવા આંતરિક મંથનમાં સરી પડ્યા હશે – એ સર્જકશોધ અહીં એક ખૂબ મજબૂત પરિમાણ રચી શકી હોત.

S

ખેર. જે રૂપે છે તે રૂપે આ નવલક્ષણની ઉપયુક્તતા, અને અલબત્ત એનું પ્રદાન શું ગણાશે ? આટલો સંઘન બૃહતું પટ કોઈ ઈતિહાસ રૂપે કે પછી ગાંધી-ચરિત્ર (બાયોગ્રાફી) રૂપે નહીં પણ નવલક્ષણ રૂપે આલેખવાનું લેખકે સ્વીકાર્યું – નવલક્ષણાકાર તરીકેની એમની લાંબી, ને પ્રશંસા પામેલી કારક્રિયા હતી. એ સર્જક અનુભવની સાથે એમણે ઉત્તર-જીવનના આ સંકલને જોડ્યો ને જ્યાં જરૂર પડી (હશે) ત્યાં નવલક્ષણાકાર તરીકેની મોકણાશનો કંઈક લાભ પણ લીધો. બહોળા સોતસંદર્ભોમાંથી પસાર થઈને પોતાની આ નવલક્ષણને અવિકૃતતા આપવાની પ્રામાણિકતા દાખલી – એક સંકલ્પપૂર્વક તેમજ સમય તથા ગાંધીજી સાથેના તાદાત્મ્યપૂર્વક. સમયખડને, એ રીતે, જીવતો કરવા તે મથ્યા એનું એક મૂલ્ય ગણાશે.

એ બધું બારાબર, પણ નવલક્ષણના સર્જનાત્મક રૂપને વધુ ને વધુ ઉઘાડાની, એને મોકણાશ આપનારી કથાપ્રયુક્તિઓને તેમજ સર્જક કૃતિના વિશેષને રચનારી કથાભાષાને પ્રાધાન્ય આપવાનું, આ વાસ્તવાગ્રહી લેખકથી, બહુ જ ઓછું થઈ શક્યું. લેખક, જાણો કે, પેલા રોમાંચક ઈતિહાસના ધોધ નીચે જ ઊભા રહ્યા.

અપાર ધીરજથી ને નિસબતપૂર્વક આલેખેલી આ કથામાં, જે ગાંધીજી એમના ચિત્તના ઊંડાણમાં ઊતરી ગયા હતા એ ગાંધીજીના ચિત્તના ઊંડાણમાં નિઃશેપણો ઊતરવાનું ખાળીને લેખક મહદેશો તો સમયનો જ ઝીઝો, લગભગ નિઃશે બનતો, થકવનારો આલેખ આપવા શા માટે ઢળતા ગયા હશે એ મારો એમની સામેનો મને મૂંજવનારો પ્રશ્ન છે. સત્યોના સંઘર્ષો આલેખવાનું કરીને એમણે આંદોલનને પોતાનો દિલ્લીકોણ આપવાનું કર્યું પણ એ દિલ્લીકોણ આખરે તો, વાસ્તવની ધરાતલ પર ઈતિહાસના કંઈક કથાગતિવાળા નિરૂપણ તરફ જતો ગયો.

પરંતુ, આપણા આ સમયમાં, ગાંધીજી પછીની ત્રીજી-ચોથી પેઢી સુધીના વાચકોનું

ગાંધીજી તરફ ધ્યાન વળશે; નવલકથા રૂપે આવેલી એ સમયની આ ગાથામાંથી ધીરજ ચાખીને પણ પસાર થનારને એક સતત વલોવાટવાળા મહા-આંદોળનનો, એક વિરલ સમયઅંડનો અનુભવ મળશે એ પ્રાપ્તિનું મૂલ્ય પણ ઓછું નથી. પરંતુ તેમ છતાં, તે છતાંય, નવલકથામાંથી ખસવાનું મન ન થાય એવી આસ્વાદીતપાના ઉંડા, અંદરના સ્તરે લઈ જતી કૃતિ માટેની એક તરસ, દરેક વાચકને ઓછીવતી પણ રહી જવાની એ વાત, આપણા આ એક મોટા સર્જકના સંદર્ભે, ઉદાસ પણ કરી જાય છે.

### સંદર્ભનોધી :

1. સદ્ગત જ્યંતભાઈએ નવલકથાની ભૂમિકા રૂપે ને દરેક ખંડના વિષયસાર રૂપે ૭-૮ પાનાં લખેલાં. એ હસ્તલિખિત લખાણની નકલો કેટલાકને આપી/પોકલાવી હશે એમ એક મને પણ આપેલી. (ત્યાં સુધી નવલકથા પ્રકાશનાર્થે પણ નહોંતી ગઈ). આ પાનામાંથી કેટલાક પેઠેખાં શ્રી મંજુલા ગારીતના, પહેલા ભાગને આરંભે મુકાયેલા નિવેદનમાં, ‘લેખકના પોતાના જ શબ્દોમાં જોઈએ’ એવી નોંધ સાથે મુકાયા છે. બીજા-નીજા-ચોથા ખંડનાં આરંભિક પાનામાં ‘સમયની રેતમાં કાળની કથા સાથે...’ એવા શીર્ષકથી મૂકેલાં લખાણોમાં જ્યંતભાઈના પેલા હસ્તલિખિત લખાણમાંના જ પ્રસ્તુત અંશો (પૂરેપૂરા) મુકાયા છે પણ એ લખાણો હેઠળ લેખકનું નામ નથી ! વળી એમાં, ‘જ્યંતભાઈએ દર્શાવ્યું છે કે...’ પ્રકારના નિર્દેશો પણ પ્રવેશય છે, એથી વાચકને મૂળવણ થવાની કે તો શું આ લખાણ લેખકનું જ નથી ? તો આ કોણું લખાણ છે ? પ્રકાશકે કે પરિવારજનોએ ત્યાં નામ-નિર્દેશ કે સ્પષ્ટતા કરવાં જોઈતાં હતાં.
  2. આ સમીક્ષામાં, નવલકથામાંથી લીધેલા ઉદ્ઘરણાંશો મેં બધી જ માન્ય જોડણીમાં ફેરફાને લીધા છે. જ્યંત ગારીતે એક ‘ઉંદી’વળી ઊજા જોડણીમાં આ નવલકથા લખી છે. એ જોડણીમાં લખેલું લખાણ કોઈને વાંચયે અગવદભર્યું લગી શકે. વળી એમણે છુસ્ત ‘ઈ’, ‘દીર્ઘ ‘ઉ’ ઉપરાંત મૂર્ધન્ય ‘ષ’ અને જોડાકરવાળા ‘દ્વા’નો પણ પરિહાર કરેલો છે, એથી ‘ધોશ, વીશશુ, રાશ્ટ્રીય, સીધ્યાત, બધ્ય’ એવી જોડણી વાંચવાવારો આવે છે, અને આ સમીક્ષાલેખના વાચનમાં પણ જોડણીનાં બે સત્રો વાચન-વ્યવધાન કરી શકે એમ છે. – એ કારણે, મૂળ સાથે એટીક છૂટ, ક્ષમાયાચનાપૂર્વક, લીધી છે.
  3. આ દરમાન એમણે એક નવલકથા એક અસ્વભ સુધી જીવન (૨૦૦૪) આપેલી ને આપદ્ધમથી બેચાર વિવેચનાંથો કરેલા એ જ.
  4. ચોથા ખંડન અંતે મૂકેલી ગુજરાતી, અંગેજી, હિંદી સંદર્ભગ્રંથોની બૃહત્ સૂચિ એ બતાવી આપે છે.
  5. ચોથા ખંડનાં છેલ્લાં તરોક પાનાં (૨૫૭-૨૫૮) એમણે બોલીને ઉત્તરાવેલાં જાણાય છે. એમાં વાક્યો સર્ણંગ છે પણ વિગતો કિરીક તૂટક અને પૂર્ણ સ્પષ્ટ ન બનતા અર્થો અને સમયસંદર્ભો વળી છે. ચી. ના. પટેલે ગુજરાતી વિશ્કોશના દ્વા ભાગ (અમદાવાદ, ૧૯૮૪)માં ગાંધી વિશે, સ્પષ્ટ વિગત/વર્ણના નિર્દેશો સાથેનું અધિકૃત અધિકરણ લખ્યું છે અને સામે રાખીને, મેં સત્ય નવલકથાનાં આ છેલ્લાં પાનાની વિગતોના અર્થસંદર્ભો મેળવી લેવાનું કર્યું છે. (ચી. ના. પટેલનાં અવતરણો ને પૃષ્ઠનિર્દેશો ગોળ કોંસમાં મૂક્યાં છે). જુઓ :
- (૧) ભાગલાનો અસ્વીકાર કરતો ગાંધીજીનો ઠરાવ કોંગ્રેસ કારોબારીએ સર્વાનુમતે ઉડાવી દીધો. ‘આ એમની મોટી નિરાશા હતી. એમણે તરત બિહારનો રસ્તો પકડ્યો’ [૪ : ૨૫૮] ફરી ‘કોંગ્રેસ કારોબારીએ કારોકરીની સ્થિતિમાં’ ગાંધીજીને દિલ્હી બોલાવ્યા... નછૂટકે, મરજ વિરુદ્ધ, કારોબારીમાં એ ઠરાવ [ભાગલાના] પર એમણે સહી કરી [૪ : ૨૫૮] (૧૯૮૪નો).

એમી મેએ ગાંધીજી પાછા કલકત્તા ગયા. – વિશ્કોશ-૬ : ૨૬૦)

(૨) ‘દિલ્હીમાં હોલનગારાં વાગવા માંડયાં’ [૪ : ૨૫૮] આ સ્વાતંત્ર્ય હિન અંગે હશે ? જુઓ : (‘જ્યારે આખો દેશ સ્વતંત્રતાનો ઉત્સવ ઊજવી રહ્યો હતો ત્યારે ગાંધીજીએ ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ કરીને ઊજવ્યો,’ – વિશ્કોશ-૬ : ૨૬૧)

‘એ વાતે મોહનદાસ કલકત્તાનાં કોમી રમખાણો અટકાવવા આમરણાંત ઉપવાસ પર ઉત્તર્યા’ [૪ : ૨૫૮] સરખાવો : (‘ઓગસ્ટની ૩૧મી [૧૯૪૭]એ ઉશ્કેરાયેલા હિંદુ યુવાનોનું ટોંગું હેઠળી મેન્શન પર ધરી આવ્યું, તે પછી સારેમાં પહેલીએ પણ હિંદુ યુવાનોએ રોઝન કર્યું એથી તે જ દિવસે સાંજે ગાંધીજીએ કલકત્તામાં અનિશ્ચિત મુદ્તનો ઉપવાસ શરૂ કર્યો’ – વિશ્કોશ-૬ : ૨૬૧)

(૩) ‘ત્યાંનાં [કલકત્તાનાં] રમખાણો શમાવ્યાં. દિલ્હીમાં સતત રમખાણો થયાં. ત્યાં આવીને ૨૦ દિવસના ઉપવાસ કર્યા’ [૪ : ૨૫૮] સરખાવો : (‘ગાંધીજી સમજી ગયા કે દિલ્હીમાં પાછી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી પોતે પંથા જવાનો વિચાર ન જ કરવો જોઈએ’ (વિશ્કોશ-૬ : ૨૬૨) પછી એ ત્યાં જ રહ્યા અને ‘દિલ્હીમાં હિંદુ અને મુસ્લિમાનો વચ્ચે સંપૂર્ણ શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો નિર્ણય જોહર કર્યો અને (૧૯૪૭) જાન્યુઆરીની ૧૩મીથી એમણે ઉપવાસ શરૂ કર્યો’ – વિશ્કોશ-૬ : ૨૬૩)

(૪) ઉપરાન સંદર્ભ પ(ત)ાં આવતા વાક્ય પછી તરત જ આવે છે : ‘મોહનદાસ આખરે દાવાનળમાં હોમાઈ ગયા’ [૪ : ૨૫૮] ને પછી તરત પેલો ઉદ્ગાર : ‘બલે હું નિષ્ફળ ગયો પણ [...] હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ.’) એ ગાંધીજીના અવસાનનો સંકેત હોઈ શકે ? – લેખકના મનમાં ગાંધીજીના અવસાન સુધી નવલકથા લઈ જવાનો નિર્ધાર હતો. એ અખાતચિત્તનો નિર્ધાર આ રીતે, તૂટક રીતે, બ્યક્ત થયો હોય એમ મને લાગે છે. (અલબત્ત, ‘દાવાનળમાં હોમાઈ ગયા’ એ વાક્યને ઉપકાત્મક અભિવ્યક્તિ ગણવી કે કેમ એ પણ કોઈ વિચારી શકે)

૬. નવલકથાનું સંકલનસૂત્ર બચાબર સમયના કમે ચાલે છે. ખંડ : ૧ ૧૯૧૫થી ૧૯૧૮ સુધીના ઘટનાક્રમો સુધી; ખંડ : ૨ ૧૯૧૯થી ૧૯૩૦ સુધી; ખંડ : ૩ ૧૯૩૨-૧૯૩૮ સુધી ને ખંડ : ૪ ૧૯૩૮થી ૧૯૪૮ સુધી. પ્રકરણો ને પેટાપ્રકરણો એ જ સૂત્ર-અનુસાર ચાલે છે. પરંતુ ખંડ : ૨નાં પહેલાં ૩ પેટાપ્રકરણો ૧૯૨૨ના માચની ૧૦મી સુધી ચાલે છે; પેટાપ્રકરણ ૪ અન્નિલ ૧૯૨૯થી ૨૨ માર્ચ ૧૯૩૧ ભાગતસિંહ વગેરેને ફંસી સુધી ચાલે છે ને વળી પેટાપ્રકરણ ૫ માર્ચ ૧૯૨૪થી શરૂ થાય છે – એટલે કે પેટાપ્રકરણ ઉના અંત સાથે અનુસંધાન સાધી છે. આમ ભગતસિંહની કથા, સર્ણંગ સમયસૂત્ર તોડીને વચ્ચે મુકાઈ છે.

એટનું જ સુભાષના મહાપ્રયાશને આવેખતું, ખંડ : ૪નું પ્રકરણ પણ સર્ણંગ સમયસૂત્રને તોડીને વચ્ચે મુકાયું છે. ત્યાં તો પ્રકરણો સાથે જ વર્ણનિર્દેશો છે : પ્રકરણ ૧ (૧૯૩૮-૪૦), ૨ (૧૯૪૦-૪૧), ૩ (૧૯૪૨), ૪ [સુભાષકથા] (૧૯૪૦-૪૫), ૫ (૧૯૪૨-૪૪), ૬ (૧૯૪૪-૪૫), ૭ (૧૯૪૬....) અલબત્ત, સુભાષપ્રકરણ, આટનું વિગતે, મૂકવા માટે લેખક સામે કોઈ બીજો વિકલ્પ હતો ? તેમ છતાં, સર્ણંગ કથાપ્રવાહમાં આ પ્રકરણ જે રીતે પથરાઈ ગયું છે તે સંકલનનો પ્રશ્ન ઊભો તો કરે છે.

સરદારનું લોખંડી મનોબળ અમને વારસામાં મળેલું, એમાં ભવ્ય ચઢ્ઠી યુવાનીના દિવસો. પર્વતને હઠાવી માર્ગ કરવાનું ઝનૂન તો જાણે ઉછળા મારે. ને એવે યાણે અમારો મિત્ર સુનીલ સંઘળી શક્તિઓ રચનાત્મક દિશામાં વળે એવી સૂચક પ્રવૃત્તિ લઈ આવ્યો. કહે “સરદાર જ્યંતી આવી રહી છે, આપણે એક સાઈકલરેલી કાઢીએ.” માર્ગ હતો અમારી સેઠાન્ટ ઐવિયર્સ, આણંદથી વાયા વિદ્યાનગર થઈ કરમસદ બસસ્ટેન્ડ પાસેના સરદારની પ્રતિમા સુધીનો. બસ પછી તો યુવાનીનું ‘કામાનંદી’ મન અમે આ કામે લગાડ્યું. સમરસિયાઓની એક મંડળી તૈયાર થઈ. મૂળે અમે બે ભાઈબંધી – હું ને મહેશ. મહેશનો મિત્ર તે આ સુનીલ ને ભાઈબંધોનો ભાઈબંધ તે મારોય ભાઈબંધ એમ મિત્રતા ‘વકરેલી.’ એમાં જોડાયો ‘લીધેલું પૂરું કરવાની ભાવનાવાળો’ યુવાન મિત્ર સુધીર.

આયોજન તો અદ્ભુત હતું અને આ પ્રવૃત્તિથી અમારી પર ચોમેરથી પ્રશંસાનાં પુષ્પો વેરાશે એવી પાકી આશા બંધાયેલી. વળી આ જ અરસામાં આણંદ કોલેજમાં યોજાયેલી ‘સરદાર’ નિબંધસ્પર્ધામાં હું પ્રથમ આવેલો એટલે એ સમર્યકણ દરમિયાન હુંયે પૂરો સરદારને રંગાયેલો. રેલીસંદર્ભે કામ ઘણાં હતાં. સાઈકલરેલી ‘પ્રભાવક’ બનાવવા મૌચી સંખ્યામાં સાઈકલ ધરાવતા યુવાનો જોઈએ ને ઘણીબધી સાઈકલો (અંદાજિત ત્રણસો) શહેરના રસ્તાઓ પર અરાજકતા ન સર્જે, માટે અગ્રાઉથી પોલીસ-કલેક્ટર જેવા સરકારી તંત્રની પરવાનગી લેવાની. રેલીમાં ભાગ લેનારા યુવાનો સાઈકલ પર સરદાર અને દેશભક્તિને લગતોં પ્લેકાઇસ-પોસ્ટર્સ મૂકે તો જ અમારો ‘સંદેશ’ લોકો સુધી પહોંચે. વળી રેલીને કોઈ જાણીતી વ્યક્તિ લીલી ઝંડી આપે, રસ્તામાં – મામલતદાર કચેરી પાસેના ચાર રસ્તે ગાંધીજીના ભાવલાને સૂતરની આંદી પહેરાવાય ને કરમસદ પહોંચ્યા પછી ગામના સરપણ્ય અમારું સ્વાગત કરી, રેલીના યુવાનોને સંબોધી, સરદારના ભાવલાને સૂતરની આંદી પહેરાવે પછી રેલીનું વિસર્જન કરવું એમ નક્કી થયું. અમે લાગી પડ્યા. સૌ પહેલાં પોલીસાંત્રને જાણ કરી, કલેક્ટરની પરવાનગી લેવાનું સૂર્જયું. એમણે વિભિત્તમાં રેલીનો રૂટ અને અરજી માળ્યાં. મિલન-મુલાકાતો ને વિભિત્ત અરજીઓના દોર પછી એ નક્કી થયું કે પોલીસની ‘વાન’ આવશે અને રેલીની આગળ/પાછળ ચાલશે જેથી ટ્રાફિક સંબંધી મુશ્કેલીઓ અને અન્ય ગેરવ્યવસ્થા ન સર્જીય.

કાંઈકમને / રેલીને લીલી ઝંડી આપવા માટેનું નામ તો પહેલેથી જ નિર્વિવાદ હતું; અમારા શિક્ષક અને સાહિત્યકાર જોસેફ મેકવાનનું. ‘એ વ્યસ્ત હોય અને એમનો સમય મૂલ્યવાન હોય’ એ કરતાં ‘આપણા સાહેબ’ એટલે આપમણે કહીશું એટલે આવશે જ એવો વિશ્વાસ. એમણે પ્રેમપૂર્વક સંમતિ આપી એટલે એટલા એમે નિરોત્ત બન્યા; પણ અમે કરમસદના સરપણ્યને ઓળખવામાં થાપ ખાઈ ગયા. રેલી કાઢ્યા પહેલાં જ સાઈકલો ચલાવીને (ભાડાનું ખર્ચ બચાવી શકાય માટે) સરપણ્યને મળવા ગયા. ખાસ્સી માથાકૂટના

અંતે એમને ખોળી કાઢ્યા. ઠળતી બપોરે એ ઘેર તો નહોત્તા; પણ સરદારના ભાવલા પાસેથી પસાર થતાં રસ્તામાં જ દીવાવે અઢેલીને એમના મિત્રો સાથે ઊભા ઊભા ગળ્યાં મારતા હતા અને સંભવત: કંઈક ‘નશીલી’ હાલતમાં હતા. અમે સાઈકલો ‘સ્ટેન્ડ’ કરી; એમને બાજુ પર બોલાવી, ‘વિદ્યાર્થીશિક્ષસ્ત’ સાથે ‘સાઈકલરેલી’ અને અમારી ‘દેશભક્તિ’ની યોજના સમજાવી. ‘સાત્ત્વાઓ... (નાળો) આટલાં વર્ષે તમને સરદાર યાદ આપો? અતાર સુધી કંઈ... જેવું ખાસ્સું સંભળાયું, એમે હહડી ગયા. અમારી રાષ્ટ્રભાવનાના ફૂરચા ઊડી ગયા. સરદારના ભાવલા પાસે જ અમારું ‘લોખંડી મનોબળ’ ઓગળવા લાગ્યું, શું બોલવું એ સૂર્જે નહીં. આ ભયાનક પરિસ્થિતિમાંથી અમારો ‘સરદાર’ સુનીલ હિંમત હાર્યો નહીં. ખાસ્સા પ્રયાસોને અંતે, એક ‘અભાગી ક્ષેત્રે’ સરપણે રેલીને આવકારી, સંબોધવાની હા ભાડી. અમે ‘ઈડલિયો ગઢ’ જીત્યાની લાગણી સાથે પાછા ફરતા હતા પણ સરપણ્યના વર્તને અમારા મનમાં અનેક સવાલો ઊભા કરેલા.

હવે મુખ્ય બે કામ બાકી હતાં. પ્લેકાઇસ-પોસ્ટર્સ તૈયાર કરવાનાં અને યુવાનોને રેલીના સમયે આવવા તૈયાર કરવાના. પ્લેકાઇસ માટે મોટી સાઈઝનાં પૂંઠાં, લાકડાનાં પાટિયાં, ગળી, પાંછી, ખીલીઓ વગેરે સામગ્રી ખરીદવા પૈસા જોઈએ; પણ અમારી પાસે કોઈ ‘મોટી’ રકમ નહીં, ‘ગાંધનું ગોપીચંદન’ કરવાનું હતું. કોઈ ‘સ્પોન્સર્સ’ કે સ્થાનિક રાજકારણીનો ટેક્સી એમે લીધો નહોતો. શુદ્ધ દેશભક્તિની મૂડી પર જ આ ધંધો કરવાનો હતો એટથે અમે ચારેય જ્ઞાનાએ ખર્ચને સરાએ ભાગે વહેંચી લેવાનું નક્કી કર્યું. સુધીર ફાઈન આર્ટ્સનો વિદ્યાર્થી હતો એટલે એણે એ બધી જવાબદારી સંભાળી લીધી. સ્કૂલ બાજુમાં જ પ્રિન્ટિંગ પ્રેસ લે ચાંચ જઈ વિનંતી કરતાં એગલે મજા પૂંઠાં આપ્યાં જો નિયમાંથી લાડુણાં પાટિયાં અને બજારમાંથી બાકીની સામગ્રી ખરીદી લાવ્યા. વિનો વળોટતાં અમને જે સફળતા મળતી હતી એથી અમારો ઉત્સાહ વધી ગયેલો. અમારાં સગાંવહાલાંથી પ્રવૃત્તિઓનો ધમધમાટ જોઈ અંબું પામેલાં. એમે મિટિંગો કરી રાને મોડા ઘેર જઈએ તો ય કોઈ વઢે નહીં. સરદાર જ્યંતી આડે દસેક દિવસ રવા ત્યારે અમે ‘તાન’માં આવી ગયેલા. સૌથી મોંઢું કામ ‘રેલીપ્રચાર’ અને યુવાનોને એકદા કરવાનું હતું તે આ છેલ્લા દિવસોમાં પરકાસ્થાએ પહોંચ્યું. ‘ખારડોલી સત્ત્વાગ્રહને આડે એટલું માણણ’ ભેગું કરવાની નેમ. ‘યુવાનોને જોતરવાનો’ એક સહેલો માર્ગ શોધી કાઢ્યો. એમે એ દિવસોમાં કિકેટ પુષ્ટળ રમીએ અને રજાના દિવસે ‘ખેચ’ લઈએ – સ્થાનિક યા પડોશી ગામોમાંથી કોઈ પણ ગામમાં. ગમે ત્યાં જઈએ, સાઈકલો પર બેટ મૂડી પહોંચી જઈએ. પંદર કે વીસ ઓવરની મેચ રમીએ. ટેનિસ બોલ પણ બન્ને ટીમોએ અડધા અડધા પૈસા કાઢી ખરીદી હોય ને ફિજેટા ટીમ બોલ લઈ લે એવી શરત. જીંટોડિયા, કરમસદ, વિદ્યાનગર, વધારી જેવાં આજુબાજુનાં ગામોમાં સાઈકલો લઈ રમવા જવું એ રમતવાત હતી અને આ કિકેટ ટીમોના યુવાનોને સારી રીતે ઓળખીએ એટલે આ કિકેટટીમોને જ રેલીમાં બોલાવીએ તો અડીસો-ત્રણસો સાઈકલો તો આરામથી થઈ જશે એવો અંદાજ અને એથી વધી જાય તો ડેમના ‘મેનેજ’ કરીશું એવો ફફડાટ.

અમે નમતી બપોરે નીકળીએ. જે ગામમાં જઈએ તે ગામના યુવાનોને મળી હસ્તલિંગિત જાહેરાતો આપીએ, શક્ય હોય તો ફિયાના બોર્ડ કે ચોકમાં જાહેરાતો ચોંટાડી કે લખાવડાવીને પ્રચાર કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીએ. સાથે સાથે અમારી સાથે કિકેટ

રમનારાઓ ‘અમે તો વીસ જ્ઝા આવીશું જ... ચિંતા કરશો નહીં... અમને ગડી જ લો, કહો તો આગલી રાતે આવી જઈએ... તમારી સાથે જ છીએ... બહુ સારી પ્રવૃત્તિ છે. કહેવું પડે... જેવાં અદ્ભુત વાગ્બાણોથી અમને ઘાયલ કરતા રહ્યા ને અમારો ઉત્સાહ બેવડાવતો રહ્યા. આવી ભવ્યાતિબિબ્ય રેલી જોઈ સરદાર પણ ગફગદ થઈ જશે ને બાવલામાંથી પ્રગટ થઈ અમારો ખબો થાબડશે એવા વિચારોય મનને જણાજ્ઞાવી જતા.

ચુંટણીના પડઘમ આગલી રાતે શમી જાય એમ અમારાય પ્રચારકાર્યનો અંત આવ્યો પણ આગલી રાત્રે સુધીરના ઘરે પ્લેકાર્ડ્સ લખવાનું કામ પૂરા જોશમાં ચાલ્યું ને મોડી રાત્રે એ પૂરું થતાં સવારે સાડા સાત-આઈ વાગ્યા સુધીમાં સ્કૂલ પાછળ ચર્ચ કુપાઉંડમાં આવી જતું એવો નિર્ઝય લઈ અમે છઠ્યા પડ્યા. રેલી પ્રસ્થાનનો સમય સવારે નવનો હતો. સરદાર જ્યંતીની એ સવારે, સાડાસાત પહેલાં જ, અમે ચારેય જ્ઝા એકદા થઈ ગયા. પ્લેકાર્ડ્સ વગરે લઈ આવ્યા ને કાગડોએ અમારા મિનોની રાહ જોવા લાગ્યા. અમે ચારેય અમારી સાઈકલો પર પાટિયાં લગાવી દીવીલાં ને હમણાં આ દિશામાંથી સાઈકલોનું ધાડું આવશે; પેલી દિશામાંથી લોટિયા ભાગોળવાળા કે વડોદવાળા આવશે જેવી અટકળો – પ્રતીક્ષા કરતા રહ્યા. લગભગ નવ વાગવા આવ્યા અને અમારા ચાર જ્ઝા ઉપર પાંચમો જ્ઝા ન આવ્યો ત્યારે અમે ગભરાયા. રેલીનો ‘ફ્રિયાસ્કો’ થશે એ ભય પાક્કો થયો. ઢગલાંધ પ્લેકાર્ડ્સ સાઈકલોની રાહ જોતાં એક ખૂણામાં નિમણાં પડ્યાં હતાં. અમારાં મોઢાં જોવા જેવાં થઈ ગયા. દરમિયાનમાં ‘પોલીસદણ’ વાન લઈ આવી પહોંચ્યું. અમને થયું “પોલીસવાળા આપજાને મારવા ના લે તો સારું.” અમને ચારને જ સાઈકલો લઈ ઊભેલાં જોઈ ‘ફરજ દરમિયાન મોઢે થઈ ગયેલી ગાળો’ બોવતાં અદશ્ય થયા. કદાચ એમના ધંધાનો ટાઈમ અમે બગાડ્યો હતો. ક્ષાળાભર થયું કે રેલી કેન્સલ કરી નાખોએ. પણ કરમસદયાં રેલીની રાહ જોતા સરપંચ આંખો સામે તરવરે. આ મુશ્કેલીઓ વચ્ચે જોસેફ મેકવાન સર રેલીને લીલી ઝંડી આપવા આવી પહોંચ્યા. અમારી આપવીતી અમે એમને વર્જાવી. એમજો સંવિધારો બંધાવ્યો; કહે કે સારા કામમાં સાથ આપનારા ઓછા હોય છે. તમાશાને તેંદું ન હોય. તમે સારું જ કરો છો તેથી ક્ષોભ અનુભવવાની જરૂર નથી વગરે...

બસ આ સંવાદો ચાલતા હતા ત્યાં જ છ-સાત છિકરાંઓનું ટોળું સાઈકલો લઈને આવ્યું. અમારા ગામના જ પણ અન્ય કિકેટ ટીમનાં છોકરાંઓ હતાં. અમને એમ કે રેલીમાં ભાગ લેવા આવ્યાં; તો કહે ‘ના, અમે તો અગિયાર વાગ્યે મેચ લીધી છે એટલે ખૂટતા પ્લેવરો કરવા નીકળ્યા છીએ.’ મેં આંદું માર્પું – મેચ તો અગિયાર વાગ્યે છે. રેલી તો દસ-સવા દસ સુધીમાં પતી જશે. તો જવાબ આવ્યો : “જતાં-આવતાં વીસ-બાવીસ કિલોમીટર સાઈકલો ચલાવીને હૂસ નીકળી જાય પછી મેચમાં શું રમાય? ચા-નાસ્તો કરાવવાના હો તો આવવાનું વિચારીએ.”

“ભલે ત્યારે ઘા ભેગો ઘસરકો.” અમે સંમત થયા અને પાંખી હાજરી વચ્ચે માંડ દસ-બાર સાઈકલોને લીલી ઝંડી આપતાં જોસેફ મેકવાને શુભાશ્રિષ સાથે પ્રસ્થાન કરાવ્યું.

અમે નીકળ્યા; પણ નવરા પડેલા દસ-બારનું ટોળું જાણે મસ્તી કરવા નીકળ્યું હોય એવું લાગે. ‘સરદાર અમર રહો’નું પાટિયું મેં મારી સાઈકલ પર લગાડેલું પણ રેલીનું સંચાલન કરતાં હવે અંઘારાં આવ્યાં. આંધાંદ-મામલતદાર ઓફિસ-ગોદી પણે ગાંધીજીના

બાવલાને સૂતરની આંટી પહેચાવવા રોકાયા તો ટોળું જોઈને રાહદારીઓ-વાહનચાલકો એક ક્ષણ તો શંકાની નજરે જોવા લાગ્યા કે અમે બાવલાને કંઈ નુકસાન તો નથી કરતાને ? મોટાભાગના લોકોએ તો એની કંઈ નોંધ પણ ન લીધી. વિશાળ, સફળ રેલીઓ કાઢવા માટે શું શું જોઈએ એ અમે શીખ્યા હતા પણ બાવલા પાસેની કશોડી હાલતનું વર્જાન શક્ય નથી. વળી રેલી આગળ ચાલી ત્યારે શહેરનાં રોજિંદાં વાહનોની ભીડમાં દસ-બાર સાઈકલો એવી આગળ-પાછળ થઈ ગઈ કે રેલી પસાર થઈ રહી હોવાની કોઈને ગંધ સુધ્યાં ન આવી.

એમ સાઈકલો ચલાવતાં થાક્યાપાક્યા અમે કરમસદ બસસ્ટેન્ડે પહોંચ્યા. સરપંચ આજે સારા મૂડમાં હતા. બાજુમાં જ પાનના ગલ્વે ઊભેલા અમે માંડ દસ-બાર હતા એટલે ભાષણ તો કંઈ ન થયું; પણ અમારી હાજરીમાં એમણે સરદારને સૂતરની આંટી પહેચાવી, એ આંટી હજી તો સરદારના ગણેય નહોતી પહોંચી ત્યાં તો પેલા છ-સાતમાંથી એક બોલ્યો : “ચા-નાસ્તો કરવા કયાં જઈશું ?” અમે કંબું ‘વિચારીએ.’ ત્યાં તો એક જણ બોલ્યો : ‘વિદ્યાનગર નાના બજારમાં મેં એક મસ્ત જ્ઝા જોઈ છે. ત્યાં જઈએ.’ હવે દલાતરવાડીના આ વંશજો આગળ ચાલ્યા ને અમે દોરવાયા. ‘પારકે પૈસે નાસ્તો કરવાનો આનંદ’ તેમના ચહેરાઓ પર સાફ જલકતો હતો. ચાની ચૂસુકીઓ લેતાં અમારો ‘સરદાર’ સુનીલ ઔપચારિક રીતે રેલી ‘સફળ’ બનાવવા બદલ સૌનો આભાર માનતો હતો. દરમિયાનમાં ‘સાઈકલ રેલી તો કયારેય નહીં’ એવો પોલાદી નિર્ઝય હું લઈ ચૂક્યો હતો કારણ કે સરદારનું લોંગી મનોબળ અમને વારસામાં મળેલું.

## અંતિમ સંબોધન

સાજે ! સુહુદ ! — એહેવાં રસ્તિક સ્નેહસંબોધનો સહી નવ શકે અહીં પ્રકૃતિબાળકો કોમળાં.

કહે : ‘કવતી કોકિલા સકલ કાજ, ડાળો જૂલે વિશાળ સહુ માટ છાંય ધરતી, — નથી શું લીધી ?

સરે સરિતગીત, નિર્જર ઝરે, તમેયે પીઓ !

— અમે અતિશ નંદતાં રસ પસારી સૌને હેયે.

કવિ ! કચમ તને જ સંકુચિતતા વરી તો પણી ?

વિશાળ ઉર્ભાવ વિસ્તર અસીમ દેશે તુંયે !

સાજે ! — ફરી કદી ન હું વદીશ એહ સંબોધન.

હવાં ગગનધૂમ્મટે જ પડઘાઈ ફેલી જશે

તનેય રસસ્વાદ આજ લગીમાં લગાડ્યો જ, તો

વિરાટપુ વિશમાં પ્રસર ગ્રાણ તું, જેથી હું

સુણું, નીરખું વ્યોમમાં, ભૂતલમાં, બધી તું હિ તું !

— [‘સમગ્ર કવિતા’] — ઉમાશક્ર જોશી

### પ્રયોગાત્મક ટૂંકીવાર્તાના સર્જક ઘનશ્યામ દેસાઈની ચિરવિદ્યા | પ્રફુલ્લ રાવલ

‘કાગડો’, ‘ગોકળજીનો વેલો’, ‘ગણગણાટ’, ‘તુકા મહણે’ અને ‘ટોણું’ જેવી ટૂંકીવાર્તાઓમાં આધુનિકતા સાથે દીપક દોશી કહે છે તેમ ‘માટીની સુગંધ’નો અનુભવ કરાવનાર ઘનશ્યામ દેસાઈને સદેહે ૨૮ એપ્રિલ, ૨૦૧૦ના રોજ આપણી વચ્ચેથી વિદ્યાય લીધી. મૃત્યુ ક્યારેક બ્યક્ઝિના ભીતરને પ્રકાશિત કરે છે. ભુલાયેલું પુનઃ સ્મરણમાં આવે છે અને ઢંકાયેલું અનાવૃત્ત થાય છે. એ બ્યક્ઝિનું સમસ્ત બ્યક્ઝિતત્વ જ્ઞાન ખૂલ્લી રહે છે ! સિતાંશુ યશશ્વરન્દ્ર ઘનશ્યામ દેસાઈને ‘આપણા સમયનો હસ્તો ફ્લિલસ્ફૂફ’ તરીકે ઓળખારે કે લાભશર્કર ઠાકર, મધુરાય, અનિલ જોશી કે હોમી દસ્તુર એમના બ્યક્ઝિતવની એકાધિક બાજુને ઉધારી આપે, પરંતુ ટૂંકીવાર્તા ને બાળસાહિત્યના સર્જક તરીકેની એમની ઓળખ એટલી જ મહત્વની છે. થોડું પણ સત્ત્વશીલ સર્જન કરવું એ માટી વાત છે. વળી અથવા જીના નિમિત્ત સંપાદકીય પ્રવૃત્તિ કરવી ને છતાંય નવોદિત સર્જનોની સર્જનાત્મકતાને સંકોરવી એ એમના સંપાદનધર્મની વિશિષ્ટ બાજુ હતી.

ઘનશ્યામ દેસાઈનો જન્મ ૪ જૂન, ૧૯૭૪ના રોજ દેવગઢબાસિયામાં થયો હતો. એમ. એ. સુધીનો અભ્યાસ કર્યો. થોડો સમય ધીરુબહેન પટેલના વિદ્યાર્થી પણ હતા. અભ્યાસ પછી સોનગઢ અને મુંબઈની ન્યૂએરા સ્ક્લુમાં શિક્ષક હતા પછી પત્રકાર બન્યા. અને એમાંથી સાહિત્યિક પત્રકારત્વમાં પ્રવેશ કર્યો ૧૯૮૨ રમાં. હર્યાન્દ દવે જેવા પત્રકાર-સર્જકનો સંગ મળ્યો. પછી તો એ જ એમની મુખ્ય પ્રવૃત્તિ બની રહી. ‘મૃહુભાષી’ ઘનશ્યામ દેસાઈ સંપાદક તરીકે ‘સ્પષ્ટભાષી’ પણ હતા જ. એમનાં પત્રી ઊર્મિબહેન ઉત્તમ ભાષાવિદ અને ઘનશ્યામ દેસાઈ ઉત્તમ ‘વાગ-કર્મી’ આથી તો ‘ગુજરાતી ભાષાની બે ઉત્તમ સમજણ એ દંપતી તુપે સંલગ્ન થઈ’ એવા સિતાંશુના કથનમાં વાજભીપણું છે જ. કષ્ય ને પક્ષધાતના રોગ વચ્ચે ન ઘનશ્યામ દેસાઈનું મનોબળ ઘટયું કે ન ઊર્મિબહેનની સહનશરીલતામાં ઓટ આવી. એમની માંદળી સંદર્ભ સુરેશ દાલાવે લખ્યું છે. ‘કોઈ જાળમાં માછલીની જેમ એ ફસાઈ ગયો હતો અથવા એમ કહું કે જાળમાં એનો આખો દરિયો ફસાઈ ગયો હતો.’

ઘનશ્યામ દેસાઈના એકમાત્ર વાર્તાસંગ્રહ ‘ટોણું’ને ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું હતું. બાળસાહિત્યની ‘ભૌલિક કથામણી’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું તો ૨૦૦૭માં એમને ગંગાબહેન પટેલ સારસ્વત સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાતી ભાષામાં જ્યારે પણ ટૂંકીવાર્તાની વાત કરવાની થશે ત્યારે ‘ટોણું’માંની વાર્તાઓના સર્જક ઘનશ્યામ દેસાઈને હાસિયામાં મૂકવાનું શક્ય નહીં બને. એ જ એમની સર્જકસિદ્ધ છે.

‘ટોણું’ વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ થયેલો ૧૯૭૭માં. એમાં માત્ર વીસ ટૂંકીવાર્તાઓ સમાવિષ્ટ થઈ છે. એક બાજુ આધુનિકતાનો સ્પર્શ ને બીજી બાજુ પારપરિક વાર્તાશીલી વચ્ચે સ્વત્ત્વને

જળવી રાખવાની મથામણ એ ઘનશ્યામ દેસાઈની સર્જનયાત્રાનું કેન્દ્રબિંદુ છે. એમની વાર્તાઓમાં ગુજરાતી ભાષાનું વિત્ત વર્તય છે તો ગુજરાતી ગદ્યની સર્જનાત્મકતાની સુગંધ પણ પમાય છે. ‘હું’નાં વિવિધ રૂપોનું – સંવેદનોનું વિસ્તરણ આ વાર્તાઓનો સમ છે. મનુષ્ય માનસિક ગડમથલ વચ્ચે જોતને જોવાનું કરે કે જોતને વેદનામાં ઘડકે છે તેની પ્રતીકાત્મક અભિવ્યક્તિ આ વાર્તાઓમાં છે. ‘કાગડો’ વાર્તાનો નાયક ‘હું’ છે જેણે ‘નાનું ટપકું’ જોયું છે. એ કહે છે, ‘હું એ ટપક તરફ એકીસે તાકી રહ્યો. મેં ધ્યાનથી જોયું તો એ ટપકાના કદમ્યાં વધારો થતો હતો. તેથી તેની ગતિ માર દિશામાં જ હોવી જોઈએ એમ મેં માચ્યું. માંસું કુતૂહલ વધી ગયું. જોતજોતામાં એ ટપકું મોટું થતું ગયું. પછી જોરદાર પવન ફૂકાયો. વૃક્ષોનો પડવો અતિશય ફસ્ફેફાયો. દરિયાનાં મોંઝાં વધારે ઊંચાં ઊછાયાં. એક વિશાળ ચક્કર મારી એ ટપકું દરિયાના પાણી ઉપર બેસી ગયું, અને તરતુંતરતું મારી દિશામાં આવવા લાગ્યું. પછી પાણીમાંથી કિનારા પર એ જીતરી પડ્યાં. ત્યારે જ મેં જોયું કે એ તો એક સાધારણ કદનો કાગડો હતો. દફૂક દફૂક કરતો એ મારી દિશામાં આવવા માંડ્યાયો. છાતી ફુલવાને એ એવી છાયાથી ચાલતો હતો કે જાણે દરિયાને ખેંચાને કિનારે ન ઘસડી લાવતો હોય ! પાછળ દરિયો અને આગળ કાગડો એમ બેંગ થોડી વાર ચાલ્યા. ફૂદતો ફૂદતો એ મારી ખૂબ નજીક આવી ગયો.’ (પૃ. ૨)

કાગડાનો આમ જોયા પછી સંવેદનશીલ વાર્તાનાયકનું આત્મનિરીક્ષણ ચાલે છે. કાગડો એ જ છે. કાગડાની સૃષ્ટિ એ જ વાર્તાનાયકની સૃષ્ટિ છે. ઉભયનું રૂપાંતર થાય છે અન્યોન્યમાં. કાગડો ઊડ્યો તેની સાથે વાર્તાનાયક ખેંચાયો ને ઊડવા લાગ્યો. છેવટે ‘માનવમાં હું કોકુલો જ હતો અને જાણે કે જ માનવમાણ વિચ્છેલ્યાઈ ગયે જોઈએ એકલતા અનુભવવા લાગ્યો.’ (પૃ. ૫) વાર્તાનાયક પુનઃ ટપકું જોયું. એને પુનઃ એ પીણું પડવાની ધાસ્તી થઈ અને છેવટે એણે અનુભવેલી સ્થિતિ વચ્ચે રેતીમાં અર્ધી દટાયેલો એક માનવદેહ જોયો અને ‘ચહેરો ઓળખાત્માં જ એક ક્ષણ હું ચોક્કોયો.’ (પૃ. ૬) આ ચોક્કવાની ઘટના જ વાર્તાનાયકની મનઃસ્થિતિને નિર્દેશ છે. આત્મપીડનની આ વાર્તા ઘનશ્યામ દેસાઈને આધુનિક વાર્તાકારની પંગતમાં સ્થાન અપાવે છે. માનવમનાં સંચનલનોની અદ્ભુત સર્જનાત્મક અભિવ્યક્તિ એમની સર્જકપત્રિભાને નિર્દેશ છે.

‘ટોણું’ વાર્તામાં ટોણું માનવપરિસ્થિતિનું પ્રતીક છે. અહીં પણ ‘ટપકું’ છે. વાર્તાનાયક – હું એ ટપકું ભૂસવા મથે છે પણ ભૂસી શકતો નથી. અને ‘એટલે જ હું ઘસડાઉં છું, અહીંથી તહીં ફૂંગોળાઉં છું, ઘડેલાઉં છું, નિસંહાર, નિરાધાર, ટોળા સાથે, ચિચિયારીઓની વચ્ચે ભાગભાગી કરતા માણસો સાથે, પણ મનમાં એક વિચાર હુંમેશાં ઘૂમરાયા કરે છે કે આ ટપકું ભૂસી નાખું જોઈએ... જો ભૂસી નાખું તો....’ (પૃ. ૧૪૫)

‘ગોકળજીનો વેલો’ વાર્તાનો કથક પણ ‘હું’ છે અને એની વથા વાર્તાને જે વાક્યથી અભિવ્યક્ત થઈ છે એમાં ‘હું’ને ભૂલવાની જ કથા છે. આ વાર્તામાં વાર્તાનો કથક જ વંશાવલિ આપે છે. અને એ અતીતને સ્મરતો કહી રહે છે : ‘હજ્જે જ્યારે આણોઆણો વરસાદ વરસતો હોય છે, અને એકલો બેઠોબેઠો હું હ્યાતિ વિષે વિચાર કરતો હોઉં છું ત્યારે ઘણીયે વાર મારા વડાદાના ખભા ઉપર હાથ મૂકી મિત્રભાગે કાકલું કરતો હોઉં એમ મારાથી મનોમન બોલી જવાય છે : ‘ભલા’દ્મી ઉડાવી લે ને પથરો !’ (પૃ. ૧૧)

‘એણ’ જુગુપ્સાપ્રેરક વાર્તા છે. ‘ચીસ’માં અતીતવર્તમાન વચ્ચે આવતા-જતા હસમુખરાયનો આત્મસંવાદ છે. શંકા માનવમનને કેવી આંતરયાત્રા કરાવી વથાગ્રસ્ત કરે છે એ ‘ફરી એક વાર’ની કથા છે. અહીં પણ વાર્તાનાયક ‘હું’ જ છે અને એની શકાશી ઉદ્ભવેલી વથાનું જાણે એ સંભાષજા કરે છે. ‘વાલ બોપણી’માં વાર્તાકથક-હુંની બાન્તિ પાસે વાર્તાનો કાવ્યાત્મક-કળાત્મક અંત છે. મનુષ્ણની આંતરવૃત્તિની ધારણા-કલ્યાના ન થાય તે ‘નેપોલિયન ન પુંસક હતો?’ એ વાર્તામાં અભિવ્યક્ત થયું છે. કેવળ સર્વનામથી આ વાર્તા કહેવાઈ છે. ‘કાર્યોડો’ વાર્તામાં કાર્યોડાના પ્રતીકથી ઘનશ્યામ દેસાઈએ મૃત્યુ અને મૃત્યુમાંથી જીવન શોધવાની વૃત્તિને છીતી કરી છે. ‘હુંફ’માં સરિતાનાં મનોસંચલનોને વાર્તાકારે એમાં જ આત્મસંવાદથી વ્યક્ત કર્યા છે. ‘ગણગણાટ’ના નાયકને સતત એક ગીણો ગણગણાટ સંભળાયા કરે છે જે એના હદ્યને સારીની જેમ કોરે છે. વાર્તાનાયક કહે છે, ‘અને ભય લાગે છે – લોકોનો, વૃક્ષોનો, મકાનોનો.’ વળી કહે છે, ‘જુઓ ગણગણાટ ધીમે ધીમે વધી રહ્યો છે. વારે વારે આમ જ થયા કરે છે. દીવાલ તરફ મોં કરીને હું શાંતિથી સૂતો રહું છું. મારી જત સાથે વાત કર્યા કરું છું. નીચે બહુ લોકો એકઠા થયા લાગે છે. હિસ્ક પ્રાણીઓની જેમ એમની આંશી ધુરધુરાતી સંભળાય છે. જમીન પર પંજા પદ્ધતવાના, પૂછી પટકવાના અવાજો આવે છે. હું કાન સરવા કરું છું. પણ એકેય શબ્દ સમજતો નથી. ગણગણાટની ભાષાનો અર્થ ઉકેલવો મુશ્કેલ છે.’ (પૃ. ૮૭) આ ગણગણાટ વાર્તાનાયકનો પીછો છોડતો નથી. છીવટે લોકો ધસી આવ્યાની બાન્તિ થતાં ટેબલ નીચે ભરાઈ હું બે હથ આંખો પર ઢાંકી દઉં છું... અને...’ (પૃ. ૮૮) અને ત્યારે વાર્તાનાયક ‘શરીર વગરનો બની ગયો.’ (પૃ. ૮૯) આ ‘શરીર વગરનો’ બની જવાની ઘટના મનુષ્ણની બાન્તિ છે તો ભીતિ પણ છે જ.

‘....આ શરીર પર ચાસ પાડીને મૃત્યુએ ખેડ કરી રાખી છે; બી વાવી રાખ્યું છે, પાણી પિવડાવી રાખ્યું છે, ઓચિંતા એક દિવસ ફણગો ફૂટશે – લીલો, સુંવળો, ફૂઝો, વાણી જેવો પોચો.’ (પૃ. ૮૬) વળી આ મકાન હવે ખજડધજ થયું, ડેરટેર એમાં તિરાડો પડી છે, જ્યાં ત્યાં એની દીવાવો નમી ગઈ છે, સિમેન્ટના પોપડા ઊઝડી ગયા છે, અને છિતાંય એ પડી જતું નથી એ નવાઈ કહેવાય.’ (પૃ. ૮૭) ‘લીલો ફણગો’ વાર્તામાં વશાયેવી આ ઘટના મનુષ્ણની જિઞ્ચુવિષાનું જાણો આધુનિક કાવ્ય છે.

ઘનશ્યામ દેસાઈએ આ વાર્તાઓ દ્વારા આધુનિક યુગનો મનુષ્ય જે આત્મસંવાદની પરિસ્થિતિમાંથી પસાર થતો, આભનીરિક્ષાણ કે આત્મપુરના માર્ગ ગતિ કરે છે તેનું નિરૂપણ કર્યું છે. અલબત્ત, એમનું ગવા માત્ર સપાટી પરની પ્રસન્નતા કે પ્રાસાદિકતાનું ધોતક નથી. એનું ભીતરી સત્ત્વ ભાવકનું મન ભરી દે છે. ગુજરાતી ગવધની સર્જનાત્મક ક્ષમતા એમજો પ્રયોજીલી વિધવિધ ગવધતરેહ દ્વારા અભિવ્યક્ત થઈ છે. એમજો પ્રયોજીલા અલંકારો એમની ગવધતરેહના સંદર્ભે જોઈશું તો ઘનશ્યામ દેસાઈના ગવધની અનન્યતા સમજશો. ‘એની હાજરીમાં હું લાકડાના ગચ્છા જેવો બની જતો.’ કે ‘બેસી ગચ્છેલી ઘોડીને ચાબૂક મારે અને સટાક કરીને આંખું શરીર ખંખેરીને તે બેદી થાય તેમ લીના ટંકાર થઈ ગઈ.’ કે ‘એની માંજરી આંખો ભાવવિહોળી હતી, જાણો કે સુગંધ વિનાના ફૂલ જેવી’ જેવા અલંકારો ઘનશ્યામ દેસાઈના ગવધ-વિત્તને દર્શાવવા પૂરતા છે.

## સમર્થ સમકાલીન કવિ-વિવેચક : નીતિન મહેતા | મણિલાલ ડ. પટેલ

પહેલી જૂન (૧-૬-૨૦૧૦)ની બપોર થવામાં હતી ને ઘરનો ફોન, ફોન પડે એ રીતે, રણકી ઊકચો. હા, જયદેવ શુક્લનો ગળગળો અવાજ બલકે હૂસકાંથી વીટળાયેલો અવાજ હતો : ‘નીતિન મહેતા હવે... આપણી વચ્ચે નથી... રહ્યા...’ હું સાવ અવાજ... માની ન શકાય એવા આધાતક સમાચાર હતા. હજ એપ્રિલની તીજી તારીખે તો અમે મુંબઈમાં એમને ઘરે નિરાંતે મળ્યા હતા ને ઘણા વખત પછી ખૂબ વાતો કરી અને હસેલા. સાંજે એ મારું વ્યાખ્યાન સંભળવા આવેલા ને રાતે છૂટા પડેલા. હવે મુંબઈ જઈશું ત્યારે કોને મળીશું? વિદ્યાર્થીઓના પ્રિય ‘નીતિન સર!’ નહીં મળે... આપણા, અછાંદસના નોખા કવિનો અવાજ હવે એમની કવિતામાં જ સંભળાશે... એક સહજ, સરળ, પ્રેમાણ અને ઘણું ઘણું કહેવા માગતો મિતભાષી મિત્ર હવે ન્યૂ શિલ્પા ટેરેસના ઘરમાં નહિ મળે... સૂનકાર સહેવાશે નહિ!

કવિ-વિવેચક-સંપાદક નીતિન મહેતા (૧૯૪૪-૨૦૧૦); પ્રોફેસર નીતિન મહેતા મૂળે સૌરાષ્ટ્ર-ગુજરાતના વતની. પણ એમનાં ઉછેર-ભાણતર-ઘડતર મુંબઈમાં થયાં... અધ્યાપક થયા. વચ્ચે ચારપાંચ વર્ષ વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં જોડાયા પણ ફૂટુંબની સવલત માટે પાણી મુંબઈ વિદ્યાપીઠમાં જોડાયા. અધ્યક્ષ તરીકે વિદ્યારીય અને સાહિત્યિક પ્રવૃત્તિઓને ખૂબ વેગવંત બનાવી. ઉંચાં ધોરણો સાચવીને ગુણવત્તાસભર કાર્યો કરતા રહ્યા. એમનાં નિષ્ઠા-નિસબ્દત અને સ્નેહસૌધાર્દ એવાં કે મિત્રો-વિદ્વાનો અગવડ વેઠીને, જાતે ઘણાઈને પરિસંવાદીમાં જાય... વિશેષ દસ્તિકોણથી અભ્યાસપૂર્ણ ચર્ચાઓ-વક્તવ્યો થાય... ને પછી મિલનમેળના આનંદો છલકાય... નીતિન સર માટે વિદ્યાર્થીઓ ખેડ પગે હાજર ને મિત્રો પણ... નહિ ભુલાય એ દિવસો !!

બેદી દીનું શરીર. કાબરચીતરી ભરચું હોય... ચહેરો ‘હિલોસોફર’ જેવો લાગે. શાંત ચિત્ત વિચારતા પમાય. ડાબે હાથે દાઢીના વાળને કે મોઢા પરના મસાને રમાડતા-ખાણતા-પંપાળતા જાય અને વાત કરે... જરાક ઊંચી પીચ પરથી નીચે ઊતરે ને કશોક નર્મભર્મ કરીને હસી પડે - તરત તાળી માટે હથ લંબાવે ત્યારે ચહેરો જ નહિ એ આજેઆજા અતિપ્રસન્તતાથી ખીલી ઊઠેલા હોય. એક પગે જરાક તકલીફ તે ધીમેથી ઊપાડે ને હળવેથી મૂકે... કાયમ પેન્ટશર્ટ ઠન તથા બૂટ-મોઝામાં હોય. સાંજે અથવા વ્યાખ્યાન પતી ગયા પછી શર્ટથી કાઢી દેતા. સહેદ ને સ્કાય બ્લ્યુ શર્ટ ગમે ને ક્યારેક ચેક્સ પહેરતા. કવિતાની, વિવેચનાની, મિત્રોના પ્રેમની સુ. જો. તથા ઉ. જો. અને મિલાન ફુન્દેરાની વાતો કરતાં થાકતા નહીંતા. નાસ્તો કે જમતી વખતે મંદાબહેને બંધાવેલા નાની સાઈઝના ખાખરા કાઢે. બધાંને આપે પછી જમવામાં ખોવાઈ જાય.

નીતિન મુખ્યત્વે કવિ-વિવેચક. સંપાદનો. પણ કર્યા. આધુનિકતાની આભોહવામાં ઘડાયેલા. આરંભે વિદ્રોહી. કવિતામાં એ વિદ્રોહી અવાજ પ્રારંભે વધુ હતો. એમની કવિતા વધુ તો આધુનિકતા તરફ ઢોલી ને પછી અનુઆધુનિકતા તરફ વળેલી. ઓહી પણ સંજીવિદાર અછાંદસ રચનાઓ કરતા હતા. મહાનગરની સમર્સ્યાઓ અને તનાવભર્યા સંવેદનો વચ્ચે જીવતો સામાન્ય માણસ એમની કવિતામાં આવ્યો છે તો કવિ-તત્ત્વવેત્તા જેવા

સંવેદનશીલ તથા બૌદ્ધિકોની માનસિકતા વિશે પણ એમની કવિતા મુંગ્ઠી નથી રહી. નીતિનની કવિતા હુંબોધ નથી પણ નર્મમર્મથી ભરેલી અને આધુનિક માનવીની કરુણ નિયતિને વંગ્ય કે વંજનામાં આલેખની વિશીષ કવિતા છે. ‘નિર્વિષ’ (૧૯૮૮)ની કૃતિઓ આવાં અનેક ઉદાહરણો રૂપે ટાંકી શકાશે. બીજો કાવ્યસંગ્રહ હજુ થવામાં હતો.

નીતિનનો ટ્રેન કાવ્યો તથા દરિયો અને તુચ્છ વિષયની રચનાઓ પણ ખાસસાં જાણીતાં છે. નીતિના દાખાંતો લઈશું : ટ્રેન વિશે – ૧ :

અહીં પરાંની ટ્રેનનું વાતાવરણ અને જીવનનું સત્ય જીવાયાં છે. ‘ટ્રેન વિશે એટલું તો / ચાચું છે કે તે આપણા વિશે / કદી વિચારતી નથી / કોઈ આવે કે જાય / બારણા પાસે જિલ્લે / કે બારી પાસે બેસે / ખાંસી ખાય કે સીંગ ખાય / કે ગોકાં ખાય / કે અડધી આંખ મીચી લાઈન મારે / ગાળો બોલે કે બિસસું કાપે / પણ ટ્રેનને શું ? / જ્યાં સ્મૃતિ નથી ત્યાં સુખદુઃખ નથી / તે સત્યનું બીજું નામ ટ્રેન છે.’ (નિર્વિષ : પૃ. ૨)

‘માણસો’ (પૃ. ૧૦) વિશેના કાવ્યમાં કવિ મારી-તમારી જ વાત માંડતા સંભળાય છે :

“મને તો સાચ્યે જ એ માણસો માટે માન છે / જે અંધારામાં અથડાઈ પડે છે / કે ટ્રેનમાં ઊંઘી જાય છે ને / ભણતે સ્ટેશને પહોંચી જાય છે.”

“મને માણસ માટે હજુ માન છે / ફર્નિચરની વાત કરતાં તેનું મોહું પડી જાય છે / એક સાંજે તે કોઈની રાહ જુઓ છે. / આત્મહત્યાના વિચારો કરે છે / ચાવીઓ ખોઈ નાખે છે / ભૂતકાળને ખોલ્યા કરે છે / દલ આચરી શકે છે... / તે હજુ જાંદી શકે છે / મૂંઝાય છે, રઘવાયો થાય છે / ફીફાં જેવી વાતનો પહાડ કરે છે... / મને ખરેખર માણસ માટે / માન છે ને તે મને ગમે છે.”

‘મૃત્યુ’-૨ (પૃ. ૧૩) વિશેની રચનામાં કહે છે :

“આજે મને શાસમાં / સંભળાય છે લીલી લીલી મહેક. / સવારે ડોક્ટર પાસે ગયો / ત્યારથી શરીર પર ધીમે ધીમે / ઘાસ ઊળી રહ્યું છે / ....દૂર ક્ષિતિજ સુધી હથ લંબાવી / ચન્દ્રની ડાળીનો સ્વર્ણ કર્યો / ટેરવાં પર બાળેલી ધૂળમાં / પરી અને પાંખાળો ઘોડો ફૂટી નીકળ્યાં / ને મેં પત્નીયાંની જેમ કૃંગય કૃંગય ઉંગ્યા કર્યું...”

S

ગંધીયુગમાં તુચ્છ વિષયો પર કવિતા થતી અને જીવનના માંગલ્યની કલ્યાણ કરવામાં આવતી, એ ભાવનાવાદ હતો. જાજુની માખી, ઉકરડો, ચુસાયેલો ગોટલો વગેરે વિશે નીતિન પણ વિડબનાપૂર્વક કવિતા રચે છે ને વંગ કરે છે. ‘ચુસાયેલો ગોટલો’ (પૃ. ૩૨) કાવ્ય નોંધવાથી બધું વિશેદ થઈ જશે.

“રસ્તામાં જતો હતો / ત્યાં મને એક ગોટલો દેખાયો / અનુકૂળથી માંડું હદ્ય દવી ઊંઘું / જે જે ગોટલાભાઈ, / કેમ છો તમે ? / તો સાલો મને કહે :

ઊંચા વિચાર વિચાર / તમારામાં છે કે ! / મારા ત્યાગની ગાથા ગાતા નથી તે / તમે કાંચાંના કવિ હાલી મળ્યા ! / ઊંચા વિચાર, પરીક, અલંકારનીભાષામાં / અમને અમર કરો / મેં ચશમાંની ઢાંચી સીધી કરતાં / કદું : ગાંડું શ્રીસ થયાં / ગોલીના તને શું અમારો સુખદુઃખની / ખબર પડે - / કદી તેને જોરથી લાત મારી / આગળ ચાલતો થયો / વિચારતો હતો આ ગોટલાને / આંગણામાં વાબ્યો હોત તો / આવતી કાલ મારી ને કવિતાની / ઉજળી થાત - / ઘરે આવીને જોઉ છું તો / અંગૂધામાં લોડી જામી ગયું છે / ને પાનીમાં આંબાની ડાળી / ફૂલી નીકળી છે.”

અભિવ્યક્તિની તિર્યક્તા છતાં વિશેદટા ને પ્રત્યાનક્ષમતા નીતિનની કવિતાને, આધુનિક કવિતાની કૃતકતાથી જુદી પાડે છે. હરીશ મીનાશ્રુ, ભરત નાયક, કમલ વોરા, જીવદેવ શુક્લ, વંશેશ દવે જેવા એમના સમર્થ સમકાળીનો (અનુઆધુનિકો)માં પણ સંવેદન અને ભાષારચનાની ભાતે નીતિન ખાસસા જુદા પડે છે. હરીશ મીનાશ્રુ કહે છે તેમ એ કવિતાના જાણતાલ કવિ રહ્યા છે.

મુંબઈ યુનિવર્સિટીએં વ્યાખ્યાનો માટે જવાનું થતું ત્યારે અને પૂના તથા દિલ્હીમાં યુચ્છાનીના કાર્યો માટે જતા ને અને ચાર દિવસ સણું જોડે રહેવાનું થતું ત્યારે દેશ-દુનિયાની કવિતા વિશે વધુ વાતો થતી. નીતિન બીજાનો જુદો મત નિખાલસપણે સ્વીકારતા એટલે તથા કશો અહ્યું કે ભાર જ ન રાખતા એટલે ચર્ચાઓ જામતી અને અનેક ક્ષીત્રોમાં ફરી વળતા. સંપત્તસાહિત્ય શિક્ષણનું ચિત્ર જોઈને એ પણ ઘણા નિરાશ થતા પણ થોડાક મિત્રો સરસ કામ કરે છે એની વાતે રાજ્યાં વ્યક્ત કરતા. એમનાં વિદ્યાર્થી-અધ્યાપકોને સતત પ્રેરતા ને સંકોરતા રહેતા... નીતિન સર એ રીતે પણ નહિ જ ભૂલી શકાય.

એમણે થોકબંધ નથી લખ્યું. પણ જે લખ્યું તે સારું થયું છે. એમનાં પુસ્તકો આટલાં છે :

- S નિર્વિષ (કવિતા : ૧૯૮૮) CAS એવોર્ડ
- S કાવ્યબાની (સંશોધન : ૨૦૦૧) ગુ.સા. અકાદમી પ્રથમ પારિતોષિક
- S અપૂર્વ (લેખો : ૨૦૦૪) ગુ.સા. અકાદમી પ્રથમ પારિતોષિક
- S નિરેતર (વિવેચન : ૨૦૦૭) ગુજ. સા. અકાદમી પ્રથમ પારિતોષિક
- S સુ.જો. કેટલીક નવલિકાઓ (સંપાદન : NBT : ૨૦૦૨)
- S પદિતયુગનું પુનઃમૂલ્યાંકન (પરિસંવાદગ્રંથ : ૧૯૮૮)
- S ગુજરાતી કવિતાચયન (સંપાદન : ૨૦૦૩ : ગુ. સા. ૫.)

‘થાહોમ’ અને ‘પ્રત્યક્ષ’ના આરંભના અંકોનું સંપાદન કરેલું તથા હાલ ‘એતદ્દનું સંપાદનકાર્ય સંભાળતા હતા.

સુરેશ જોખીના માર્ગદર્શનમાં ‘૧૯૮૬ પછીની ગુજરાતી કવિતાની પદાવલિ’ વિશે શોધનિબંધ – જે ‘કાવ્યબાની’ નામે પ્રકાશિત છે – લખીને પીએચ.ડી.ની પદ્ધતિ મેળવી હતી. આમ સુરેશ જોખીની નિકટ તો આચ્યા પણ અભ્યાસનિષ્ઠા કેળવાઈ અને નિજ મુદ્રા માટે સંઘર્ષ કરવાનું સહજ બન્યું. એમનાં વિવેચનોમાં એ ગુણ તરત દેખાય છે.

કવિતા વિશે નીતિન મહેતા એક કવિ તરીકે નોખી રીતે વાત કરે છે. જુઓ :

“કવિતાની પ્રક્રિયા સંકુલ છે. તેનાં સંદર્ભો અને અર્થઘટનો સમયે સમયે નવા વાસ્તવ રૂપે આપણને મળે છે. દરેક કાચ્ય અપૂર્ણ છે એટલે તો બીજી રચના તરફ વળીએ છીએ. દરેક કવિતામાં કવિનું મૃત્યુ થાય છે અને ભાવનમાં દરેક કવિતા ફરીથી પ્રગટે છે. કવિતા કવિનો અસ્તિત્વલેખ છે. વાસ્તવ અને અસ્તિત્વ વારંવાર રચાય છે, છેંકાચ-ભૂસાય છે. આજ વાસ્તવ સાથેની અસ્તિત્વની ભાષાકીય મથામણ. એક જ શબ્દને, પદાર્થને, વસ્તુને કેટકેટલી રીતે, કેવા કેવા સંદર્ભોમાં, કેવા ભાષાકીય વાસ્તવ વડે પ્રયોજી શકાય - આ કવિની મથામણ છે.” (નિર્વાચિત : નિવેદન)

શિરીષ પંચાલ જેવા વિદ્વાન અને કથાસાહિત્યના મોટા-ઉંડા અભ્યાસી તરીકે જાણીતા વિવેચક ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ (સંશોધનાત્મક ગ્રંથમાં) વિશે વાત કરતાં સંવેદન અને ભાષારચનાની સહજસંપૃક્તિ વિશેના પ્રશ્નોની ચર્ચા કરે છે ત્યારે જાણે એ જ વાતની બીજી બાજુ કે બીજો છેઠે લઈને નીતિન મહેતા, પોતાની નિજ ભાષા-ભાત લઈને આવતા સંવેદનનો અને સબળ અભિવ્યક્તિનો મહિમા કરે છે. ગુજરાતીના દરેક સમકાળીનોની કવિતા લઈને એમણે કાવ્યભાષાની ઊરી સમીક્ષા કરી છે. એમની વિવેચક દસ્તિનો અહીં વિ-શિષ્ટ પરિચય સાંપડે છે. તો વળી સુ. જો.ની વાર્તા વિશે વાત કરતાં, શિરીષ પંચાલ તથા અન્યોથી નોખા પડીને, સુ. જો.ના વાર્તાવિશેષોને પોતાની રીતે ઉપસાવી આપવામાં સફળ રહ્યા છે.

નીતિન મહેતા કૃતિનિષ્ઠ વિવેચનની મર્યાદાઓ જાણ્યા છતાં એ અભિગમમાં શ્રદ્ધા ધરાવે છે ને એ પ્રકારે સમીક્ષાઓ પણ કરતા રહે છે. ‘નિરંતર’માં એનાં દાંસંતો મળે છે. પાશ્ચાત્ય સાહિત્યના એ સારા ભાવક અને આસ્ત્વાદક રહ્યા છે. એમનો રસ ભાવકક્ને અભિગમમાં પણ વિશેષ રહ્યો છે. કૃતિ સાંસ્કૃતિક સંદર્ભોથી સમૃદ્ધ બને છે એ વાત એ પદીથી વધુ વિચારતા અને સ્વીકારતા થયા હતા. ‘નિરંતર’ (પૃ. ૧૦૭)માં એમનો એક લેખ : “સાંસ્કૃતિક વિભેદનું રચકારણ અને ૧૯૮૦ પછીની કેટલીક ગુજરાતી વાર્તાઓ” ખાસો જુદો અને ધ્યાનપાત્ર છે. સર્જકની ભાવસંપત્તિને વિવેચકે ઓળખવાની જરૂર હોય છે. ‘અપૂર્ણ’માં એમણે નવ જેટલા કાવ્યસંચયોનો સમીક્ષાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. સમકાળીનો માટેની એમની આવી નિસબ્ધત ઉમાશંકર જોશીની યાદ આપાવે છે. કાવ્યભાષા એમના રસનો વિષય હોવાથી એ નરસિહની અને રચણની કાવ્યભાષા વિશે પણ વાત માંડે છે. “વિવેચક સુન્દરમું : પુનઃમૂલ્યાંકન” લેખ પણ એમની સૂક્ષ્મદર્શિ અને સમૃદ્ધ રસવૃત્તિનો પરિચય કરાવે છે. વિવેચક તરીકે એ છેલ્લા દાયકમાં ખાસ્સું નિખર્યા હતા અને વિસ્તર્ય હતા.

અંખોની તકલીફને લીધે છેલ્લાં બેત્રાણ વર્ષોમાં એમનું કાર્ય ધીમું પડેલું છતાં વર્ષમાં ત્રણચાર વાર ગુજરાતમાં પરિસંવાદો-વ્યાખ્યાનો માટે આવ્યા જ હોય. અમારે ત્યાં - વલલભવિદ્યાનગર ખાતે વિલિટ્રિંગ ફેલો તરીકે કેમ્પસ પર રહેલા અને ઘણી સંસ્થાઓમાં વાર્તાલાપો અને વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ ચર્ચાઓ કરતા રહેતા હોવાથી એક વાતાવરણ રચાયું હતું. મિત્રોને મળવાના પ્રલોભન આગળ શરીરની પીડાઓને નગણ્ય ગણતા નીતિન મહેતા વિશાળ મિત્રવર્તુને આટલા વહેલા અને અચાનક ઉદાસ છોડી જરી એવું કોઈએ ધાર્યું જ ન હોય ને ! કાળની આગળ આપણે નિઃસહાય છીએ....

## અહેવાલ

## સામાજિક સદ્ગ્રાહિતા આપણી સહિતારી

### જવાબદારી છે – સદ્ગ્રાહિતા પર્વ-૨ ઊજવાયું

દુકેશ ઓઝા

‘વિશગ્રામ’ની પહેલથી અને મોરારીબાપુના સહકારમાં ગુજરાતના કેટલાક વિચારશીલ અને સંવેદનશીલ નાગરિકોએ ‘સદ્ગ્રાહિતા ફોરમ’ રચીને ગુજરાતમાં સહચિત્તન શરૂ કર્યું છે. શાંતિ-અહેંસા અને સંવાદિતાનું વાતાવરણ કાયમી બનાવવા થોડું કામ કરવા માંગ્યું છે. આજા વર્ષ દરમિયાન સમાજમાં અને શાળા-કોલેજોમાં વિચાર-ગોરિછાઓ અને વાચનશિબિરોમાં નાગરિકો-શિક્ષકો-યુવામિત્રોને જોડીને કરેલા કામ બાદ, વરસે એક વાર, સદ્ગ્રાહિતા પર્વમાં બધા સાથે મળીને ચર્ચા-વિચારણા કરે છે. તા. ૧૬-૧૭-૧૮ મે દરમિયાન કેવાસ ગુરુકુળ, મહુવા ખાતે મોરારીબાપુના સાન્નિધ્યમાં બીજું સદ્ગ્રાહિતા પર્વ યોજાયું જેમાં ૨૦૦થી વધુ કાર્યકરો એકઢા મળ્યા.

આ વખતનો મુખ્ય વિષય હતો : ‘સામાજિક સદ્ગ્રાહિતા આપણી સહિતારી જવાબદારી.’ ડૉ. પુરુષોત્તમ અગ્રવાલે ડૉ. રમયંદ શુક્લને યાદ કરીને કષ્ટથી લોકોને સમજને ધર્મનો માર્ગ કાઢવો. નહીં તો સમાજ રહેશે, આપણે નહીં રહીએ. સંઘ લોકસેવા આયોગના સભ્ય અને હિન્દી સાહિત્યકાર ડૉ. અગ્રવાલ ‘સામાજિક સદ્ગ્રાહિતા અને શિક્ષણ’ વિષય પર બોલી રહ્યા હતા. કોલોનિયલ શિક્ષણપદ્ધતિની સામે ટાગોર અને ગાંધીએ ભારતીય શિક્ષણપદ્ધતિનાં ઉંઘાલ્લા મૂડ્યાં પણ આપણો સન્માજ હેઠળ હદ્દથી સ્વીકારી ન શક્યો. બીજાની પીડા સમજવાનું શિક્ષણ આપાય તો માનવમાત્ર તરીકેની મૂળભૂત સમાનતા આધ્યારિત સદ્ગ્રાહિતાના. કેળવી શકાય. માનવસમાજની બધી પરંપરાઓમાં હિંસા છે. આપણે બીજા પ્રત્યે નિસબ્ધતાવ પેદા કરવાનો છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. સુદર્શન આયંગારે જગ્યાવ્યું કે દેશના વિભાગની વિભાગિકા અને પીડા છતાં તેમના સિંહા શિક્ષકોએ ગાંધીધામમાં તેમને નફરત-ધ્યાણ કે હિંસાનું શિક્ષણ નહોંતું આય્યું. તેમણે તો સહઅસ્તિત્વ અને પરસ્પરાવંબનની જ શીખ દીવેલી. બીજી બેઠક કલા અને સાહિત્યની હતી. ડૉ. મણિવાલ હ. પેટેલે કષ્ટથી પ્રકૃતિ સાથેનો વિચછેદ માણસને લાગડીશૂન્ય બનાવે છે. શિક્ષક જ ઊંઘો ઉતરે છે અને તેથી જ ધારેલાં પરિણામ પ્રાપ્ત નથી થતાં. ફિલ્મજગતના ગુજરાતી કલાકાર ફારુખ શેખે પ્રશ્ન કર્યો કે આજાદીનાં આટલાં વર્ષો પછી ગુજરાતમાં સદ્ગ્રાહિતાની શોધ શા માટે આદરવી પડે છે ? ગાંધી નોઆખલી પછી કરાંચીમાં હિન્દુઓ પરના અત્યાચારની બાબતે તપાસ કરવા જવા ધારતા હતા અને પાકિસ્તાનસરકારની આઈ. બી.નો અહેવાલ હતો કે ગાંધી આવશે તો પ્રજા તેમની વાત માનશે, સરકારની નહીં ! ફિલ્મો સમાજને ભાયે જ માર્ગદર્શન પૂરું પાડી શકે. એ તો લોકોને મજા કરાવવાનું સાધનમાત્ર છે.

બીજા દિવસે સામાજિક સદ્ગ્રાહિતાના અને વિકાસના મોડેલની ચર્ચા હતી. ડૉ. વાય. કે. અલઘે આજનાં ભૌતિક સુખોની પ્રાપ્તિ પછી નિજ સુખ અને સામાજિક સુખ વચ્ચે પસંદગી કરવાનો તકાજો હોવાનું જગ્યાવ્યું. સિંગાપુર મોડેલ તરફ નજર કરવાની જરૂર નથી કરવા તે તો કાચા સિદ્ધાંતો પર ઊભું છે. સામાજિક સંસ્થાઓના કામ તરફ બાબુશાહીએ

નજર કરીને તેને ટેકો પૂરો પાડવાની જરૂર હોવાનું પણ તેમણે કહ્યું. પૂર્વ નાણામંત્રી અને અભ્યારી વિચારક સનત મહેતાએ કહ્યું કે આપણે અમેરિકા તરફ નજર કરીએ છીએ તે યુરોપ-અમેરિકા પરી ભાંગ્યા અને હવે જગત ભારત-ચીન તરફ અને ગાંધીવિચાર તરફ નજર કરે છે ત્યારે આપણે આપણા તરફ જોવાની જરૂર છે, બીજા તરફ નહીં. ગાંધીના અર્થશાસ્ત્રના મૂળમાં સદ્ગ્રાવના છે જે વિસ્તારવાની આવશ્યકતા છે. જે લોકો ગરીબીને પારખી શકે તેમ નથી તેઓ તેનો ઉકેલ કેવી રીતે કરી શકવાના?

બપોરની બેઠક સમૂહમાધ્યમો અંગે હતી. પીઠ પત્રકાર રહીન્દ ત્રિપાઠી અને ભાસ્કરના ગ્રૂપ એડિટર અધ્યક્ષ ઉમટે જગતાંથું કે મીડિયા તો અવળા માર્ગ જ છે અને વિશ્વસનીયતાની કટોકટી ઊભી થઈ છે. ગુજરાતમાં ટીકાત્મક વિચાર અને વિરોધના સૂરની પરંપરા જ ઊભી થતી નથી. બજારુ કલ્યારના માહોલમાં મીડિયા પાસે સામાજિક સદ્ગ્રાવનાની આશા રાખવી વર્ષ છે એવો સૂર તેમાંથી પેદા થતો હતો. પૂર્વચલમાં આરોગ્ય સેવામાં પ્રવૃત્ત સત્ય શિવરામન પત્રકારિતા છોડીને સેવાકાર્યમાં લાગ્યા છે. તેમણે રીવી અને છાપાં જોવાનું બંધ કર્યું છે. યુદ્ધમાં માણસો મરે તેથી વધુ તો આરોગ્ય સેવાના અભાવે મરે છે ત્યારે નાગરિક સમાજે બંધારણીય મૂલ્યોના અમલ માટે દબાણ ઊભું પડશે અને સહાનુભૂતિ-સદ્ગ્રાવનાનું વાતાવરણ રચવું પડશે. ચાત્રિબેઠકોમાં ‘ગર્મ હવા’ (એમ. એસ. સચ્યુ) હિલ્બનું નિર્ધારણ અને ચર્ચા હતાં. તો બીજી રાત્રે કાલુરામ બામણિયાના જૂથે દેવાસથી આવીને કબીરનાં ભજનોથી શ્રોતાઓને રસતરબોળ કર્યા.

સમાપન-વક્તવ્યમાં મોરારીબાપુએ ગયા વર્ષની વાત દોહરાવતાં કહ્યું કે આપણા સત્યનો આગ્રહ રાખવા સાથે, સામેના સત્યને પણ સ્વીકારવું જોઈએ. વિવિધ પરંપરાઓનો આદર કરીને આગળ વધવું જોઈએ. રામનામથી ગાંધીનું ચાલ્યું એમ મારું પણ ચાલે છે. દુંદું તરફથી અદ્દેત તરફ જગતની ભારતીય પરંપરા વિશિષ્ટ છે. ગીતામાં કહ્યું છે તેમ સદ્ગ્રાવનાની સાથે સાધુભાવ એટલે શ્રેષ્ઠભાવ જોડતાં શીખવું જોઈએ.

‘સદ્ગ્રાવના ઝોરેમ’ દૈમાસિકના ચોથા અંકનું વિતરણ કરવામાં આવ્યું. પ્રત્યેક બેઠકમાં અડલોઅડલ સમય પ્રશ્નોત્તર માટે ફણળાયો હોવાથી ભાગીદારી અને નિસબ્ધત પ્રગટ્યાં અને વિચારમંથનને આગળ લઈ જગતમાં ઉપકારક સાભિત થાયાં. પ્રત્યેક વ્યક્તિ જ્યાં છે ત્યાંથી સદ્ગ્રાવનાનું નાનું મોટું કામ ચાલુ રાખે અને મીડિયામાં પ્રસિદ્ધિની વિંતા ન કરે તેવું પણ કહેવાયું. તેજસ્વી ઘટના કઢી નાની નથી હોતી ભલે તે અંતરિયાળ વિસ્તારમાં બે વ્યક્તિ વચ્ચે કેમ ન ઘટી હોય.

અનેરાના ગોવિંદ-સુમિત્ર રાવળ દંપતી, મુંબઈ સદ્ગ્રાવના સંઘના કિશન ગોરડિયા અને આખી પ્રવૃત્તિના પ્રેરણસોત અને માર્ગદર્શક બની રહેલા સનત મહેતા બધા દ્વિવ્યો દરમિયાન સક્રિય રહ્યા. નિરમા આંદોલનના લડવૈયા પ્રજાપત્રનિધિ ડૉ. કનુભાઈ કળસારિયાની પણ હાજરી રહી. નસવાડી નજીકના નાનકડા ગામના કલાકાર ફિલુખ શોખ સાથેની ચર્ચાવિચારણ શ્રોતાઓને મન ઘણી સંતર્પક બની રહી. ‘ગર્મ હવા’ તેમની પહેલી હિલ્બ હતી. તેમની નાગરિક નિસબ્ધત પ્રેરણારૂપ બની. આગામી હિલ્બોમાં સાબરમતીથી દંડી સુધીના બાકીના વિસ્તારમાં સદ્ગ્રાવના યાત્રા યોજાશે અને અન્ય કાર્યક્રમો અને કામો પણ થતાં રહેશે. ગુજરાતની આ નાગરિક પહેલ સ્વયંભૂ અને ચોકાંબંધ વિચારસરણીથી અલગ હોવાને કારણે સામાન્ય પ્રજાનો સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે તે આનંદની બીના છે.

## સમીક્ષા/ગ્રંથાવલોકન

### રાષ્ટ્રભાવનાનું ઘડતર અને રચનાત્મક કાર્ય | ડૉ. અરુણ કક્કડ

**રાષ્ટ્ર, રચનાત્મક કાર્ય અને રાષ્ટ્રપિતા :** નારાયણ દેસાઈ, પ્ર. આ. ફેબ્રુઆરી-૨૦૦૮, પ્રકાશક : રૂપાયતન - જૂનાગઢ, પુ. સં. ૩૦, સદ્ગ્રાવ મૂલ્ય રૂ. ૨૦]

સ્વાતંત્ર્યસેનાની, આરજી હક્કુતનાં સરસેનાપતિ અને રચનાત્મક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારાં રતુભાઈ અદાણીની સ્મૃતિમાં રૂપાયતન સંસ્થા દ્વારા ‘શ્રી રતુભાઈ અદાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા’ શરૂ કરી. તેનું પ્રથમ વ્યાખ્યાન તા. ૧૩-૧૧-૦૫ના રોજ શ્રી નારાયણભાઈ દેસાઈએ ‘રાષ્ટ્ર, રચનાત્મક કાર્ય અને રાષ્ટ્રપિતા’ એ વિષય પર આખ્યું હતું. એ આપણને પુસ્તિકા રૂપે મળ્યું છે. પુસ્તિકાના આરંભે પ્રકાશકનું નિવેદન છે. ત્યારબાદ મુખ્ય વ્યાખ્યાન પ્રગત કર્યું છે. વ્યાખ્યાન પછી શ્રી મનસુમભાઈ સાવલિયાનો સાધુચરિત રતુભાઈ અદાણી વિશેનો ‘ઉંબરે થઈ અંબરે અંબતું વિશેટ વ્યક્તિત્વ’ લેખ આખ્યો છે. ત્યારબાદ રતુભાઈના લગ્નપ્રસંગે તેમના ધર્મપત્ની કુસુમબહેનને, તેમના પિતાતુલ્ય પૂ. નારાયણદાસ ગાંધીએ આપેલા આશીર્વદન પ્રગત કરવામાં આવ્યાં છે. ત્યાર પછીનો લેખ શ્રી જીનીલ ડ. લડેરીનો છે. જેમાં રતુભાઈના વ્યક્તિત્વને ‘સૌરાષ્ટ્રનું ખમીરવંતું વ્યક્તિત્વ’ જામાં આવ્યું છે. અંતે શ્રી હેમંત નાણાવટીએ મુખ્ય વક્તા શ્રી નારાયણભાઈ જીનાછના પારચ્ય, સંકલિત કરીને, મૂકી આખ્યો છે.



શ્રી નારાયણભાઈ વ્યાખ્યાનના આરંભે કહે છે કે : રતુભાઈ એટલે રચનાત્મક કાર્ય, સાંદું સંયમપૂર્વકનું જીવન અને ઉત્તમ વહીવટકશણતા – આ ત્રણ ગુણોનો નિવેણીસંગમ. આ કારણે વ્યાખ્યાનમાળાના આ પ્રથમ મણકામાં, રચનાત્મક કાર્ય અંગે ગાંધીજીના વલણને જે રીતે હું સમજ્યો છું તે રીતે રજુ કરવું, એ રતુભાઈને પણ મારા તરફથી અંજલિ થશે. ત્યાર બાદ ‘રાષ્ટ્ર’ શબ્દને સમજાવતાં તેઓ કહે છે કે, રાષ્ટ્ર શબ્દ મારી દણિએ ભાવના સાથે જોડાયેલો છે. ગાંધીજીએ સાબરમતી આશ્રમ સ્થાપ્યો અને તેનું બંધારણ લખ્યું. આ બંધારણના પહેલા વાક્યમાં જ ગાંધીની રાષ્ટ્ર વિશેની ભાવના શું હતી એ આવી જાય છે. ગાંધીજીને સૌપ્રથમ નેતાજી સુભાષચન્દ્ર બોજે રાષ્ટ્રપિતા કહ્યાં હતા. ગાંધીજી રાષ્ટ્રના ઘડવૈયા હતા. એક એક ઈંટ ગોઠવી ગોઠવીને રાષ્ટ્રનું મંદિર ગાંધીએ બનાવ્યું. તેને કારણે એમને રાષ્ટ્રપિતા કહ્યા. રાષ્ટ્રભાવનાને ઘડવાનું સાધન એટલે રચનાત્મક કાર્ય. માતૃભાષા પોતાના પ્રદેશમાં અને પ્રદેશ બહાર હોય તો રાષ્ટ્રભાષા. આ ભાષા રાષ્ટ્રની ઈમારત ઘડવાની બે ઈંટો હતી. ગાંધીજીએ કહ્યું રાષ્ટ્ર અના ગામડામાં છે અને એમાં જો રાષ્ટ્રીયતાની ભાવના, એકાત્મકતાની ભાવના પેદા થાય તો જ રાષ્ટ્ર બને. રાષ્ટ્રભાષાનો પ્રચાર એ એક રચનાત્મક કાર્ય તરીકે ગાંધીજીએ લીધું.

કાન્તિનાં બે પાસાં હોય છે. જૂની વ્યવસ્થાને જમીનદોસ્ત કરી અને નવી વ્યવસ્થાને

અંકૃતિત કરવી. પરંતુ દુનિયાનાં મોટા ભાગના કાન્ટિકારીઓને કઈ વ્યવસ્થાને જમીનદોસ્ત કરવી છે એ જેટલું મગજમાં સ્પષ્ટ છે એટલું કેવી વ્યવસ્થા ઉભી કરવી છે એ સ્પષ્ટ નથી. એ લોકો શું પારી નાંખવું એ બરાબર જાણે છે પણ શું ઉભું કરવું તેની ખબર નથી. મોટે ભાગે તો જેને પાડી નાંખ્યું હોય એની જ નકલ કરતા હોય છે. પણ ગાંધીજી જાણતા હતા કે મારે અન્યાયી વ્યવસ્થાને ખતમ તો કરવી જ છે પણ એ ખતમ કરતાં કરતાં નવી અહિસા વ્યવસ્થા પણ ઉભી થવી જોઈએ. માટે આવી વ્યવસ્થા માટે શબ્દ વાપર્યો રચનાત્મક કાર્ય. અસહકારનું આંદોલન કરવા માટે તે વિસ્તારના લોકો માટે ત્રણ શરતો રખાતી. ગામેગામ રૈટિયો ચાલવો જોઈએ, ગામની હરિજનબાળા ગામના જાહેર ફૂવામાંથી પાડી જેંચી ગામ આજાને પિવડાવે અને ગામની શાળા રાષ્ટ્રીય શાળા બને. આ ત્રણોત્ત્રણ રચનાત્મક કાર્યક્રમો થાય તેને અસહકારની પરવાનગી અપાતી. બારડોલી તાલુકાવાળાઓ આ ત્રણ કરી બતાવ્યું એટલા માટે બારડોલીની પસંદગી થયેલી. આ ત્રણ સાંકેતિક કાર્યક્રમોનો અર્થ એ કે બ્રિટિશ સામ્રાજ્યનું રાજ્ય અહિંથી સમાપ્ત થાય અને બીજી બાજુ સમાજનાં લોકો બેઠાં થાય.

ત્યાગને લીધી ઉત્પન્ન થયેલું નેતૃત્વ રાખ્યાડતરને માટે અત્યંત આવશ્યક હતું. એ નેતૃત્વ પેદા કરવાની તાકાત આ રચનાત્મક કાર્યો આપી. ત્યાગમાંથી ઉત્પન્ન થયેલા રોલ મોડેલ પેદા કરવાનું કામ પણ રચનાત્મક કામ હતું. જ્યાં જ્યાં રચનાત્મક કામ થયું ત્યાં ત્યાં આંદોલનને ટકાવી રાખવાની શક્તિ કાયમ રહી. કાં જેલ જાઓ અને જેલ ન જવાય તો ગામડામાંજાવ. જેલમાં જવાથી સત્યાગ્રહને તાકાત મળે છે. ગામડે જવાથી સત્યાગ્રહીને આરામ મળે છે. રચનાત્મક કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ લોકોની અહિંસક શક્તિને જગાડવાનો હતો. જે હજુ પણ પૂરો નથી થયો. એ બાકી રહી ગયો છે.

ત્યાગનું આંદોલન જ્યાં હોય ત્યાં પ્રજા તાકાત અનુભવે છે. ભોગનું આંદોલન હોય ત્યાં પ્રજા લયપસવા માંડે છે. ગાંધીજીનો સૌથી સર્મથ કાર્યક્રમ જો કોઈ હોય તો એ ત્યાગનું આંદોલન છે. ત્યાગના આંદોલન મારફતે ગાંધીજીએ દેશની કરોડરજીજુને મજબૂત કરી, રાખ્યાવાના કેળવી. રચનાત્મક કાર્યક્રમ મારફત રાષ્ટ્રીયતાની ભાવના પેદા કરી. આમ, આ વ્યાખ્યાનમાં શ્રી નારાયણભાઈ દેસાઈએ રાખ્યાવાનાનું ઘડતર અને ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓનો સંબંધ જોડી આયો.

લોકસેવા કરનાર સુભાઈએ પોતાની લાંબી જીવનયાત્રામાં સાચા વૈષ્ણવજનના સંદ્ગુણો પાણ્યા છે. તેઓ શુદ્ધ બાઈના ચેત વસ્ત્રમાં સંત હતા એવું મનસુખભાઈ સાવલિયા નોંધે છે. શ્રી મોરારીબાપુના શબ્દો ‘ઉંભરથી અંબરને અંબતા વિરાટ વ્યક્તિત્વના મહામાનવ’ કઈ રીતે સુભાઈ માટે યોગ્ય છે તે આ સાધુચરિતનું વર્ણન કરીને દર્શાવી આપ્યું છે. શિક્ષણ, સત્યાગ્રહ, રચનાત્મક કાર્યો, આરજી હકૂમત, મુખ્ય રાજ્યમાં પ્રધાન પદ, સાડીય રાજકારણમાંથી નિવૃત્તિ, અક્ષયગઢનું નિર્માણ વગેરે પ્રવૃત્તિઓ ઉપરાંત તેમના સાહિત્યસર્જનની વાત પણ અહીં કરવામાં આવી છે. ગાંધીશૈલીમાં પ્રગટ થયેલાં તેમનાં દરશ્ય પુસ્તકોમાં ‘સત્યાગ્રહનાં સંભારણ’, ‘સોરઠની લોકકાન્તિનાં વહેણ અને વમળ’ વગેરેને યાદ કરે છે અને સુભાઈ સર્જનહારનું અનોખું સર્જન હતા એમ કહી તેમના સાધુચરિતને આ લેખમાં પ્રગટ કરી આપેલ છે. સુભાઈનાં જીવનસાથી કુસુમબહેનને લગ્નપ્રસંગે

નારાણદાસ ગાંધીએ આપેલાં આશીર્વયનમાંથી કુસુમબહેનની સેવાભાવના અને કાર્યશક્તિનો પરિચય આપણને થાય છે. અંતિમ લેખમાં શ્રી પ્રવીષ ક. લહેરીસાહેબ પણ સૌરાષ્ટ્રના આ ખમીરવંતા વ્યક્તિ સુભાઈનો આત્મીય પરિચય કરાવે છે. જેમાં તેમની તરવડા ગામની પ્રવૃત્તિ અને ચર્મઉંઘોગની વાતો મુખ્ય છે. આરોગ્યને લગતી પ્રવૃત્તિમાં સોરઠ ક્ષય નિવારણ સમિતિ નિમિત્તે સુભાઈએ કાર્યો કર્યા છે. રોજગારી ક્ષેત્રે પણ કાર્યો કર્યા છે. સુભાઈ સાથે ખબેખના મિલાવીને મીઠાના સત્યાગ્રહમાં, ભારત છોડો આંદોલનમાં અને આરજી હકૂમતમાં કામ કરનાર શ્રી કનુભાઈ લહેરીનાં પુત્ર હોવાને કારણે પ્રવીષભાઈનો આ લેખ આત્મીયતાના સંસ્કરણાનો બન્યો છે. પુસ્તકના અંતે મુખ્ય વક્તા શ્રી નારાયણભાઈ દેસાઈનાં જન્મ, જીવન, ઉછેર, પ્રવૃત્તિઓ અને સાહિત્યસર્જન વિશેની વીગતો સંકલિત કરીને મૂકી છે.

r

## મારી ઋતુઓ

શિયાળામાં મારી હદ્યરસની ઊર્મિજરણી  
જતી થીજી; વીણા હિમપદ વિશે મૂક બનતી.  
મહા ઝંઝાવાતો પ્રબળ સૂસવે બુદ્ધિબળના,  
કરે રક્ષા કો ત્યાં ? ન ઘરસંધારી, કાણ પણ ના !

અને ગ્રીઝે તાપે તપી તપી અતિશો ઊકળું,  
મને રોમે રોમે કરમ લખિયું છે પ્રજળું !  
ન ધેને ધેરાયો કંઈ સમજતો કે જીવન શું,  
અને તાપે મારું છણાધણી ઊઠે ઊર્મિજરણું !

અહા ! ત્યાં તો વર્ષા કરુણ રક્ષ રેલ્ન્ટ વરસે,  
અને થાતાં મારું ઉર સભર ભાવે, નવ રસે  
હસે, નાચે, કૂદે, વિહગ-વનવેલીથી રમતું,  
તરંગો ઊર્મિના દૂર દૂર સમુદ્ર વહવતું.

પ્રવાતે બુદ્ધિના જીવન તણું થીજેલ જરણું  
ફરી ભાવોર્મિએ નવલ રસ જીલે અણું અણું.

[‘સમગ્ર કવિતા’]

- ઊર્મિશર જોશી

## સૂચિ

# સાહિત્યિક પત્રકારત્વ વિષયના ગુજરાતી ભાષામાં પ્રાચ્ય સંદર્ભ ગંધો-લેખો

ડૉ. કિશોર વ્યાસ

## પત્રક્ષેત્ર

તંત્રીશ્રી, 'પરબ'

મે, '૧૦ના 'પરબ'માં પરિષદ-પ્રમુખશ્રીના પત્રમાં પ્રકાશકનો હવાલો આપી તેમણે વિનિતા વ્યક્ત કરી છે કે નવલકથાઓ 'હવે' નથી વંચાતી. રસોઈ, મેનેજમેન્ટ, પ્રેરણાત્મક વર્ગેરનાં પુસ્તકો જ વંચાય છે.

આ વિધાન આમ તો સારું છે. અમારા જેવાને પણ નવલકથાના બદલે સારા અનુવાદો આપવાનું સૂચન થાય છે. પણ છતાં આ વિધાન પૂર્ણ સત્ય નથી. આજે પણ એવી નવલકથાઓ પ્રગટ થાય છે, જેની એકથી વધારે આવૃત્તિ થાય છે. ધ્યુવ ભણની નવલકથાઓ તેનું ઉત્તમ ઉદાહરણ હોઈ શકે. બીજા પણ હશે. ખૂદ મારી વાત કરું તો ત્રણ વર્ષ પહેલાં, કોઈ પ્રકાશકે ન સ્વીકારતાં, મેં મારી નવલ 'અંગદનો પગ' સ્વભર્યે માત્ર ૫૦૦ નકલ છાપેલ. ખૂબ ડર હતો, પણ આજે તેની છણી આવૃત્તિ ચાલે છે અને છેલ્લી ત્રણ આવૃત્તિ તો પ્રકાશકે સ્વીકારી પણ લિધી.

લાગે છે કે બે પ્રકારની નવલકથાઓ આજે – આજની વંચાતી પેઢીને – ગમે છે. કંઠ તો 'શ્રીલર' વાર્તાઓ ગમે છે. તે ખૂબ વેચાય અને વેચાય છે. અથવા વાસ્તવિકતા દર્શાવતી અને કશોક આશાનો સંદેશો આપતી નવલ વંચાય-વેચાય છે. મારી નવલકથા વિષે 'જ્ઞાનીતા' વિરેચકોમાંથી કોઈએ લખવા તો ઠિક, વંચવાની તસ્દી પણ ન લીધી, પરંતુ અજ્ઞાન્યા કહેવાતા સામાન્ય વાચકોએ ખૂબ ઉમળકાથી વધાવી અને તેના પર ૧૫૩૦ ૨૦ લેખો પણ લખ્યા. આજે પણ લખાય છે. બે-ત્રણે તેના પર M.Phil. M.Ed.માં નિબંધ પણ લખ્યા, ખૂણેખૂણામાંથી પ્રતિભાવો સતત આપે છે.

એટલે, તફન નવલકથા નથી વંચાતી એમ કહેવું અર્ધસત્ય છે. હા, અન્ય વિષયોની તુલનામાં ઓછી વંચાતી હશે. તેનું કારણ ઉત્પાતન, તાજી અને સમયનો અભાવ હોઈ શકે. 'ઉપયોગી' પુસ્તકોની માંગ વધુ છે તે પણ કારણ હોય. છતાં "સારી" નવલકથાઓ બધા વાચકો અવશ્ય વાંચે છે. નવી ન મળે તો જૂની !

સમસ્યા 'સારી' નવલકથાઓ લખવાની છે.

- હેરેશ ધોળકિયા, ભુજ

r

77

78

## ગંધો

અખબારનું અવલોકન – ૧૯૮૧, યાસીન દલાલ, પ્રવીણ પ્રકાશન, રાજકોટ  
અખબારી લેખન – ૧૯૭૮, કુમારપાળ ડેસાઈ, યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ  
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા – નવમી આ. ૧૯૮૨, ધીરુભાઈ ઠાકર, ગુજર  
અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન – ૧૯૭૬, હિરાલાલ પારેખ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ  
આમનેપદી – ૧૯૮૭, સં. સુમન શાહ, પાર્શ્વ, અમદાવાદ  
કલમ અને કિતાબ – ૧૯૮૭, સં. મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ, ભાવનગર  
કકાવટી – ૨૦૦૬, સં. શરીરજા વીજણીવાળા, બકુલ ટેલર, કકાવટી પ્રકાશન, સુરત  
ગાંધીજીનું પત્રકારત્વ – બી. એમ. પટેલ (પરિચય પુસ્તિકા), ૨૦૦૩, પુ. કમ ૧૦૭૪, પરિચય  
ટ્રસ્ટ, મુંબઈ

ગુજરાતી પત્રકાર લઘુ સામયિક વિશેષાંક – ઓંગસ્ટ, ૧૯૮૮, મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ  
ગુજરાતી પત્રકારિતનો ઇતિહાસ – ૨૦૦૭, રતન રુસ્તમ માર્શિલ, બીજી આ., સાહિત્ય સંગમ,  
સુરત

ગુજરાતી વિવેચનમાં 'સંસ્કૃતિ' – ૧૯૮૭, કુમાર જૈમિની શાસ્ત્રી, પાર્શ્વ, અમદાવાદ  
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ભાગ : ઉ-૪ – ૧૯૭૮-૧૯૮૧, સંપા. ઉમાશંકર જોશી, યશવંત  
શુક્લ અને અન્ય, ગુજરાતી સા. પરિષદ

ગુજરાતી સાહિત્યનો દસમો દાયકો – ૨૦૦૩, સં. ભોગાભાઈ પટેલ, ગુજરાતી સા. પરિષદ  
ગુજરાતી સાહિત્યિક સામયિકો (પરિચય પુસ્તિકા, ૮૭૪), ૧૯૮૮, કિશોર વ્યાસ, પરિચય ટ્રસ્ટ,  
મુંબઈ

ચોથી જાગીર – ૧૯૮૪, યાસીન દલાલ, યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ  
જૂનું નર્મંગદ્ય – ૧૯૮૫, નર્મદાશંકર દવે, ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ

શાનસુધા : સ્વાધ્યાય અને સૂચી – ૧૯૮૦, ધીરુભાઈ ઠાકર, ગુજરાત સાહિત્ય અકાદમી  
ડાંનીઅંક – ૧૯૮૬, સં. રમેશ મ. શુક્લ, નર્મદ યુગાવર્ત્ત ટ્રસ્ટ, સુરત  
તંત્રીઅંક – શારદા, જાન્યુ. ૧૯૨૭

તંત્રીલેખ : સ્વરૂપ અને સર્જન – ૧૯૮૦, ઈશ્વરલાલ દવે, પ્રવીણ પ્રકાશન, રાજકોટ  
નવચેતન અમૃત મહોત્સવ અંક (આપણા ગણમાન્ય તંત્રીઓ), ઓક્ટો. -નવે. ૧૯૮૭, નવચેતન  
કાર્યાલય, અમદાવાદ

નવલ ગ્રંથાવલિ – ૧૯૬૬, સં. નરહરિ પરીખ, ગુજરાત વિદ્યાપીઠ  
નીલમ અને પોખરાજ – ૧૯૬૨, વિજયરાય વૈદ્ય, એન. એમ. ત્રિપાઠી, મુંબઈ  
નેપથેથી પ્રકાશવર્તુળમાં – ૧૯૮૬, સં. રમણ સોની, પાર્શ્વ, અમદાવાદ  
પત્રકારત્વ-પર્વ – ૨૦૦૮, યાસીન દલાલ, ગુજર

પત્રકારત્વ : સિદ્ધાંત અને અધ્યયન - ૧૯૮૮, ચન્દ્રકાન્ત મહેતા, નવભારત, મુંબઈ  
 પત્રકારત્વના પ્રવાહો - ૧૯૮૯, વિષ્ણુ પંડ્યા, નવભારત, મુંબઈ  
 પત્રકારત્વના સિદ્ધાંતો - ૧૯૮૯, યાસીન દલાલ, પ્રવીણ પ્રકાશન, રાજકોટ  
 પત્રકારત્વની વિકાસરેખા - ૧૯૮૯, વિષ્ણુ પંડ્યા, નવભારત, મુંબઈ  
 'પરબ'સૂચિ - ૨૦૦૭, સં. ઈતુભાઈ કુરુકૃણા, પાસુલ દેસાઈ તથા અન્ય, ગુજ. સા. પ.  
 પરિબમણ ભાગ : ૧/૨ - ૧૯૪૭, જેવેરચંદ મેઘાણી (નવસંસ્કરણ ૨૦૦૮, સં. જંત મેઘાણી,  
 ગુજરાત સાહિત્ય અકાદમી)  
 પરિષદ પ્રમુખોનાં ભાષણો (૧થી ૧૩ અને ૧૪થી ૨૭) - ૧૯૪૧, ૧૯૭૪, ગુજ. સા. પરિષદ  
 પુનર્લિખ્ય - ૨૦૦૪, કિશોર વ્યાસ, પ્ર. પોતે  
 પ્રકાંડ પત્રકારો - ૨૦૦૨, યાસીન દલાલ, પાર્શ્વ  
 'પ્રિયંવદા' અને 'સુદ્ધારણ' - ધીરુભાઈ ઠાકર, ૧૯૬૨, પ્ર. પોતે  
 બચ્યુભાઈ રાવત સ્મૃતિ અંક, કુમાર - ઓક્ટો.-નવે. ૧૯૮૧  
 બુંદબુંદી સૂરત નિરાલી - ૨૦૦૮, સં. રમણ સૌની, કિશોર વ્યાસ, પાર્શ્વ  
 ભાષણો અને અહેવાળો - ૧૯૬૩, ૧૯૬૫, ૧૯૬૭, ગુજરાતી સાહિત્ય પરિષદ  
 મણિલાલ ન. દ્વિવેદીનું આત્મવૃત્તાંત - ૧૯૭૮, ધીરુભાઈ ઠાકર, નવભારત પ્રકા.  
 માધ્યમભીમાંસા - ૧૯૮૪, યાસીન દલાલ, પાર્શ્વ  
 યશવંત દોશી (પરિચય પુસ્તિકા, ૮૭૦), ૧૯૮૮, ચન્દ્રકાન્ત શાહ, પરિચય ટ્રસ્ટ, મુંબઈ  
 રમણલાલ જોશી સ્મૃતિ અંક - ઉદેશ, જાન્યુ. ૨૦૦૭  
 રવિશંકર રાવળ સંસ્કરણ અંક - કુમાર, જાન્યુ. ૧૯૭૮  
 રા. વિ. પાઠક વાર્ષિક પ્રતિભા - ૧૯૮૧, કાન્તિલાલ કાલાણી  
 લીલાં સૂકાં પાન - ૧૯૪૨, વિજયરાય વૈદ્ય, એન. એમ. ત્રિપાઠી, મુંબઈ  
 લોકકથનાં ફૂળ અને મૂળ - ૧૯૮૦, હરિવલભ ભાયાણી, પાર્શ્વ  
 વસંત રજત મહોત્સવ ગ્રંથ, ૧૯૮૭  
 વિનાયકની આત્મકથા - ૧૯૬૬, વિજયરાય વૈદ્ય, એન. એમ. ત્રિપાઠી, મુંબઈ  
 વિશ્વકોશ ભાગ : ૧થી ૨૫ - વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ  
 વૃત્તવિવેચન - ૧૯૪૫, રમેશ રંગનાથ ગૌતમ  
 શોધ નવી હિશાઓની - ૧૯૮૭, શિરીષ પંચાલ, ક્રિતિજ સંશોધન કેન્દ્ર, વડોદરા  
 સર્જકની આંતરકથા - ૧૯૮૪, સં. ઉમાશંકર જોશી, ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ  
 સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ - ધીરુભાઈ ઠાકર, ગુજરાત. સાહિત્ય અકાદમી.  
 સમૂહમાધ્યમો અને સાહિત્ય - ૧૯૮૮, પ્રીતિ શાહ, પાર્શ્વ, અમદાવાદ  
 સંવિવાદના તેજવલયો - ૨૦૦૦ (પુનર્મુદ્રણ-૨૦૦૮), સાહિત્યિક પત્રકારત્વ નામે, પાર્શ્વ, કિશોર  
 વ્યાસ  
 સામયિકીની સૂચિ - યાસીન દલાલ, પાર્શ્વ  
 સાહિત્ય અને પત્રકારત્વ - ૧૯૮૦ (વિશેષાંક પરબ, સં. કુમારપાળ દેસાઈ) ગુજરાતી સાહિત્ય  
 પરિષદ, અમદાવાદ  
 સાહિત્યકારો સાથે પ્રશ્નાવલી - શબ્દસૂચિ (વિશેષાંક), ઓક્ટો.-નવે. ૧૯૮૭  
 સાહિત્યરંગી પત્રકારત્વ - ૨૦૦૨, અમિતા ઠાકોર, પ્ર. પોતે  
 સીધાં ચંગાણ - બીજી આ. ૧૯૪૭, ક. મા. મુનશી, ગુર્જર, અમદાવાદ

'સુદ્ધારણ' અને 'પ્રિયંવદા' - ૧૯૬૨, ધીરુભાઈ ઠાકર  
 સ્મૃતિ સંવેદન - બીજી આ. ૧૯૮૩, ચાંપશી ઉદેશી, નવચેતન કાર્યાલય, અમદાવાદ  
 સ્વાનસિદ્ધિની શોધમાં - ૧૯૮૩, ક. મા. મુનશી, ભારતીય વિદ્યાભવન, મુંબઈ  
 'સ્વાધ્યાય : સૂચિ (પુ. ૧થી ૨૫) - ૨૦૦૭, જંત ઉમરેઠિયા, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા  
 હજી મહેમદ અલારજિયા શિવાજી (પરિચય પુસ્તિકા, ૧૨૦૮) - ૨૦૦૮, કિશોર વ્યાસ  
 હજી સ્મારક ગ્રંથ - ૧૯૨૨, સં. રવિશંકર રાવળ  
 હીરા અને પના - ૧૯૮૪, વિજયરાય વૈદ્ય, રોહિણી પ્રતિષ્ઠાન, બાવનગર

### દેખસૂચિ

'અસ્મિતા' વાર્ષિક વિશે - પરબ, ૧૯૮૮  
 આપણાં માસિકો - અભિલાષકુમાર, બુદ્ધપ્રકાશ, નવે. ૧૯૮૮  
 આપણાં સાહિત્યિક સામયિકો - રમણ સૌની, એતદ્વારા, ઓક્ટો.-ડિસે. ૧૯૮૨, સાભિપ્રાય,  
 ૧૯૮૮, આર. આર. શેઠ  
 આપણાં સાહિત્યિક પત્રકારત્વનો ઠિતિહાસ શું શક્ય છે? - કિશોર વ્યાસ, તથાપિ, ડિસે.-ફેબ્રુ.,  
 ૨૦૦૭  
 આપણાં સાહિત્યિક સામયિકો બંધ કેમ પડે છે? - પ્રબોધ ર. જોશી, ઉદેશ, જૂન, ૨૦૦૮  
 આવતી કાલનું ગુજરાતી સામયિક - ત્રિશીપ સુહંદ, પરબ, ફેબ્રુ., ૨૦૦૫  
 ઉદ્વામ વિચારપત્ર : ડાયિયો - રતન રુસ્તમ માર્શાલ, પરબ, ઓગસ્ટ-સપ્ટે. ૧૯૮૩  
 ઉદેશ વિશે અવલોકન - યશવંત દોશી, ઓળખ, જાન્યુ., ૧૯૮૬  
 ઉમાશંકરનું સાહિત્યિક પત્રકારત્વમાં પ્રદાન - રમણલાલ જોશી, ઉદેશ, સપ્ટે., ૧૯૮૭  
 કન્યાકેળવણીના પ્રભર ડિમાયતી મણિલાલ દ્વિવેદી અને સૌરાષ્ટ્રનું પ્રથમ સ્ત્રીલક્ષી સામયિક  
 'પ્રિયંવદા' - નીતાબહેન ઉદાણી, અર્થાતુ, એપ્રિલ-જૂન, ૨૦૦૩  
 કવિતાનાં સામયિકો - અનિશુદ્ધ બ્રહ્મભક્ત, વિશ્વમાનવ, મે-જૂન, ૧૯૬૫  
 કવિતાની વંશાવળી 'વહી' - કિશોર વ્યાસ, પરબ, મે, ૨૦૦૦  
 કવિલોકના મહાકાવ્ય વિશેષાંક વિશે - ભોળાભાઈ પટેલ, પરબ, ઓક્ટો., ૧૯૮૩  
 'કુમારનો ઘોડો' - ભોળાભાઈ પટેલ, પરબ, માર્ચ, ૧૯૮૦  
 કેમુશરો કાબરાજીનું પત્રકારત્વ - રતન રુસ્તમ માર્શાલ, પરબ, જૂન, ૧૯૮૬  
 'ક્રીમુદી'એ ગુજરાતી વિવેચન સાહિત્યમાં આપેલો ફાળો - રમણલાલ જોશી, શબ્દસેતુ, ૧૯૭૦,  
 વોરા એન્ડ કંપની  
 (ભરત નાયક કે ચલાવાનું) 'ગાંધીપર્વ' - સુમન શાહ, ખેવના, જાન્યુ., ૧૯૮૦  
 'ગાંધીપર્વ' વિશે - ભોળાભાઈ પટેલ, પરબ, ઓગસ્ટ, ૧૯૮૦  
 'ગાંધીપર્વ'ની વસમી વિદ્યાયથી - જ્યેશ ભોગાયતા, તથાપિ, જૂન-ઓગસ્ટ, ૨૦૦૮  
 ગાંધીજી : પત્રકાર તરીકે - અંબાલાલ જોશી, પ્રાતઃસમરણીય મહાત્મા ગાંધીજી, ૧૯૮૫, ગુર્જર  
 - ડી. એન. શુક્લ, વિદ્યાપીઠ, જુલાઈ-ઓગસ્ટ, ૧૯૬૭  
 - નગીનદાસ પારેખ, વિદ્યાપીઠ, નવે.-ડિસે., ૧૯૭૮  
 - રમણ મોદી, ગાંધીજીનું સાહિત્ય, ૨૦૦૭, નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ  
 - રમણીક દલાલ, નવચેતન, મે, ૧૯૭૧  
 ગુજરાતનું પત્રકારત્વ - કપિલરાય મહેતા, વિશ્વમાનવ, મે, ૧૯૬૦  
 ગુજરાતનું પલટાવું પત્રકારત્વ - રવિશંકર મહેતા, કાર્બસ ટ્રેમાસિક, જુલાઈ-ડિસે., ૧૯૭૩

ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન – જ્યવદન પટેલ, પરબ, જૂન, ૧૯૮૦  
 ગુજરાતી ભાષાનાં ચાલુ માસિકો – ?, વસ્તં, ૧૯૨૨-૨૩, પુ. ૨૧  
 ગુજરાતી માસિકો – ડિચાલાલ પારેખ, બુદ્ધિપ્રકાશ, નવે., ૧૯૨૪  
 ગુજરાતી સામયિકો – હર્ષદ નિવેદી, શબ્દાનુભવ, ૨૦૦૭, કવિલોક ટ્રસ્ટ, અમદાવાદ  
 ગુજરાતી સામયિકોનો પ્રથમ અધ્યાય – કિરીટ ભાવસાર, અર્થાત્, જુલાઈ-સાએ., ૨૦૦૦  
 ગુજરાતી સાહિત્ય સામયિકો : એક દસ્તિપાત - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૯૮૮,  
 મથુરુ - ન મિથ્યા, રમણ સોની, ૨૦૦૮, રનાદે  
 ગુજરાતી સાપ્તાહિકનું સ્વરૂપ - નરભેસમ સધારણતી, પરબ, જૂન, ૧૯૮૦  
 ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ ૧૯૮૬-૮૭ - કિશોર વ્યાસ, પરબ, ફેબ્રુ.-માર્ચ, ૧૯૮૮  
 ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ - રતિલાલ સાં. નાયક, તાદર્થી, જૂન, ૨૦૦૨  
 ગ્રંથના ચૌદમા વર્ણ - વાડીલાલ ડગલી, ગ્રંથ, ડિસે., ૧૯૭૬  
 શાસ્ત્રપત્રો : આજના સંદર્ભમાં - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, સાએ., ૨૦૦૧, વાચનવિશેષ - સં.  
 ડંકેશ ઓઝા, ૨૦૦૨, ગુજરાત સાહિત્ય અકાદમી  
 ટી.એસ.એલ. વિશે - જ્યેન્ડ નિવેદી, પરબ, જાન્યુ., ૧૯૮૪  
 તંત્રી તરીકે ભોળાભાઈ પટેલની વિદ્યાય - રમેશ દવે, પરબ, ડિસે., ૧૯૮૮  
 તંત્રીકાર્ય એટલે શું ? - સુમન શાહ, ખેવના, નવે., ૧૯૭૧  
 તંત્રીકાર્ય ને એવું બધું - સુમન શાહ, ખેવના, સાએ. ૨૦૦૫  
 ત્રણ ભારતીય સામયિકો - અંગ્રેજીમાં - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૮૬,  
 પરોક્ષ-પ્રત્યક્ષ, ૨૦૦૪, રનાદે  
 ‘ડાંડિયો’ના પ્રકાશનપ્રારંભ વિશે ચર્ચાનોંધ - હિન્કર જોશી, પરબ, ડિસે., ૧૯૮૮; વી. બી.  
 ગણાત્રા, પરબ, જાન્યુ., ૧૯૮૪  
 દશયત્રાય માધ્યમો અને સાહિત્ય - વૈદ્ય ધીરેન્ડ મહેતા, પરબ, એપ્રિલ-મે, ૧૯૮૫  
 - રમેશ ર. દવે, પરબ, એપ્રિલ-મે, ૧૯૮૫  
 નર્મદ - ઉદ્ઘાટ વિચારપત્ર ‘ડાંડિયો’ - રતન રુસ્તમ માર્શાલ, પરબ, ઓગસ્ટ-સાએ., ૧૯૮૩  
 નર્મદ - ‘ડાંડિયો’ : પત્રકારત્વ - રમેશ મ. શુક્લ, નર્મદ : શોધ અને સમાલોચન, ૨૦૦૫, પાશ્ર  
 નર્મદ : પત્રકારત્વનું મોઢું અર્પણ - હર્ષદ દવે, પરબ, ઓગસ્ટ-સાએ., ૧૯૮૩  
 નર્મદ : સુધારક પત્રકાર - યાસીન દલાલ, પરબ, ઓગસ્ટ-સાએ., ૧૯૮૩  
 નર્મદનું નિર્ભિક પત્રકારત્વ - નીરુભાઈ ટેસાઈઠ, પરબ, ઓગસ્ટ-સાએ., ૧૯૮૩  
 નર્મદયુગનું આખાબોલું સામયિક ‘ડાંડિયો’ - ગંભીરસ્થિત ગોહિલ, કાર્બસ ત્રૈમાસિક, કોકો.-ડિસે.,  
 ૨૦૦૮  
 નવજીવનનાં સંપાદન વિશે ચર્ચાનોંધ - વી. બી. ગણાત્રા, પરબ, ઓક્ટો., ૧૯૮૨, જૂન, ૧૯૮૩  
 નવાં સામયિકો - સંજ્ય શ્રીપાદ ભાવે, શબ્દસૂચિ, મે, ૧૯૮૮  
 નાની પત્રિકાઓ - પવનકુમાર જૈન, ગ્રંથ, માર્ચ, ૧૯૭૧  
 નાંદીકાર વિશે - સંજ્ય શ્રીપાદ ભાવે, પરબ, એપ્રિલ, ૧૯૮૮  
 પત્રકાર - મગનલાલ દેસાઈ, સંસ્કૃતિ, નવે., ૧૯૮૫  
 પત્રકાર ક. મા. મુનશી - ધર્મન્દ મ. માસતર ધર્મન્દ, નવનીત-સર્માર્ષ, જાન્યુ., ૧૯૮૮  
 પત્રકારત્વ - બચ્ચુભાઈ રાવત, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨ અનું સંમેલન, ૧૯૬૫  
 પત્રકારત્વ - ભગવતીકુમાર શર્મા, ‘વીસમી સદીનું ગુજરાત’ - સં. શિરીષ પંચાલ, અન્ય, ૨૦૦૨

પત્રકારત્વ - હરીન્દ દવે, પરબનો ‘સદીનું સરવૈયું’ વિશેષાંક, સં. રધુવીર ચૌધરી, જૂન-જુલાઈ,  
 ૧૯૮૨  
 પત્રકારત્વ અને સાહિત્ય - ભાવસેતુ, સં. ચિમનલાલ નિવેદી અને નાથાલાલ રૈયારેલા (?)  
 પત્રકારત્વ અને સાહિત્ય - મધુસૂદન પારેખ, સંદર્ભ સં. જ્યંત કોઠારી, અન્ય, ૧૯૭૫, ગૂર્જર,  
 અમદાવાદ  
 પત્રકારત્વ અને સાહિત્ય - મોહનલાલ મહેતા ‘સોપાન’ અને સાહિત્ય, સં. યશવંત નિવેદી, વિ.  
 આર. આર. શેડ  
 પત્રકારિત્વ : તેનાં આદર્શો અને કર્તવ્યો - પંડ્યા મહેન્દ્ર ન., ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૮૪૦  
 સંમેલન, ૧૯૮૫  
 પડકરજનક છતાં રસપ્રદ : ૧૯૬૦થી આજ સુધીનું સાહિત્યિક પત્રકારત્વ - કિશોર વ્યાસ,  
 નવચેતન, ઓક્ટો.-નવે., ૨૦૦૮  
 પરબ વિશે - ?, પરબ, જૂન, ૨૦૦૦  
 પરબનાં પચીસ વર્ષ - ભોળાભાઈ પટેલ, પરબ, ડિસે., ૧૯૮૪  
 પરબને અલવિદા કહેતી વખતે - ભોળાભાઈ પટેલ, પરબ, ડિસે., ૨૦૦૧  
 પરબ હવે માસિક સ્વરૂપે - ભોળાભાઈ પટેલ, પરબ, જાન્યુ., ૧૯૭૭  
 પરિચય ટ્રસ્ટનું એક નવું સપનું : ગ્રંથ - ભોળાભાઈ પટેલ, પરબ, જૂન, ૧૯૭૮  
 ‘પ્રત્યક્ષ’ સામયિકના સંપાદક રમણ સોનીની મુલાકાત - ડંકેશ ઓઝા, પ્રત્યક્ષ-પરોક્ષે - રમણ  
 સોની, ૨૦૦૪, રનાદે  
 - હર્ષદ નિવેદી, પ્રત્યક્ષ-પરોક્ષે - રમણ સોની, ૨૦૦૪, રનાદે  
 ‘પ્રત્યક્ષ’ સામયિક, સંપાદક ડેફ્ઝિયટ વિશેષાંક વિશે - ડંકેશ ઓઝા, શબ્દસૂચિ, એપ્રિલ, ૧૯૮૬  
 - ભોળાભાઈ પટેલ, પરબ, માર્ચ, ૧૯૮૬  
 ‘પ્રત્યક્ષ’ના પાંચ વર્ષ - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૮૭  
 ‘પ્રસ્થાન’માં પ્રકાશિત કાલ્યરચનાઓનો અભ્યાસ - કિશોર વ્યાસ, ઠંડુમૌલિ, જુલાઈ, ૧૯૮૮  
 ફર્બસ ત્રૈમાસિકના સંપાદક મંજુ જીવેરીની મુલાકાત - રમણ સોની, પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૧૯૮૧  
 ફર્બસ ત્રૈમાસિકનો ‘મધ્યકાલીન સાહિત્ય’ વિશેષાંક - ભોળાભાઈ પટેલ, પરબ, ફેબ્રુ., ૧૯૮૬  
 બચ્ચુભાઈ રાવત : લોકરૂચિના મહેતાજી - વાડીલાલ ડગલી, ગ્રંથ, આંગસ્ટ, ૧૯૮૦  
 (આપણાં) બાળસામયિકો - કુમારપાળ દેસાઈ, પરબ, ઓગસ્ટ-સાએ., ૧૯૮૫  
 બુદ્ધિપ્રકાશ (ગુજરાત વિદ્યાસભાનો મંજુકો) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, ડિસે., ૨૦૦૧  
 ‘બુદ્ધિપ્રકાશ’ના નવ દાયકા - અનંતરાય ચાવળ, તારતમ્ય, ૧૯૭૧, ગૂર્જર  
 (૪ દાયકા પહેલાંના) બે નાટ્ય સામયિકો - સંપાદક, નાટક, ઓક્ટો.-ડિસે., ૨૦૦૮, ૨૩  
 બે વર્ષનું સાહિત્યિક પત્રકારત્વ - તરુ કાજારિયા, પરબ, એપ્રિલ, ૨૦૦૧  
 બે વિશેષાંકો - રમેશ ર. દવે, નિર્દેશ શુક્લ, પરબ, ઓક્ટો., ૧૯૮૩  
 ભાષાવિમર્શ : ભાયાણી સાહેબનું એક મહત્ત્વનું પ્રદાન - રમણ સોની, પ્રત્યક્ષ, ઓક્ટો.-ડિસે.,  
 ૨૦૦૦, પ્રત્યક્ષ-પ્રત્યક્ષ, ૨૦૦૪, રનાદે  
 મરાઈ સાહિત્યનું ‘થાઈમ્સ લિટરરી સાલીમેન્ટ’ લાલિત - જય મહેતા, ઝાંખી, ૧૯૮૪, પ્રક.  
 એસ. એન. ડી. ટી. યુનિ, મુંબઈ  
 મિલાપ - નાની શી મિલનબારી બંધ - ભોળાભાઈ પટેલ, પરબ, ફેબ્રુ., ૧૯૭૮  
 (સહધ્ય દાર્શનિક સમા પત્રકાર) મેઘાણી - ચુનીલાલ મડિયા, ઊર્મિ-નવરચના, એપ્રિલ, ૧૯૮૭,

મેધાણી વિવેચનાસંદોહ – સં. જયંત કોઠારી, ૨૦૦૨  
 (પત્રકારત્વનું શિયળ સાચવનાર) મેધાણી – મગનલાલ સતીકુમાર, ઊર્મિન-વરચના, એપ્રિલ, ૧૯૪૭  
 (સાહિત્ય અને પત્રકારત્વનો સેતુ) મેધાણી – જયેન્દ્ર ત્રિવેદી, સાધના દીપોત્સવી વિશે. સં. ૨૦૫૧ (સને ૧૯૬૮)  
 (સાપ્તાહિક પત્રકારત્વનો ઉત્કૃષ્ટ બેદૈયો) મેધાણી – યશવંત દોશી, રેલ્વો કસુંબીનો રંગ, ૧૯૬૬  
 મેધાણી : પત્રકાર તરીકે – જ્યામલ્ય પરમાર, સમયસમયના રંગ, ૧૯૬૭  
 મેધાણી : પત્રકાર તરીકે – યાસીન દલાલ, પ્રત્યાયન, જુલાઈ-ડિસે. ૧૯૬૬, શબદનો સોદાગર, ૧૯૬૭, માધ્યમચિત્તન, ૧૯૬૮  
 મેધાણી : પત્રકાર તરીકે – યાસીન દલાલ, મેધાણી શતાબ્દીવંદના, ૧૯૬૮  
 મેધાણી અને સાહિત્યિક પત્રકારત્વ – રમણ સોની, પ્રત્યાય, એપ્રિલ-જૂન, ૧૯૬૪, પરોક્ષ-પ્રત્યક્ષ, ૨૦૦૪, રનાએ  
 મેધાણીનું પત્રકારત્વ – જ્યંત જોશી, ઝવેરચંદ મેધાણી, ૧૯૬૮, સં. અનિરુદ્ધ બ્રહ્મભક્ત  
 મેધાણીનું પત્રકારત્વ – નગીનદાસ સંબંધી, ફાર્બસ ટ્રેમાસિક, જાન્યુ.-માર્ચ, ૧૯૬૭, આ તડ ને  
 આ ફડ, ૧૯૬૮, મેધાણી વિવેચના સંદોહ – સં. જયંત કોઠારી, ૨૦૦૨  
 (મૂલ્યનું તેજ, શૈલીનું સત્ત્વ) મેધાણીનું પત્રકારત્વ – પ્રીતિ શાહ, રેલ્વો કસુંબીનો રંગ, ૧૯૬૬  
 મેધાણીનું પત્રકારત્વ : એક અવલોકન – યાસીન દલાલ, શબદનો સોદાગર, ૧૯૬૭  
 ‘શુદ્ધ’ સામયિક વિશે – નવીનચંદ ત્રિવેદી, મદિયાનું અક્ષરકાર્ય, ૧૯૭૮  
 ‘ને’નું અંદોલન : એક સમીક્ષા – ચિનુ મોદી, સમીપે, જાન્યુ., ૨૦૦૭  
 લાજવાબ ‘મનીંા’ – કિશોર વ્યાસ, તથાપી, સપ્ટે.-નવે., ૨૦૦૫  
 લોકસંપર્કના દર્શય-શ્રાવ માધ્યમ – વસુબહેન ભણ, પરબ, એપ્રિલ-મે, ૧૯૮૫  
 વર્તમાનપત્રોની ગુજરાતી સાહિત્ય પર અસર – ભોગીલાલ ગાંધી, વિશ્વમાનવ, સપ્ટે.-ઓક્ટો., ૧૯૬૬  
 વર્તમાનપત્રોમાં સાહિત્ય – હસમુખ દોશી, શબ્દસૂચિ, ઔંગસ્ટ, ૧૯૬૫  
 ‘વિ’નો દલિત ગુજરાતી વાર્તા-વિશેષંક (૮૫) – શરીફા વીજળીવાળા, કક્ષાવટી, જાન્યુ., ૧૯૬૬  
 વિકાસશીલ દેશોમાં સમૂહમાધ્યમોની ભૂમિકા – યાસીન દલાલ, શબ્દસૂચિ, સપ્ટે., ૧૯૮૮  
 વિજ્યરાયનું ‘ચેતન’ – રમેશ મ. શુક્લ, પરબ, જુલાઈ, ૧૯૬૬  
 વિજ્યરાય વેદનું સાહિત્યિક પત્રકારત્વ – રમણ સોની, ફાર્બસ ટ્રેમાસિક, જુલાઈ-સપ્ટે., ૧૯૬૭,  
 સાભિપ્રાય, ૧૯૬૮, આર. આર. શેડ  
 વિવિધ માધ્યમો વચ્ચે સાહિત્ય ટક્ષે ખણું ? – રમણલાલ જોશી, પ્રવાસી, ૪-૬-૮૪  
 ‘દીણા’ અને ‘શરદ’ વાર્ષિકો વિશે – બટુકરાય પંડ્યા, પરબ, નવે., ૧૯૮૮  
 ‘વીસી સાઈ’ : સાહિત્ય, સમાજ અને ઈતિહાસ સંદર્ભે અભ્યાસ – મકરનં મહેતા, ફાર્બસ  
 ટ્રેમાસિક, ઓક્ટો.-ડિસે., ૨૦૦૨  
 શબ્દસૂચિ (સુમન શાહ સંપાદિત) – ભોગીભાઈ પટેલ, પરબ, માર્ચ, ૧૯૮૪  
 શુદ્ધ સાહિત્યિક સામયિકો કેટલાં ? – સુમન શાહ, ખેવના, જુલાઈ, ૧૯૭૧  
 શુદ્ધ સમૂહમાધ્યમોનું વલણ સંસ્કૃત વિરોધી રહ્યું છે ? – રધુંબીર ચૌધરી, જન્મભૂમિ, ૧૯-૨-૮૮  
 ‘સન્ધિ’ : થોડી પેટ્ટુથી વાતો – બાબુ સુધૂરાર, સન્ધિ, એપ્રિલ-જૂન, ૨૦૦૮  
 સમૂહમાધ્યમ – ભોગીલાલ ગાંધી, પરબ પત્રિકા-૧, ૧૯૬૫

સમૂહમાધ્યમ અને સાહિત્ય – કેતન મહેતા, પરબ, એપ્રિલ-મે, ૧૯૮૫  
 સમૂહમાધ્યમો, ભાષા અને સાહિત્ય – કુલિનચંદ યાણીક, પરબ, જૂન, ૧૯૮૮  
 સંસ્કૃતિ : ઉમાશંકરના જીવનનું રમણીય તપોવન – કૃષ્ણાવીર દીક્ષિત, સંસ્પર્શ, ૧૯૮૩, રનાએ  
 સંસ્કૃતિનાં પચીસ વર્ષ – ભોગીભાઈ પટેલ, કાલપુરુષ, ૧૯૭૮  
 સંસ્કૃતિનો પૂર્ણાંહુતિ વિરોધંક – ભોગીભાઈ પટેલ, પરબ, માર્ચ, ૧૯૮૫  
 સામયિકી : ૧/૨ – પ્રતિ-ભાવક, ઉદેશ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૦  
 ‘સાહિત્ય’ (તત્ત્વી : નિર્ણન ભગત) – ભોગીભાઈ પટેલ, પરબ, જૂન, ૧૯૭૮  
 સાહિત્ય, પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વ – વાસુદેવ મહેતા, પરબ, જાન્યુ., ૧૯૮૦  
 સાહિત્ય સામયિકોની ધરી : સંપાદક લેખક વાચક સંબંધ – રમણ સોની, ઉદેશ, જુલાઈ, ૨૦૦૯,  
 ૫૭૬-૫૮૧  
 સાહિત્ય અને દર્શયશ્રાવ્ય કલામાધ્યમો – રમેશ ર. દાબે, પરબ, એપ્રિલ, ૧૯૮૫  
 સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ – કુમારપાળ ટેમાઈ, પરબ, જૂન, ૧૯૮૦  
 સાહિત્યના પ્રચારમાં માસિકનું સ્થાન – કેશવ હ. શેડ, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૮૦  
 સાહિત્યને સમૂહમાધ્યમ કહી શકાય ? – યશવંત શુક્લ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૧૯૭૮  
 સાહિત્યને સમૂહ પ્રત્યાયનના નવા વૈશ્વિક સંદર્ભમાં કાયારે મૂલવીશું ? – યાસીન દલાલ, ગુજરાત  
 સમાચાર, ૨૮-૧૨-૮૭  
 સાહિત્યિક પત્રપત્રિકાઓ અને સંતંભો – પ્રસાદ બ્રહ્મભક્ત, પરબ, એપ્રિલ-મે, ૧૯૮૨  
 સાહિત્યિક પત્રકારત્વ – ગુલાબદાસ બોકર, સંસ્કૃતિ, મે, ૧૯૬૮  
 સાહિત્યિક પત્રકારત્વ – વાચીલાલ ડગ્લી, પરબ, જૂન, ૧૯૮૦  
 સાહિત્યિક પત્રકારત્વ : મુંબઈનાં અખબારોની પ્રશસ્ય ભૂમિકા – તરુબહેન. કજારિયા, પરબ, મે,  
 ૨૦૦૧  
 સાહિત્યિક પત્રકારત્વ : સંશાચાર્યા – કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, સાપ્ટે., ૧૯૮૮  
 સાહિત્યિક સામયિકો ચાલે તો, ચાલે શી રીતે ? – સુમન શાહ, ખેવના, જૂન, ૧૯૮૮  
 સાહિત્યિક સામયિકો : જીનાં અને નવાં – નરેન્દ્ર ત્રિવેદી, પરબ, જૂન, ૧૯૮૦  
 સાહિત્યિક સામયિકો : શું આપણે ત્યાં, શું અમેરિકાનાં – રમણ સોની, એતદુ, ઓક્ટો.-ડિસે.,  
 ૧૯૮૦, સામિપ્રાય, ૧૯૮૮, આર. આર. શેડ  
 સાહિત્યિક સામયિકો પ્રત્યે પ્રાજીની વિભૂતા – કિશોર વ્યાસ, નવનીત-સમર્પણ, જૂન, ૧૯૮૮  
 સુન્દરમુના ‘દ્વિક્ષિણા’નો છેલ્લો અંક – ભોગીભાઈ પટેલ, પરબ, ઓક્ટો., ૧૯૮૪  
 સુન્દરમુના પરમ યશનો પ્રસાદ ‘દ્વિક્ષિણા’ – કિશોર વ્યાસ, શબ્દસર, ફેબ્રુ.-માર્ચ, ૨૦૦૮  
 સુરેશ જોણીનું સાહિત્યિક પત્રકારત્વ – સુમન શાહ, સુરેશ જોણીથી સુરેશ જોશી, બીજી આ.  
 ૨૦૦૦, પાર્ટ્સ  
 ‘શુવષ્ણમાળા’ – નિપુણ ઈ. પંડ્યા, ગ્રંથ, માર્ચ, ૧૯૬૮  
 સેતુ અને ‘અ કોમન પોઓટિક ફોર ઇન્ડિયન લિટરેચર’ – હિંગીશ મહેતા, પરબ, જાન્યુ., ૧૯૮૫  
 સ્વાતંત્ર્ય પૂર્વનું ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ – ચન્દ્રકાન્ત મહેતા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૮૮  
 [આ સૂચિ સંપૂર્ણ ન ગણવા વિનંતી છે. ફોન : કિશોર વ્યાસ : ૮૮૨૪૭૭૩૫૧૧]



## પરિષદ્વત્ત

સંકલન : રાજેન્ડ્ર પટેલ

### રવીન્દ્રભવન

૨ જૂન-૨૦૧૦ના રોજ રવીન્દ્રભવન તરફથી સત્યજિત રાય દ્વિશ્વિત રાબિન્ડ્રનાથ ટગોર : A radio Biographyના શ્રવણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રવીન્દ્રનાથ વિષે વિશ્વાસ મહાનુભાવોના શબ્દોમાં એમના વ્યક્તિત્વ વિષે પરિચર્યા સંયોજિત હતી. શ્રાવણી સાથે દશ્ય માધ્યમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રોતાઓએ કાર્યક્રમ રસપૂર્વક માણયો.

### પાદ્ધિકા

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ‘પાદ્ધિકા’ના ઉપક્રમે તા. ૧૭-૬-૨૦૧૦ ને ગુરુવારના રોજ સાંજે ૬.૦૦ કલાકથી દીનાબહેન પંચાયાએ ‘ઓહવાટ’ વાર્તાનું પઠન કર્યું હતું. તેના વિષયવસ્તુ, રજૂઆતની શૈલી અને બોલિના ઉચિત વિનિયોગે સૌ ભાવકોને પ્રભાવિત કર્યા હતા. આ વાર્તાને નર્મદ સાહિત્યસભા તરફથી સ્વ. કેતન મુનશી પારિસોષિક મળ્યું છે.

### શોકાંજલિ સભા

ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય સભા, કુમાર ટ્રસ્ટ, કવિલોક ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય અક્ષાદમી તેમજ અન્ય સંસ્થાઓના ઉપક્રમે વાર્તાકાર સદ્ગત શ્રી ઘનશ્યામ દેસાઈ અને આધુનિક કવિ અને વિવેચક શ્રી નીતિન મહેતાની શોકસભા તા. ૨૨-૬-૨૦૧૦ના રોજ સાંજે ૬.૦૦ કલાક શ્રી રઘુવીર ગૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શ્રી સુમન શાહે સદ્ગત નીતિન મહેતાને સ્વસ્થ, સરળ અને સમજજાર એવાં ત્રણ વિશેષણોથી નવાજ્યા હતા અને તેમની વિવેચન વિશેની સમજ આપીને તેમની કવિતાઓનું પઠન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી રતીલાલ બોરીસાગરે સદ્ગત ઘનશ્યામ દેસાઈ વિશેના વક્તવ્યમાં દીપક દોશી, ધીરુબહેન પટેલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્વર, સુરેશ દલાલ, મધુ રાય, અનિલ જોશી અને લલિત લાડે વિવિધ સામયિકોમાં આપેલી શ્રદ્ધાંજલિના કેટલાક અંશોનું પઠન કર્યું હતું. શ્રી રઘુવીર ગૌધરીએ અધ્યક્ષીય વક્તવ્યમાં વાર્તાકાર ઘનશ્યામ દેસાઈની ‘કાગડો’, ‘થોળું’ વગેરે વાતાઓનું સમરશ કરીને વાર્તાની અને વ્યક્તિ ઘનશ્યામ દેસાઈની વિશેષતા ચીંધી આપી હતી. તો નીતિન મહેતાની સારા અધ્યાપક, સારા કવિ અને વિવેચક તરીકેની ચર્ચા કરી હતી. શ્રી રાજેન્ડ્ર પટેલે સભાનું સંચાલન કર્યું હતું તેમજ શોકઠરાવનું વાચન કર્યું હતું.

### સાહિત્યસિદ્ધાન્ત વ્યાખ્યાનશૈલી

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિર અંતર્ગત ‘સાહિત્યસિદ્ધાન્ત વ્યાખ્યાનશૈલી’નું ચોથું વ્યાખ્યાન તા. ૧૫ જુલાઈ, ૨૦૧૦ ને ગુરુવારે સાંજે ૫.૦૦ કલાક જાહીતા આધુનિક વિવેચક અને સર્જક શ્રી શિરીષ પંચાલ ‘રસપ્રતીતિનાં વિધો : પૂર્વ અને પશ્ચિમમાં’ વિષય પર આપ્યો. સાહિત્યસિદ્ધાન્તની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાબ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એ આ શૈલીનો ઉદેશ છે. રસ ધરાવનાર સૌને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.

### મૂલ્યો તો અમૂલ્ય

કાઉન્સિલ ઓફ સિનિયર્સ ઓફ એડિસનની પંદરમી વાર્ષિક જ્યંતીની ઉજવણીના ભાગ રૂપે શ્રી ભાનુભાઈ ત્રિવેદી વિવિધ મૂલ્યો તો અમૂલ્યનું ઉદ્યોગપતિ શ્રી પીયુષભાઈ પટેલે તા. ૨૩ મે, ૨૦૧૦ના રોજ રેસિટન સેન્ટર ખાતે વિમોચન કર્યું હતું.

### માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસકમનો આરંભ

માતૃભાષા સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાતી સાહિત્ય પરિષદની વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે ‘માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર’ના ૨૧ દિવસના અભ્યાસકમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૬-૭-૨૦૧૦થી તા. ૧૮-૮-૨૦૧૦ સુધી સાંજે ૫.૦૦થી ૬.૩૦ કલાક દરમાન ચાલનારા આ અભ્યાસકમની હાલ પૂરતી ઝી ૩. ૧૦૦ રખવામાં આવેલ છે. તેમાં એક કલાક અધ્યાપક અને અર્ધો કલાક પ્રશ્નોત્તરીનો રહેશે. ભાષાના પ્રાથમિક અને મહત્વાના પાસાંઓના અભ્યાસમાં કોઈપણ ભાષારસિક-ભાષાજિજ્ઞાસુ વયબેદ કે વ્યવસાયબેદ વગર જોડાઈ શકે છે. વધુ વિગત માટે પરિષદ કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી. S

ગુજરાત પુસ્તકાલય પ્રેરિત ‘સાહિત્યસૃષ્ટિ’ના ઉપક્રમે ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય સમકાના પદકારો’ વિશે ભગવતીકુમાર શર્માએ વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ ધો. ૧૨ વિજાનની પરીક્ષામાં ૮૫ ટકાથી વધુ માર્ક્સ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવનાર દેવલ અશોકકુમાર શાહ તથા ‘શાહીદ ગજલ’ માટે શકીલ કાદરીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. શ્રોતાઓને ‘ગજવામાં ગામ’ પરબ તરીકે પુસ્તક ભેટ આપ્યું હતું.

### પરદેશના સભ્યોને વિનંતી

પરબ એરમેરીલથી હેઠે મોકલવામાં આવે છે. જેની નોંધ લેવા વિનંતી. વધેલા પોસ્ટ જર્યના ઝ. ૭૨૦ (વાર્ષિક) સત્તવરે મોકલી આપવા વિનંતી.

### જેલ કાર્યક્રમ અંતર્ગત

- (૧) રનાદે પ્રકાશને કુલ ૧૧૨ પુસ્તકો ભેટ આપ્યાં. તે બદલ રનાદે પ્રકાશનનો હફ્ટયપૂર્વક આભાર.
- (૨) રાજેન્ડ્ર પટેલ તરફથી કુલ ૭૦ પુસ્તકો ભેટ મળ્યાં.
- (૩) અનિલાબહેન દલાલ તરફથી કુલ ૩૦ પુસ્તકો ભેટ મળ્યાં.

### માતૃભાષા સંવર્ધન કન્દ્ર માટે મળેલ દાન

- |  |        |
|--|--------|
| (૧) કમિશનરશ્રી, વાહનબ્યવહાર (ગુ.રા.), ગાંધીનગર | ૭૦૦૦/- |
| (૨) સ્થાનકવાસી ઝૈન સંઘ, ગાંધીનગર               | ૭૦૦૦/- |
| (૩) કિએટિવ ફોરમ, ગાંધીનગર                      | ૭૦૦૦/- |
| ઉપરોક્ત ત્રણેય દાન ઝ. શ્રી ગુણવંત શાહ          |        |

### પરબ અપીલ પેટે મળેલ દાન

- |   |        |
|---|--------|
| નીતિનચંદ સી. મોટી, નવસારી   | ૧૦૦૧/- |
| ગુજરાતી સાહિત્ય પરિષદને શ્રી પાવન બકેરી તરફથી ચાર એસી ભેટ રૂપે મળ્યા તે બદલ હફ્ટયપૂર્વક આભાર. |        |

## સાહિત્યવૃત્ત

સંકલન : પ્રકુલ્લ રાવલ

### દર્શક ફાઉન્ડેશન એવોર્ડ

ગુજરાતીના અગ્રાહી નવલકથાસર્જક શ્રી વીનેશ અંતાણીને દર્શક ફાઉન્ડેશનના એવોર્ડ અને શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર ઉત્તર ગુજરાતની સંસ્થા ગાંધી આશ્રમ - જીવિતાને દર્શક ફાઉન્ડેશન શિક્ષણ એવોર્ડથી સન્માનિત કરશે.

### ભાવનગર ગદ્યસભા : સર્જકસંવાદ, વિમોચન સમારોહ તથા એકંકીકાર સન્માન

ભાવનગર ગદ્યસભા, સર્જકસંવાદ ગુજરાતી લેખક મંડળ અને ડિવાઈન પટિબંદેશનસ (અમદાવાદ)ના સંયુક્ત ઉપકમે સર્જકસંવાદ દ્વારા સંપાદિત અને ડિવાઈન પટિબંદેશનસ દ્વારા પ્રકાશિત વાર્તાસંગ્રહ 'અભિનવ વાર્તાઓ'નું વિમોચન ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીના હસ્તે; તથા ગદ્યસભાના અધ્યક્ષ શ્રી ગંભીરસિંહજી ગોહિલના લેખણોને સંગ્રહ 'અંથવિવેક'નું વિમોચન ડૉ. સતીશ વ્યાસના હસ્તે અને અજય ઓઝાની હિન્દી વાર્તાઓના સંગ્રહ 'સિતારોં કી ધૂપ'નું વિમોચન ડૉ. ગંભીરસિંહજી ગોહિલના હસ્તે તા. ૩૦-૫-૧૦ ને રવિવારે ભાવનગર ખાતે સંપન્ન થયું.

કાર્યક્રમના પ્રારંભે ગદ્યસભાના સંવાદહક્કશી માય ડિયર જ્યુ અને ડિવાઈન પટિબંદેશનસના શ્રી અમૃત ચૌધરીએ સભાને ઉદ્ઘોધન કર્યું હતું. બી. એમ. કોમર્સ કોલેના પ્રિન્સિપાલશી પરેશભાઈ ત્રિવેદીએ 'વાંચે ગુજરાત' વિશે વાતો રજૂ કરી હતી.

વિનોદ અમલાણીના સૌજન્યથી ભાવનગર ગદ્યસભા દ્વારા આયોજિત એકંકી નાટ્યદેશન સ્પર્ધાના વિજેતાઓને જાહીતા નાટ્યવિવિદ ડૉ. સતીશ વ્યાસ દ્વારા સન્માનવામાં આવ્યા હતા. એકંકીસ્પર્ધામાં પ્રથમ કમે એકંકી 'એક અધૂરો ઇન્ટર્વ્યૂ' (નીલમ દોશી), દ્વિતીય કમે 'રઝાની લાશ' (વાસુદેવ સોઢા) અને તૃતીય કમે 'દીપમાલા' (યામિની ગૌરાંગ વ્યાસ) વિજેતા જાહેર થયાં હતાં.

ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી શ્રી રાજેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આ સમારોહ નિમિત્તે શ્રી હર્ષદ ત્રિવેદીએ 'આજની ટૂકીવાર્તા' વિશે અને ડૉ. સતીશ વ્યાસે 'આજના એકંકી' વિશે રચનાત્મક વક્તવ્ય આપ્યાં હતાં. સમારોહના અંતે ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીશ્રી રાજેન્દ્ર પટેલ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.

'વાંચે ગુજરાત'ને સમપિત આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજય ઓઝાએ અને ગદ્યસભાના મંત્રીશ્રી નટવર વ્યાસે આભારવિધિ કરી હતી.

સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી ભાષાસાહિત્ય ભવનના ઉપકમે તા. ૨૮-૫-૨૦૧૦ના રોજ વર્ષાં અડાલજાના પ્રમુખસ્થાને સુરેશ દલાલે '૨જનીકાન્ત જે. મહેતાના ડાયસ્પોરા નિબંધોનો લોકપર્ણવિધિ મુંબઈમાં થયો હતો.

### કોરિયા ખાતે ઇન્ડો-કોરિયન લિટરેચર પરિસંવાદ

કોરિયા ખાતે ઇન્ડો-કોરિયન લિટરેચર પરિસંવાદ' કોરિયન લિટરેચર એસોસિએશન, કોરિયાના આમંત્રણથી અને સાહિત્ય અકાદમી, દિલહિના ઉપકમે રાગોર લિટરેચર એવોર્ડ વિજેતા ભારતીય લેખકો સર્વશ્રી ભગવાનદાસ પેટેલ (જુજરાત), અગ્રાહાર કૃજશમૂર્તિ (દિલહિ), નારીસીમા અખ્તર (કાશમીર), રાજી શેઠ (ઉત્તર પ્રદેશ) ચંદ્રોખર કંબાર (કાશીટક) અને સુપ્રસન્નાચાર્ય કોરેલ (કાશીટક)એ કોરિયાની રાજ્યાની સિઓલમાં તા. ૭-૬-૨૦૧૦થી ૧૩-૬-૨૦૧૦ના પરિસંવાદમાં ભાગ લીધો હતો.

### ગુજરાતી-મરાಠી અનુવાદકો માટે કાર્યશાળા

સાને ગુરુજી રાખ્રીય સ્મારકના ઔંતરભારતી અનુવાદ સુવિદ્યાકેન્દ્ર, મુંબઈ વિદ્યાપીઠ તથા મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અને સંસ્કૃતિમંડળના સંયુક્ત ઉપકમે તા. ૪-૬-૨૦૧૦થી ૬-૬-૨૦૧૦ના રોજ ગુજરાતી-મરાಠી અનુવાદકો માટે ડૉ. હરિશ્ચંદ થોરાતના માર્ગદર્શનમાં ગામ વડ્ઘર, ગૌરેગાવમાં કાર્યશાળાનું આચ્યોજન થયું હતું. જેમાં વસ્તાં દણક, પ્રા. પ્રા. પણંજપે, ડૉ. અભય દોશી, ડૉ. નૂતન જાની, ડૉ. સચિન કેતકર, પ્રા. અધિની બાપટ, અરવિંદ ટિકેકર, સુખ્મા શાલિગ્રામ, ડૉ. રામદાસ ભટકણ અને પ્રા. પુષ્પા ભાવેએ અનુવાદકાર્યની સમસ્યા, ઉપયોગિતા અને વિશિષ્ટતાઓ વિશે વક્તવ્યો આપ્યાં હતાં.

### 'જીવનકોટેજ'નું અનાવરણ

ડૉ. રક્ષાબહેન પ્ર. દવેના ૪૭મા પુસ્તક 'જીવનકોટેજ'નું અનાવરણ તા. ૫-૪-૨૦૧૦ના રોજ શ્રી વેણીભાઈ વોરા તથા શ્રી લલિતભાઈ વોરાના શુભહસ્તે ભાવનગરમાં થયું.

### આદ્વિકાસી સાહિત્યના અભ્યાસીઓ જોગ

શ્રી શિવશંકર ચુનીલાલ જોશી ટ્રસ્ટ, અંબાજની શિવસન્માન ફેલોશિપ અંતર્ગત ગુજરાતના આદ્વિકાસી કંઠપરંપરાનાં સંપાદન-સંશોધનનો ઈતિહાસ શ્રી હસુ યાણ્ણિક લખી રહ્યા છે. જેમણે આ વિષય પર લેખ-પુસ્તકના રૂપમાં લખ્યું હોય, પ્રકાશિત કે પ્રકાશય હોય એવી સામગ્રી ૧, પચાવતી બંગલો, ભાવિન સ્કૂલ પાસે, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૮ના સરનામે મોકલાવવા વિનંતી.

## આ અંકના લેખકો

અરવિંદ ટાંક	: બી/૩૫, રામભાગ સોસાયટી, સહકારી જી રોડ, હિમતનગર-૩૮૨૦૦૧
અસુષ કક્કડ	: બી/૪૦૩, મોતી પેલેસ પ્લાસ એપાર્ટમેન્ટ, વંથળી રોડ, રીબાવાડી, જૂનાગઢ-૩૬૨૦૧૫
ઇતુભાઈ કુસુટ્ટિયા	: ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમમાર્ગ, 'ઘરીમ્સ' પાછળ, અમદાવાદ-૩૮૦૦૦૮
ઉજશ્વરી પરમાર	: ૭૫, સમરથનગર, હાંસોલ, અમદાવાદ-૩૮૨૪૭૫
ડૉ. કૃષ્ણર વ્યાસ	: ૬/બી, મહેતા સોસાયટી, કાલોલ-૩૮૮૩૩૦, જિ. પંચમહાલ
ચંદ્રકાન્ત શેઠ	: બી/૮, પૂર્ણભર ફ્લેટ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૩૮૦૦૧૫
દંકેશ ઓઝા	: ૧૦૩, ઓમ એંવન્યુ ટિવાળીપુરા, વડોદરા-૩૮૨૦૦૭
તૃપ્તિત પારેન	: ૧૦, ઓમ હુપેક્સ, છીઠીયા દરવાજા, પાટશા-૩૮૪૨૬૫
નીતિન વડગામા	: હંદુલ, ૧૮, સ્વાતિ સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૪
નિર્ણન ત્રિવેદી	: ૫૦, લેઠક વ્યૂ સોસાયટી, ગોવિંદ વાડી પાસે, ઈસનપુર, અમદાવાદ-૩૮૨૪૪૩
પ્રકુલ્પ રચલ	: ૩, રાજમહેલ ફ્લેટ, આઈઓસી કોલોની રોડ, વીરમગામ-૩૮૨૧૫૦
ભગવતીકુમાર શર્મા	: ૩૨/બી, પદ્મિત્ર રોડાઉંસ ગેટ નં. ૨, સહજ સુપર સ્ટોરની ગલીમાં, આનંદમહલ રોડ, અડાજા, સુરત-૩૮૫૦૦૮
ભરત જોશી	
“પાર્થ મહાભાઈ”	: પ્રોફેસર અને ડાયેક્ટર, IASE, ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમરોડ, અમદાવાદ-૧૪
મધુસૂદન ઢાંકી	: પીપલ્સ પ્લાઝ, મેમનગર ફાયર સ્ટેશન પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮
મણિલાલ ડ. પટેલ	: સહજ બંગલો, શાસ્ત્રીમાર્ગ, શાંતિબા પાર્ક પાસે, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦
મનોહર ત્રિવેદી	: પ્રણાત, સૂર્યનગર, ઢાસ જેંકશન ૩૬૪૭૪૦
મીરાં ભટ્ટ	: ૭૩, રાજસ્થાન સોસાયટી, પોલોગ્રાઉન્ડ, રાજમહેલ રોડ, વડોદરા-૩૮૦૦૦૧
મુહુદ ડ. ભટ્ટ	: ૮, રજીનિસ્મત સોસાયટી, એ.એ.મ.એ. રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫
રમણ ચોની	: ૧૮, હેમટ્યુપ સોસાયટી, ટિવાળીપુરા, જૂન પાદરા રોડ, વડોદરા-૩૮૦૦૧૫
રાજેન્ડ પટેલ	: ૭૮, નિહારિકા બંગલોઝ, હિમતલાલ પાર્ક સામે, સેટેલાઈટ, અમદાવાદ-૧૫
રાજેશ મેકવાન	: 203/15, Jansusie Road, Eto Bicoke on, Canada Maw 4V4
લાભશંકર ટાકર	: સી/૧૮, જલદરણ ફ્લેટ, પાંચમે માળ, એચ. કે. કોલેજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૮
શિવાની પટેલ (આવરણ)	: ૭૮, નિહારિકા બંગલોઝ, હિમતલાલ પાર્ક સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
હનીક સહિલ	: ૧૪, આશ્રમાન પાર્ક, મહેમદાવાદ-૩૮૧૧૩૦ જિ. ખેડા
હરિદ્ધા પાટક	: પ્લોટ નં. ૬૨/૨, સેક્ટર ૨-એ, ગાંધીનગર-૩૮૨૦૦૭
હરીશ મીનાશ્રુ	: ૮૨, સુમિરન, સૌરય બંગલા, વિનુકુકા માર્ગ, બાકરોલ-૩૮૮૩૧૫. જિ. આણંદ
હરેશ ધોળકિયા	: ન્યૂ મિન્ટ રોડ, ભૂજ-૩૭૦૦૦૧ (કચ્છ)
હર્ષ બહાભદ	: ૭૪/૮, જગાભાઈ પાર્ક, સોસાયટી, રામકૃષ્ણ કેન્દ્ર સામે, રામભાગ, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮

૧

## રંગદ્વાર પ્રકાશન

G-૧૫, યુનિવર્સિટી પ્લાઝ, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા,

અમદાવાદ-૩૮૦ ૦૦૮. ફોન નંબર : (૦૭૯) ૨૭૮૧૩૩૪૪

ઈમેઇલ : rangdwar.prakashan@gmail.com

વેબસાઈટ : <http://www.rangdwar.com>

શબ્દરીનાં બોર (પ્રેક કથાઓ) ડૉ. પ્રકૃત્લ  
શાહ, રૂ. ૧૦૦/-

અ૱ગણીસમી સર્દીની ગુજરાતી ગ્રંથસમૂહદ્વિ  
દીપક મહેતા, રૂ. ૧૫૦

મેધધનુષના રંગો (વાર્તાઓ) શાનુભાઈ  
અંધારિયા, રૂ. ૮૦/-

એક ડગ આગળ બે ડગ પાછળ આજના  
ગ્રામજીવનનું માર્મિક નિરૂપક કરતી  
નવલકથા રઘુવીર ચૌધરી, રૂ. ૧૭૦/-

ચંદન અને સાધુ (વાર્તાસંગ્રહ) ભાનુપ્રસાદ  
ત્રિવેદી, રૂ. ૧૦૦/-

અનુભવની ઓરણ પર (શિક્ષણનો સંસ્કરણો)  
મનસુખ સલ્લા, રૂ. ૧૫૦/-

વાતાવિદ્યું વગતાળિદ્યું (લોકકથા) કાનજી  
ભૂયાબારોટ, રૂ. ૨૫૦/-

સરવરગ્યા (સાંસ્કૃતિક લેખો) નરોત્તમ પવાળા,  
રૂ. ૧૦૦/-

વીજળી હાજ કાસમની (સંશોધન અને  
લોકસાહિત્ય) વાય. એમ. ચીતલવાલા, રૂ.  
૧૮૦/-

ટેગો (વાર્તાસંગ્રહ) કાનજી પટેલ, રૂ. ૮૦/-

અંદર બહાર એકાકાર (કાબ્યસંગ્રહ) લવિત  
ત્રિવેદી, રૂ. ૮૦/-

શ્રી પુરાંત જણસે (કાબ્યસંગ્રહ) ચંદેન પટેલ,  
રૂ. ૮૦/-

ઘટના ઘાટે (કાબ્યો) હરિદ્ધા પાઠક, રૂ. ૭૦/-

તિબન્ન ખડજ (કાબ્યો) હરિશ્ચંદ જોશી, રૂ. ૮૦/-

વેણુવન વસાહત (નવલકથા) ગભરુ  
ભડિયાદરા, રૂ. ૧૬૦/-

બિટનમાં ગુજરાતી દાયસ્પોરા મકરંદ મહેતા,  
શિરીન મહેતા, રૂ. ૨૨૦/-

ગિરનાર સંજ્ય ચૌધરી, રૂ. ૧૬૦/-

ગુજરાતમાં નારીચેતના શિરીન મહેતા,  
રૂ. ૨૫૦/-

અપાજિતા (શ્રેષ્ઠ પ્રવાસનિબંધો) પ્રીતિ  
સેનગુપ્તા, રૂ. ૧૭૦/-

ગીરમંગલ (જીર વિશે નવલકથા) કાલિન્દી  
પરીખ, રૂ. ૭૦/-

યાદગાર અનુભવો (સંસ્કરણો) કાધર  
વર્ગાસ પોલ, રૂ. ૧૮૦/-

રાગાધીનમ્ય (કાબ્ય) સર્જ વાળા, રૂ. ૮૦/-

જિંદગી જુગાર છે ? (વાર્તાસંગ્રહ) રઘુવીર  
ચૌધરી, રૂ. ૭૦/-

પ્રાણપ્રિયા (વાર્તાસંગ્રહ) રઘુવીર ચૌધરી,  
રૂ. ૭૦/-

રઘુવીર ચૌધરીની કથાત્રચીની નવી  
આવૃત્તિઓ ઉપરવાસ-સહવાસ-  
અંતરવાસ રૂ. ૪૮૫/-

ગોકુળ-મથુરા-દારકા રૂ. ૪૨૫/-

પૂર્વગા-પરસ્પર-પ્રેમઅંશ રૂ. ૩૫૦/-

મનેખ નાનું, મન મોટું (પ્રેક સ્મરણો)  
ડૉ. પ્રકૃત્લ શાહ, રૂ. ૮૦/-

સમજ્યા વિના છૂટા પડવું (નવલકથા)  
રઘુવીર ચૌધરી, રૂ. ૧૨૦/-

## કવિ શ્રી સુન્દરમ્ભુના નવા કાવ્યસંગ્રહો

૧. પત્રવિતા	૧૯૯૫	૮૫૩૬	રૂ. ૧૬૦
૨. મહાનાનદ	૧૯૯૫	૭૫૧૮૩	રૂ. ૮૦
૩. પ્રભુ-પદ	૧૯૯૭	૧૩૪૪૧	રૂ. ૨૨૫
૪. અગમ નિગમા	૧૯૯૭	૧૧૨૮૨	રૂ. ૧૫૦
૫. પ્રિયાંકા	૧૯૯૭	૧૧૩૬૭	રૂ. ૧૫૦
૬. નિત્યશ્લોક	૧૯૯૭	૧૨૧૮૮	રૂ. ૧૦૦
૭. નવા પૈસા	૧૯૯૮	૧૩૩૩૩	રૂ. ૧૭૫
૮. વરદા	૧૯૯૮	૧૮૫૨૮	રૂ. ૨૫૦
૯. ચક્કદૂષ	૧૯૯૮	૮૨૪૬	રૂ. ૧૨૫
૧૦. લોકલીલા	૨૦૦૦	૧૩૨૫૨	રૂ. ૧૦૦
૧૧. દક્ષિણા-૧	૨૦૦૨	૧૭૩૨૩	રૂ. ૫૦
૧૨. મનની મર્મર	૨૦૦૩	૧૦૪૩૮૭	રૂ. ૫૦
૧૩. ધ્રુવયાત્રા	૨૦૦૩	૧૨૩૪૫	રૂ. ૫૦
૧૪. ધ્રુવચિત્ર	૨૦૦૪	૧૭૨૭૪	રૂ. ૫૦
૧૫. ધ્રુવપદ	૨૦૦૪	૧૧૨૪૩	રૂ. ૫૦
૧૬. શ્રીમાતાજીના સાનિધ્યમાં-૧	૨૦૦૪	૧૬૩૨૦	રૂ. ૨૦૦
૧૭. શ્રીમાતાજીના સાનિધ્યમાં-૨	૨૦૦૪	૧૬૩૭૦	રૂ. ૨૦૦
૧૮. શ્રીમાતાજીના સાનિધ્યમાં-૩	૨૦૦૬	૩૨૩૧૭	રૂ. ૨૫૦
૧૯. મંગળા-માંગલિકા	૨૦૦૭	૨૮૨૩૮	રૂ. ૧૫૦
૨૦. તું ક્યાં... હું ક્યાં !?	૨૦૦૮	૨૮૩૦૪	રૂ. ૨૫૦
૨૧. સ્વાગતમ્ભુ ગીતવાહીને	૨૦૦૮	૧૬૨૦૭	રૂ. ૧૫૦
૨૨. 'સાવિત્રી'ના કાવ્યાંડો	૧૯૯૫	૨૪૪૭૩	રૂ. ૩૦૦
(અનુવાદ : શ્રી અરવિન્દના મહાકાવ્ય Savitriમાંથી, મૂળ અંગ્રેજી સાથે.)			
૨૩. દક્ષિણા-૨	૨૦૦૨	૧૮૬૭૬	રૂ. ૫૦

(અનુવાદ : શ્રી અરવિન્દના Last Poems, More Poems, Collected Poemsમાંથી, મૂળ અંગ્રેજી સાથે.)

### આ તમામ સંગ્રહોનાં પ્રાપ્તિસ્થાન :

- ગ્રંથાગાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમમાર્ગ, ગાંધીજી એન્ડ ઇન્ડિયા પાઠ્યા, અમદાવાદ-૩૮૦૦૦૮
- ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧

### મજૂરીની ત્રૈવડ છે, સંપાદક ?

એક પૈસોયે આવવાનો નથી, પૂરું બીલ સમયસર ચૂકવવાનું છે, મેટર મળે જ એવી આશા ન રાખો, મળે જ તો તમે પસંદ કરો એવી જ મળે એવી આશા ન રાખો. જરૂર પડ્યે આખા અંકનું મેટર જાતે તૈયાર કરવાની હિંમત અને મજૂરીની ત્રૈવડ હોય, પ્રશંસાને બદલે એકાદ અક્ષર ટીકાનો આવશે તો આજનું તમને દાઢમાં રાખશે અને તમે કલ્પી ન શકો એ રીતે માર્ગમાં આડે આવશે – આટલી તૈયારી હોય તો અંગત ડિસાબે-જોખમે સ્વતંત્રપણે સાહિત્યિક માસિક બહાર પાડો અને પ્રેસ ધાપી આપે તો પોસ્ટ કરો. આટલી પાયાની તટસ્થવૃત્તિ હોય તો સાહિત્યિક સામયિક ચલાવો. રાને પ્રૂફ આવે ને સવારે ચા પીતા હશો ત્યારે લેવા આવશે, વાંચીને તૈયાર રાખી શકો તો અંક છેક છેલ્લી ઘડીએ તૈયાર થશે ! એક જુદી જ નિષ્ઠામ વૃત્તિની અપેક્ષા આ કામ રાખે છે – શ્રીકૃષ્ણને પણ એની જાણ નહીં હોય !

પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]

રતિલાલ 'અનિલ'

### સ્થાનસમર્પિત

### વસન્ત આત્મા ચેરિટેબલ ટ્રસ્ટ

ગુજરાત સ્ટીલ ડિસ્ટ્રિબ્યુટર  
અમદાવાદ